

મસ્લા આ'લા હજરત જિંદાગાન !
مَنْ يُرِدُ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهُهُ فِي الدِّينِ

بَهَارِ شَرِيْعَتْ

બહાર શરીયત (માચ-૪)

:: ઉર્દૂમાં મૂળ લેખક ::

હજરત અલ્લામા હકીમુલ ઉમત, ફિલીહે આ'ઝમ, ફષ્ણે સુન્નિયત હજરત મોલાના
شાહ અલુલ ઉલા અમજદઅલી આ'ઝમી, ફાદરી રજવી
رَحْمَةُ اللَّهِ عَلَيْهِ

:: અનુવાદકો ::

હજરત અલ્લામા સૈયદ અલ્હાજ પીર ફિમરુદ્ડીન એ. પીરજાદા સાહબ (કારંટવી)

મર્દૂમ હાજ ડૉસુભાઈ કે. પહોંચીયા, નકશબાંદી, મુજદિદી (મોડાસ્વી)

પ્રકાશક

સુન્ની દા'વતે ઈસ્લામી (દયાદરા શાખા)

C/o. ફિયુજાને રજા મંજિલ, મુ.પો. દયાદરા, તા. જિ. : ભરૂચ,
પિન. ૩૮૨૦૨૦ ફોન. : (૦૨૬૪૨) ૨૮૦૦૧૧, ૨૮૦૧૬૨,
૨૮૦૨૬૨ મો. : ૮૪૨૭૪૬૪૪૧૧

Email : anjuman2006@hotmail.com

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
 الصلوة والسلام عليك يا رسول الله ﷺ
 وعلى آليك وأصحابك يا حبيب الله ﷺ

સર્વ હક્ક પકાશકને રવાધિન

કિતાબનું નામ	: બહારે શરીઆત (ભાગ ચોથો)
ઉર્દૂમાં મૂળ લેખક	: હજરત અલ્લામા હક્કીમુલ ઉમ્મત, ફકીરે આ'ઝમ, ફથ્રે સુન્નિયત મૌલાના શાહ અબુલ ઉલા અમજદઅલી આ'ઝમી, કાદરી રજવી رحمۃ اللہ علیہ
અનુવાદકો	: (૧) હજરત અલ્લામા સૈયદ અલ્હાજ પીર કફુરુદીન એ. પીરાંદા સાહબ (કારંટવી) (૨) મર્ઝીમ હાજી ડૉસુભાઈ કે. પહોંચીયા નક્શબંદી, મુજદિદી (મોડાસ્વી)
પેજુસ	: ૧૨૬ ★ કિંમત : ★ નકલ : ૨૦૦૦
પકાશન વર્ષ	: ૬ રજબુલ મુરજજબ, હિ.સ. ૧૪૩૦ અંગ્રેજી તા. ૨૮-જુન-૨૦૦૮, વાર : સોમવાર
પ્રાપ્તિસ્થાન	: સુણી દા'વતે ઈસ્લામી (દચાદરા શાખા) મુા.પો. દચાદરા, તાલુકા & જિલ્લા : ભરૂચ પિન. ૩૮૨૦૨૦, ફોન : (૦૨૬૪૨) (ઓફિસ) ૨૮૦૦૧૧, (ઘર) ૨૮૦૧૯૨, ૨૮૦૨૮૨ મો. ૯૪૨૭૪૬૪૪૧૧, Email : anjuman2006@hotmail.com

પકાશક

સુણી દા'વતે ઈસ્લામી (દચાદરા શાખા)

C/o. ફયૂઝાને રાજા મંજિલ, મુા.પો. દચાદરા,
 તાલુકા & જિલ્લા : ભરૂચ પિન. ૩૮૨૦૨૦, ફોન : (૦૨૬૪૨) (ઓફિસ) ૨૮૦૦૧૧,
 (ઘર) ૨૮૦૧૯૨, ૨૮૦૨૮૨, મો. ૯૪૨૭૪૬૪૪૧૧

બહારે શરીઅત ભાગ - ૪

(શુજયતી)

અનુક્રમણિકા

ક્રમ નંબર	વિષય	પેજ નંબર	ક્રમ નંબર	વિષય	પેજ નંબર
૧	વિત્રનું બયાન	૧	૨૭	ઈમામની વિરોધતા કરવા અને જમાઅતમાં શામેલ થવાના મસાઈલ	૨૮
૨	વિત્રના ફિક્છી મસાઈલ	૨	૨૮	કાં નમાજનું બયાન	૨૮
૩	સુનતી તથા નવાફિલનું બયાન	૫	૨૯	નમાજના ફિદીયાના મસાઈલ	૩૪
૪	સુનન ફિક્છી મસાઈલ	૭	૩૦	સિજદએ સહવનું બયાન	૩૪
૫	નિફલ નમાજ શરૂ કરીને તોડી નાખવાના મસાઈલ	૧૦	૩૧	બીમારની નમાજનું બયાન	૪૨
૬	ઉભા થઈને બેસીને અને આડા પડીને નિફલ પઢવાના મસાઈલ	૧૧	૩૨	તિલાવતના સિજદાનું બયાન	૪૬
૭	ગાડી અને સવારી પર નમાજ પઢવાના મસાઈલ	૧૨	૩૩	નમાજમાં સિજદાની આયત પઢવાના મસાઈલ	૪૦
૮	ગાડા અને સવારી પર ફર્જ તથા વાજિબ પઢવાના મસાઈલ	૧૩	૩૪	મુસાફિરની નમાજનું બયાન	૪૪
૯	ફર્જ તથા વાજિબ સવારી અથવા ગાડી ઉપર પઢવાના ઉકરો	૧૩	૩૫	ઈકામત (નિવાસ)ની નિયતની શર્તો	૫૭
૧૦	મનાત માનીને નમાજ પઢવાના મસાઈલ	૧૪	૩૬	મુસાફિર તથા મુક્રમની ઈક્તેદાના અહકામ	૬૦
૧૧	તહયુતુલ મસ્લિદ	૧૪	૩૭	અસલી વતન અને ઈકામતે વતનના મસાઈલ	૬૧
૧૨	ઈશરાકની નમાજ	૧૫	૩૮	જુમ્માનું બયાન	૬૨
૧૩	ચાશત ની નમાજ	૧૫	૩૯	જુમ્માના ફિક્છી મસાઈલ	૬૨
૧૪	સફરથી પાછા આવવાની નમાજ	૧૬	૪૦	પુત્રબાના કેટલાક બીજા મસાઈલ	૭૫
૧૫	સલાતુલ લેલ	૧૬	૪૧	ઈદન નું બયાન	૭૬
૧૬	તહજ્જૂદ	૧૬	૪૨	ગ્રહણની નમાજનું બયાન	૮૬
૧૭	રાતમાં પઢવાની કેટલીક દુઆઓ	૧૮	૪૩	ઈસ્તિસ્કાની નમાજનું બયાન	૮૬
૧૮	નમાજે ઈસ્તેખારા	૧૮	૪૪	પૌફની નમાજનું બયાન	૮૬
૧૯	સલાતુતસ્ખીદ	૧૯	૪૫	બીમારનું બયાન	૮૮
૨૦	નમાજ હાજત	૨૧	૪૬	એપાદત (બીમાપુસી)ના ફરજાઈલ	૮૯
૨૧	સલાતુલ અસરાર	૨૨	૪૭	મૃત્યુ આવવાનું બયાન	૮૩
૨૨	નમાજે તૌબા	૨૨	૪૮	ગુસ્સ આપવાનું બયાન	૮૪
૨૩	સલાતુર્ગાઈબ	૨૨	૪૯	કફન નું બયાન	૮૮
૨૪	તરાવીહનું બયાન	૨૨	૫૦	જનાજી લઈને ચાલવાના બયાનમાં	૧૦૩
૨૫	મુનફિરદનું ફરજોની જમાઅત પામવું	૨૭	૫૧	જનાજીની નમાજનું બયાન	૧૦૪
૨૬	અગાન પછી મહિલામાંથી બહાર જવાના મસાઈલ	૨૮	૫૨	કશ તથા દક્ફન નું બયાન	૧૧૩
			૫૩	તઅજીયતનું બયાન	૧૧૮
			૫૪	શહીદનું બયાન	૧૨૧
			૫૫	કા'બામાં નમાજ પઢવાનું બયાન	૧૨૫

બહારે શરીરાત

(ભાગ ચોથો)

મિસ્ટિમલ્લાહિર્હમાનિર્હીમ

નહસ્ટોહ વ નુસલ્લી અલા રસ્લેહિલ-કરીમ

વિત્રનું બયાન

હદ્દીસ-(૧) : સહીહ મુસ્લિમ શરીરમાં છે કે, અખુલ્લાહ બિન અખ્બાસ રદ્દિયલ્લાહો અન્હોમાં કહે છે કે, રસ્લુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના ત્યાં હું સુઈ રહેલો હતો, હુઝૂર જાગૃત થયા અને મિસ્વાક કર્યું અને વુજૂર કર્યું અને એ જ હાલતમાં આયત ઈન્ના ફી ખલિક્સ સમાવાતે વલઅર્ડ ખત્મે સુરાસ સુધી પઢી પછી ઉલા થઈને બે રકાતો પઢી જેમાં કયામતથા રુક્ઊઅતથા સુજૂદને તવીલ (લાંબો) કર્યો, પછી નમાજ પઢીને આરામ કર્યો ત્યાં સુધી કે શ્વાસનો અવાજ આવ્યો. આવી રીતે જ ત્રણ વખતમાં છ રકાતો પઢી. દરેક વખત મિસ્વાક તથા વજુ કરતા અને તે આયતોની નિલાયત કરતા, પછી વિત્રની ત્રણ રકાતો પડ્યો.

હદ્દીસ-(૨) : સહીહ મુલ્લિમમાં છે કે અખુલ્લાહ બિન ઉમર રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે, રાતની નમાજોના આધિરમાં વિત્ર પઢો અને ફરમાવે છે સુખહની નમાજોની અગાઉ વિત્ર પઢો.

હદ્દીસ-(૩) : મુસ્લિમ તથા તિરમિજી તથા ઈન્નેમાજા વગેરે જાબીર રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, જેને શંકા હોય કે પાછલી રાતમાં (ઠી શકશે નહીં તો અવ્યલ રાતમાં વિત્ર) પઢીલે અને જેને ઉમ્મીદ હોય કે પાછલી રાત્રે ઉઠાસે તો પાછલી રાતના (વિત્ર) પઢે કે અંતિમ રાતની નમાજ મશહૂદ છે (અર્થાત તેમાં રહેમતના ફરિશતા હાજર થાય છે) અને આ અફઝલ છે.

હદ્દીસ-(૪થી૬) : અખૂદાઉદ, તિરમિજી, નિસાઈ

તથા ઈન્નેમાજા મૌલા અલી રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, રસ્લુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવું, અલ્લાહ વિત્ર છે, વિત્રને (એકાઈને) મેહબૂબ (પ્રિય) રાખે છે. અને જેથી અય કુર્અનવાળાઓ વિત્ર પઢો અને એ જ પ્રમાણે જાબિર તથા અખૂદુર્યરહ રદ્દિયલ્લાહો અન્હોમાંથી મરવી (રિવાયત) છે.

હદ્દીસ-(૭ થી ૧૧) : અખૂદાઉદ, તિરમિજી તથા ઈન્નેમાજા ખારજા બિન હુઝાફ રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુઝાફ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહ તાદાલાએ અન્હોથી તમારી સહાયતા કરી તે સૂર્ખ (લાલ) ઊંટ કરતાં બેહતર છે, તે વિત્ર છે. અલ્લાહ તાદાલાએ તેને ઈશા તથા તુલુએ ફજરની વર્ષ્યે રાખી છે. આ હદ્દીસ બીજા સહાયાઓથી પણ મરવી છે. દા.ત. માઝ બિન જબલ, અખુલ્લાહ બિન ઉમર, ઈન્ને અખ્બાસ, તથા ઉકબા બિન આભિર જુહની વિગેરે (રદ્દિયલ્લાહો અન્હુંમ)

હદ્દીસ-(૧૨) : તિરમિજી જૈદ બિન અસ્લમથી મુરસલન રાવી કે રસ્લુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવું, જો વિત્ર પઢ્યા વગર સુઈ જાય તો સવારમાં પડી લે.

હદ્દીસ - (૧૩ થી ૧૬) : ઈમામ અહમદ ઉદ્દૈ બિન કાબબ થી અને દારોમી ઈન્ને અખ્બાસથી અને અખૂદાઉદ તથા તિરમિજી ઉમ્મુલ મોમેનીન આઈશા સિદ્દીકા રદ્દિયલ્લાહો અન્હોથી અને નિસાઈ અખૂર્હમાન બિન અબ્જા રદ્દિયલ્લાહો અન્હુમાથી રિવાયત કરે છે કે, રસ્લુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ વિત્રની પઢેલી રકાતમાં “સભેહીસ્મરબ્લેકલ આઅલા” અને બીજામાં “કુલ યા ઐયુહલ કાફેરન” અને ત્રીજી માં “કુલ હો વલ્લાહો અહદ” (નીસુરતો) પઢતા,

હદ્દીસ - (૧૭) : અહમદ, અખૂદાઉદ તથા હાકિમ એફાદએ તસહીહથી (સહીહ રિવાયતોની શરતોથી) બુરૈયદહ રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, રસ્લુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવું વિત્ર હક્ક છે, જે વિત્ર ન પઢે તે અમારા પૈકી નથી, વિત્ર હક્ક છે, જે વિત્ર ન પઢે તે અમારા પૈકી નથી.

હબીબા રદીયલ્લાહો અન્હાથી રિવાયત કરે છે કે હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે કે જે શાખ્સ જોહરથી પહેલા ચાર અને પાછળની ચાર રકાતોની રક્ષા કરે (પઢે) અલ્લાહ તથાલા તેને આગ માટે હરામ કરી દેશે (એટલે કે આગ તેને બાળી શક્ષે નહીં) તિરમિઝીએ આ હદીસને હસન સહીંગ ગરીબ કર્યું છે.

હદીસ-(૧૧) : અબૂદાઉદ તથા ઈબ્ને માજા અબૂઅયુબ અન્સારી રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે. જોહરથી પેલા ચાર રકાતો જેની વચ્ચે સલામ ન ફરવવામાં આવે, તેમના માટે આસ્માનના દરવાજા ખોલવામાં આવે છે.

હદીસ-(૧૨) : અહ્મદ તથા તિરમિઝી અબુલ્લાહ બિન સાઈબ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુઝૂરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમ સુરજ ફળી ગયા પછી, જોહરની નમાજથી પહેલા ચાર રકાતો પઢતા અને ફરમાવતા, આ એવી કષ્ણ છે કે તેમાં આસ્માનના દરવાજા ખોલવામાં આવે છે, જેથી હું પ્રિય રાખું છું (પસંદ કરું છું) કે તેમાં મારો કોઈ અમલે સાલેહ બુલંદ કરવામાં આવે.

હદીસ-(૧૩) : બાબરે સૌબાન રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરી કે બે પહોર (બપોર) પછી ચાર રકાતો પઢવાનું હુઝૂરને પસંદ હતું. ઉમ્મુલ મોમેનીન સિદ્દીકા રદીયલ્લાહો અન્હા એ અર્જ કરી યા રસૂલુલ્લાહ ! હું જોઉ છું કે આ સમયમાં આપ હુઝૂર ન નમાજ (પદ્ધું) પ્રિય રાખો છો. આપે ફરમાવ્યું, આ સમયે આસ્માનના દરવાજા ખોલવામાં આવે છે અને અલ્લાહ તથારક વ તથાલામ ખલૂકની તરફ રહેમતની નજર કરે છે. અને આ નમાજ પર આદમતથા નુહ તથા ઈશ્રાહિમ તથા મુસા તથા ઈસા અલયહિમુસસલામ સુરક્ષા કરે છે.

હદીસ-(૧૪ થી ૧૫) : તિભ્રાની બરાઅબિન આજિબ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે હુઝૂરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે જેણે જોહરની પહેલા ચાર રકાતો

પઢી જાણે કે તેણે તહજીબુદ્દની ચાર રકાતો પઢે અને જેણે ઈશાની પછી ચાર રકાતો પઢી તો આ શબેક્ડમાં ચારના અનુરૂપ છે. હજરત ઉમર ફારૂકે આજમ તથા બીજા સહાબાઓ ડિરામ રદીયલ્લાહો અન્હુમાંથી પણ તેના જેવું જ મરવી (રિવાયત) છે.

-: અસરની સુણનોના ફળાઈલ :-

હદીસ-(૧૬) : અહ્મદ, અબૂદાઉદતથા તિરમિઝી બ ઈફાદએતહસીન હજરત અબુલ્લાહ બિન ઉમર રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુઝૂર સલ્લલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે કે, અલ્લાહ તથાલા તે શાખ્સ ઉપર રહેમ કરે જેણે અસરથી પહેલા ચાર રકાતો પઢી.

હદીસ-(૧૭) : તિરમિઝી મૌલા અલી રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુઝૂર અસરથી પહેલા ચાર રકાતો પઢ્યા કરતા હતા અને અબૂદાઉદની રિવાયતમાં છે કે, બે પંદતા હતા.

હદીસ-(૧૮ થી ૧૯) : તિભ્રાની કબીરમાં ઉમ્મુલ મોમેનીન ઉમ્મે સલમા રદીયલ્લાહો અન્હાથી રિવાયત કરે છે. કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે કે, જે (માણસ) અસરથી પહેલાં ચાર રકાતો પઢે અલ્લાહ તથાલા તેના બદનને આગ પર હરામ કરી દેશે. બીજી રિવાયત તિભ્રાનીની અમ બિન આસ રદીયલ્લાહો અન્હોથી છે કે હુઝૂરે સહાબાઓના મજમામાં કે જેમાં અમીરુલ્મોમેનીન ઉમર બીન ખતાબ રદીયલ્લાહો અન્હો પણ હતા, ફરમાવ્યું, જે અસરથી પહેલા ચાર રકાત પઢે તેને આગ સ્પર્શશી નહીં.

મગારીબની સુણનોના ફળાઈલ

હદીસ-(૨૦ થી ૨૧) : મુહદિસરજીને હજરત મકહુલથી મુરસલન રિવાયત કરી કે હુઝૂર ફરમાવે છે, જે શાખ્સ મગારિબની નમાજ પછી વાત કરવાથી પહેલાં બે રકાતો પઢે તેની નમાજ ઈલ્લાયન (ઉદ્દે જન્તતનું નામ) માં ઉઠાવવામાં આવે છે અને એક રિવાયતમાં ચાર રકાત છે. એવીજ તેમની બીજી રિવાયત હુંયફા રદીયલ્લાહો અન્હોથી છે. તેમાં એટલી વાત વધારે છે કે આપ ફરમાવતા હતા કે, મગારીબ પછીની બંને રકાતો જલ્દી પઢો કે તે ફર્જની સાથે રજુ થાય છે. (ધણા ભાઈઓ વગીફો

પઢવા બહુવાર સુધી બેસી રહે છે તે આ હ્યાસને ધ્યાનમાં રાખે. અનુ.)

-: જાણવ્યાખીનની નમાંગ :-

હ્યાસ-(૨૨) : તિરમિઝી તથા ઈલ્લે માજા અખૂદુરયરહ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે હુંગૂર ફરમાવે છે કે જે માણસ મગરીબ પછી છ રકાતો પઢે અને તે દરમિયાનમાં કોઈ બુરી (ખરાબ) વાત ન કહેતો બાર વર્ધની ઈબાદતની બરાબર ગણના કરવામાં આવશે.

હ્યાસ-(૨૩) : તિથ્રાની, અમ્મારાબિન યાસિર રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે હુંગૂર ફરમાવે છે કે (માણસ) મગરીબ પછી છ રકાતો પઢેતેના ગુનાહ બખ્શી દેવામાં આવશે ભલે સાંદુરના ફીણની બરાબર હોય.

હ્યાસ-(૨૪) : તિરમિઝીની રિવાયત ઉમ્મુલ મોમેનીન સિદ્ધીકા રદીયલ્લાહો અન્ધોથી છે કે જે મગરીબ પછી વીસ રકાતો પઢે અલ્લાહ તાબાલા તેના માટે જુન્નતમાં એક મકાન બનાવશે.

હ્યાસ-(૨૫) : અખૂદાઉદ્દિની રિવાયત તેમનાથી જ છે કે ફરમાવે છે કે ઈશાની નમાજ પઢીને નભીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ મારા મકાન પર તશરીફ લાવતા તો ચાર અથવા છ રકાતો (નિફલ નમાજમાં) પઢતા.

ફિકલી મસાઈલ

(ઇશાની સુન્નત તથા નવાફિલ, સુન્નત તથા નવાફિલના મસાઈલ)

કેટલીક સુન્નતો, સુન્નતે મોઅક્કડા છે કે શરીરાતમાં તેના માટે તાકીદ આવી કે, ઉઝર વગર એક પણ તર્ક કરેતો મલામતના યોગ્ય છે. અને તર્કની આદત પડે તો ફાસિક મરદૂદે શહાદત, જહન્નમના પાત્ર છે. અને કેટલાક (ફિકહના) ઈમામોએ ફરમાવ્યું કે તે ગુમરાહ ઠેરવવામાં આવશે અને તે ગુનેહગાર છે. જોકે તેનો ગુનો વાજિબના તર્ક (ત્યાગ) થી ઓળા છે. "તલ્વીહ" માં છે કે તેનો ત્યાગ હરામના નિકટ છે તેનો ત્યાગી (છોડનાર) તેના પાત્ર છે (માઝાઝલ્લાહ) શરીરાતથી મેહરૂમ થઈ જાય કે હુંગૂરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું : જે (માણસ મારી સુન્નતને)

તર્ક કરશે તેને મારી શરીરાત મળશે નહીં. સુન્નતે મોઅક્કડાને "સુનનુલ હુદા" પણ કહે છે બીજો પ્રકાર જેર માઝક્કડા છે જેને સુનનુઝ જવાઈદ પણ કહે છે તેના ઉપર શરીરાતમાં તાકીદ આવી નથી, કયારેક "મુસ્તહબ" અને "મન્દૂબ" પણ કહે છે અને નિફલ આમ છે કે સુન્નત ઉપર પણ તેને બોલવામાં આવે છે. અને તેના જેર ને પણ નિફલ કહે છે એ જ કારણ છે કે હુકહાએ કિરામ નવાફિલ પ્રકારણમાં સુન્નનનો એ જ ઉલ્લેખ કરે છે કે નિફલ પણ તેમાં શામેલ છે. (રદ્દુલ મુહૃતાર) જેથી નિફલના જેટલા અહકામ બયાન થશે તે સુન્નતો ને પણ શામેલ હશે. અલબત જો સુન્નત માટે કોઈ ખાસ વાત હશે તો તે સર્વથા હુકમથી તેને અલગ કરવામાં આવશે, જ્યાં અલગતા ન હાય એ જ સર્વથા નિફલના હુકમા શામેલ સમજે.

મસાલા-(૨૦) : સુન્નતે મોક્કડા આછે, બે રકાત નમાજ ફજરથી પહેલાં, ચાર રકાત ઝોહરથી પહેલાં, બે ઝોહરથી પછી, બે રકાત મગરીબની પછી, બે ઈશાની પછી અને ચાર રકાત જુમ્માથી પહેલાં અર્થાત જુમ્માના દિવસે જુમ્મા ચારબાદમાં પઢવાવાળાઓ ઉપર (૧૪) ચૌદ રકાતો છે. અને જુમ્મા સિવાયના બાકીના દિવસોમાં દરરોજ બાર (૧૨) રકાતો છે. (આમાંએ કુતુબ)

મસાલા-(૨૧) : અફજલ એ છે કે જુમ્મા પછી ચાર રકાત પઢે પછી બે કે બને હ્યાસો ઉપર અમલ થઈ જાય. (ગુનીયા)

મસાલા-(૨૨) : જે સુન્નતો ચાર રકાત છે, દા.ત. જુમ્મા તથા ઝોહરની, તો ચારે એક સલામથી પઢવામાં આવશે, અર્થાત ચારે પઢીને ચોથી રકાત પછી સલામ ફેરવો. એમ નહીં કે બે બે પર સલામ ફેરવો અને જો કોઈએ આબું કર્યું તો સુન્નતો અદાથઈ નહીં. એવી જ રીતે જો ચાર રકાતની મન્નત માની અને બે બે રકાત કરીને ચાર પઢી તો મન્નત પૂરી થઈ નહીં બલ્કે જરૂરી છે કે એક સલામ સાથે ચારે પઢો. (દુર્ભુખતારવિગેરે)

મસાલા-(૨૩) : સધણી સુન્નતોમાં કવીતર (ધષી, જ જરૂરી) સુન્નત ફજર છે. ત્યાં સુધી કે કેટલાકો તેને વાજિબ કહે છે. અને તેની મશરૂ ઈચ્છત (શરીરાતમાં

જરૂરી છે.) નો જો કોઈ ઈન્કાર કરે તો જો શંકાથી અથવા અજ્ઞાનતાથી હોય તો કુઝનો ભય છે. અને જો જાણી જોઈને શંકા વગર હોય તો તેની તકફીર (કાફીર કહેવું) કરવામાં આવશે તદઉપરાંત આ સુન્નતો ઉઝર વગર ન બેસીને થઈ શકે ન સવારી પર, ન ચાલતી રેલ્વે ઉપર, તેમનો હુકમતે વાતોમાં બિલકુલ વિત્ર જેવો છે. તેના પછી મગરીબની સુન્નતો પછી જોહરના ફર્જ પછીની ઈશાના ફર્જ પછીની, જોહરના ફર્જ પહેલાની સુન્નતો અને સહીએ (સાચું) એ છે કે ફજરની સુન્નત પછી જોહરની પહેલી સુન્નતોનો મરતબો છે કે, હદ્દીસમાં ખાસ તેમના વિષે ફરમાવ્યું કે જે તેમને તર્ક કરશે તેને મારી શંકાત પહોંચશે નહીં.

(રદ્દુલ મુહતાર વિગેરે)

મસ્ફ્લા-(૨૪) : જો કોઈ આલિમ, મુફતી હોય કે ફત્વો આપવામાં તેને સુન્નત પઢવાનો મોકો નથી મળતો, ફજર સિવાયની બાકી સુન્નતો તરૂં કરી શકે છે તે સમયે જો મોકો નથી તો મોકૂફ રાખે. જો સમયની અંદર મોકો મળે તો પછી લે. નહીં તો માઝાફ છે. અને ફજરની સુન્નતો એ સંજોગોમાં પણ તર્ક કરી શકતો નથી.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસ્ફ્લા-(૨૫) : ફજરની નમાઝ કરા થઈ ગઈ અને જવાલથી પહેલા પઢી લીધી તો સુન્નતો પણ પઢે. નહીં તો, ન પઢે. ફજર સિવાયની બીજી સુન્નતો કરા થઈ ગઈ તો તેની કરા નથી.

(રદ્દુલ મુહતાર)

મસ્ફ્લા-(૨૬) : બે રકાતના નિફલ પઢી અને એ ગુમાન હતું કે ફજર તુલુઅ થઈ ગયું હતું તો આ રકાતો ફજરની સુન્નતના કાયમ મુકામ (સ્થાને) થઈ જશે. અને ચાર રકાતની નિયત બાંધી અને તે પૈકી બે પાછલી તુલુઅ ફજર પછી ઘટિત થઈ તો આ સુન્નતો ફજરના કાયમ મુકામ ન થશે.

(રદ્દુલ મુહતાર)

મસ્ફ્લા-(૨૭) : તુલુઅ ફજરથી પહેલાં ફજરની સુન્નતો પઢવું જાઈજ નથી. અને તુલુઅમાં શંકા હોય તો પણ ના શાઈજ છે. અને તુલુઅની સાથે સાથે શરૂ કરી તો જાઈજ છે. (આલમગીરી)

મસ્ફ્લા-(૨૮) : જોહર અથવા જુમાની પહેલાંની

સુન્નતો છુટી ગઈ અને ફર્જ પઢી લીધા તો જો સમય બાકી છે તો ફર્જની પછી, પઢી લે. અને અફજલ એ છે કે પાછલી સુન્નતો પઢીને તેમને પઢે.

(ફત્હલુલ કદીર)

મસ્ફ્લા-(૨૯) : ફજરની સુન્નતો કરા થઈ ગઈ અને ફર્જ પઢી લીધી તો હવે સુન્નતો ની કરા નથી. અલબજ ઈમામ મોહમ્મદ રહમતુલ્લાહે અલયહે ફરમાવે છે કે, તુલુઅ આફતાબ પછી પઢી લે તો બેહતર છે (ગુનીયા) અને તુલુઅથી પહેલા સર્વસંમતિએ (સર્વથા) મમનૂઅ - મના છે (દુર્ભ મુખ્તાર). આજ કાલ અકસર લોકો ફર્જ પછી તુરત જ પઢી લે છે આ નાજાઈજ છે. પઢવી હોય તો સૂરજ બુલંદ થઈ ગયા (લગભગ ૨૦ મિનિટ) પછી જવાલથી પહેલા પઢે.

મસ્ફ્લા-(૩૦) : સ્વોર્યદયની પહેલાં ફજરની સુન્નતો કરા પઢવા માટે એ બહાનું કરવું કે, શરૂ કરીને તોડી નાપે, ફરી અદા કરે, આ નાજાઈજ છે. ફજરની સુન્નતો પઢી લીધી અને ફર્જ કરા થઈ ગઈ તો કરા પઢવામાં સુન્નતનું પુનરાવર્તન ન કરે. (ગુનીયા)

મસ્ફ્લા-(૩૧) : ફર્જ એકલા પઢે તો પણ સુન્નતોનું તર્ક કરવું જાઈજ નથી. (આલમગીરી) ફજરની સુન્નતની પહેલી રકાતમાં અલહમદો પછી સૂરાએ કાફેરન અને બીજીમાં કુલહોવલ્લાહ પઢવું સુન્નત છે. (ગુનીયા વિગેરે)

મસ્ફ્લા-(૩૨) : જમાઅત કાયમ થયા પછી ફજરની સુન્નતો સિવાય બીજી કોઈ નિફલનું શરૂ કરવું જાઈજ નથી, કે જો એમ સમજે કે સુન્નત પઢયા પછી જમાઅત મળી જશે, બલે કાયદામાં જ શામેલ થવાય, તો (ફજરની) સુન્નતો પઢી લે. પરંતુ સફની બરાબર (લાઈનમાં) પઢવું જાઈજ નથી. બલ્કે પોતાના ધેર પઢે અથવા મસ્જિદની બહાર કોઈ જગ્યા ન માઝને યોગ્ય હોય તો ત્યાં પઢે અને એ શક્ય ન હોય તો જો અંદરના હિસ્સામાં જમાઅત થતી હોય તો બહારના હિસ્સામાં પઢે. બહારના હિસ્સામાં હોય તો અંદરની અને જો તે મસ્જિદમાં અંદર બહાર બેદરજા (વિભાગ) ન હોય તો થાંભલા અથવા વૃક્ષની આડમાં પડે કે તેના અને સફની વચ્ચે આવી જાય અને સફની પાછળ પઢવું પણ મમનૂઅ-મના છે. જો કે સફની પઢવું અધિક બુરુ

છે. આજકાલ અકસર લોકો તેના બિલકુલ ઘ્યાલ રાખતા નથી. અને એજ સફમાં ધૂસીને શરૂ કરી દે છે. આ નાજાઈજ છે. અને જો હજુ જમાઅત શરૂ થઈ નથી તો જ્યાં ચાહે સુન્નતો પઢે ભલે ગમે તે સુન્નત હોય. (ગુનિયા) પરેતુ જાણતો હોય કે જમાઅત ઉભી થવાની તૈયારી છે અને ત્યાં સુધીમાં સુન્નતોથી ફારેગ ન થવાશે તો એવી જગ્યાએ ન પઢે કે તેના કારણે સફ કતાચ (કપાઈ જાય) થાય. મસખલા-(૩૩) : ઈમામને રૂકુમમાં દેખ્યો અને એ ખબર નથી કે પહેલી રકાઅતનો રૂકુઅ છે કે બીજાનો, સુન્નતો તર્ક કરી દે અને જમાઅતમાં શામેલ થઈ જાય.

(આલમગીરી)

મસખલા-(૩૪) : જો સમયમાં ગુજાઈશ હોય અને તે વખતે નવાફિલ પઢવું મકરૂહ ન હોય તો જેટલા નવાફિલ પઢવા હોય પઢીલે. અને જો નમાઝે ફર્જ અથવા જમાઅત જતી રહેશે તો નિષ્ફળોમાં મશગૂલ થલું નાજાઈ છે.

મસખલા-(૩૫) : સુન્નત તથા ફર્જની વચ્ચે વાતચીત કરવાથી ખરું (સાચું) એ છે કે, સુન્નત બાતિલ થતી નથી અલબજત સવાબ ઓછો થઈ જાય છે. એ જ હુકમ દરેક તે કામનો છે જે તેહરીમાના મનાફી (નકારાતમક) છે. (તનદીર) જો કોઈ માણસ ખરીદ-વેચાણ અથવા જમાવામાં મશગૂલ થયો હોય તો તે પુનરાવર્તન કરે. હા, પાછલી સુન્નતોમાં જો ખાણું લાવવામાં આવ્યું અને બદ મગાહ (અસ્વાદિષ્ટ) થઈ જવાની આશંકા છે, તો ખાણું ખાઈ લે પછી સુન્નત પઢે. પરંતુ સમય ચાલ્યો જવાની આશંકા હોય તો પઢ્યા પછી ખાવ. અને ઊર વગર પાછલી સુન્નતોમાં પણ તાપાર (વિલંબ) કરવું મકરૂહ છે. જો કે અદા થઈ જશે.

(રદ્દુલ મુહતાર)

મસખલા-(૩૬) : ઈશા તથા અસરની નમાજ પહેલા તથા ઈશાની નમાજ પછી ચાર ચાર રકાઅતો એક સલામથી પઢવું મુસ્તહબ છે.. અને એ પણ અખત્યાર છે કે ઈશા પછી બેજ પઢે. મુસ્તહબ અદા થઈ જશે. એવીજ રીતે જોહરના ફર્જ પછી ચાર રકાઅતો પઢવું મુસ્તહબ છે. કે હદીસમાં ફરમાવ્યું છે કે, “જેણે જોહરથી પહેલા ચાર અને

બાદમાં ચાર રકાઅત પર સુરક્ષા કરી (પઢી), અલ્લાહ તતાલા તેના ઉપર આગ હરામ કરી દેશે.” અલ્લામા સૈયદ તહતાવી ફરમાવે છે કે, પહેલાથી આગમાં દાખલજ થશે નહીં. અને તેના ગુના મિટાવી દેવામાં આવશે અને તેના ઉપર જે તકાજાઓ છે તે અલ્લાહ તતાલા તેના પક્ષોને રાણ કરી દેશે અથવા એ ભાવાર્થ છે કે તેને એવા કામોની તૌફિક આપશે કે જેના ઉપર સજા ન થાય. અને અલ્લામા શામી ફરમાવે છે કે, તેના માટે બશારત છે કે સાચાદત (ઈમાન) પર તેનો ખાત્મો થશે. અને દોઝખમાં જશે નહીં.

મસખલા-(૩૭) : સુન્નત નમાજની મન્નત માની અને પઢી તો સુન્નત અદા થઈ ગઈ. એવીજ રીતે જો શરૂ કરીને તોડી નાખી અને ફરી પણ પઢી તો સુન્નત અદા થઈ ગઈ.

(હર્રી મુખ્યાર, રદ્દુલ મુહતાર)

મસખલા-(૩૮) : નિષ્ફળ નમાજ, મન્નત માની પઢવું, મન્નત વગર પઢવા કરતા બહેતર છે, દા.ત. ફિલાણો બીમાર સારો થઈ જશે તો આટલી નમાજ પઢીશ. એ સુન્નતોમાં મન્નત ન માનવું અફઝલ છે.

(રદ્દુલ મુહતાર)

મસખલા-(૩૯) : મગરિબની નમાજ પછી છે રકાઅતો પઢવું મુસ્તહબ છે. તેમને “સલાતુલ અલ્લાહિન” કહે છે. ભલે એક સલામથી સંઘળી પઢે કે બેદી અથવા ત્રણથી અને ત્રણથી સલામથી અર્થાત દરેક બે રકાઅત પર સલામ ફરવવાનું અફઝલ છે.

(હર્રી મુખ્યાર, રદ્દુલ મુહતાર)

મસખલા-(૪૦) : જોહર તથા મગરિબ તથા ઈશા પછી જે મુસ્તહબ છે તેમાં સુન્નતે મોઅક્કડા શામેલ છે: દા.ત. જોહર પછી ચાર રકાઅત પઢી તો મોઅક્કડા તથા મુસ્તહબ બંને અદા થઈ ગઈ. અને એમ પણ થઈ શકે છે કે મોઅક્કડા તથા મુસ્તહબ બંનેને એક સલામ સાથે અદા કરે અર્થાત ચાર રકાઅત પર સલામ ફરવે

(ફિતહુલકદીર)

મસખલા-(૪૧) : ઈશાના ફર્જ પહેલાની સુન્નતો છુટી જાય તો તેની કંઝ નથી, તે છતાં જો બાદમાં પઢશે તો નિષ્ફળ-મુસ્તહબ છે. તે સુન્નતે મુસ્તહબબા જે ફોત થઈ (છુટી ગઈ) તે અદા ન થઈ

(હર્રી મુખ્યાર, રદ્દુલ મુહતાર)

મસ્ફલા-(૪૨) : દિવસના નિફલમાં એક સલામ સાથે ચાર રકાતથી વધારે અને રાતમાં આઠ રકાત કરતાં વધારે પઢવું મકરૂહ છે. અને અફજલ એ છે કે દિવસ હોય કે રાત, ચાર ચાર રકાત પર સલામ ફરવે. (દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૪૩) : જે સુન્નતો મોઅક્કડા ચાર રકાત છે તેના કઅદાએઉલામાં કેવળ “અત્તહિયાત” પઢે અને જો ભૂલથી દુરૂદ શરીર પઢી લીધું તો સિજદાએ સહવ કરે. અને તે સુન્નતોમાં જ્યારે ગ્રીજા રકાત માટે ઉભો થાય તો સુખભાનક અને અઉઝો પણ ન પઢે અને તે સિવાય બીજી ચાર રકાતવાળા નવાફિલના કઅદાએઉલમાં પણ દુરૂદ શરીરી પઢે અને ગ્રીજા રકાતમાં સુખભાનક અને અઉઝો પણ પઢે એ શર્તે બે રકાત પછી કઅદોહ કર્યો હોય નહીં. તો પથમવાળું સુખભાનક અને અઉઝો કાફી છે. મન્નતની નમાજના પણ કઅદાએ ઉલામાં દુરૂદ પઢે અને ગ્રીજામાં સનાતથાત અલ્યુઝ (અઉઝો) પઢે. (દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૪૪) : ચાર રકાત નિફલ નમાજ પઢ યા અને કાઅદાએઉલા ફોત થઈ ગયો બલ્કે ઈરાદા પૂર્વક પણ તક કરી દીધો તો નમાજ બાતિલ થઈ નહીં. અને ભૂલીને ગ્રીજા રકાત માટે ઉભો થઈ ગયો તો પૂનરાવર્તન કરે નહીં. અને સિજદાએ સહવ કરી દે. નમાજ કામિલ અદા થઈ જશે. જો નાણ રકાતો પઢી અને બીજી પર બેઠો નહીં તો નમાજ ફાસિદ થઈ ગઈ. અને જો બે રકાતની નિયત બાંધી હતી અને કાએદો કર્યા વગર ગ્રીજા માટે ઉભો થઈ ગયો તો પાછો ફરે (એટલો બેસી જાય) નહીં તો નમાજ ફાસિદ થઈ જશે.

(આલમગીરી)

મસ્ફલા-(૪૫) : નમાજમાં કેયામ લાંબો કરવું (વધારે વાર ઉભા રહેવું), વધારે રકાતો પઢવા કરતાં અફજલ છે. અથોંત જ્યારે કે કોઈ મુકર્રર સમય સુધી નમાજ પઢવા ઈચ્છે. દા.ત. બે રકાતમાં એટલો સમય ખર્ચ કરી દેવો, ચાર રકાત નમાજ પઢવા કરતા અફજલ છે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૪૬) : નિફલ નમાજ ધરમાં પઢવું અફજલ છે. પરંતુ તરાવીહ તથા તહિયતુલ મસ્ઝિદ

અને સફર (પ્રવાસ)થી પાછા ફરવા વેળાના બે નફલ, તેને મસ્ઝિદમાં પઢવું બહેતર છે. અને એહરામની બે રકાતોને મીકાતની નજીદીક કોઈ મસ્ઝિદ હોયતો તેમાં પઢવું બહેતર છે. અને તવાફની બે રકાતો “મકામે ઈબ્રાહિમ”ની પાસે પઢે. અને એટેકાફના નવાફિલ અને સૂર્યગ્રહણની નમાજ મસ્ઝિદમાં પઢે અને જો એ ઘ્યાલ હોય કે ધેર જઈને કામોની મશગુલી (વ્યસ્તતા)ના કારણે નવાફિલ છુટી જશે અથવા ધરમાં મન લાગશે નહીં અને ખૂશ્શુઅ (વિનન્તા) ઓછું થઈ જશે તો મસ્ઝિદમાં જ પઢે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૪૭) : નિફલની દરેક રકાતમાં ઈમામ તથા મુનફરિદ એકલા પઢનાર પર કિરાત ફરજ છે. અને જો મુકતદી હોય, જો કે ફરજ પઢનારની પાછળ ઈકતેદા કરી હોય તો ઈમામની કિરાત તેના માટે કાફી છે તેણે પોતે પઢવું જોઈએ નહીં.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

નિફલ નમાજ શરૂ કરીને તોડી

નાખવાના મસાઈલ :

મસ્ફલા-(૪૮) : નિફલ નમાજ ઈરાદાપૂર્વક શરૂ કરવાથી વાજિબ થઈ જાય છે કે જો તેને તોડી નાખશે તો કાગ પઢવી પડશે. અને જો ઈરાદાપૂર્વક શરૂ કરી ન હતી, જેવું કે એ ધારણા હતી કે ફરજ નમાજ પઢવી છે અને ફરજની નિયતથી શરૂ કર્યું પછી યાદ આલ્યુઝ કે પઢી લીધી હતી તો હવે આ નમાજ નિફલ નમાજ છે અને તેને તોડી નાખવાથી કાગ વાજિબ થશે નહીં. એ શર્તે કે યાદ આવતાજ તોડી નાખે. અને યાદ આવવા છતાં તે નમાજને પઢવું ચાલુ રાખ્યું તો તોડી નાખવાથી કાગ વાજિબ થશે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૪૯) : જો વગર ઈરાદે નમાજ ફાસિદ થઈ ગઈ ત્યારે એજ કાગ વાજિબ છે. દા.તત્પરમ્યમુખી નમાજ પઢી રહ્યો હતો અને નમાજ દરમિયાન પાછી પ્રાપ્ત થયું એવી જ રીતે નિફલ પઢતામાં સ્વીને હેઝ(માસિક)આવી ગયું, તો કાગ વાજિબ થઈ ગઈ. તહારત (પાકી) પછી કાગ પઢે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૫૦) : નમાજ શરૂ કરવાના બે પ્રકાર છે એક એકે તહરીમા બાંધી, બીજું એ કે ગ્રીજા રકાત

માટે ઉભો થઈ ગયો, એ શર્ત કે આરંભ સહીહ હોય. અને જો આરંભ સહીહ ન હોય. દા.ત. ઉમ્મી(અનપદ) અથવા સ્ત્રીના પાછળ ઈક્તેદા કરી અથવા બે વુણું નાપાક કપડાઓમાં શરૂ કરી દીધી તો કઝ વાજિબ થશે નહિ.

(રદ્દુલ મુહ્તાર, આલમગીરી)

મસાલા-(૫૧) : ફર્જ પઢવાવાળાની પાછળ નિફલની નિયતથી નમાજ શરૂ કરી, પછી યાદ આવ્યું કે આ ફર્જ મારે પઢવાની છે અને તોડીને એજ ફર્જની નિયતથી ઈક્તેદા કરી જે તે પઢી રહ્યો હતો અથવા તોડીને બીજી નિફલની નિયત કરીને શામેલ થયો તો આ નિફલની કઝ વાજિબ નથી

(હુર્રે મુહ્તાર)

મસાલા-(૫૨) : તુલૂઅ (સ્વર્યોદય) તથા ગુરુબ (સ્વર્યાસ્ત) તથા મધ્યાહનના સમયે નિફલ નમાજ શરૂ કરી તો વાજિબ છે કે તોડી નાખે અને ગેર મકરૂહ સમયમાં કઝ પઢે અને બીજા મકરૂહ સમયોમાં કઝ પઢી તો પણ નમાજ થઈ ગઈ પરંતુ ગુનોહ થયો અને પૂર્ણ કરી લીધી તો થઈ ગઈ, પરંતુ મકરૂહ સમયમાં પઢવું ગુનોહ થયો શરીર કારણો વગર નિફલ શરૂ કરીને તોડી નાખું હરામ છે

(રદ્દુલ મુહ્તાર વિગેરે)

મસાલા-(૫૩) : નિફલ નમાજ શરૂ કરી ભલે ને ચાર રકાતની નિયત બાંધી તો પણ બે જ રકાત શરૂ કરનાર ઠેરવવામાં આવશે, કારણકે નિફલના દરેક શફ્ફ (અથવા રકાત) જુદી જુદી નમાજ છે

(આલમગીરી)

મસાલા-(૫૪) : ચાર રકાત નિફલ નમાજની નિયત બાંધી અને પ્રથમ બે રકાત અથવા પાછળી બે રકાતમાં તોડી નાખી તો બે રકાત કઝ વાજિબ થશે, પરંતુ પાછળી બે રકાત કઝ વાજિબ થવાની એ શર્ત છે કે બીજી રકાત પર કાયદો કરી લીધો હોય. નહિ તો ચાર રકાત કઝ કરવી પડશે.

(હુર્રે મુહ્તાર)

મસાલા-(૫૫) : સુન્નતે મોઅકક્કદા અને મન્નતની નમાજો ચાર રકાતી હોય તો તેને તોડવાથી ચારની કઝ પઢે અને એવી જ રીતે જો ચાર રકાતી ફર્જ પઢનારની પાછળ નિફલની નિયત બાંધી અને તોડી નાખી તો ચાર રકાતની

કઝ વાજિબ છે પ્રથમ બે રકાતમાં તોડી નાખી અથવા બીજીમાં તોડી નાખે તો પણ.

(હુર્રે મુહ્તાર વિગેરે)

મસાલા-(૫૬) : ચાર રકાતની નિયત બાંધી અને ચારેમાં કિરાત ન કરી અથવા પ્રથમ બેમાં અથવા પાછળી બેમાં ન કરી અથવા પાછળી બે પૈકી એક રકાતમાં ન કરી અથવા પાછળી બે પૈકી એક રકાતમાં ન કરી અથવા પ્રથમ બંને અને પાછળીમાંથી એકમાં કિરાત છોડી દીધી તો આ છ

(૬) સ્વરૂપોમાં બે રકાત કઝ વાજિબ છે. અને જો પ્રથમ બેમાંથી એક અને પાછળી બેમાંથી એક અથવા પ્રથમ બેમાંથી એકમાં અને પાછળીની બંનેમાં કિરાત છોડી દીધી તો આ હાલતોમાં ચાર રકાત કઝ વાજિબ છે.

(અમૃતુલ કુતુબ)

મસાલા-(૫૭) : જો બે રકાત પર તશહહુદ જેટલું બેસ્યો પછી તેને તોડી નાખી તો એ હાલતમાં શીલકુલ કઝ નથી એ શર્ત કે ગ્રીજ માટે ઉભો થયો ન હોય. અને પ્રથમ બંનેમાં કિરાત પઢી લીધી હોય (હુર્રે મુહ્તાર) પરંતુ વાજિબ તર્ક કરવાના કારણે તેના પુનરાવર્તન નો હુકમ આપવામાં આવશે.

મસાલા-(૫૮) : નિફલ પઢનારાએ નિફલ પદ નારાની ઈક્તેદા કરી, ભલે તશહહુદમાં જ કરી, તો જે હાલ ઈમામનો છે એ જ હાલ મુકતદીનો છે અર્થાત જેટલીની કઝ ઈમામ પર વાજિબ થશે મુકતદી ઉપર પણ વાજિબ થશે. (હુર્રે મુહ્તાર)

ઉભા થઈને, બેસીને અર્ને આડા પડીને જિફલ પઢવાના મસાઈલ

મસાલા-(૫૯) : ઉભા થઈને નમાજ પઢવાની શક્તિ હોય તે છતાં બેસીને નિફલ પઢી શકે છે, પરંતુ ઉભા થઈને પઢવું અફજલ છે કે હદ્દીસમાં ફરમાવ્યું કે : “બેસીને પઢનારની નમાજ ઉભા થઈને પઢનારની નમાજ કરતા અર્ધીછે” અને ઉગ્રના કારણે બેસીને પઢે તો સવાબમાં કમી થશે નહિ. જે આજકાલ એવો આમ રિવાજ પડી ગયો છે કે નિફલ બેસીને પઢે છે, જાહેર રીતે એવું લાગે છે કે કદાચ બેસીને પઢવાને અફજલ સમજે છે. જો એવું છે તો તેમનો ઘ્યાલ ગલત છે વિત્રના પછી જે બે રકાત નિફલ પઢીએ છીએ તેનો પણ એજ હુકમ છે કે, ઉભા રહીને પઢવું અફજલ છે. અને તેમાં એ હદ્દીસથી

દલીલ લાવવી કે, હુઝૂરે અકદસ સલ્લલાહો અલયહે વસલ્લમે વિત્ર પછી બેસીને નિફલ પઢ યા સહીહ નથી, કારણકે તે હુઝૂરની વિશિષ્ટતા પૈકી છે

સહીહ મુસ્લિમની હદીસ હજરત અખુલ્લાહ બિના ઉમર રદ્દિયલ્લાહો અન્હોથી છે તેઓ ફરમાવે છે કે, મને ખબર પહોંચી કે હુઝૂરે અકદસ સલ્લલાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું છે કે, બેસીને પઢનારની નમાજ ઉભા થઈને પઢનારની નમાજ કરતા અર્ધી છે, તે પછી હું આપની પવિત્ર સેવામાં હાજર થયો તો હુઝૂરને બેસીને નમાજ પઢતા જોયા. આપના પવિત્ર મસ્તક ઉપર મે હાથ મૂક્યો (કે બીમાર તો નથી?) આપે ઈરશાદ ફરમાવ્યો : અય અબહુલ્લાહ શું છે? મે અર્જ કરી : યા રસુલલ્લાહ ! હુઝૂરે તો આવું ફરમાવ્યું છે અને હુઝૂર બેસીને નમાજ પઢો છો. આપે ફરમાવ્યું :- હા, પરંતુ હું તમારા જોવો નથી. ઈમામ ઈશ્રાહિમ હળ્બી તથા દુર્દુલ મુહ્તાર તથા રદ્દુલ મુહ્તારના કર્તાએ ફરમાવ્યું કે આ હુકમ હુઝૂરની વિશિષ્ટતા પૈકી છે અને એજ હદીસથી સનદ રજૂ કરી.

મસ્ખલા-(૬૦) : જો તુફૂઅની હદ સુધી ઝૂકીને નિફલની તહરીમા બાંધી તો નમાજ થશે નહિ (રદ્દુલ મુહ્તાર) લેટીને નિફલ નમાજ પદ્ધતું જાઈજ નથી, જ્યારે કે કોઈ ઊજર ન હોય. અને ઊજરના કારણે હોય તો જાઈજ છે (દુર્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૬૧) : નમાજ ઉભા થઈને શરૂ કરી હતી પછી બેસી ગયો અથવા બેસીને શરૂ કરી હતી, પછી ઉભો થઈ ગયો તો બને હાલતો જાઈજ છે. ભલે એક રકાત ઉભા થઈને પઢી અને એક બેસીને પઢી અથવા એક જ રકાતના એક ભાગને ઉભા થઈને પઢ્યા અને થોડોક ભાગ બેસીને પઢ્યો. (દુર્દુલ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર) પરંતુ બીજી હાલત અર્થात ઉભા થઈને શરૂ કરી પછી બેસી ગયો તેમાં મતલ્બેદ છે. માટે તેનાથી બચવું ઉત્તમ છે.

મસ્ખલા-(૬૨) : ઉભા થઈને નિફલ નમાજ પઢતો હોય અને થાકી ગયો તો અસા (લાકી) અથવા દિવાલને ટેકો લગાવી પઢવામાં વાધો નથી. (આલમગીરી) અને થાક્યા વગર જો એવું

કરે તો કરાહત છે. નમાજ થઈ જશે.

મસ્ખલા-(૬૩) : નિફલ નમાજ બેસીને પઢે તો એવી રીતે બેસે જેવું તશાહુહદમાં બેસીએ છીએ, પરંતુ કિરાતની હાલતમાં નાફ (ઠુઠી) ના નીચે હાથ બાંધેલા રહેજેવું કે કયામમાં બાંધીએ છીએ.

(દુર્દુલ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

ગાડી અને સવારી પર નમાજ પઢવાના મસાઈલ

મસ્ખલા-(૬૪) : શહેરની બહાર (જ્યાંથી કસર વાળ્યિબ થાય છે.) સવારી ઉપર પણ નિફલ પઢી શકાય છે. અને આ હાલતમાં કિબ્લાનું ઈસ્તકબાલ (કિબ્લા તરફ મોં કરવું) શર્ત નથી બલ્કે સવારી જે દિશાએ જઈ રહી હોય તે બાજુ એ જ મોહું હોય અને જો તે દિશાએ મુખ ના હોય તો નમાજ જાઈજ નથી. અને શરૂ કરતી વખતે પણ કિબ્લાની તરફ મુખ હોવું શર્ત નથી, બલ્કે સવારી જે બાજુએ જઈ રહી છે તે બાજુએ હોય અને રૂક્ખ તથા સિજદા ઈશારાથી કરે અને સિજદાનો ઈશારો રૂક્ખ કરતા પસ્ત હોય

(દુર્દુલ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૬૫) : સવારી પર નિફલ પઢવામાં જો તેને હાંકવાની જરૂર પડે અને અમલેકલીલથી હાંકે. દા.ત. એક પગથી એડ લગાવી અથવા હાથમાં ચાબુક છે તેનાથી ડરાવે તો વાંધો નથી અને જરૂરત વગર જાઈજ નથી (રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૬૬) : સવારી પર નમાજ શરૂ કરી, પછી અમલેકલીલ સાથે ઉત્તરી ગયો, તો તેના ઉપર જ બિના કરી શકે છે. ભલે ઉભા થઈને પઢી કે બેસીને, પરંતુ હવે કિબ્લા તરફ મુખ કરવું જરૂરી છે. અને જમીન ઉપર શરૂ કરી હતી, પછી સવાર થયો તો બિના કરી શકતો નથી. નમાજ તુટી ગઈ.

(દુર્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૬૭) : ગાવ અથવા તંબુમાં રહેવાવાળો જ્યારે ગામ અથવા તંબુથી બહાર નીકયો તો સવારી પર નિફલ નમાજ પઢી શકે છે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૬૮) : નિફલ નમાજ શહેર બહાર સવારી ઉપર શરૂ કરી હતી કે પઢતા પઢતા શહેરમાં દાખીલ થઈ ગયો તો જ્યાં સુધી ઘેર પહોંચ્યો નહિ, સવારી પર પૂરી કરી શકે છે. (દુર્દુલ મુહ્તાર)

ગાડી અને સવારી પર ફરજ તથા વાજિબ નમાજ પઠવાના મસાઈલ

મસ્ખલા-(૬૯) : ઉટની (મહભીલ) કાઠી અને સવારીની ગાડી ઉપર નિફલ નમાજ સર્વથા જાઈજ છે, જ્યારે કે એકલો પઢે, અને નિફલ નમાજ જમાતથી પઠવા ચાહે તો તેના માટે એ શર્ત છે કે, ઈમામ તથા મુખતદી અલગ સવારીઓ પર ન હોય (દુર્ભ મુખ્તાર)

મસ્ખલા-(૭૦) : મહભીલ (કાઠી) ઉપર નમાજ તે વખતે જાઈજ છે કે ઉત્તરવા પર પ્રભુત્વ ન હોય. હા જો રોકાએલ હોય અને તેના નીચે લાકડીઓ લગાવી દે કે જમીન ઉપર કાયમ થઈ ગયું તો જાઈજ છે (દુર્ભ મુખ્તાર)

મસ્ખલા-(૭૧) : ગાડાની ધૂસરી જાનવર ઉપર મુશ્કેલી હોય, ગાહું ઉલ્લંઘન હોય કે ચાલતું તેનો હુક્કાનું એજ છે જે જાનવર ઉપર નમાજ પઠવાનો છે. અર્થાત ફરજ, વાજિબ તથા ફજરની સુન્નતો ઊઝર વગર જાઈજ નથી. અને જો ધૂસરી જાનવર ઉપર ન હોય અને રોકાયેલી હોય તો નમાજ જાઈજ છે (દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુખ્તાર) આ હુકમ તે ગાડીનો છે જેમાં બે પૈડા હોય ચાર પૈડાવાળી જ્યારે રોકાયેલ હોયતો કેવળ ધૂસરી જાનવર પર હશે. અને ગાડી જમીન પર સ્થાયી હશે. જેથી જ્યારે ઉભેલ હોય તો તેના પર નમાજ જાઈજ થશે, જેવું કે પાટ ઉપર જાઈજ છે

ફરજ તથા વાજિબ સવારી અથવા ગાડી ઉપર પઠવાના, ઉઝરો

મસ્ખલા-(૭૨) : ગાડી અને સવારી ઉપર નમાજ પઠવા માટે આ ઉઝરો છે. (૧) વરસાદ પડી રહ્યો હોય (૨) એટલા પ્રમાણમાં કાદવ કિયદ હોય કે જો ઉત્તરીને નમાજ પઢીએ તો મોહું કાદવમાં ખૂપી જાય અથવા કીચડમાં ખરડાઈ જાય અથવા જે કપું બીછાવીએ તે સાવ લથપથ થઈ જાય અને આવી પરિસ્થિતિમાં સવારી ન હોય તો ઉભા (ઉભા ઈશારાથી પદબું) (૩) સાથીઓ ચાલ્યા જશે કે અથવા (૪) સવારીનું જાનવર તોકાની છે કે સવાર થવામાં મુશ્કેલી થશે, મદદગારની જરૂરત પડશે અને મદદગાર મોજુદ નથી અથવા (૫) તે વૃદ્ધ છે કે

મદદગાર વગર ચઢી ઉત્તરી શક્ષેનહિ અને મદદગાર હાજર નથી અને એજ હુકમ સ્ત્રી માટે છે. (૬) બીમારીમાં વધારો થશે (૭) જાન (૮) માલ (૯) સત્તીની આંબડુ જવાની આંશકા હોય (દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુખ્તાર)

ચાલતી રેલગાડી ઉપર ફરજ, વાજિબ તથા

ફજરની સુન્નતો થઈ શકતી નથી. અને તેને જહાજ તથા નૌકાના હુકમમાં કલપવું ભૂલ છે. કારણકે, નૌકા જો રોકવામાં પણ આવે તી પણ જમીન ઉપર ન થોભશે. અને રેલગાડી એવી નથી. અને નૌકા ઉપર પણ તે વખતે નમાજ જાઈજ છે: જ્યારે તે દરિયાની વચ્ચે હોય. ત્રિનારા ઉપર હોય, અને ખુશ્કી પર આવી શકતા હોય તો તેના ઉપર પણ જાઈજ નથી. જેથી જ્યારે સ્ટેશન ઉપર ગાડી થોબે તે સમયે આ નમાજો પઢે. અને જો એમ લાગે કે નમાજનો સમય જતો રહેશે તો જેવી રીતે પણ શક્ય હોય ન માજ પઢી લે, પછી જ્યારે બોગે મળેપુનરાવર્તન કરી લે કે જ્યાં ઈબાદત ના હેતુની કોઈ શર્ત અથવા રૂકન વિલુખ હોય ત્યાં તેનો એજ હુકમ છે.

મસ્ખલા-(૭૨) : મહભીલ (અંબાડી) ની અંદર એક બાજુએ પોતે સવાર છે અને બીજી બાજુએ તેની માં અથવા પત્ની અથવા બીજી કોઈ મહેરમ વ્યક્તિ પૈકી છે, જે પોતે સવાર થઈ શકતી નથી અને તે પોતે ચઢી-ઉત્તરી શકે છે. પરંતુ તેના ઉત્તરવાથી મહીમલ ઉથલી પઠવાનો સંભવ છે, તો તેણે પણ તેના ઉપર નમાજ પઠવાનો હુકમ છે. (દુર્ભ મુખ્તાર)

મસ્ખલા-(૭૩) : જાનવર અને ચાલતી ગાડી પર અને તે ગાડી ઉપર જેની ધૂસરી જાનવર ઉપર હોય, શરીર ઊઝર વગર ફરજ તથા ફજરની સુન્નતો તથા સધળા વાજિબો જેવા કે વિનિત તથા નઝર (મન્નત) ની નમાજ અને નિફલ જેને તોડી નાંખી હોય અને સિજદાની આપતકે જે જમીન પર તિલાવત કરી હોય તો તેનો સિજદો તેના ઉપર અદા કરી શકતા નથી. અને જો ઉઝરના લીધે હોય તો તે સધળામાં એ શર્ત છે કે જો શક્ય હોય તો કિયલા તરફ ઉભા થઈને અદા કરે. નહિ તો જેવું પણ શક્ય હોય. (દુર્ભ મુખ્તાર)

મસ્થલા-(૭૪) : કોઈએ મન્નત માની કે બે રકાતો તહારત (પાકી) વગર પઢશે, તેમાં કિરાત ન કરશે અથવા નજીન હાલતમાં પઢશે અથવા એક અથવા અધીરકાતની મન્નત માની તો તે સંઘળી સૂરતોમાં તેના ઉપર તહારત, કિરાત તથા સતર સાથે બે રકાત વાજિબ થઈ ગઈ. અને ત્રણની મન્નત માની તો ચાર રકાત વાજિબ થઈ.

(દુર્ભુખતાર, રદ્દુલ મુહતાર, આલમગીરી)
મસ્થલા-(૭૫) : મન્નત માની કે ફલાણાં સ્થળે ન નમાજ પઢશે અને તેનાથી ઓછા દરજાના સ્થળ ઉપર અદા કરી તો તે મન્નત થઈ ગઈ. દા.ત. મસ્ઝિદે હરામમાં પઢવાની મન્નત માની, અને મસ્ઝિદે કુદસ અથવા ઘરની મસ્ઝિદમાં અદા કરી, મન્નત માની કે કાલે ન નમાજ પઢશે. અથવા સ્ત્રીએ મન્નત માની કે રોજો રાખશે, બીજા દિવસે તેને હૈજ (માસિક) આવી ગયું તો કરા કરે. અને જો એ મન્નત માની કે હૈજની હાલતમાં બે રકાત ન નમાજ પઢશે તો કાંઈ નથી. (તેની કરા નથી)

(દુર્ભુખતાર)

મસ્થલા-(૭૬) : મન્નત માની કે આજ બે રકાત ન નમાજ પઢશે અને આજ ન પઢી તો તેની કરા નથી, બલ્કે કફફારો આપવો પડશે.

(આલમગીરી)

(નોટ : તેનો કફફારો એજ છે જે કસમ તોડવાનો છે. અર્થાત એક ગુલામ આજાદ કરવો અથવા દસ મિસ્કીનોને બંને ટાઈમ પેટ ભરીને ખાણું ખવડાવવું અથવા દસ મિસ્કીનોને કપડા આપવું અથવા ત્રણ રોજા રાખવા.)

મસ્થલા-(૭૭) : આખા મહિનાની ન નમાજની મન્નત માની તો એક મહિનાના ફર્જ તથા વિત્રની જેમ તેના ઉપર વાજિબ છે. સુન્નતની જેમ નહીં. પરંતુ વિત્ર તથા મગરિબના સ્થાને ચાર રકાત પઢે અર્થાત દરરોજ બાવીસ રકાતો પઢે.

(આલમગીરીં)

મસ્થલા-(૭૮) : જો ઉભા થઈને ન નમાજ પઢવાની મન્નત માની, તો ઉભા થઈને પઢવું વાજિબ છે. અને સર્વથા ન નમાજની મન્નત છે તો અપત્યાર છે

(તે ઉભા થઈને પઢે કે ન પઢે.)

(આલમગીરી, દુર્ભુખતાર)

ચેતવણી : નવાફિલ તો બહુજ છે, મમનુઅ (મના કરૈલ) સમયો સિવાય આદિભીજટલા નિફલો પઢવા ચાહે પઢે, પરંતુ તે પૈકી કેટલાક જે હુશ્રે સૈયહુલમુરસલીન સલ્લાહો અલયહે વસ્લ્યમ તથા દીનના ઈમામોથી મરવી (રિવાયત) છે. બયાન કરવામાં આવે છે.

તહિયતુલ-મસ્જિદ :

જે શાખ મસ્જિદમાં આવે તેણે બે રકાત ન નમાજ પઢવી સુન્નત છે. બલ્કે બેહતરતો એ છે કે ચાર પઢે. બુખારી તથા મુસ્લિમ, અબૂ કતાદાહ રદીયક્ષાહો અન્હોથી રિવાયત કરે છે કે, જે શાખ મસ્જિદમાં દાખલ થાય, બેસવાથી પહેલાં બે રકાત (નિફલ) પઢી લે.

મસ્થલા-(૭૯) : એવા સમયે મસ્જિદમાં આવ્યો કે જેમાં નિફલ ન નમાજ પઢવી મકરૂહ છે. દા.ત. તુલૂઅમાં ફરજ પછી અથવા અસરની ન નમાજ પછી, તો "તહિયતુલ મસ્જિદ" ન પઢે, બલ્કે તત્સીહ તથા તહલીલ તથા હૃદદ શરીફમાં મશગુલ થાય. મસ્જિદનો હક્કાદા થઈ જશે. (દુર્ભુખતાર)

મસ્થલા-(૮૦) : ફરજ અથવા સુન્નત અથવા કોઈ ન નમાજ મસ્જિદમાં. પઢી લીધી તો "તહિયતુલ મસ્જિદ" અદા થઈ ગઈ. ભલે તહિયતુલ મસ્જિદની નિયત ન કરી હોય. આ ન નમાજનો હુકમ તેના માટે છે, જે ન નમાજની નિયતથી મસ્જિદમાં ન ગયો બલ્કે દર્સ તથા જિક વિગેરમાટે ગયો હોય જો ફરજ અથવા ઈકતેદાની નિયતથી મસ્જિદમાં ગયો. તો એજ તહિયતુલ મસ્જિદના કાયમ મુકામ છે. એ શર્તે કે મસ્જિદમાં દાખલ થયા પછી જ પઢે. અને જો થોડા ટાઈમ પછી પઢશે તો તહિયતુલ મસ્જિદ પઢે.

(દુર્ભુખતાર)

મસ્થલા-(૮૧) : બેહતર એ છે કે બેસવાથી પહેલાં તહિયતુલ મસ્જિદ પઢી લે. અને પઢ્યા વગર બેસી ગયો તો સાકિત (રદ) ન થઈ, હવે પઢી લે.

(દુર્ભુખતાર વિગેરે)

મસ્થલા-(૮૨) : દરરોજ એક વખત તહિયતુલ મસ્જિદ કાફિ છે, દરેક વખતે જરૂરી નથી. અને જો

કોઈ કારણોસર કે તહિયુલ મરિજદ પઢી શકતો નથી, તો ચાર વખત સુભાનલ્લાહો વલ હમ્દોલિલ્લાહો વલાઈલાહો ઈલ્લલ્લાહો વલાહો અકબર પછે.
(હર્ષ
મુહ્તાર)

"તહિયુલ વુજૂ"

તહિયુલ વુજૂને વુજૂ પછી અવયવો સુકાતા પહેલા બે રકાત નમાજ પઠવી મુસ્તહબ છે. સહીહ મુસ્લિમમાં છે કે નભીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાયું : જે શાખ્સ વુજૂ કરે અને સારુ વુજૂ કરે અને જાહિર તથા બાતિન (બાહ્ય તથા આંતરિક) સાથે ધ્યાનિત થઈને બે રકાત પછે તેના માટે જન્ત વાચિબ થઈ જાય છે.

મસ્ખલા-(૮૩) : ગુસ્લ પછી પણ બે રકાત નમાજ (પઠવી) મુસ્તહબ છે. વુજૂ પછી ફરજ વિગેરે પદ્ધા તો તહિયુલ વુજૂના કાયમ મુકાન થઈ જશે.
(રદ્દુલ મુહ્તાર)

ઈશરાકની નમાજ :

તિરમીજી, અનસ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુજૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાયું કે, જે માઝાસ ફજરની નમાજ જમાઅતથી પઢીને જિક્ર ખુદા કરતો રહ્યો, ત્યાં સુધી કે સૂરજ બુલંદ થઈ ગયો, પછી બે રકાતો પઢી તો તેને પુરી હજુ તથા ઉમરાનો સવાબ મળશે.

ચાશતની નમાજના ફરજાઈલ :

ચાશતની નમાજ મુસ્તહબ છે. ઓછામાં ઓછી તેની બે અને વધુમાં વધુ બાર રકાતો છે. અને અફગાલ બાર છે. કે (૧) હદીસમાં છે. કે જેણે ચાશતની બાર રકાતો પઢી અલ્લાહ તથાલા તેના માટે જન્તમાં સોનાના મહેલ બનાવશે. આ હદીસને તિરમીજી તથા ઈન્નેમાજાએ અનસ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરી. (૨) સહીહ મુસ્લિમમાં અભૂતર રદીયલ્લાહો અન્હોથી મરવી છે કે, હુજૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે આદમી પર તેના દરેક જોડ (સાંઘા) ના બદલે સદકો છે. (શરીરમાં કુલ ત્રણસો સાઈઠ જોડ છે.) દરેક તરફીહ સદકો છે. અને દરેક હમદ સદકો છે. અને લાઈલાહો ઈલ્લલ્લાહ કહેવું સદકો છે. અને

અલ્લાહો અકબર કહેવું સદકો છે. અને સારી વાતનો હુકમ કરવો સદકો છે. અને બુરી વાતથી મના કરવું સદકો છે. અને આ સૌની તરફથી ચાશતની બે રકાતો ડિફાયત કરે છે.

(ત થી ૫) તિરમીજી, અભૂદરદા તથા અભૂતરથી અને અભૂદાઉં તથા દારોમી નઈમાલિન હેમારથી અને અહમદ, આ સધાનાઓથી રિવાયત કરે છે. હુજૂર સલ્લલ્લાહો અલયહે પસલ્લબન ફરમાવે છે. અથ ઈન્ને આદમ ! દિવસના આરંભમાં મારા માટે ચાર રકાતો પઢીલે, દિવસના અંત સુધી હું તારી ડિફાયત કરીશ.

(૬) તિબાની અભૂદરદા રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે નભીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, જેણે બે રકાતો ચાશતની પઢી તેને ગાફિલોમાં લખવામાં આવશે નહીં. અને જે ચાર પછે આખીદોમાં લખવામાં આવશે. અને જે છ પછે, તે દિવસે તેની ડિફાયત કરવામાં આવી. અને જે આઠ પછે અલ્લાહ તેને કાનેતીન (વિલાયતનો એક દરજા) છે.) માં લખશે. અને જે બાર પછે અલ્લાહ તથાલા તેના માટે જન્તમાં એક મહેલ બનાવશે. અને કોઈ દિવસ અથવા રાત એવી નથી જેમા અલ્લાહ તથાલા બંદાઓ પર એહસાન તથા સદકો ન કરે. તે બંદાથી વધીને કોઈ ઉપર એહસાન ન કર્યો જેને પોતાનો જિક ઈલ્હામ કર્યો (૭) અહમદ તથા તિરમીજી તથા ઈન્નેમાજા, અભૂ હુરયરહ રદીયલ્લાહો અન્હોથી રાવી કે હુજૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે, જે માઝાસ ચાશતની બે રકાતપર રક્ષા કરે તેના ગુનાહ બક્ષી દેવામાં આવશે. ભલેને દરિયાના કીંશ બરાબર હોય.

મસ્ખલા-(૮૪) : ચાશતનો સમય સૂરજ બુલંદ થયા પછી જવાલ અથવિત શરીર મધ્યાહન સુધી છે. અને બેહતર એ છે કે ચોથાઈ દિવસ ચઢે ત્યારે પછે..

(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)
નમાજે સફર :

સફર (પ્રવાસ) માં જતા સમયે બે રકાત નમાજ પોતાના ધરમાં પઢીને જાવ, તિબાની ની હદીસમાં છે કે, કોઈએ પોતાના અહલ (પરિવાર) પાસે તે બે રકાત કરતાં ઉત્તમ કાંઈ ન છોડયું, જે

સફરના ઈરાદાના સમયે તેમની પાસે પછી.

સફરથી પાછા આવવાની નમાજ :

પ્રવાસથી પાછા આવીને બે રકાતો મસ્જિદમાં એદા કરે. સહીહ મસ્લિમમાં કાયબબિન માલિક રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સહ્લલ્લાહો અલયહે વસલ્લભ માં પ્રવાસથી દિવસમાં ચાશ્તના સમયે તશરીફ લાવતા અને સૌથી પ્રથમ મસ્જિદમાં જતા અને બે રકાતો નમાજ તેમાં પઢતા, પછી ત્યાં જ મસ્જિદમાં (થોડીકવાર) બેસતા.

મસ્ખલા-(૮૫) : મુસાફિરે દરેક મણીલ (પડાવ) માં બેસવાથી પહેલા બે રકાત નિફલ પઢવી જોઈએ. જેવું કે હુઝૂરે અકદસ સહ્લલ્લાહો અલયહે વસલ્લભ કર્યો કરતા હતા. (રદ્દુલ મુહતાર)

સલાતુલ લૈલ :

રાતમાં ઈશાની નમાજ પછી જે નિફલ પદ વામાં આવે છે તેને "સલાતુલ લૈલ" કહે છે. અને રાતની નિફલો દિવસની નિફલો કરતા અફગલ છે. કે (૧) સહીહ મુસ્લિમમાં મરહુનઅન રિવાયત છે, ફર્જો પછી અફગલ નમાજ રાતની નમાજ છે. (૨) અને તિથાનીએ મરહુનઅન રિવાયત કરી છે કે રાતમાં થોડીક નમાજ જરૂરી છે ભલે એટલી જ વારની હોય જેટલી વારમાં બકરી દોહી લઈએ છીએ અને ઈશાની ફર્જ પછી જે નમાજ પઢી તે "સલાતુલ લૈલ" છે.

તહજુદ :

મસ્ખલા-(૮૬) : અને એજ સલાતુલ લૈલનો એક પ્રકાર તહજુદ છે. કે ઈશા પછી રાતમાં સુઈ રહીને ઉકે અને નવાફિલ પઢે. સુઈ રહેવાથી પહેલાં જે કાંઈ પઢે તે તહજુદ નથી.

(રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૮૭) : "તહજુદ" નિફલ નમાજનું નામ છે, જો કોઈ માણસ ઈશા પછી સુઈ રહ્યો પછી ઉઠીને કર્યા પઢે તો તેને તહજુદ કહીશું નહીં.

(રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૮૮) : તહજુદની ઓછામાં ઓછી બે રકાતો છે. અને હુઝૂરે અકદસ સહ્લલ્લાહો અલયહે વસલ્લભ મથી આઠ રકાત સુધી સાખીત

છે. નબીએ કરીમ સહ્લલ્લાહો અલયહે વસલ્લભ મે ફરમાવ્યું કે, જે માનવી રાતમાં જાગૃત થાય અને પોતાના અહલ (પત્ની/પતિ) ને જગાડે પછી બંને બે બે રકાતો પઢેતો કસરતથી (અધીક પ્રમાણમાં) યાદ ખુદા કરવાવાળાઓ માં લખવામાં આવશે. આ હદીસને નિસાઈ તથા ઈબ્નેમાજા પોતાની સુનનમાં અને ઈબ્નેહિબ્બાન પોતાની સહીહમાં અને હાકીમે મુસ્તાદરકમાં રિવાયત કરી અને મુન્હેરીએ કહ્યું આ હદીસ શૈખેન (હજરત ઈમામ બુખારી તથા હજરત ઈમામ મુસ્લિમ) ની શર્ત મુજબ સહીહ છે.

(રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૮૯) : જે શખ્સબે તૃતીયાંશ રાત્રી સુઈ રહેવા માંગે અને એક તૃતીયાંશ રાત સુધી ઈબાદત કરવા ઈચ્છે તેના માટે અફગલ એ છે કે પ્રથમ અને પાછલી તૃતીયાંશમાં સુઈ રહે અને વચ્ચેના ભાગમાં ઈબાદત કરે અને જો અર્ધ રાત્રી એ સુઈ રહેવા ઈચ્છે છે અને અર્ધ રાત્રી જાગવા ચાહે છે તો પાછલા અર્ધમાં ઈબાદત અફગલ છે. કે (૫) સહીહ બુખારી તથા મુસ્લિમમાં અબુહુરૈષ રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુઝૂરે ફરમાવ્યું કે રખ્ય અજગલ દરેક રાતમાં જ્યારે પાછલો તૃતીયાંશ બાકી રહે છે તો આસમાને દુનિયા ઉપર ખાસ તજલ્લી કરે છે. અને ફરમાવે છે કે, છે કોઈ હુઅા કરનાર કે તેની હુઅા કખુલ કરું, છે કોઈ માંગનાર કે તેને આપું, છે કોઈ મગફીરત ઈચ્છનાર કે તેની અભીસ કરી દઉં અને સૌથી વધીને તો નમાજે દાઉં (અલયહિસ્સલામ) છે કે (૬) બુખારી તથા મુસ્લિમ અબુહુરૈષ બિન ઉમર રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુઝૂરે ફરમાવ્યું સૌ નમાજોમાં અલ્લાહ અજગલ જલ્લને વધારે મહેબુલ નમાજે દાઉં છે કે, તેઓ અધી રાત સુઈ રહેતા અને તૃતીયાંશ રાત ઈબાદત કરતા પછી છકા ભાગમાં સુઈ રહેતા.

મસ્ખલા-(૯૦) : જે માણસ તહજુદનો આદી (આદત વાળો) હોય, ઉંઘર વગર તેને છોડવું મકરણ છે કે (૭) સહીહ બુખારી તથા મસ્લિમની હદીસમાં છે કે હુઝૂરે અકદસ સહ્લલ્લાહો અલયહે વસલ્લભ મે અબુહુરૈષ બિન ઉમર રદીયલ્લાહો અન્હોને ફરમાવ્યું કે અથ અબુહુરૈષ ! તું ફલાણ માણસના

જેવો ન થતો કે, રાતમાં ઉઠયા કરતો હતો પછી (ઉઠવું) છોડી દીધું (૮) બુખારી તથા મુસ્લિમ વગેરેમાં છે કે આપે ફરમાવ્યું કે અલ્લાહને આ માલમાંઅધિક પસંદ તે છે કે સર્વદા થયા કરે. ભલે થોડું જ હોય.

મસ્ખલા-(૮૧) : ઈદૈન (બંને ઈદો) અને શાબાનની પંદરમી રાત અને રમઝાનની અતીમ દસ રાતો અને જિલહિજજાને પહેલી દસ રાતોમાં શબબેદારી (રાત્રી જાગરણ) મુસ્તહબ છે. રાતના અકસર (બહુધા) ભાગમાં જાગવું પણ શબબેદારી છે, (દુર્ઘતાર) ઈદૈનની રાતોમાં શબબેદારી એ છે કે, ઈશાતથા સવારની નમાજો જમાઅતે (ઉલાથી થાય કે), સહીહ હદીસમાં ફરમાવ્યું છે કે, જેણે ઈશાની નમાજ જમાઅતથી પઢી તેણે અધીરાત્રી ઈબાદત કરી અને જેણે ફજરની નમાજ જમાઅતથી પઢી તેણે સમગ્ર રાત ઈબાદત કરી અને જો આ રાતોમાં જાગશે તો ઈદની નમાજ કુર્બાની વિગેરેમાં મુશ્કેલી પડશે માટે તેના ઉપર જ સંતોપ માને અને જો આ કામોમાં તફક્વત ન આવે તો જાગવું બહુજ ઉત્તમ છે.

મસ્ખલા-(૮૨) : આ રાતોમાં એકલા નિફલ નમાજો પદવું અને તિલાવતે કુર્માન અને હદીસ પદવું અને સાંભળવું અને દુર્ઘટ શરીરક પદવું શબબેદારીછે, નકે ખાલીજાગવું. (રદ્દુલ મુહતાર) સલાતુલ લૈલ વિષે આઠ હદીસો આનુસંગિક ઉપર મજુકર થઈ હવે તેના ફિજાઈલની કેટલીક હદીસો સાંભળો.

હદીસ-(૮) : તિરમિઝી, ઈબ્ને માજા તથા હાકીમ શૈખેનની શર્ત ઉપર અબુલ્લાહ બિન સલામ રદ્દીયલ્લાહો અન્હોની રિવાયત કરે છે. કે રસૂલુલ્લાહ સલલ્લાહો અલયહે વસલ્લમ જ્યારે મદ્દીનામાં પદાર્થી તો લોકો અધિકતાથી આપની સેવામાં હાજર થયા, હું પણ હાજર થયો જ્યારે મે હુઝૂરના ચહેરાને ધ્યાનથી દેખ્યો તો ઓળખી લીધો કે આ મુખું જુડાઓનું મુખું નથી. તેઓ પોતે કહે છે કે મે હુઝૂરથી પ્રથમ વાત સાંભળી તે એ છે કે આપે ફરમાવ્યું-અય લોકો સલામ પ્રસિધ (વ્યાપક) કરો અને ખાશું ખવડાવો અને સંબધીઓથી નેક સુલુક (સદવર્તિવ) કરો. અને રાતમાં નમાજ

પઢો જ્યારે કે લોકો નિદ્રાવિન હોય. આવું કરવાવાળા સલામતી પૂર્વક જન્તમાં દાખલ થશે. હદીસ-(૧૦) : હાકીમે બઈ ફાદાએ સહીહ રિવાયત કરી કે અબુ હુઝીરહ રદ્દીયલ્લાહો અન્હોએ સવાલ કર્યો હતો કે કોઈ એવી ચીજ બતાવો કે તેના ઉપર અમલ કરું તો જન્તમાં દાખલ થાઉં, તેના ઉપર પણ એ જ જવાબ મળ્યો.

હદીસ - (૧૧-૧૨) : તિબ્રાની કબીરમાં હસન સનદોથી તથા હાકીમ બઈ ફાદાએ તસહીહ શૈખેનની શર્ત પર અબુલ્લાહ બિન ઉમર રદ્દીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુઝૂર ફરમાવે છે, જન્તમાં એક બાલા માનું (જરૂરું) છે કે બહારની વસ્તુ અંદરથી દેખાય છે અને અંદરનું બહારથી દેખાય છે. અબુ માલિક અશારી એ અર્જ કરીકે યા રસૂલુલ્લાહ તે કોના માટે છે, આપે ફરમાવ્યું તેના માટે કે જે સારી વાત કરે અને (ખાવાનું ખવડાવે) અને રાતમાં કિયામ કરે જ્યારે કે લોકો નિદ્રાવિન હોય અને તેના જેવું જ અબુ માલિક અશારી રદ્દીયલ્લાહો અન્હોથી પણ મરવી છે.

હદીસ - (૧૩) : બયહકીની એક રિવાયત અસમાનિતે યજીદ રદ્દીયલ્લાહો અન્હોથી છે કે (હુઝૂર) ફરમાવે છે કિયામતના દિવસે લોકો એક મેદાનમાં ભેગા કરવામાં આવશે. તે સમયે મુનાદી પોકારશે. કયાં છે તેઓ જે મની કરવટો ખ્વાબગાહો (શયનખંડો) થી અલગ થતી હતી, તે લોકો ઉભા થશે અને તેથોડા હશે. તેઓ વગર હિસાબે જન્તમાં દાખલ થશે. પછી બીજા લોકો માટે હિસાબનો હુકમ થશે.

હદીસ - (૧૪) : સહીહ મુસ્લિમમાં જાબિર રદ્દીયલ્લાહો અન્હોથી મરવી છે કે, હુઝૂર ઈરશાદ ફરમાવે છે, રાતમાં એક એવી પળ છે કે મર્દું મુસ્લિમાન તે ઘરી (કષાળમાં) અલ્લાહ તાઆલાથી હુનિય: તથા આખેરતની જ ભલાઈ માંગે તે તેને આપશે. અને આ દરેક રાતમાં છે.

હદીસ - (૧૫ થી ૧૯) : તિરમિઝી અબુઓમામા બાહેલી રદ્દીયલ્લાહી અન્હોથી રાવી કે (હુઝૂર) ફરમાવે છે: કિયામુલ્લેલને પોતાના ઉપર લાજીમ (જરૂરી) કરી લો કે, આ અગાઉના નેક લોકોનો તરીકો છે અને તમારા રબ્બની તરફ નિકટતાનું

માધ્યમ છે. અને સૈયાત (ગુનાહો) ને મટાડનાર અને ગુનાહોથી રોકનાર છે. અને સત્ત્વાન ફારસી રદ્દિયલ્લાહો અન્ધોની રિવાયતમાં એ પણ છે કે શરીરમાંથી બીમારી દરેક કરનાર છે.

રાતમાં પટવાની કેટલીક દુચાઓ :

હદીસ-(૧૭) : સહીએ બુખારીમાં ઉબાદહ બિન સામિત રદ્દિયલ્લાહો અન્ધોથી રિવાયત છે કે, હુજુર સત્ત્વલ્લાહો અલયહે વસત્ત્વલમ ફરમાવે છે કે, જે માણસ રાતમાં ઉઠે અને આ દુચા પઢે :

લાઈલાહા ઈલ્લલાહો વહદહુ લાશરીકલહુ
લહુલ મુલ્કો વહદહુ લહુલ વહુવા અલા કુલ્લે શેઈન
કદીર વ સુબ્હાનલ્લાહે વહ લહુલ લિલ્લાહે
વલાઈલાહા ઈલ્લલાહો વહલાહો અકબુર વહા
હૌલ વહાકુષ્યતા ઈલ્લા બિલ્લાહે રજીગ ફિરલી.
(તરજુમો - અલ્લાહ સિવાય કોઈ માઅબૂદ નથી,
તે એકલો છે. તેનો કોઈ શરીક (ભાગીદાર) નથી.
તેના માટે મુલક (બાદશાહીત) છે અને તેનાજ માટે
હમદ (સ્તુતિ) છે અને તે દરેક વસ્તુ પર કાદિર
(શક્તિમાન) છે. અને પાક છે અલ્લાહ અને હમદ
છે અલ્લાહ માટે અને અલ્લાહ સિવાય કોઈ
માઅબૂદ (પૂજ્ય) નથી. અને મહાન છે. અને
નથી ગુનાહોથી ફરવું અને ન નેકીની શક્તિ, પરંતુ
અલ્લાહની સાથે અય મારા પરવરદિગાર તું મને
બખ્શી દે.) આ દુચા પઢ્યા પછી જે દુચા કરશે.
મકબુલ (માન્ય) થરો અને જો વુજુ કરીને ન માઝ
પઢ્યો તો તેની ન માઝ મકબુલ થરો.

હદીસ-(૧૮) : સહીએ બુખારીતથા સહીએ મુસ્લિમ શરીરમાં હજરત અખ્દુલ્લાહ ઈબને અખ્બાસથી રિવાયત છે કે, હુજુર નબીએ કરીમ સત્ત્વલ્લાહો
અલયહે વસત્ત્વલમ રાતે તહજીદુની ન માઝ પઢવા
માટે ઉઠાતા ત્યારે આ દુચા પઢતા હતા.

“અલ્લાહુમ્મ લકલહુમ્મો અન્ન કૈયેમુસ્સમાવાતે
વલખર્દ વમન ફીહિન્ન વહ કલહુમ્મો અનતત
નુરુસ્સમાવાતે વલખર્દ વમન ફીહિન્ન વહ કલહુમ્મો
અન્ન મલેકુસ્સમાવાતે વલખર્દ વમન ફીહિન્ન
વહ કલહુમ્મો અનતલકુકો વ વઅદોકલકુકો વ
લિકાઓકા હક્કુન વકીલોકા હક્કુન નવજ્જનન્તોક
કંકુન વન્નારો હક્કુન વન્નારો હક્કુન વન્નાખીઓના હક્કુન વ મુહમ્મદુન હક્કુન

વરસાઅતો હક્કુન અલ્લાહુમ્મ ! લકા અસ્લભો વ
બેકા આમન્તો વઅલૈકાતવક્કલ્લો વ ઈલૈકા અનભો
વ બેકા ખાસભો વઈલૈકા ડાકભો ફંફીરલી
માકદમ્ભો વમા અખ્યર્તો વમા અસ્રત્રો વમા
અઅલન્તો વમા અન્ન અસ્લભો બેહિ મિન્ની
અન્નાલ મુકદમ્ભો વઅન્નાલ મુઅખ્યેરો લાઈલાહા
ઈલ્લા અન્ન વલાઈલાહા ગૈરોકા.”

(તરજુમો : ઈલાહી તારાજ માટે હમદ (સ્તુતિ) છે,
આસ્માન તથા જમીન અને જે કાંઈ તેઓમાં છે સૌને
તું કાયમ રાખવા વાળો છે. અને તારા માટે જ હમદ
છે. આસ્માન તથા જમીન અને જે કાંઈ તેઓમાં છે.
સૌનુંતુનૂર છે. અને તારા માટે જ હમદ છે. આસ્માન
તથા જમીન અને જે કાંઈ તેઓમાં છે. તું સૌનો
બાદશાહ છે અને તારાજ માટે હમદ છે. તું હક છે
અને તારો વાયદો હક (સત્ય) છે અને તારાથી મળ
વું (કાયમતમાં) હક છે અને જન્નત હક છે અને
દોખખ હક છે અને અંબીયા હક છે અને મુહમ્મદ
(સત્ત્વલ્લાહો અલયહે વસત્ત્વલમ) હક છે. અને
ક્રેમત હક છે. અય અલ્લાહ તારા માટે હું ઈસ્લામ
લાભ્યો (ઈસ્લામ સ્વીકાર્યો) અને તારાજ ઉપર ઈમાન
લાભ્યો અને તારાજ ઉપર તવક્કુલ (ભરોસો) કર્યો
અને તારા તરફજ રજૂ થયો અને તારીજ મદદથી
પૂરુષત (યુધ્ય) કર્યું અને તારીજ તરફ ફેસલો લાભ્યો,
પસ તું બખ્શીદે મારા માટે તે ગુનોહ જે મેં પહેલા
કર્યો અને પાછળથી કર્યો અને દુપાવીને કર્યો અને
અલાનીયા કર્યો અને તે ગુનોહ જેને તું મારા કરતાં
વધારે જાણે છે, તું જ આગળ વધારનાર છે અને તું
જ પાછળ હઠાવનાર છે, તારા સિવાય કોઈ મઅબૂદ
નથી.)

આ એક દુચા અને કેટલીક હદીસોનો ઉલ્લેખ
કરી દેવામાં આવ્યો અને તદઉપરાંત તે ન માઝ ના
ફિક્હીલમાં અધિકતાથી હદીસો આવેલી છે જેને
અલ્લાહ તૌકીક આપે તેના માટે એજ કાફી છે,

નમાઝે ઈસ્ટોખારા :

સહીએ હદીસ, જેને મુસ્લિમ સિવાય
મુહદિસોની જમાઅતે જાબિર બિન અખ્દુલ્લાહ
રદ્દિયલ્લાહો અન્ધોથી રિવાયત કરી, ફરમાવે છે કે
રસૂલુલ્લાહ સત્ત્વલ્લાહો અલયહે વસત્ત્વલમ અમોને
સથળા કાર્યોમાં ઈસ્ટોખારાની તાલીમ ફરમાવતા,

જેવું કે કુઅનીની સુરત તખલીમ ફરમાવતા (શીખવતા) હતા. આપ ફરમાવે છે જ્યારે કોઈ કોઈ કોમનો નિર્ણય કરે તો બે રકાત નિફલ પઢે, પછી કહે. “અલ્લાહુમાઇની અસ્તખીડકા બે ઈલ્મેકા વાસસતક દેરકા બે કુદરતેકા વ અસ અલુકા મિન ફદ્લેકલ અગીમે ફઈન્નકા તકદીર વલા અકટેરુ વતખલમો વલા અખલમો વ અન્તા અલ્લામુલ ગુયબે અલ્લાહુમા! ઇન્કુન્તાત અખલમો અન્ન હાજલ અગ્રેખેરુલીકી દીનીવમાશી વ આકેબતે અમરી, અવ કાલ આજિલે અમરી વ આજેલેહિ ફકુરહોલી વયસ્થિસરહોલી સુખ્મા બારિકલી ફીહે વર્ધિન્કુન્તાત અખલમો અન્ન હાજલ અમરા શરીલી ફીદીની વ માશીવ આકેબતે અમરી, અવકાલા આજિલે અમરી વ આજિલેહિ ફાસરિફહો અન્ની વ અસરિફની અન્હો વકુલેયઈખરહયોકાનાસુખ્મા રદ્દિનીબેહિ,” (તરજુમો : અય અલ્લાહ હું તારાથી ઈસ્તે ખારા કરું છું તારા ઈલ્મની સાથે તારી કુદરત સાથે તલબે કુદરત કરું છું અને તારાથી તારા ફઞ્ચે અગીમનો સવાલ કરું છું એટલા માટે કેનું કાદિર છે અને હું કાદિર નથી અને તું જાણો છે અને હું જાણતો નથી અને તું ગૈબોનો જાણનાર છે. અય અલ્લાહ જો તારા ઈલ્મમાં એ છે કે આ કામ મારા માટે બેહતર છે. મારાદીન તથા આજીવિકા અને અંજામકારમાં અથવા ફરમાવ્યું અત્યારે અને ભવિષ્યમાં તો તેને મારા માટે નિયત કરી દે અને એહસાન કર, પછી મારા માટે તેમાં બરકત આપ અને જો તુ જાણો છે મારા માટે આ કામ બુરું છે, મારા દીન તથા આજીવિકા અને પરિણામ રૂપમાં અથવા ફરમાવ્યું અત્યારે અને ભવિષ્યમાં તો તેને મારાથી ફેરવી દે અને મને તેનાથી ફેરવ અને મારા માટે ખેર (ભલાઈ) ને નિયુક્ત કર જ્યાં પણ હોય પછી મને તેનાથી રાજી કર.)

(ઉપરની દુઅા પઢી લીધા પછી પોતાની હાજતનો ઉત્તેખ કરે. ભલે “હાજલ અમર”ના બદલે હાજત (જરૂરત)નું નામ લો અથવા તેના પછી (રદ્દુલ મુહુતાર) અવકાલા આજિલે અમરીમાં ઔશક રાવી છે. હુક્મા ફરમાવે છે કે, એકત્ર કરે અર્થાત એમ કહે કે “વ આકેબતે અમરી

વ આજિલે અમરી વ આજિલહુ” (ગુનીયા) મરસ્મલા-(૮૩) : હજ્જ અને જેહાદ અને બીજા નેકકામો માટે ઈસ્તેખારા થઈ શકતો નથી. હા, સમય નિર્ધારિત કરવા માટે કરી શકે છે.

(ગુનીયા)

મરસ્મલા-(૮૪) : મુસ્તહબ એ છે કે, આ દુઆના અધ્યાત્મ-આધિરમાં, “અલહદ્રો-લિલ્જાહ” અને “હુરદ શરીફ” પઢે, અને પહેલી રકાતમાં કુલયાઅથ્યોહલ કાફેરુન અને બીજામાં “કુલ હોવલ્લાહ” પઢે, અને કેટલાક મશાએખો ફરમાવે છે કે, પહેલીમાં “વરબ્બોકા યખલુકો મા યશાઓ વ યખતારોયુઅલેનુન” સુધી અને બીજામાં “વમાકાના લે મુઅમેનિવ વલામોમિન તિન આમર આયત સુધી પણ પઢે. (રદ્દુલ મુહુતાર)

મરસ્મલા-(૮૫) : બેહતર એ છે કે સાત વખત ઈસ્તેખારા કરે, તે એક હદીસમાં છે કે, અય અનસ જ્યારેતુ કોઈ કામનો વિચાર કરે તો પોતાના રબથી તેનામાં સાત વખત ઈસ્તેખારા કર, પછી નજર કરકે તારા દિલમાં શું ગુજરૂકે, બેશક તેમાજ ખેર (ભલાઈ) છે. અને કેટલાક મશાએખી મન કુલ છે કે મજજુર દુઆ પઢીને તહારત સાથે (પાકી ની હાલતમાં) ડિલારુખ રહે જો સ્વભન્માં સુફેદી અથવા સર્જી (લીલોતરી) દેખે તો તે કામ ઉત્તમ છે. અને કાળાશ અથવા લાલાશ દેખે તો બુરુ છે. તેનાથી બચો.

(રદ્દુલ મુહુતાર)

“ઈસ્તેખારા”નો સમય ત્યાં સુધી છે. હું એક બાજુએ અભિપ્રાય સંપૂર્ણ રીતે જામી ન ગયો હોક્યુ

સલાતુતરસનીહ :

આ નમાઝમાં અનહદ સવાબ છે. કેટલાક મુહુતકીકો ફરમાવેછે દીનમાં સુસ્તી કરવાવાળા સિવાય બીજો કોઈ તેની બુજુર્ગિસાંભળાવ્યા પછી તર્ક કરશે નહીં. નબીએ કરીમ સલ્લાહુઅલયહે વસલ્લમે હજરત અખ્બાસ રદીયલ્લાહો અનહોથી ફરમાવ્યું, અય કાકા ! શું હું તમને અતા (અર્પણ) ન કરુ ? શું હું તમને બખ્શીશ ન કરું ? શું હું તમને ન આપું ? શું તમારી સાથે એહસાન ન કરું ? દસ ખસલતો છે કે, જ્યારેતુ કરો તો અલ્લાહ તારાલા તમારા ગુનાહ બખ્શી દેશો. આગલા-પાછલા, જુના-નવા,

જે ભૂલથી કર્યા હોય તે અને જે ઈરાદા પૂર્વક કર્યા તે નાના મોટા, છુપા અને જાહેર, તેના પછી સલાતું તરખીણની તરીકીબ તાચાલીમ ફરમાવી. પછી ફરમાવ્યું કે જો તમારાથી થઈ શકે કે દરોજ જીઝામાં એક વખત અને એ પણ ન કરો તો દરેક મહિનામાં એક વખત અને તે પણ ન કરો, તો વર્ષમાં એક વખત અને એ પણ ન કરો તો આયુષ્ય (જીંદગી) માં એક વખત અને તેની તરકીબ (વિધિ) અમારી રીતે તે છે કે જે સુનનતિરમિઝી શરીરફમાં અભુદુલ્લાહ બિન મુખારક રદીયત્વાહો અન્ધોની રિવાયતથી મજફર છે. તેઓ ફરમાવે છે કે, “અલ્લાહો અકબર” કહીને “સુભાનક લિલ્લાહુમ્માવ બેહમ્ડેકવતબરકસ્મોકાવતઆલા જદ્વોકા વલાઈલાહ ગયરોકા,” પછો પછી અ પછો “સુભાનલલાહે વલ હમ્દો લિલ્લાહે વ લાઈલાહ ઈલ્લલલાહો વલ્લાહો અકબર” પંદર વખત, પછી અઉજો અને બિસ્મિલ્લાહ અને અલહમ્ડો અને (કોઈ પણ) સૂરત પઢીને દસ વખત એ જ તરખીણ પછો પછી રૂક્ષાથી માયું ઉઠાવો અને તસ્મીઅ (સમેઅલ્લાહો....) તહમીએ (રખના લકલહમ્) પછી ઉપરોક્ત તરખીણ કહો, પછી સિજદહથી માયું ઉઠાવી દસ વખત પછો, પછી સિજદામાં જાવ અને તેમાં દસ વખત પછો, આવી રીતે ચાર રકાત પછો. દરેક રકાતમાં ઉપ વખત ઉપરોક્ત તરખીણ અને ચારે રકાતાતોમાં (ઉપરોક્ત તરખીણ) ન્રાણસો થઈ અને રૂક્ષાં તથા સૂજૂદમાં “સુભાન રખ્યેયલ અભીમ” સુભાન રખ્યેયલ આ’ લા કહેવા પછી તરખીણ પછો. (ગુનિયા વિગેરે)

મસ્ફલા-(૮૬) : ઈન્ને અખબાસ રદીયત્વાહ અન્ધોમાંથી પૂછવામાં આવ્યું કે આપને ખબર છે, આ નમાજમાં કઈ સૂરત પદ્ધવામાં આવે? આપે ફરમાવ્યું. ‘સૂરએ તકાસુર’ વલઅશર અને ‘કુલ યા ઐયોહલ કાફેરુન’ અને ‘કુલ હો વલ્લાહો’ અને કેટલાકોએ કહું સુરએ હદીએ અને હશર અને સર્જ અને તગાઅન. (રદુલ મુહ્તાર)

મસ્ફલા-(૮૭) : જો સિજદહે સહવ વાજિબ હોય અને સિજદો કરે તો આ બંનેમાં તરખીણાત ન પદ્ધવામાં આવે અને જો કોઈ સ્થળે ભૂલથી દસ

વખતથી ઓછી પઢી છે તો બીજા સ્થળે પઢીલે કે તે માત્રા પુરી થઈ જાય અને બેહતર એ છે કે તેના પછી જે બીજો પ્રસંગ તરખીણનો આવે ત્યાં જ પઢીલો. દા.ત. કૌમહના સિજદામાં કહો અને રૂક્ષાથમાં ભૂલી ગણો તો તેને પણ સિજદામાં કહો નકે કોમામાં કોમાની માત્રા થોડી હોય છે. અને પહેલા સિજદામાં ભૂલ્યો તો બીજામાં કહો, જલ્સામાં નહીં. (રદુલ મુહ્તાર) મસ્ફલા-(૮૮) : તરખીલ આંગળીઓ ઉપર ન ગણો બદક થઈ શકે તો દિલમાં ગણત્રીકરે નહીં તો આંગળીઓ દબાવી (ગણત્રી કરે).

મસ્ફલા-(૮૯) : દરેક ગેરમકરુહ સમયમાં આ નમાજ પઢી શકાય છે. અને સારુંથે છે કે, જોહરથી પહેલાં પઢે. (આલમગીરી, રદુલ મુહ્તાર)

મસ્ફલા-(૧૦૦) : ઈન્ને અખબાસ રદીયત્વાહો અન્ધોમાંથી મરવી છે. કે આ નમાજમાં સલામથી પહેલા આ દુઆ પછો.

અલ્લાહુમ્મા ઈન્ની અસાલોકા લોફીક અહ-લિલ હુદા વ અચમાલા અહલિલ યકીના વ મુજાસહતો અહલિલતોબતે વ અગ્રમા અહલિસ્સાલે વ બિદે અહલિલ ખશ્યતે વતલબ અહલિલર્ગબતે વતચાલોદ અહલિલ વરાથે વ ઈરફાના અહલિલ ઈલ્મે, હત્તા અખાફકા અલ્લાહુમ્મા ! ઈન્ની અસાલોકા મખાફિતમ તહજરોની અન મથાસીકા હત્તા અચમલાબેતાઓતેકા અમલન અસતહિકોબેહી રિદાકા વ હત્તા ઉનાસેહ-કા બિતોબતે ખોફ મભિનકા વહત્તા ઉખ-લેસા લકણસીહતા હુદ્દબલ લકા વ હત્તા અતવક્કલા અલયકા ફીલ ઉમુરે હુસના ગરનિમ બેકા સુજ્હાનાખા લેકિન્નૂરે. (દુર્ભ મુહ્તાર)

તરજુમો : અય અલ્લાહ હું તારાથી સવાલ કરું છું છિદ્યાત વાળાઓના આ માલ અને અહલે તૌબાની ભેરખ્યાહી અને સભ્ર વાળાઓનો કોશિશ અને રગબતવાળાઓની તલબ અને પરહેઝગારોની ઈલ્લાદત અને ઈલ્મવાળાઓની મઅરેકત કે જેથી હું તારા થી ડરું, અય અલ્લાહ હું તારાથી એવો ખોફ (ડર) માગું છું જે મને તારી નાફરમાનીઓથી રોકે કે જેથી હું તારી તાસત (આજ્ઞા-પાલન) સાથે એવો અમલ કરું જેના કારણે તારી રજા (ઈચ્છા) ના પાત્ર

થઈ જાઉ અને જેથી તારા ડરથી ખાલિસ (નિર્ભળ) તૌબા કરું અને જેથી તારી મહોષ્યતના લીધે ભલાઈને તારા માટે ખાલિસ કરું અને જેથી સધણા કાર્યોમાં તારા ઉપર તવકુલ (વિશ્વાશ) કરું તારા ઉપર નેક ગુમાન કરતાં, (તું) પાક છે નૂરનો ઉત્પન્ન કરનાર.

નમાંગે હાજત :

અખુદાઉંદ, હુઝેફા રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે, જ્યારે હુઝૂરે અકદસ સલ્લલ્લાહો અલૈદે વસ્થમને કોઈ મહત્વનું કામ આવી પડતું તો નમાજ પઢતા, તેના માટે બે રકાત અથવા ચાર રકાત પઢે. હદીસમાં છે કે, પહેલી રકાતમાં સુરએ ફાતેહા અને ત્રણ વખત આપતુલ કુર્સી પઢો અને બાકીની રકાતોમાં સુરએ ફાતેહા અને કુલ હોવલ્લાહ અને કુલ અઉજો બે રબિલફલક અને કુલ અઉજો બે રબિબનાસ. એક એક વખત પઢે. તો તે એવી છે જેવું કે શબે ક્રમમાં ચાર રકાતો પઢી. મશાયખ ફરમાવે છે કે, અમો એ નમાજ પઢી અને અમારી હાજતો પૂરી થઈ. એક હદીસમાં છે જેને તિરમિઝ તથા ઈન્દેમાજાએ અખુલાહ બિનઅબી ઔઝ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરી કે, હુઝૂરે અકદસ સલ્લલ્લાહો અલૈદે વસ્થમ ફરમાવે છે. જેની કોઈ હાજત અલ્લાહની તરફ હોય અથવા કોઈ બની આદમ (મનુષ્ય) ની તરફ હોય સારી રીતે તે વુગ્ઝ કરે પછી બે રકાત નમાજ પઢીને અલ્લાહ અજાવ જલ્લની સના (સ્તુતિ) કરે અને નબીએ કરીમ સલ્લલ્લાહો અલૈદે વસ્થમ પર દર્દું મોકલે પછી આ દુઅા પઢે.

લાઈલાહ ઈલ્લાહુ લહલીમુલ કરીમો સુખાનલ્લાહે રબિલઅર્શિલઅર્જીમે, અલ હમ્દો લિલ્લાહે રબિલ આલમીના અસ્યલોકા મોજિબાતે રહમતેકા વઅજાઈમા મગફિરતોકા વલ ગનીમતા બિન કુલ્લે બિરર્વં વસ્સલાતા બિન કુલ્લે ઈસ્લિમિનલા તદઓલી ઝખ્ખન ઈલ્લા ગફરતહુ વલા હુભ્મા ઈલ્લા ફરજતહુ વલા હાજતન હેયા લકા રદન ઈલ્લા કદ્દેય તહા ચા અહીમ રહેણીમન. - (તરજુમો : અલ્લાહ સિવાય કોઈ મસબૂદ (પૂજ્ય) નથી જે હલીમ (ઉદાર) તથા કરીમ (કૃપાળુ) છે

પાક છે. અલ્લાહ, માલિક તે અર્શે અર્જીમનો, હમ્દ છે અલ્લાહ માટે જે રબ્બ છે, તમામ જહાનનો હું તારાથી તારી બક્ષીશ ના માધ્યમો અને દરેક નેકીથી ગનીમત અને દરેક ગુનાહથી સલામતી ને મારા માટે, કોઈ ગુનોહ મગફિરત વગર ન છોડ અને દરેક ગમે (રંજ) ને દૂર કરીએ અને જે હાજત તારી રાખ અનુસારથે તેને પૂર્ણ કરીએ, અથ સધણા મહેરબાનોથી અધિક મહેરબાન)

તિરમિઝિબઈફાદએ તહસીન વતસહીહ તથા ઈન્દેમાજા તથા તિખાની વિગેરે ઉસ્માન બિન હનીફ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે એક નાભીના શષ્ષ (અંધજન) હુઝૂરની સેવામાં હાજર થયા અને અર્જ કરી કે અલ્લાહથી દુઅા કરો કે મને આફિયત (કુશળતા) આપે આપે ફરમાવ્યું કે, જો તારી ઈચ્છા હોય તો દુઅા કરો દઉ અને ચાહે તો સબ્જ કર અને તે તારા માટે ઉત્તમ છે. તેમણે અર્જ કરી : “હુઝૂર દુઅા કરો.” આપે તેમને હુકમ કર્યો કે વુગ્ઝ કર્યો જાને સારી રીતે વુગ્ઝ કરો અને બે રકાત નમાજ પઢીને આ દુઅા પઢો.

“અલ્લાહુમ ઈન્ની અસ્યલોકા અતરવસ્સલો વ અતવજ્જધો ઈલૈકા બે નબીએકા મુહમ્મદિન નબીએરહમતે યા રસૂલલ્લાહે ઈન્ની તવજ્જ હતો બેકા ઈલા રખ્ખી ફી હાજતી હાજેહિ.... લેતુકદા લી. અલ્લાહુમા ફશિફશાહો ફીય”

(તરજુમો : અથ અલ્લાહ ! હું તારાથી સવાલ કરું છું અને તવસ્સુલ (વસીલો) કરું છું અને તારી તરફ ધ્યાનિત થાઉ છું તારાનબી મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસ્થમ) ના માધ્યમથી જે નબી - એ રહેમત છે. યાં રસૂલલ્લાહ હું હુઝૂરના માધ્યમથી પોતાના રખ્ખની તરફ આ હાજત માટે ધ્યાનિત થાઉ છું કે જેથી મારી હાજત (આવશ્યકતા) પૂરી થાય ઈલાહી તેમની શફાઅત મારા હક્કમાં કબૂલ ફરમાવ.

ઉસ્માન બિન હનીફ રદીયલ્લાહો અન્ધો ફરમાવે છે. ખુદાના સોગંદ અમો ઉઠવા પણ પાય્યા ન હતા ! વાતો જ કરી રહ્યા હતા કે તેઓ અમારી પાસે આવ્યા જાણો કયારેય આંધળા હતા જ નહીં. કાંગે હાજત (જરૂરત પૂર્ણ કરવા) માટે એક મુજર્દબ (અનુભૂત) નમાજ જે ઉલ્માઓ સર્વદા પઢતા આવ્યા

છે તે આ છે કે, ઈમામે આજામ રદ્દીયલ્લાહો અન્ધોના મજાર મુખારક પર જઈને બે રકાત પઢે, અને ઈમામ સાહેબના વસીલાથી અલ્લાહ અજા વ જલ્લથી સવાલ કરે, ઈમામ શાકેઈ રહેમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે, હું એવું કરું છું તો બહુજ જલ્દી મારી હાજર પૂર્ણ થઈ જાય છે, (પૈરાતુલહેસાન)

સલાતુલ અસરાર :

આના માટે એક મુજર્દબે નમાજ સલાતુલ અસરાર છે, જે ઈમામ અબુલ હસન નુરદીન અલીબિન જરીર લખ્મી શતનૂફી. “બહજતુલ અસરાર” માં અને મુલ્લા અલી ફારી તથા શેખ અબ્દુલ હક્ક મુહદિસ દહેલ્વી રદ્દીયલ્લાહો તાચાલા આન્દો, હુગ્રેર સૈયદના ગૌસૂલ આજામ રદ્દીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે તેની તરકીબ આ છે કે, મગરિબની નમાજ પછી સુન્નતો પછીને બે રકાત નિફલ નમાજ પઢે., અને ઉત્તમ એ છે કે, “અલહાન્ડો.” પછી દરેક રકાતમાં ૧૧-૧૧ વખત “કુલહોવલ્લાહ” પઢે. સલામ પછી અલ્લાહ અજા વ જલ્લની હદ્દ સના (સ્તુતી) કરે, પછી નબી એ કરીમ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમ પર ૧૧ વખત હુરુદો સલામ અર્જ કરે, અને ૧૧ વખત આ પ્રમાણે કહે.

યા રસૂલુલ્લાહ યા નબીયલ્લાહ અગિસની અમહુદની ફી કઝાએ હાજરીયાકાદીયલ હાજત. (તરજુમો - અય અલ્લાહના રસૂલ, અય અલ્લાહના નબી મારી ફરિયાદે પહોંચો અને મારી મદદ કરો. મારી હાજત પુરી થવામાં અય તમામ હાજતોને પૂર્ણ કરવાવાળા) પછી ઈરાકની દિશાએ અગિયાર કદમ ચાલે દરેક કદમ પર આમ કહે, યા ગૌસસ સકલેથને વયા કરીમત તરફેયને અગિસની વમુદની ફી કઝાએ હાજરી યા કઝી અલ હગતે.

પછી હુગ્રેરના વસીલાથી અલ્લાહ અજા વ જલ્લથી હુએ કરો.

નમાજે તોંબા ?

અબુ દાઉદ, તિરમિઝી, ઈબ્ને માજા અને ઈબ્ને હજ્જાન પોતાની સહીએ (હદીસોની કિતાબો) માં અબુબક સિવીક રદ્દીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે હુગ્રેર ફરમાવે છે જ્યારે કોઈ બંદો ગુનોહ કરે, અલ્લાહ તાચાલા તેના ગુનાહ બખી દરે.

પછી આ આયત પઢી.

વલ્લજીના ઈજા ફાલ્લુફાહેશતન અવ જલ્દુમ અન્ફોસહુમ જકરુલ્લાહ ફસ્ત ગફરુ લેજોનૂફબેહિમ વખ્યા પગફેરુજ ઝોનુબા ઈલ્લલ્લાહો વલમ ઘોસિરુ અલા માફયલુ વ હુમ પખલમુન

(અર્થ) જેમણે નિલેજતાનું કોઈ કામ કર્યું અથવા પોતાના પ્રાણો પર જૂલમ કર્યો પછી અલ્લાહને યાદ કર્યો અને પોતાના ગુનાહની બખીશ માંગી અને અલ્લાહ સિવાય કોણ ગુનો બખશે અને પોતાના કૂર્મ પર જાણી જોઈને હઠ ન કરી.

સલાતુર્ ગાઈબ :

મસ્ખલા-(૧૦૧): સલાતુર્ ગાઈબ કે જે ૨૪જ્ઞબની પહેલી જુગ્માની રાતે અને શાબાનની પદરબી રાતે અને શબેકદ્રમાં જમાઅત સાથે નિફલ નમાજ કેટલાક સ્થળોએ લોકો અદા કરે છે હુકહા તેને નાજાઈજ તથા મકરુહ તથા બિદાત કરે છે અને લોકો તેના વિશે જે હદિસો બયાન કરે છે, મુહદીસો તેને મોજુઅ (મનઘડત) બતાવે છે. પરંતુ મહાન અકાબિરે ઓલીયાથી સહીહસનદો સાથે મરવી છે કે તો તેના મનામાં અતિશ્યોક્તિ ન કરવી જોઈએ. અને જો જમાઅતમાં ગ્રાન્ડ કરતાં વધારે મુકતાઈ ન હોય ત્યારે તો વાસ્તવમાં કાંઈ વાંધો નથી.

તરાવીહનું બચાન :

મસ્ખલા-(૧૦૨): તરાવીહ મર્દ તથા ઔરત સૌના માટે બિલઈજમાએ (સર્વ સં મતથી) સુન્નતે મોઅક્કદાછે. તેનો ત્યાગ જાઈજ નથી (હરે મુખતાર વિગેરે) આના ઉપર ખુલ્કાએ રાશેદીન રદ્દીયલ્લાહો તાચાલા અન્હુમે નિરંતરતા કરી અને નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમનો ઈરશાદ છે કે, મારી સુન્નત અને ખુલ્કાએ રાશેદીનની સુન્નતને પોતાના ઉપર લાજીમ સમજો અને ખૂદ હુજૂરે પણ તરાવીહ પઢી અને તેને બહુજ પસંદ કરી.

સહીહ મુસ્લિમમાં અબુ હુરયરહ રદ્દીયલ્લાહો અન્ધોથી રિવાયત છે કે, હું ઈરશાદ ફરમાવે છે કે રમાજાનમાં ઈમાનના કારણે અને સવાબ તલબ કરવા માટે કિયામ કરે તેના અગાઉના સધ્યા ગુનાહ, બખી દેવામાં આવશે અર્થાત સગીરા ગુનાહ પછી તે અંદેશાના કારણે કે ઉમ્મત પર ફર્જ ન થઈ જાય.

આપે તર્ક કરી દીધી. પછી ફારૂકે આજમ રદ્દીયલ્લાહો તથાલા અન્હો રમજાનમાં એક રાતે મસ્જિદમાં તશરીફ લઈ ગયા અને લોકોને વિવિધ રીતે નમાજ પઢતા જોયા, કોઈ એકલો પઢી રહ્યો છે. કોઈની સાથે કેટલાક લોકો પઢી રહ્યા છે, તો આપે ફરામાયું કે હું યોગ્ય સમજું હું કે, આ સધળાઓને એક ઈમામની સાથે જમા (એકગ્ર) કરી દઉં. તો ઉત્તમ થાય. સૌને એક ઈમામ (ઉબે બિન કાબબ રદ્દીયલ્લાહો અન્હોની સાથે એકગ્ર કરી દીધા. પછી ભીજા દિવસે તશરીફ લઈ ગયા તો દેખ્યું કે, લોકો પોતાના ઈમામની પાછળ નમાજ પઢે છે. આપે ફરામાયું : “નેઅમતુલ બિદઅતો હાજા” (અર્થ : -આ સારો બિદઅતો છે.) (રવાહો અસહાયે સુનન)

મસ્ખલા-(૧૦૩) : જમબુર (અકસર ઉલ્મા) નો મજહબ એ છે કે, તરાવીહની વીસ (૨૦) રકઅતો છે. અને એજ હદીસોથી સાબિત છે. બયહકીએ સહીહ સનદથી સાઈબ બિન યઝીદ રદ્દીયલ્લાહો તથાલા અન્હોથી રિવાયત કરી કે લોકો ફારૂકે આજમ રદ્દીયલ્લાહો અન્હોના જમાનામાં વીસ રકઅતો પઢતા હતા અને ઉસમાન તથા અલી રદ્દીયલ્લાહો અન્હોમાંના જમાનામાં પણ એમ જ હતું અને મોઅત્તામાં યઝીદ બિન રોમાનથી રિવાયત છે કે ઉમર રદ્દીયલ્લાહો અન્હોના જમાનામાં લોકો રમજાનમાં (૨ ઉ) તેવીસ રકઅતો પઢતા. બયહકીએ કહ્યું કે તેમાં ત્રણ રકઅતો વીત્રની છે. અને મૌલા અલી રદ્દીયલ્લાહો અન્હોએ એક શાખસને હુકમ કર્યો કે, રમજાનમાં લોકોને ૨૦ રકઅતો પઢાવે. આમા વીસ રકઅતો હોવામાં એ હિકમત છે કે, ફરાઈજ તથા વાજિબાતની તેનાથી પૂર્તિ થઈ જાય છે. અને કુલ ફરાઈજ તથા વાજિબની નિત્ય વીસ રકઅતો છે. આથી ઉચ્ચિત એકે આ પણ વીસ હોય કે સંપૂર્ણત બરાબર (સરખી) હોય.

મસ્ખલા-(૧૦૪) : તરાવીહનો સમય ઇશાની ફર્જ નમાજ પછીથી તૂલું એ ફરજ સુધી છે. વિત્રની પહેલા પણ થઈ શકે છે અને પછીથી પણ. જો કોઈની કેટલીક રકઅતો બાકી રહી ગઈ કે ઈમામ વિત્ર માટે ઉભો થઈ ગયો તો ઈમામની સાથે વિત્ર

પઢીલે પછી બાકીની અદા કરે, જ્યારે કે ફર્જ જમા અત્સાથે પઢી હોય અને આ અફજલ છે. અને જો તરાવીહ પૂરી કરીને વિત્ર એકલો પઢે તો પણ જાઈજ છે. અને જો પાછળથી બબર પરી કે ઈશાની નમાજ તહારત વગર પઢી હતી અને તરાવીહ તથા વિત્ર તહારત સાથે તો ઈશા તથા તરાવીહ ફરીથી પઢે, વિત્ર થઈ ગઈ. (હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહતાર, આલમગીરી)

મસ્ખલા-(૧૦૫) : મુસ્તહબ એ છે કે તૃતીયાંશ રાત્રી સુધી તાપીર (વિલંબ) કરે અને અર્ધ રાત્રી પછી પઢે તો પણ કરાહત નથી. (હુર્રે મુખ્તાર)

મસ્ખલા-(૧૦૬) : જો તરાવીહની નમાજ ફોત થઈ જાય તો તેની કંઝ નથી અને જો કંઝ એકલો પઢે પોતો તરાવીહ નથી બલ્કે નિફલ મુસ્તહબ છે, જેવું કે મગરીબ તથા ઈશાની સુન્નતો

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૧૦૭) : તરાવીહની વીસ રકઅતો દસ સલામથી, અર્થાત દરેક બે રકઅત પર સલામ ફરવે અને જો કોઈ એ વીસ પછીને છેવટમાં સલામ ફરવ્યો તો જો દરેક બે રકઅત પર કાયદો કરતો રહ્યો તો નમાજ થઈ જશે. પરંતુ કરાહત સાથે. અને જો કાયદો કર્યો નહતો તો બે રકઅતની બરાબર થઈ.

(હુર્રે મુખ્તાર)

મસ્ખલા-(૧૦૮) : સાવધાની એ છે કે જ્યારે બે બે રકઅત પર સલામ ફરવે તો દરેક બે રકઅત પર અલગ અલગ નિયત કરે અને જો એક સાથે વીસ રકઅતની નિયત કરી લીધી તો પણ જાઈજ છે.

(રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૧૦૯) : તરાવીહમાં એક વખત કુર્અની મજૂદ ખતમ કરવું, સુન્નતે મોઅક્કદા છે અને બે વખત ફર્જિલત અને ત્રણ વખત અફજલ છે. લોકોની સુસતીના કારણે ખતમને તર્ક ન કરે. (હુર્રે મુખ્તાર)

મસ્ખલા-(૧૧૦) : ઈમામ તથા મુક્તદી દરેક બે રકઅત પર સના પઢે અને તશહ્હુદ પછી દુખા પણ પઢે હાં જો મુક્તદી પર બોજ પડે તો તશહ્હુદ પછી, અલ્લાહુમા સલ્લેઅલા મુહુમદિવ્યાલેહિ. પર સંતોપ માને,

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૧૧૧) : જો એક કુર્અની ખતમ કરવું

હોય તો ઉત્તમ એ છે કે, સત્તાવીસ (૨૭)મી રાત્રે ખત્મ થાય, પછી જો આ રાતમાં અથવા તેના પહેલા ખત્મ થાય તો આપણી રમજાન સુધી તરાવીહ બરાબર પઢતા રહે કે, સુન્તતે મોઅક્કડા છે.

(આલમગીરી)

મસ્ખલા-(૧૧૨) : અફ્જલ એ છે કે તમામ શુફાઓ (બે બે રકાત) માં કિરાત બરાબર હોય અને જો એવું ન કર્યું તો પણ વાંધો નથી. એવીજ રીતે દરેક શુફા બે બે રકાતની પહેલી રકાત અને બીજીની કિરાત સમાન હોય બીજીની કિરાત પહેલીની કરતા અધિક ન હોવી જોઈએ. (આલમગીરી)

મસ્ખલા-(૧૧૩) : કિરાત અને અરકાનની અદાયગીમાં જલ્દી (ઉતાવળ) કરવું મકરૂહ છે. અને જેટલી તરતીલ (ઉચ્ચાર સહિતની કિરાત) અધિક હોય તે ઉત્તમ છે, એવીજ રીતે તાબુજ તથા તસ્મીયહ તથા તમાનીનત તથા તસ્બીહને છોડી દેવું પણ મકરૂહ છે.

(આલમગીરી, દુર્ભ મુખ્તાર)

મસ્ખલા-(૧૧૪) : દરેક ચાર રકાત પર એટલી વાર બેસવું મુસ્લિમ છે જેટલી વારમાં ચાર રકાતો પઢી. પાંચમી તરવીહા અને વિત્રની વચ્ચે જો બેસવું લોકોને ભારતૃપ થાય તો બેસે નહીં.

(આલમગીરી વિગેરે)

મસ્ખલા-(૧૧૫) : આ બેસવામાં તમને અધિકાર છે કે ચુપ બેસી રહે અથવા કલ્યો પઢે અથવા તિલાવત કરે અથવા હુરુદ શરીર પઢે અથવા નિદ્ધિલ ચાર રકાતો એકલા પઢે, જમાઅતથી પદ્ધતું મકરૂહ છે અથવા આ તસ્બીહ પઢે. સુફ્લાન જિલ મુલ્ક વલ્મેક્કૂતે સુફ્લાન ગીલ્યુઝગતે વલાજમતે વલ્લેબતે વલ્કુદરતે વલ્કીદિયાએ વલ્જરિતે સુફ્લાનબલેકિલ્હેથિલ્ગી લાયનામો વલાયમુતો સુફ્લુહુન કુદ્દુસુન રલ્બુલ મલાઈકતે વર્ઝ લાઈલાહા ઈલ્લલાહો નસ્તગુફે ઇલ્લાહ નસ્થાલોકલજની વનઊરો લેકા મિનનારે.

તરજુમો : પાક છે મુલ્ક તથા મલ્કુતવાળો, પાક છે ઈજાત તથા બુરુરી અને મોટાઈ અને મહાનતાવાળો, પાક છે બાદશાહ જે જીવંત છે, જે

ન સૂર્ય રહે છે, ન મૃત્યુ પામે છે. પાક મુક્કસ છે ફરિશ્તાઓ અને રૂહનો માલિક, અલ્લાહ સિવાય કોઈ મઅબુદ (પૂજય) નથી, અલ્લાહથી અમો મગફેરત (મોકષ) ચાહિએ છીએ. તારાથી જન્મતનો સવાલ કરીએ છીએ અને જહનનથી તારી પનાહ માંગીએ છીએ.

(ગુનીયા, રદ્દુલ મુહતાર વિગેરે)

મસ્ખલા-(૧૧૬) : દરેક બે રકાત પછી બે રકાત પદ્ધતું મકરૂહ છે, એમજ દસ રકાત પછી બેસવું પણ મકરૂહ છે

(દુર્ભ મુખ્તાર, આલમગીરી)

મસ્ખલા-(૧૧૭) : તરાવીહમાં જમાઅત સુન્તતે કિફાયા છે એટલે કે જો મસ્જિદના સઘળા લોકો ત્યજ દેશે, તો સૌ ગુનેહગાર થશે અને જો કોઈ એક ધરમાં એકલા પઢી લીધી તો ગુનેહગાર નથી, પરંતુ જે શખ્સ મુક્કસ (આગેવાન ઈમામ) હોય કે તેની હાજરીથી જમાઅત મોટી થાય છે અને હાજરી ત્યજ દેશે તો લોકો ઓછા થઈ જો તો તેણે વગર ઉત્તરે (વગર કારણે) જમાઅત છોડવાની ઈજાત નથી.

(આલમગીરી)

મસ્ખલા-(૧૧૮) : તરાવીહ મસ્જિદમાં બાજમાઅત પદ્ધતું અફ્જલ છે. જો ધરમાં જમાઅતથી પઢી તો જમાઅતના ત્યાગનો ગુનોહ ન થયો, પરંતુ તે સવાબ મળશે નહીં જે મસ્જિદમાં પઢવાનો હતો.

(આલમગીરી)

મસ્ખલા-(૧૧૯) : જો આલીમ હાફિઝ પણ હોય તો અફ્જલ એ છે કે, ખૂદ પઢે, બીજાઓની ઈક્તેદા (પેરવી) ન કરે. અને જો ઈમામ ગલત પઢે છે, તો મહોલ્લાની મસ્જિદ છોડીને બીજી મસ્જિદમાં જવામાં વાંધો નથી. એવીજ રીતે જો બીજા સ્થળનો ઈમામ ખુશ અવાજ હોય અથવા હલ્કી કિરાત પઢતો હોય અથવા મહોલ્લાની મસ્જિદમાં (કુઅન) ખન ન થતું હોય તો બીજી મસ્જિદમાં જવું જરૂરી નથી.

(આલમગીરી)

મસ્ખલા-(૧૨૦) : ખૂશખ્વાન (મધુર અવાજથી પઢનાર) ને ઈમામ બનાવવો જોઈએ નહીં, બલ્કે દુરસ્તખ્વાં (સહીહ પઢનાર) ને બનાવવો,

(આલમગીરી). અફસોસ સદાફસોસ કે આ જમાનામાં હાફિઝોની હાલત બહુજ શર્મ જનક છે. અકસર (બહુધા) તો એવું પઢે છે કે, યાચલમુન-તાચલમુન સિવાય કાંઈ સમજાતું જનથી અલ્ફાજ (શબ્દો) તથા હુરુફ (અકસર) ખાઈ જાય છે. જે સારું પઢવાવાળા કહેવાય છે તેમને દેખો તો હુરુફ સહીહ અદા કરતા નથી. હમજુહ, અલિફ, ઐન, અને જાલ, જે-ગોય અને સે-સિન, સાદ તે તોયવિગેરે અક્ષરોમાં ફરક (તફાવત) કરતા નથી. (મૂળ અરબી અક્ષરો જુઓ) જેનાથી સર્વથા નમાજ જ થતી નથી. ફર્ડિર (લેખક) ને એજ મુસિબતોના કારણે ત્રાજ વર્પ ખત્મે કુર્યાન સાંભળવા ન મળ્યું. મૌલા અ઱્જન વ જલ્દ મુસલમાન ભાઈઓને તૌફીક આપે કે મા અનજલલાહો (અલ્લાહ જ ઉત્તાર્યું તે) પઢવાનો પ્રયત્ન કરે.

મસ્ખલા-(૧૨૧) : આજકાલ અકસર રિવાજ થઈ ગયો છે કે હાફિઝોને પગાર આપીને તરાવીહ પઢવેછે, આ નાજાઈજ છે, આપનાર અને લેનાર બંને ગુનેહગાર છે, પગાર કેવળ એજ નથી કે અગાઉ મુકર્રર કરી લે કે આ લઈશું કે આ આપીશું બલ્કે જો ખબર છે કે અહીયા કાંઈ મળે છે. જો કે તેનાથી તથ થયું ન હોય, આ પણ નાજાઈજ છે કે અલ મખુરુફો કલ મશરૂતે. હા જો કહી દે કાંઈ આપીશ નહીં અથવા લઈશ નહીં, પછી પઢે અને હાફિઝની ખિદમત કરે તો કાંઈ વાંધો નથી કે “અસ્સરીહો યફુકુદદલાલત.”

મસ્ખલા-(૧૨૨) : એક ઈમામ બે મસ્જિદોમાં તરાવીહ પઢવે છે, જો બંનેમાં પૂરેપૂરી પઢવે તો નાજાઈજ છે. અને મુકતદીએ બે મસ્જિદોમાં પૂરીપૂરી પઢી તો વાંધો નથી. પરંતુ બીજોમાં વિત્ર પઢવું જાઈજ નથી. જ્યારે કે પહેલીમાં પઢી લીધી હોય અને જો ઘરમાં તરાવીહ પઢીને મસ્જિદમાં આવ્યા અને ઈમામત કરી; તો મકરૂહ છે.

(આલમગીરી)

મસ્ખલા-(૧૨૩) : લોકોએ તરાવીહ પઢી લીધી, હવે ફરીથી પઢવા ચાહે છે તો એકલા પઢી શકે છે. જમાઅતની ઈજાત નથી. (આલમગીરી)

મસ્ખલા-(૧૨૪) : અફઝલ એ છે કે એક ઈમામની

પાછળ પઢે અને બે ઈમામોની પાછળ પઢવા ચાહે તો બેહતર (ઉત્તમ) એ છે કે પુરી “તરાવીહ” પર ઈમામ બદલે દા.ત. આઠ એક ઈમામની પાછળ અને બાર રૂક્યાત બીજાની પાછળ.

(આલમગીરી)

મસ્ખલા-(૧૨૫) : નાબાલિગની પાછળ, બાલિગો (પુષ્ટ વયના) ઓની તરાવીહ થશે નહીં. એજ સહીહ છે. (આલમગીરી)

મસ્ખલા-(૧૨૬) : રમજાન શરીફમાં વિત્ર જમાઅતથી પઢવું અફગલ છે. ભલે એજ ઈમામની પાછળ જેના પાછળ ઈશા તથા તરાવીહ પઢી અથવા બીજાની પાછળ.

(આલમગીરી, દુર્લ્લ મુખ્તાર)

મસ્ખલા-(૧૨૭) : એ જાઈજ છે કે એક વ્યક્તિ ઈશા તથા વિત્ર પઢવે અને બીજો તરાવીહ દા.ત., હઝરત ઉમર રદીયલ્લાહો અન્હો ઈશા તથા વિત્રની ઈમામત કરતા હતા અને હઝરત ઉબે બિન કાબે રદીયલ્લાહો અન્હો તરાવીહની ઈમામત કરતા હતા. (આલમગીરી)

મસ્ખલા-(૧૨૮) : જો સધળા લોકોએ ઈશાની જમાઅત તર્ક કરી દીધી તો તેઓ તરાવીહ પણ જમાઅતથી ન પઢે. હા જો ઈશા જમાઅતથી થઈ અને કેટલાકને જમાઅત મળી નહીં તો આ તરાવીહની જમાઅતમાં શરીક થાય. (દુર્લ્લ મુખ્તાર)

મસ્ખલા-(૧૨૯) : જો ઈશાની નમાજ જમાઅતથી પઢી અને તરાવીહ એકલાએ પઢી તો વીત્રની જમાઅતમાં શરીક થઈ શકે છે. અને જો ઈશા એકલાએ પઢી ભલે તરાવીહ જમાઅત સાથે પઢી તો વિત્ર એકલો પઢે. (દુર્લ્લ મુખ્તાર, રદ્દુલ મુહત્તાર)

મસ્ખલા-(૧૩૦) : ઈશાની સુન્નતોની સલામ ફેરવી ન હોય અને તેમાં જ તરાવીહ મેળવી શરૂ કરી તો તરાવીહ થઈ નહીં. (આલમગીરી)

મસ્ખલા-(૧૩૧) : તરાવીહ ઉગર (કારણ) વગર બેસીને પઢવું મકરૂહ છે. બલ્કે કેટલાકોની નજરોમાં તો થશે જ નહીં. (દુર્લ્લ મુખ્તાર)

મસ્ખલા-(૧૩૨) : મુકતદી માટે એ જાઈજ નથી કે બેસી રહે અને જ્યારે ઈમામ રૂક્યા કરવા લાગે તો ઉભો થઈ જાય કે આ મુનાફિકો સાથે મુશાબહત

(અનુરૂપતા) છે. અલ્લાહ અગ્રં વ જલ્દ ઈશ્વાર ફરમાવે છે: “ઈજા કામ્યૂઈલસ્સલાતે કામ્યૂકોસલા” મુનાફિકો જ્યારે નમાજ માટે ઉભા થાય છે તો થાકેલા જીવથી. (શુનીયા વિગેરે)

મસ્ખલા-(૧૩૩) : ઈમામથી ભૂલ થઈ કોઈ સૂરત અથવા આયત છૂટી ગઈ તો મુસ્તહબ એ છે કે તેને પહેલા પઢીને પછી આગળ વધે. (આલમગીરી)

મસ્ખલા-(૧૩૪) : બે રકાત ઉપર બેસવું ભૂલી ગયો, ઉભો થઈ ગયો તો, જ્યાં સુધી ત્રીજીનો સિજદો ન કર્યો હોય બેસી જાય અને સિજદો કરી લીધો હોય તો ચાર પૂરી કરી લે, પરંતુ આ બે ગણવામાં આવશે. અને જો બે ઉપર બેસી લીધું છે, તો ચાર થઈ. (આલમગીરી)

મસ્ખલા-(૧૩૫) : ગ્રંથ રકાત પઢીને સલામ ફેરવી, જો બીજી રકાત ઉપર બેઠા ન હતા તો નમાજ થઈ નહિ, તેના બદલે બે રકાત ફરીથી પઢે. (આલમગીરી)

મસ્ખલા-(૧૩૬) : કાએદામાં મુકતઈ સુઈ ગયો, ઈમામ સલામ ફેરવીને અને બે રકાત પઢીને કાએદામાં આવ્યો, હવે તે જાગૃત થયો તો જો ખબર પડી ગઈ તો સલામ ફેરવી સામેલ થઈ જાય અને ઈમામના સલામ ફેરવ્યા પછી પોતાની નમાજ જલ્દી પૂરી કરીને ઈમામની સાથે થઈ જાય.

(આલમગીરી)

મસ્ખલા-(૧૩૭) : વિત્ર પઢ્યા પછી લોકોને યાદ આવ્યું કે બે રકાતો રહી ગઈ, તો જમાઅતથી પઢી લે. અને આજે થાદ આવ્યું કે કાલે બે રકાતો રહી ગઈ હતી, તો જમાઅતથી પદ્ધતું મકરૂહ છે.

(આલમગીરી)

મસ્ખલા-(૧૩૮) : સલામ ફેરવ્યા પછી કોઈ કહે કે બે રકાત થઈ અને કોઈ કહે છે ગ્રંથ થઈ, તો ઈમામના ઈતબમાં જે હોય તેનો એતબાર છે. અને ઈમામને કોઈ વાતનું યકીન ન હોય તો જેને સાચો સમજતો હોય તેના કથનનો વિશ્વાસ કરે. અને જો તેમાં લોકોને શંકા હોય કે વીસ રકાત થઈ કે અધાર, તો બે રકાત એકલા પઢે

(આલમગીરી)

મસ્ખલા-(૧૩૯) : જો કોઈ કારણસર તરાવીહની

નમાજ ફાસિદ થઈ જાય તો જેટલું કુર્ચાન તે રકાતોમાં પઢ્યું છે, તેનું પુનરાવર્તન કરે (તેટલું ફરીથી પઢે) કે જેથી ખતમમાં નુકસાન ન રહે.

(આલમગીરી)

મસ્ખલા-(૧૪૦) : જો કોઈ કારણસર ખતમ ન થાય તો સુરતોથી તરાવીહ પઢે, અને તેના માટે કેટલાકોએ એતરીકો (રીત) રાખ્યો હુંકે, “અલમતરા કયફા”થી છેવટની સુરત સુધી બે વખત પઢવામાં વીસ રકાતો થઈ જશે.

(આલમગીરી)

મસ્ખલા-(૧૪૧) : એક વખત બિસ્મિલ્હાહ શરીફ જહરથી પદ્ધતું સુન્નત છે અને દરેક સુરતના આરંભમાં ધીમે પદ્ધતું મુસ્તહબ છે. અને આજકાલ જાહિલોએ જે વાત કાઢી છે કે, એકસો ચૌદ (૧૧૪) વખત બિસ્મિલ્હાહ જહરથી પઢવામાં આવે નહીં તો કુર્ચાન ખતમ ન થશે. આ વાત હન્દી મજાહબમાં બે બુનિયાદ છે. (પાયા વિનાની છે.)

મસ્ખલા-(૧૪૨) : મુતઅખ્ખિયરીને (પાછળના આલીમો) એ ખતમે તરાવીહમાં ગ્રંથ વખત “કુલહોવલ્લાહ” પદ્ધતું મુસ્તહબ કહ્યું. અને બેહતર એ છે કે ખતમના દિવસે પાછલી રકાતમાં “અલેઝ લામ મિમ” થી “મુફિલેહુન” સુધી પઢે

મસ્ખલા-(૧૪૩) : શબીનાની એક રાતની તરાવીહમાં પૂરુ કુર્ચાન પઢવામાં આવે છે. જેવી રીતે આજકાલ રિવાજ છે કેકોઈ માણસ બેસીને વાતો કરી રહ્યો છે, કેટલાક લોકો સુઈ રહેલા છે, કેટલાક લોકો ચા પીવામાં મશગુલ છે, કેટલાકો મસ્ઝિદની બહાર બીડીઓ પી રહ્યા છે અને જ્યારે મનમાં આવે એકાદ રકાતમાં સામેલ પડ્યા થઈ જાય છે, આ નાજાઈજ છે.

ફાયદો: અમારા ઈમામે આજમ રદીયલ્લાહો અન્ધો રમજાન શરીફ મા એકસઠ (૬૧) વાર કુર્ચાન ખતમ કરતા હતા ત્રીસ (૩૦) દિવસમાં અને ત્રીસ કુર્ચાન (૩૦) રાત્રીમાં અને એક કુર્ચાન તરાવીહમાં અને આપે પીસ્તાલીસ (૪૫) વર્ષ સુધી ઈશાના વુજુથી ફજરની નમાજ પઢી છે.

मुनक्षिद (थेकाकी)नुं कुर्मोनी ज्माअत पामवु

ईमाम मालिक तथा निसाई रिवायत करे छे के, महजन (रद्दीयल्लाहो अन्हो) नामना एक सहाबी हुग्गुरे अकदस सल्लल्लाहो अलयहे वसल्लम साथे एक मजलिसमां हाजर हता. अजान थई तो हुग्गुर उभा थई गया अने नमाज पढी, तेओ बेठेला ज रही गया. आपे ईरशाद फरमाव्यो के, ज्माअत साथे नमाज पढवाने क्यो वस्तुअे तमने अटकाव्या? शु तमे मुसलमान नथी? तेमणे अर्ज करी या रसुलल्लाह! हुं हुं तो मुसलमान, परंतु में नमाज धेर पढी लीधी हती. आपे ईरशाद फरमाव्यो ज्यारे नमाज पढीने मस्तिष्ठमां आवो अने नमाज कायम करवामां आवे तो लोकोनी साथे पढीलो, भले पढी लीधी होय. ऐना जेवो ज पजीद बिन आमीर रद्दीयल्लाहो अन्हो नो बनाव छे, जे अबुदाउदमां मरवी छे. ईमाम मालिके रिवायत करी के अबुल्लाह बिन उमर रद्दीयल्लाहो अन्हो फरमावे छे: जे माणसे मगरीब अथवा फजर (सवार)नी नमाज पढी लीधी होय पढी ज्यारे ईमामनी साथे नमाज पढवाना प्रसंग मणे तो नमाज नुं पुनरावर्तन न करे. (ऐले के ईमाम साथे नमाज न पढे)

मस्अला-(१४३) : एकला फर्न नमाज शरु करी ज हती अर्थात् हज पडेली रकतनो सिजदो कर्यो न हतो के ज्माअत कायम थई तो रकअत तोडीने ज्माअतमां शामेल थई जाय. (दुर्भ मुख्तार)

मस्अला-(१४४) : फजर अथवा मगरिबनी नमाज एक रकअत पढी लीधी होय के ज्माअत कायम थई तो तुरत ज नमाज तोडीने ज्माअतमां शामेल थई जाय भले भीज रकअत पढी रहयो होय अलबत भीज रकअतनो सिजदो करी लीधो होय तो हवे आ बे नमाजेमां तोडवानी ईजाजत नथी. अने नमाज पूरी करी लीधा पढी निफ्लनी नियतथी पाणा तेमां शरीक थई शकता नथी. कारण के फजरनी नमाज पढी निफ्ल नमाज पढवुं जाईज नथी. अने मगरिबमां ए कारणे के निफ्लनी त्रषा रकअतो नथी, अने मगरिबमां जे शामेल थई

गयो तो बुरे कई, ईमामना सलाम फेरव्या पढी एक रकअत भीज मेलवीने चार करी ले. अने जो ईमामना साथे सलाम फेरवी लीधी तो नमाज फासिद थई गई, चार रकअत करा करे,

(आलमगीरी विग्रे)

मस्अला-(१४५) : मगरिबनी नमाज पढनारानी पाछण निफ्लनी नियतथी शामेल थई गयो. ईमामे चोथी रकअतने त्रजु गुमान करी अने (उभो थई गयो, आ मुकतदीओ तेनी ईत्तेबाअ (पेरवी) करी तो तेनी नमाज फासिद थई गई. त्रीजु पर ईमामे कायदो कर्यो होय के न कर्यो होय, तो पश.

(आलमगीरी)

मस्अला-(१४६) : चार रकअतवाणी नमाज शरु करीने जो एक रकअत पढी लीधी अर्थात् पडेली रकअतनो सिजदो करी लीधो तो वाजिब छे के एक रकअत भीज पढीने तोडे के आ बे रकअतो निफ्ल थई जाय. अने बे पढी लीधी होय तो ऐज वधते तोडी नापे अर्थात् “तशहहूद” पढीने सलाम फेरवी ले. अने त्रजा पढी लीधी हाय तो वाजिब छे के, न तोडे. तोडे तो गुनेहगार थशे, बल्के हुक्म ए छे के पूरी करीने निफ्ल नियतथी ज्माअतमां शामेल थई जाय. ज्माअतनो सवाब मणी जशे. परंतु असरमां सामेल थई सकतो नथी. कारण के असर पढी निफ्ल नमाज जाईज नथी. (आलमगीरी)

मस्अला-(१४७) : ज्माअत कायम थवानो अर्थ मोअज़जिननुं तक्बीर कहेवुं मुराद नथी, बल्के ज्माअतनुं शरु थई ज्वुं मुराद छे. मोअज़जिन-॥॥ तक्बीर कहेवाधी नमाज कतभ न करवुं भले पडेली रकअतनो हज सिजदो न कर्यो होय

(रद्दुल मुहतार)

मस्अला-(१४८) : ज्माअत कायम थवाथी नमाज तोडवुं ते वधते छे के, जे स्थान उपर तमे नमाज पढ ता होय त्यांज ज्माअत कायम थाय, जो तेओ घरमां नमाज पढता होय अने मस्तिष्ठमां ज्माअत कायम थई अथवा एक मस्तिष्ठमां पढतो होय अने भीज मस्तिष्ठमां ज्माअत कायम थई तो तोडवानो हुक्म नथी, भले पडेलीनो सिजदो न कर्यो होय, तो पश.

(रद्दुल मुहतार)

મસ્થલા-(૧૪૯) : નિફલ નમાજ શરૂ કરી હોય અને જમાઅત કાયમ થાય તો નમાજ તોડે નહીં, બલે બે રકાત પૂરી કરી લે ભલે પહેલીનો સિજદો પણ ન કર્યો હોય, તો પણ અને જો ગ્રીજા પછ્ટો હોય તો ચાર પૂરી કરી લે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્થલા-(૧૫૦) : જુમ્મા અને જોહરની સુન્નતો પછવામાં ખુત્બો અથવા જમાઅત શરૂ થઈ જાય તો ચાર પૂરી કરી લે. (દુર્ભ મુખ્તાર)

મસ્થલા-(૧૫૧) : સુન્નત અથવા કઝા નમાજ શરૂ કરી હોય અને જમાઅત કાયમ થઈ જાય તો નમાજ પૂરી કરીને જમાઅતમાં શામેલ થાય. હા, જો કઝા શરૂ કરી હોય અને જો એ જ કઝા માટે જમાઅત કાયમ થાય તો નમાજ તોડીને તેમાં શામેલ થઈ જાય. (દુર્ભ મુખ્તાર)

મસ્થલા-(૧૫૨) : નમાજ તોડવું જો ઉજર (કારણ) વગર હોય તો હરામ છે, અને માલ ચોરાઈ જવાની આશંકા હોય તો જાઈજ છે અને કામિલ (આણી શુદ્ધ) કરવા માટે હોય તો મુસ્તહલ છે, અને જીવ બચાવવા માટે હોય તો વાજીબ છે. (રદ્દુલ મુહ્તાર)

મસ્થલા-(૧૫૩) : નમાજ તોડવા માટે બેસવાની - જરૂરત નથી. ઉભા ઉભા એક બાજુએ સલામ ફેરવી તોડી નાભે. (આલમગીરી)

અગ્નાન પછી મસ્તિજદમાંથી

બહાર જવાના મસાઈલ

મસ્થલા-(૧૫૪) : જે માણસે નમાજ ન પઢી હોય તેણે મસ્તિજદમાં અગ્નાન પછી નીકળવું મહત્વું તાહરીમી છે. ઈને મજા, ઉસ્માન રદ્દિયલ્લાહો અનહોથી રિવાયત કરે છે કે, હુજુર સલ્લલ્લાહો અલયહે વસ્લલે ફરમાવ્યું: અગ્નાન પછી જે માણસ મસ્તિજદમાથી બહાર નીકળી ગયો અને કોઈ હાજત માટે નથી ગયો અને પાછા ફરવાનો ઈરાદો નથી તો તે મુનાફિક છે. ઈમામ બુખારી ઉપરાંત બીજા મુહદિસોની જમાઅતે રિવાયત કરી કે, અબુશાશ શાઓ કહે છે કે અમ્રો અબુ હુરયરહ રદ્દિયલ્લાહો અનહોની મસ્તિજદમાં હતા, જ્યારે મોઅજિને અસરની અગ્નાન કહી તે સમયે એક માણસ ચાલ્યો

ગયો, તેના ઉપર તેમણે ફરમાવ્યું કે, તેણે અબુલ કાસિમ હુજુર સલ્લલ્લાહો અલયહે વસ્લલ્લાહની નાફરમાની કરી. (દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્થલા-(૧૫૫) : અગ્નાનથી મુરાદ નમાજનો સમય થઈ જવું છે, ભલે હજુ અગ્નાન થઈ હોય કે ના થઈ હોય. (દુર્ભ મુખ્તાર)

મસ્થલા-(૧૫૬) : જે શાખ કોઈ બીજી મસ્તિજદની જમાઅતનો મુનતાજિમ (વ્યવસ્થાપક) હોય દા. ત ઈમામ અથવા મોઅજિન હોય કે તેની હાજરીથી લોકો હાજર થાય છે. નહિ તો વિભરાઈ જાય છે. એવા માણસને ઈજાજત છે કે અહીંયાથી પોતાની મસ્તિજદમાં ચાલ્યો જાય ભલે અહીંયા ઈકામત પણ શરૂ થઈ ગઈ હોય, પરંતુ જે મસ્તિજદનો મુનતાજિમ છે જો ત્યાં જમાઅત થઈ ગઈ તો હવે અહીંથી જવાની ઈજાજત નથી. (દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્થલા-(૧૫૭) : સબકનો સમય છે તો અહીંથી પોતાના ઉસ્તાદની મસ્તિજદ તે જઈ શકે છે. અથવા કોઈ જરૂરત હોય અને પાછા આવવાનો ઈરાદો હોય તો પણ જવાની ઈજાજત છે. જ્યારે કે ખાત્રી હોય કે જમાઅતથી પહેલા પાછા આવી જવાશે.

(દુર્ભ મુખ્તાર)

મસ્થલા-(૧૫૮) : જેણે જોહર અથવા ઈશાની નમાજ એકલા પદી લીધી હોય તેને મસ્તિજદથી ચાલ્યા જવાની મનાઈ તે વેળા છે કે ઈકામત શરૂ થઈ ગઈ, ઈકામતથી પહેલા જઈ શકાય છે અને જ્યારે ઈકામત શરૂ થઈ ગઈ, તો હુકમ છે કે, જમાઅતમાં નિફલ નમાજની નિયતથી શરીક થઈ જાય અને મગારિબ તથા ફરજરતથા અસરમાં તેને હુકમ છે કે મસ્તિજદથી બહાર ચાલ્યો જાય, જ્યારે કે નમાજ પઢી લીધી હોય.

(દુર્ભ મુખ્તાર)

ઈમામની વિરુદ્ધતા કરવા અને જમાઅતમાં શામેલ થવાના મસાઈલ

મસ્થલા-(૧૫૯) : મુક્તાદીએ બે સિજદા કર્યા અને ઈમામ હજુ પહેલા સિજદામાં જ હતો તો મુક્તાદીનો બીજો સિજદો ન થયો. (દુર્ભ મુખ્તાર)

મસ્થલા-(૧૬૦) : ચાર રકાતવાળી નમાજમાં કોઈને એક રકાત ઈમામ સાથે મળી તો, તે જમાઅત પામ્યો નહીં. હા, જમાઅતનો સવાબ

મળશે. ભવે આપરી કાઅદામાં શામેલ થયો હતો, બલ્કે જેને ત્રણ રકાતો મળી તે પણ જમાઅત ન પામ્યો. જમાઅતનો સવાબ મળશે. પરંતુ જેની કોઈ રકાત જતી રહી તેને એટલો બધો સવાબ ન મળશે. એટલો આરંભથી શરીક થનારને છે. આ મસ્ખલાનો લાભ એ છે કે કોઈએ સોંગં ખાદ્યા કે ફિલાણી નમાજ જમાઅતથી પઠશે અને કોઈ રકાત છુટીગઈ તો સોંગં તૂટી ગયો, તેનો કફફારો આપવો પડશે. ત્રણ અને બે રકાતવાળી નમાજમાં પણ એક રકાત ન મળી તો જમાઅત ન મળી અને લાહિકનો હુકમ, સંપૂર્ણ જમાઅત મેળવનારનો છે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)
મસ્ખલા-(૧૬૧) : ઈમામ રૂકુઅમાં હતો કે કોઈ એ તેની ઈક્તેદા કરી અને ઉભો રહ્યો ત્યાં સુધી કે ઈમામે માણું ઉઠાવી લીધું તો તે રકાત મળી નહી માટે ઈમામ ફારેગ થયા પછી તે રકાત પઢી લે અને જો ઈમામને કિયામમાં મળ્યા અને તેની સાથે રૂકુઅમાં શરીક ન થયા તો પહેલા રૂકુઅ કરી લે, પછી બીજા અફાલા ઈમામ સાથે કરે. અને જો પહેલા રૂકુઅ ના કર્યો, બલ્કે ઈમામની સાથે થઈ ગયો પછી ઈમામના ફારેગ થયા પછી રૂકુઅ કર્યો તો પણ થઈ જશે. પરંતુ વાજિબ તર્ક કરવાના કારણો ગુનેહગાર થયો. (હુર્રે મુખ્તાર)

મસ્ખલા-(૧૬૨) : મુક્તદીના રૂકુઅ કરવાથી પહેલાં ઈમામે માણું ઉઠાવી લીધું, જેથી તેને રકાત ન મળી તો આ હાલતમાં નમાજ તોડી નાખું જાઈન નથી. જેવું કે કેટલાક જાહિલ લોકો કરે છે, બલ્કે તેના ઉપર વાજિબ છે કે સિજદામાં ઈમામની તાબેદારી કરે. જો કે આ સિજદાની રકાતમાં ગણના થશે નહી એવી જ રીતે જો આ સિજદામાં મખ્યો તો પણ સાથ આપે. તે છતાં જો સિજદા ન કર્યા તો નમાજ ફાસિદ થશે નહી, ત્યાં સુધી કે જો ઈમામના સલામ ફેરવ્યા પછી તેણે પોતાની રકાત પઢી લીધી તો નમાજ થઈ ગઈ પરંતુ વાજિબ તર્ક કરવાને કારણો ગુનેહગાર થયો. (હુર્રે મુખ્તાર)

મસ્ખલા-(૧૬૩) : મુક્તદીએ ઈમામથી પહેલાં રૂકુઅ કર્યો પરંતુ તેના માણું ઉઠાવવાથી પહેલાં

ઈમામે પણ રૂકુઅ કર્યો તો રૂકુઅ થઈ ગયો એ શર્ત કે તેણે તે વખતે રૂકુઅ કર્યો હોય કે ઈમામે ફરજ જેટલી કિરાત પઢી લીધી હોય નહી તો રૂકુઅથી થયો નહી, અને આ હાલતમાં ઈમામની સાથે અથવા પછી જો ફરીથી રૂકુઅ કરી લેશે તો નમાજ થઈ જશે. નહી તો નમાજ તુટી ગઈ અને ઈમામથી પહેલાં રૂકુઅ અથવા કોઈ તકન આદા કરવામાં (બહરહાલ) ગુનેહગાર થશે. (હુર્રે મુખ્તાર)

મસ્ખલા-(૧૬૪) : ઈમામ રૂકુઅમાં હોય અને મુક્તદી તકખીર કહીને રૂકુઅ હોય કે ઈમામ ઉભો થઈ જાય તો જો રૂકુઅની હુદમાં સાથ થઈ ગયો ભલે થોડો જ તો રકાત મળી ગઈ. (આલમગીરી)

મસ્ખલા-(૧૬૫) : મુક્તદીએ સધણી રકાતનો માણું રૂકુઅ તથા સિજદા ઈમામથી પહેલા કર્યા તો સલામ પછી જરૂરી છે કે એક રકાત કિરાત વગર પઢે જો ન પઢી તો નમાજ થઈ નહી. અને જો ઈમામ પછી રૂકુઅ તથા સિજદા કર્યા તો નમાજ થઈ ગઈ. અને જો રૂકુઅ પહેલા કર્યો અને સિજદો સાથે કચા તો ચારે રકાતો કિરાત વગર પઢે અને જો રૂકુઅ સાથે કર્યો અને સિજદો પહેલા કર્યો તો બે રકાત પછીથી પઢે.

(આલમગીરી)

કણા નમાજનું બચાન

ગજવાએ ખન્દકમો હુલ્લુરે એકદસ સલ્લલલાહો અયહે વસલ્લની ચાર નમાજો મુશરિકોના કારણો છુટી ગઈ ત્યાં સુધી કે રાતનો કેટલોક ભાગ પસાર થઈ ગયો. બિલાલ રદીયલ્લાહો અનહીને આપે હુકમ ફરમાવ્યો. તેમણે અજાન તથા ઈકામત કહી, હુલ્લુરે ઝોહરની નમાજ પઢી પછી, ઈકામત કહી, તો અસરની નમાજ પઢી, પછી ઈકામત કહી તો મગરિબની નમાજ પઢી, પછી ઈકામત કહી તો ઈશાની નમાજ પઢી. ઈમામ અહમદે અભી જુમાહ હભી બિન સભાઅથી રિવાયત કરી કે, ગજવાએ અહાજાબમાં મગરિબની નમાજ પઢીને ફારિગ થયા તો ફરમાવ્યું. કોઈને ખબર છે કે મેં અસરની નમાજ પઢી છે? લોકોએ વિનંતી કરી કે, નથી પઢી, આપે મોઅજિનને હુકમ કર્યો. તેણે ઈકામત કહી, હુલ્લુરે અસરની નમાજ પઢી પછી મગરિબની નમાજનું પુનરાવર્તન કર્યું, તિખ્રાની તથા બયહકી ઈબ્ને ઉમર રદીયલ્લાહો

અન્હોથી રિવાયત કરે છે કે આપે ફરમાવ્યું જે શખ્સ કોઈ નમાજ ભૂલી જાય અને તે વખતે યાદ આવે કે ઈમામની સાથે હોય તો આ નમાજ પૂરી કરી લે, પછી ભૂલેલી નમાજ પઢે પછી તે નમાજ પઢે જેને ઈમામની સાથે પઢી હતી. “સહીહ ભૂખારી” તથા “મુસ્લિમ” માં છે કે હુલ્લુર સલ્લાહો અલયહે વસ્તુભે ફરમાવે છે કે, જે માણસ નમાજ ભૂલી જાય અથવા સૂર્ય જાય તો જ્યારે યાદ આવે પઢી લે કે એજ તેનો સમય છે. સહીહ મુસ્લિમની રિવાયતમાં એ પણ છે કે નિદ્રાવસ્થામાં (જો નમાજ જતી રહે) તો કુસુર નથી, કુસુરતો જગૃત વસ્થામાં છે.

મસ્ખલા-(૧૬૬) : શર્દી ઉજર વગર નમાજ કરા કરવી સખત ગુનોહ છે. તેના ઉપર ફરજ છે કે તેની કરા પઢે, અને સાચા દિલથી તૌબા કરે. તૌબા અથવા મકબુલ હજજ દ્વારા તાખીર (વિલંબ) કરાનો ગુનો માફ થઈ જશે. (હુર્ર મુખ્તાર)

મસ્ખલા-(૧૬૭) : તૌબા ત્યારે સહીહ છે કે કરા પઢીલે. છુટી ગયેલી નમાજ તો અદા ન કરે અને તૌબા કર્યે જાય તો તે તૌબા નથી, કે તે નમાજ જે તેના જીમે હતી તેનું ન પઢવું તો હજુ પણ બાકી છે અને જ્યારે ગુનાહથી અટક્યો નહીં તો તૌબા કર્યાં થઈ? (રદ્દુલ મુહ્તાર) હઠીસમાં ફરમાવ્યું છે કે, ગુનાહ પર કાયમ ટકી રહી ઈસ્તિગફાર કરનાર તેના જેવો છે જે પોતાના રખ્ય સાથે ઠડો કરે છે.

નમાજ કગ્ગા કરવાનાં ઉગ્ર

મસ્ખલા-(૧૬૮) : દુશ્મનોનો ભય નમાજ કરા માટે ઉજર છે. દા.ત. મુસાફિરને ચોર અને ડાકુઓનો સાચો અંદરો છે તો તેના કારણો વક્તી (તે સમયની) નમાજ કરા કરી શકે છે. એ શર્તે કોઈ પણ રીતે નમાજ પઢવા પર કાદિર (શક્તિમાન) ન હોય અને જો તે સવાર છે. અને સવારી પર પઢી શકે છે, ભલે ચાલવાની હાલતમાં અથવા બેસીને પઢી શકે છે તો ઉજર ન થયો. એવી જ રીતે જો કિબ્લા તરફ મુખ કરે છે તો દુશ્મનનો સામનો થાય છે તો જે દિશાએ બની શકે પઢીલે નમાજ થઈ જશે. નહીં તો નમાજ કરા કરવાનો ગુનોહ થયો. (રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૧૬૯) : દાયશ (નર્સ) જો નમાજ પઢે તો બાળકના મૃત્યુ પામવાની આ શંકા છે તો નમાજ કરા કરવા માટે આ ઉજર છે. બાળકનું માથું બહાર આવી ગયું અને નિફાસથી પહેલાં સમય પત્તમ થઈ જશે તો આ હાલતમાં પણ તેની માતા પર નમાજ પઢવી શક્ય છે. ન પઢશે તો ગુનેહગાર થશે, કોઈ વાસણમાં બાળકનું માથું મુકીને જેનાથી તેને સદ્ગો (ઇઆ)ન પહોંચે નમાજ પઢે પરંતુ આ તરકીબથી પઢવામાં પણ બાળકના મૃત્યુની આશંકા છે તો વિલંબ (તાખીર) માફ છે. નિફાસ (પ્રસુતાનું લોહી બંધ થયા) પછી તે નમાજની કરા પઢે.

(હુર્ર મુખ્તાર)

કગ્ગા તથા અદા તથા એ આદાની તારચીફો અને કગ્ગા થવા અને તેના પટવાની સુરતો

મસ્ખલા-(૧૭૦) : જે ચીજાનો બંદાઓ ઉપરહકમ છે એજ સમયમાં બજાવી લાવવાને અદા કહે છે અને સમય પછી અમલમાં લાવવું (તેનું પાલન કરવામાં) કોઈ ખરાબી ઉત્પન થઈ જાય તો ફરીથી તે ખરાબી દર્કે કરવા માટે કરવું એઆદા (પુનરાવર્તન) છે.

(હુર્ર મુખ્તાર)

મસ્ખલા-(૧૭૧) : નમાજના સમયમાં જો તહરીમા બાંધી લીધી તો નમાજ કરા થઈ નહીં, બલકે અદા થઈ. (હુર્ર મુહ્તાર) પરંતુ ફરજર, જુભા તથા ઈદૈનની નમાજ કે તે આં સલામથી પહેલા પણ જો સમય નીકળી ગયો તો નમાજ જતી રહી.

મસ્ખલા-(૧૭૨) : નિદ્રાવસ્થામાં અથવા ભુલથીનમાજ કરા થઈ ગઈ તો તેની કરા પઢવી ફરજ છે. અલબત્ત કરાનો ગુનોહ લાગુ પઢશે નહીં પરંતુ જગૃત થવા અને યાદ આવવા પછી જો મકરૂહ સમય ન હાય એજ સમયે પઢી લે. તાખીર (વિલંબ) મકરૂહ છે, કેમ કે હઠીસમાં હુલ્લુરે ઈરશાદ ફરમાવ્યો છે કે જે માણસ નમાજ ભૂલી જાય અથવા સૂર્ય જાય તો યાદ આવવાથી પઢીલે કે એજ તેનો સમય છે. (આલમગીરી વિગેરે) પરંતુ સમય થઈ ગયા પછી સૂર્ય ગયો પછી સમય નિકળી ગયો તે સર્વથા ગુનેહગાર થયો. જ્યારે કે જગૃત થવા પર સાચો વિશાસ અથવા જગડનાર ઉપસ્થિત નહીંય, બલ્કે

ફજરમાં સમયની પ્રવેશથી પહેલા પણ સૂર્ય રહેવાની ઈજાત થઈ શકતી નથી, જ્યારે કે રાતનો અધિકાંશ ભાગ રાતના જાગવામાં પસાર થઈ ગયો અને ખાત્રી છે કે, હવે સૂર્ય રહેશે તો સમયમાં આંખ મુલશે નહીં.

મસ્ફલા-(૧૭૩) : કોઈ માણસ સૂર્ય રહ્યો છે અથવા નમાજ પદ્ધતું ભૂલી ગયો તો જેને ખબર હોય તેના ઉપર વાજિબ છે કે સૂર્ય રહેલાને જગાડે અને ભૂલી ગયેલાને યાદ અપાવે. (રદ્દુલ મુહ્તાર)
મસ્ફલા-(૧૭૪) : જ્યારે એ આશાંકા હોય કે ફજરની નમાજ જતી રહેશે તો શરીરજરૂરત વગર રાતમાં મોડા સુધી જાગવું મળનું અ (મના) છે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૧૭૫) : ફર્જની કાં ફર્જ છે અને વાજિબની કાં વાજિબ અને સુન્નતની કાં સુન્નત છે. અર્થાત તે સુન્નતો કે જેની કાં છે દા.ત. ફજરની સુન્નતો જ્યારે કે ફર્જ પણ છુટી ગયા હોય અને ઝોહરની પહેલી સુન્નતો જ્યારે કે ઝોહરનો સમય બાકી હોય. (હુર્રુ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૧૭૬) : કાં માટે કોઈ સમય નિશ્ચિત નથી. જિંદગી ભરમાં જ્યારે પણ પહેલી જવાબદારી માથી મુક્ત થઈ જશે પરંતુ તુલું (સૂર્યોદય) ગુરૂબ (સૂર્યાસ્ત) અને જવાલ (મધ્યાહન)ના સમયે કે આ ત્રણ સમયોમાં નમાજ પદ્ધતી જાઈ નથી.

(આલમગીરી)

મસ્ફલા-(૧૭૭) : મજનુન (ગાંડા)ની ગાંડપણની હાલતમાં જે નમાજો છુટી ગઈ, સારા થયા પછી તેના કાં વાજિબ નથી. જ્યારે કે ગાંડપણ છ નમાજો સુધી સંપૂર્ણત રહ્યું હોય. (આલમગીરી)

મસ્ફલા-(૧૭૮) : માઝાલ્લાહ (અલ્લાહની પનાહ) જે શખ્સ મુરતદ થઈ (ઇસ્લામથી નિકળી) ગયો પછી ઇસ્લામ લાભ્યો તો મુરતદ થઈ ગયા પછીના સમયના નમાજોની કાં નથી, અને મુરતદ થવાના પહેલાં ઇસ્લામની હાલતમાં જે નમાજો છુટી ગઈ હતી, તેની કાં વાજિબ છે. (હુર્રુ મુહ્તાર)

મસ્ફલા-(૧૭૯) : દારુલ ઉર્બ (જેર ઇસ્લામી દેશ)

માં કોઈ માણસ મુસલમાન થયો અને શરીરઅહેકામો નમાજ, રોજા, જ્કાત વિગેરેની તેને ખબર ન પડી તો જ્યાં સુધી ત્યાં રહ્યો તે દિવસોની કાં તેના પર વાજિબ નથી, અને જ્યારે દારુલ ઇસ્લામ (ઇસ્લામના અરકાનો આદા કરવામાં જ્યાં શાસકો તરફથી પ્રતિબંધ ના હોય તે દેશ) માં આવી ગયો તો હવે જે નમાજ કાં થશે તેને પદ્ધતું ફર્જ છે કે “દારુલ ઇસ્લામમાં” અહેકામોનું ન જાડાંનું ઉજર (કારણ રૂપ) નથી, અને કોઈ એક વ્યક્તિએ પણ તેને નમાજ ફર્જ હોવાની ખબર આપી દીધી, ભલે ફાસિક અથવા બાળક અથવા સ્ત્રી અથવા ગુલામે તો હવે જેટલી નમાજો નહિ પદ્ધતો તેની કાં વાજિબ છે. “દારુલ ઇસ્લામ”માં મુસલમાન થયો તો જે નમાજો છૂટી ગઈ તેના કાં વાજિબ છે. ભલે તે એમ કહે કે મને તેની ખબર ન હતી. (હુર્રુ મુહ્તાર)

મસ્ફલા-(૧૮૦) : એવો બીમાર કે ઇશારાથી પણ નમાજ પડી શકતો નથી, જો આ હાલત સતત નમાજના છ સમય સુધી રહે, તો આ હાલતમાં જે નમાજો છૂટી ગઈ તેમની કાં વાજિબ નથી.

(હુર્રુ મુહ્તાર)

મસ્ફલા-(૧૮૧) : જે નમાજ જેવી ફોત થઈ (છૂટી ગઈ) તેની એવી જ કાં પદ્ધતામાં આવે દા.ત. સફર (પળા માઈલનો) પ્રવાસમાં નમાજ કાં થઈ તો ચાર રક્ખત વાળી બે જ પદ્ધતામાં આવે ભલે ઈકામતની હાલતમાં પઢો અને જો ઈકામત (પ્રવાસ સિવાય) ની હાલતમાં ફોત થઈ તો ચાર રક્ખત વાળી નમાજની કાં ચાર રક્ખત છે. ભલે સફરમાં પઢે અલબત કાં પદ્ધતા સમયે કોઈ ઉજર છે તો તેનો એતેબાર કરવામાં આવશે દા.ત. જે સમયે ફોત થઈ હતી તે સમયે ઉભો થઈને પઢી શકતો હતો અને હવે કિયામ કરી શકતો નથી, તો બેસીને પઢે અથવા તે સમયે ઇશારાથી જ પડી શકે છે તો ઇશારાથી પઢે. અને સેહત (સ્વાસ્થ્ય) પછી તેનું પુનરાવર્તન નથી. (આલમગીરી, હુર્રુ મુહ્તાર)

મસ્ફલા-(૧૮૨) : છોકરી ઇશાની નમાજ પડીને અથવા વગર પદ્ધયે સૂર્ય રહી, આંખ મુલીનો માલૂમ પડ્યું કે સૌપ્રથમ હેજ (માસિક) આવ્યું તો તેના ઉપર તે ઇશા ફર્જ નથી, અને જો ઓહતેલામ

(સ્વપનદોષ) થી બાલિગ થઈ તો તેનો હુકમ એજ છે જે છોકરાનો છે, કે પોહ ફાટવા પહેલા આંખ ખુલી તો તે સમયની નમાજ ફરજ છે. ભલે પઢીને સુઈ રહી અને પોહ ફાટવા પછી આંખ ખુલી તો ઈશાની નમાજનું પુનરાવર્તન કરે અને વધ્યથી બાલિગ થઈ અર્થાત તેનું વય પૂરા પંદર વર્ધનું થઈ ગયું તો જે સમયે પૂરા પંદર વર્ધની થઈ ગઈ તે સમયની નમાજ તેના ઉપર ફરજ છે, ભલે પહેલા પઢી લીધી હોય. (આલમગીરી વિગેરે)

કગા નમાજોમાં તરતીબ વાજિબ છે.

મસ્ઝલા-(૧૮૩) : પાંચ ફર્જોમાં પરસ્પર અને ફરજ તથા વિત્રમાં તરતીબ (કમ) જરૂરી છે કે પહેલા ફજર પછી જોહર અસર મગારિબ પછી ઈશા પછી વિત્ર પહેલેઆસધળી કગા હોય અથવા કેટલીક કગા અને કેટલીક અદા દા.ત. જોહરની નમાજ કગા થઈ ગઈ તો ફજરનો સમય તંગ હોવું ગુમાન કરી, ફજરની નમાજ પઢી લીધી. પછી એ ખબર પડી કે સમય તંગ ન હતો તો ફજરની નમાજ થઈ નહીં, હવે જો બંને નમાજો પછી વાની ગુજાઈશ હોય તો ઈશાની નમાજ પઢીને પછી ફજરની નમાજ પઢે. નહીં તો ફજર પઢીલે. જો બીજીવાર ફરી ભુલ માલૂમ પડે તો એજ હુકમ છે અર્થાત બંને પઢી શકે છે તો બંને પઢે, નહીં તો કેવળ ફજર ફરીથી પઢે, અને જો ફજરનું પુનરાવર્તન ન કર્યું અને ઈશા પઢવા લાગ્યો અને તશહહુદ જેટલું બેસવા પાખ્યો હતો નહીં કે સુરજ નીકળી આવ્યો તો ફજરની નમાજ જે પઢી હતી તે થઈ ગઈ.

(આલમગીરી વિગેરે)

મસ્ઝલા-(૧૮૪) : જો સમયમાં એટલી ગુજાઈશ નથી કે, સમયની તથા કગાઓ સધળી પઢી લેતો સમયની અને કગા નમાજોમાં જેની ગુજાઈશ હોય પઢે. બાકીમાં તરતીબ સાકિત (ત્યજય) છે. દા.ત. ઈશા તથા વિત્ર નમાજ કગા થઈ ગઈ અને ફજરના સમયમાં પાંચ રકાતની ગુજાઈશ છે, તો વિત્ર તથા ફજર પઢે (શર્હ વકાયા)

મસ્ઝલા-(૧૮૫) : તરતીબ માટે સર્વથા સમયનો એતબાર છે. મુસ્તહબ સમય હોવાની જરૂરત નથી, તો જેની જોહરની નમાજ કગા થઈ ગઈ અને સૂરજ પીળા પડવાથી પહેલા જોહરથી ફારેગ થઈ શકતા નથી, પરંતુ સૂરજ હુબવા પહેલા બંને પઢી શકે છે તો જોહર પઢે પછી અસર પઢે (રદ્દુલ મુહતાર)

મસ્ઝલા-(૧૮૬) : જો સમયમાં એટલી ગુજાઈશ છે કે મુખ્તસર (સંક્ષિપ્ત) રીતે પઢે તો બંને પઢી શકે છે અને સારી રીતે પઢે તો બંને નમાજોની ગુજાઈશ નથી, તો એ હાલતમાં પણ તરતીબ ફરજ છે, અને જવાઝ જેટલું જ્યાં સુધી ટુકાઝ કરી શકે છે, કરે.

(આલમગીરી)

મસ્ઝલા-(૧૮૭) : સમયની તંગીથી તરતીબ તુટી

જવી એ સમયે છે કે નમાજ શરૂ કરતી બેણા સમય તંગ હોય, જો શરૂ કરતી વખતે ગુજાઈશ હતી અને એ યાદ હતું કે તે સમયથી પહેલાની નમાજ કગા થઈ ગઈ છે અને નમાજમાં લંબાશ કર્યું કે હવે સમય તંગ થઈ ગયો, તો આ નમાજ થશે નહીં હા, જો તોડીને ફરીથી પઢે તો થઈ જશે. અને જો કગા યાદ ન હતી અને સમયની નમાજમાં લંબાશ કર્યું કે સમય તંગ થઈ ગયો, હવે યાદ આવ્યું તો આ નમાજ થઈ ગઈ, તોડે નહીં.

(આલમગીરી)

મસ્ઝલા-(૧૮૮) : સમય તંગ હોવા ન હોવામાં તેના ગુમાનો એતેબાર નથી, બલ્કે એ દેખવામાં આવશે કે વાસ્તવમાં સમય તંગ હતો કે નહીં. દા.ત. જેની ઈશાની નમાજ કગા થઈ ગઈ અને ફજરનો સમય તંગ હોવું ગુમાન કરી, ફજરની નમાજ પઢી લીધી. પછી એ ખબર પડી કે સમય તંગ ન હતો તો ફજરની નમાજ થઈ નહીં, હવે જો બંને નમાજો પછી વાની ગુજાઈશ હોય તો ઈશાની નમાજ પઢીને પછી ફજરની નમાજ પઢે. નહીં તો ફજર પઢીલે. જો બીજીવાર ફરી ભુલ માલૂમ પડે તો એજ હુકમ છે અર્થાત બંને પઢી શકે છે તો બંને પઢે, નહીં તો કેવળ ફજર ફરીથી પઢે, અને જો ફજરનું પુનરાવર્તન ન કર્યું અને ઈશા પઢવા લાગ્યો અને તશહહુદ જેટલું બેસવા પાખ્યો હતો નહીં કે સુરજ નીકળી આવ્યો તો ફજરની નમાજ જે પઢી હતી તે થઈ ગઈ.

એવી જ રીતે જો ફજરની નમાજ કગા થઈ ગઈ અને જોહરના સમયે બંને નમાજોની ગુજાઈશ તેના ગુમાનમાં નથી અને જોહર પઢી લીધી, પછી ખબર પડી કે ગુજાઈશ છે તો જોહરની નમાજ થઈ નહીં. ફજર પઢીને જોહર પઢે ત્યાં સુધી કે જો ફજર પઢીને જોહરની એક રકાત પઢી શકે છે તો ફજરની નમાજ પઢીને જોહર શરૂ કરે. (આલમગીરી)

મસ્ઝલા-(૧૮૯) : જુમાના દિવસે ફજરની નમાજ કગા થઈ ગઈ. જો ફજર પઢીને જુમામાં શરીક થઈ શકે છે તો ફજર છે કે પહેલા ફજર પઢે. ભલે ખુલ્બો થતો હોય અને જો જુમા મળશે નહીં, પરંતુ જોહરનો સમય બાકી રહેશે તો પણ ફજર પઢીને જોહર પઢે અને જો એવું છે કે ફજર પઢવામાં જુમા પણ જતી રહેશે અને જુમાની સાથે સમય પણ

પુરો થઈ જશે તો જુમ્ઝા પઢી લે, પછી ફજર પઢે. આ અલભતમાં તરતીબ સાકીત છે. (તેમાં વાંધો નથી. અનુ.). (આલમગીરી)

મસખલા-(૧૯૦) : જો સમયની તંગીના કારણે તરતીબ સાકીત થઈ ગઈ અને સમયની નમાજ પઢી રહ્યો હતો કે નમાજ દરમિયાન સમય ખતમ થઈ ગયો તો તરતીબનું પુનરાવર્તન થશે નહીં અથડી સમયની નમાજ થઈ ગઈ (આલમગીરી) પરંતુ ફજર તથા જુમ્ઝા કે સમય નીકળી જવાથી તે પોતે જ થઈ નહીં.

મસખલા-(૧૯૧) : કઝા નમાજ યાદ રહી નહીં અને સમયની પઢી લીધી, પઢ્યા પછી યાદ આવ્યું તો સમયની નમાજ થઈ ગઈ, અને પઢવા દરમિયાન યાદ આવ્યું તો નમાજ (તુરી) ગઈ. (આભ્રમએકૃતુભ)

મસખલા-(૧૯૨) : પોતાને બાવજૂ સમજું ઝોડરની નમાજ પઢી, પછી વુજુ કરીને અસરની નમાજ પઢી, પછી ખબર પડીકે ઝોડરમાં વુજુ હતું નહીં, તો અસરની નમાજ થઈ ગઈ. કેવળ ઝોડરનું પુનરાવર્તન કરે. (આલમગીરી)

મસખલા-(૧૯૩) : ફજરની નમાજ કઝા થઈ અને યાદ હોવા છતાં ઝોડરની નમાજ પઢી લીધી, પછી ફજરની પઢી તો ઝોડરની નમાજ થઈ નહીં, અસરની નમાજ પઢતા સમયે ઝોડરની યાદ હતી પરંતુ પોતાના ગુમાનમાં ઝોડરને જાઈજ સમજતો હતો તો અસરની થઈ ગઈ. સારાંશ એ છે કે તરતીબની ફરજીયતથી જે માણસ ના વાકેફ (અજ્ઞાત) છે તેનો હુકમ ભુલવાવાળા જેવો છે કે તેની નમાજ થઈ જશે. (હર્રે મુખ્તાર)

મસખલા-(૧૯૪) : જેની છ (૬) નમાજો કઝા થઈ ગઈ છે છઠીનો સમય ખતમ થઈ ગયો તેના ઉપર તરતીબફરજ નથી. હવે જો કે સમયમાં ગુંજાઈશ હોવા છતાં સમયની નમાજ પઢેશો તો થઈ જશે, ભલે તે સધળી એકી સાથે કઝા થઈ. દા.ત. એક દમથી છ સમયોની નમાજો ન પઢી અથવા અલગ અલગ રીતે કઝા થઈ ગઈ. દા.ત. છ દિવસ ફજરની નમાજ પઢી નહીં અને બાકીની નમાજો પઢતો રહ્યો પરંતુ તે પઢતી વખતે તે કઝાઓ ભુલી ગયો

હતો ભલે તે સધળી જુની (પાછલી) હોય કે કેટલીક તાજ (નવી), કેટલીક પાછલી દા.ત. એક મહીનાની નમાજ પઢી નહીં પછી પઢવી શરૂ કરી, પછી એક સમયની કઝા થઈ ગઈ તો તેના પછીની નમાજ થઈ જશે જો કે તેનું કઝા થવું યાદ હોય.

(હર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસખલા-(૧૯૫) : જ્યારે છ નમાજો કઝા થવાના કારણે તરતીબ સાકીત (ખંડીત) થઈ ગઈ તો તેઓ પેકી કેટલીક પઢી લીધી કે, છ થી ઓછી રહી ગઈ તો તે તરતીબ પાછી ના ફરશે અર્થાત તેઓ પેકી જો બે એક બાકી હોય તો યાદ હોવા છતાં સમયની નમાજ થઈ જશે. અલભત જો સધળી કઝાઓ પઢી લીધી તો હવે ફરીથી સાહબે તરતીબ (તરતીબશાળી) થઈ ગયો કે, હવે જો કોઈ નમાજ કઝા થઈ જાય તો પાછલી શરતો અનુસાર તેને પઢીને સમયની પઢે નહીં તો નમાજ થશે નહીં.

(હર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસખલા-(૧૯૬) : એવી જ રીતે જો ભુલથી અથવા સમયની તંગીના કારણે તરતીબ ખંડીત થઈ ગઈ તો તે પણ પુનરાવર્તન કરશે. દા.ત. ભુલથી નમાજ પઢી લીધી હવે યાદ આવ્યું તો નમાજનું પુનરાવર્તન નથી જો કે સમયમાં કેટલીએ ગુંજાઈશ હોય

(હર્રે મુખ્તાર)

મસખલા-(૧૯૭) : સમયની ગુંજાઈશ અને યાદ હોવા છતાં સમયની નમાજ વિચે જે કહેવામાં આવ્યું કે નમાજ થશે નહીં. તેનાથી મુરાદ એ છે કે તે નમાજ મોહુક છે જો સમયની પઢતા રહ્યાને કઝા રહેવા દીધી તો જ્યારે બંને મળીને છ થઈ જશે અર્થાત છઠીનો સમય ખતમ થઈ જશે તો સધળી સહીહ થઈ ગઈ અને જો આ દરમિયાનમાં કઝા પઢી લીધી તો સધળી (ફર્જ) નમાજો ગઈ અર્થાત નિફલ થઈ ગઈ. સધળી નમાજો ફરીથી પઢે.

(હર્રે મુખ્તાર)

મસખલા-(૧૯૮) : કેટલીક નમાજો પઢતા સમયે કઝા યાદ હતી અને કેટલીકમાં યાદ રહી નહીં, તો જેમાં કઝા યાદ છે તેમાં પાંચમીનો સમય ખતમ થઈ જાય અર્થાત કઝા સમેત છઠીનો સમય થઈ જાય તો હવે સધળી થઈ ગઈ, અને જે નમાજો ના અદા કરતી વેળા કઝાની યાદ હતી નહીં તેમનો એતેબાર નથી.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૧૯૯) : સ્ત્રીની એક નમાજ કરા થઈ તેના પછી દેઝ (માસિક) આવી ગયું તો હેઠથી પાક થઈને પહેલા કરા પઢી લે, પછી સમયની નમાજ પઢે, જો કરા યાદ હોવા છતાં સમયની પદ્ધશે તો નમાજ થશે નહીં. જ્યારે કે સમયમાં ગુંજાઈશ હોય.

(આલમગીરી)

કરાએ ઉમ્મીના મસાઈલ

મસ્ખલા-(૨૦૦) : જેના માથે કરા નમાજો હોય, જો કે તેનું પદ્ધતું જલ્દીથી જલ્દી વાજિબ છે. પરંતુ બાલ-બચ્ચાઓનું પાલન-પોપળ અને પોતાની જરૂરીયાતો એકત્ર કરવાના કારણે તાખિર (વલંબ) જાઈછે, તો કારોબાર પણ કરે અને જે કુરસદનો સમય મળે તેમાં કરા પદ્ધતો રહે ત્યાં સુધી કે પૂરી થઈ જાય. (દુર્લ્લમુખ્તાર)

મસ્ખલા-(૨૦૧) : કરા નમાજો નવાફિલ (નિફલો) કરતાં મહત્વની છે અથવા જે સમયે નિફલ પઢે છે તેને છોડીને તેના બદલે કરાઓ પછીને જવાબદીરીમાંથી મુક્ત થઈ જાય. અલબત્ત તરાવીહ અને બાર રકાતો સુન્નતે મોઅક્કદાની છોડવી નહીં.

(રદ્દુલ મુહ્તાર)

કરા નમાજના વિવિધ મસાઈલ

મસ્ખલા-(૨૦૨) : મન્જતની નમાજમાં કોઈખાસ સમય અથવા દિવસની કેદ લગાવી તો તે સમય અથવા દિવસમાં પદ્ધતું વાજિબ છે, નહીં, તો કરા થઈ જશે, અને જો સમય અથવા દિવસ મુકર્રર નથી તો ગુંજાઈશ છે.

(દુર્લ્લમુખ્તાર)

મસ્ખલા-(૨૦૩) : કોઈ માણસની એક નમાજ કરા થઈ ગઈ અને એ યાદ નથી કે કંપી નમાજ હતી તો એ એક દિવસની સઘળી નમાજો પઢે, એવી જ રીતે જો બે નમાજો બે દિવસમાં કરા થઈ તો બંને દિવસોની સઘળી નમાજો પઢે, એવી જ રીતે ત્રણ દિવસની ત્રણ નમાજો અને પાંચ દિવસની પાંચ નમાજોનું પણ સમજી લેવું

(આલમગીરી)

મસ્ખલા-(૨૦૪) : એક દિવસે અસરની અને

એક દિવસે જોહરની નમાજ કરા થઈ ગઈ અને એ યાદ નથી કે, પહેલા દિવસની કંચી નમાજ હતી તો જેમાં તખીબત જામે તેને પહેલી ઠેરવો અને કોઈ બાજુએ દિલ જામતું નથી તો કોઈ પણ નમાજ પહેલા પઢો, પરંતુ બીજી પઢ્યા પછી જે પહેલા પઢી છે તેને ફેરવે અને બેહતર એ છે કે પ્રથમ જોહર પઢે પછી અસર પછી અસર પછી જોહરનું પુનરાવર્તન કરે અને જો પહેલા અસર પઢો પછી જોહર પઢી, પછી અસરનું પુનરાવર્તન કર્યું તો પણ વાધો નથી. (આલમગીરી)

મસ્ખલા-(૨૦૫) : અસરની નમાજ પદ્ધવામાં યાદ આવ્યું કે નમાજનો એક સિજદો રહી ગયો છે, પરંતુ એ યાદ નથી કે આ નમાજનો જ રહીગયો છે કે જોહરનો, તો જે બાજુએ દિલ જામે તેના ઉપર અમલ કરે અને કોઈ બાજુએ દિલ જામે નહીં, તો અસરની નમાજ પૂરી કરીને અંતમાં એક સિજદો કરી લે, પછી જોહરનું પુનરાવર્તન કરે. અને જો પુનરાવર્તન ન કર્યું તો પણ વાધો નથી. (આલમગીરી)

નમાજના ફિદ્દીયાના મસાઈલ :

મસ્ખલા-(૨૦૬) : જેની નમાજો કરા થઈ ગઈ અને તેનો ઈન્ટેકાલ થઈ ગયો તો જોવસીયત કરી ગયો અને માલ - મિલિકત પણ પાછળ મુકી ગયો તો તિહાઈ (તૃત્યિંશ) થી દરેક ફર્જ તથા વિત્રના બદલે અર્ધો સાઅ (૧૭૫૪ તોલા) ધર્ત અથવા એક સાઅ (૩૫૧ તોલા) જવ સદકો કરે, અને માલ છોડયો નથી અને વારસદારો ફિદ્યો આપવા માંગે તો થોડોક માલ પોતાની પાસેથી અથવા કરજ લઈને મિસ્કીનપર સદકો કરે તેના કણ્ણમાં આપી દે અને મિસ્કીન પોતાના તરફથી તેને ડેબા (બાખીશ) કરીદે અને આ લોકો કણ્ણો પણ કરી લે, પછી તેઓ મિસ્કીનને આપે, આવી જ રીતે આપ લે કરતા રહે ત્યાં સુધી કે સઘળી નમાજોનો ફિદ્યો અદા થઈ જાય, અને જો આ માલ મુક્યો પરંતુ તે અપુરતો છે, તો પણ એમજ કરે અને જો વસિયત ન કરી અને વાલી પોતાની તરફથી એહસાન (ભલાઈ) તરીકે ફિદ્યો આપવા ચાહે તો આપે. અને જો માલની તિહાઈ (૧/૩) પુરતી છે અને વસિયત એ કરી હોય કે, આમાંથી થોડુંક લઈને આપલે કરીને ફિદ્યો

પુરો કરીલે અને બાકીનો વારસો અથવા બીજો કોઈ લઈ લે તો આવી વસીયત કરનાર ચુનેહગાર થયો.

(દુર્ભુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૨૦૭) મરનારે વલીને પૌતાના બદલે નમાજ પઠવાની વસીયત કરી અને વલીએ પઢી પણ લીધી તો આ ના કાફી (અપુરતી) છે. એવી જ રીતે જો બીમારીની હાલતમાં તેની નમાઝનો ફિદ્યો આખ્યો તો અદા થયો નહીં (દુર્ભુખ્તાર)

મસાલા (૨૦૮) : કેટલાક અજ્ઞાન લોકો એવી રીતે ફિદ્યો આપે છે કે નમાઝોના ફિદ્યાની કિમત ગણીને સઘળાના બદલે કુર્ચાન મજૂદ આપી દે છે, આવી રીતે તમામ ફિદ્યો અદા થતો નથી, આ કેવળ અસલ વગર (અર્થહીન) વાત છે બલ્કે કેવળ એટલો જ અદા થશે જે કિમતના કુર્ચાન શરીફ છે. (બહારે શરીઅત-૩)

મસાલા-(૨૦૯) : શાફુર મજહબ વાળાની નમાજ કરા થઈ ગઈ, તે પછી જો તે હનફી થઈ ગયો તો હનફીઓની રીતે કરા પછે.

(આલમગીરી)

મસાલા-(૨૧૦) : જેની નમાઝોમાં નુકસાન તથા કરાહત હોય તે સમગ્ર જીવનની નમાઝો ફરીથી પઢે તો સારી વાત છે. અને કોઈ ખરાબી ન હોય તો એવું કરવાની જરૂર નથી. અને કરે તો ફજર તથી અસર પછી ન પઢે, અને સઘળી રકાતો ભરેલી (કિરાત વાળી) પઢે, અને વિત્રમાં દુઆએ કુનુત પઢીને ત્રીજી રકાત પછી કાએદો કરે પછી એક બીજી મેળવે કે ચાર થઈ જાય

(આલમગીરી)

મસાલા-(૨૧૧) : કરાએ ઉમ્રીને શબે કદ્ર અથવા રમાઝાનની આખરી જુમ્મામાં જમાઅતથી પઢે છે અને એમ સમજે છે કે જિંદગીભરની કરાઓ આ એક જ નમાઝથી અદા થઈ ગઈ, આ બાતિલ (બ્યથ) છે.

સિજદાએ સહવનું બચાન

હદીસમાં છે કે એક વખત હુઝૂર બે રકાત પઢીને ઉભા થઈ ગયા, બેસ્યા નહીં, બાદમાં સલામ પછી સહવનો સિજદો કર્યો, આ હદીસને તિરમિજી એ

મુગીરાબિન શુઅબા રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરી અને ફરમાવ્યું કે, આ હદીસ હસન સહીહ છે.

મસાલા-(૨૧૨) : નમાઝના વાજિબાતો પૈકી જ્યારે કોઈ ભૂલથી રહી જાય તો તેની તલાફી (નુકસાનનો બદલા) માટે સહવનો સિજદો વાજિબ છે. તેનો તરીકો એ છે કે, “અતાહિયાત” પછી જમણી તરફ સલામ ફરવી બે સિજદા કરે, પછી તશહિદુદ વિગેરે પઢીને સલામ ફરવો.

(આભમએ કુતુબ)

મસાલા-(૨૧૩) : જો સલામ ફરવ્યાવગર સિજદા કરી લીધા તો કાફી છે, પરંતુ એવું કરવું “મકરુહે તનજીહી” છે.

(આલમગીરી, દુર્ભુખ્તાર)

મસાલા-(૨૧૪) : ઈરાદા પુર્વક વાજિબ તર્ક કરી દીધી તો સિજદાએ સહવથી તે નુકસાન દફા થશે નહીં, બલ્કે પુનરાવર્તન વાજિબ છે. એવી જ રીતે જો ભૂલથી વાજિબ તર્ક થયું અને સિજદાએ સહવ કર્યો નહીં તો પણ પુનરાવર્તન વાજિબ છે

(દુર્ભુખ્તાર)

મસાલા-(૨૧૫) : કોઈ એવું વાજિબ તર્ક કર્યું જે નમાઝોના વાજિબો પૈકી નથી બલ્કે તેનું વજૂબ અઝ પારિજ (નમાજ બહાર) પૈકી હોય તો સિજદાએ સહવ વાજિબનથી. દા.ત. બિલાફે તરતીબ (ઉલ્ટું) કુર્ચાન પઢવું તર્ક વાજિબ છે, પરંતુ તરતીબના મુવાક્કિક પઢવું તિલાવતના વાજેબાત પૈકી છે. નમાઝના વાજેબાત પૈકી નથી, જેથી સિજદાએ સહવ નથી.

(રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૨૧૬) : ફર્જ તર્ક થઈ જવાથી નમાજ જતી રહે છે, (તુટી જાય છે) સિજદાએ સહવથી તેની પૂર્તિ થઈ શકતી નથી માટે ફરીથી પઢે અને સુન્નતો તથા મુસ્તહબો. દા.ત. તખબ્યુજ, તસ્મીયહ, સના, આમીન, તકબીરો તસ્બીહોની બદલીના તર્કથી પણ સિજદાએ સહવ નથી. બલ્કે નમાજ થઈ ગઈ.

(રદ્દુલ મુહ્તાર ગુનીયા)

પરંતુ પુનરાવર્તન મુર્હબ છે, ભૂલથી તર્ક કર્યું હોય કે ઈરાદા પુર્વક.

મસાલા-(૨૧૭) : સિજદાએ સહવ તે વખતે વાજિબ છે કે સમયમાં ગુંજાઈશ હોય, અને જો ન

હોય દા.ત. ફજરની નમાજમાં સહવ ઘટીત થયો અને પહેલો સલામ ફરવ્યો અને સિજદો પણ ન કર્યો કે સુરજ નીકળી આવ્યો તો સિજદએ સહવ સાકિત થઈ ગયો (ઉત્તરી ગયો) એવીજ રીતે જો કંપા પઢતો હતો અને સિજદાથી પહેલા સુરજ પીળો પડી ગયો તો સિજદો સાકિત થઈ ગયો. જુમ્મા અથવા ઈંદનો સમય જતો રહેશે તો પણ એ જ હુકમ છે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૧૮) : જે વસ્તુ બિનાના મનાઈ રૂપ બનેલ છે. દા.ત. વાતચીત વિગેરે જે નમાજથી (મનાઝી વિપરીત) છે. જો સલામ પછી જોવામાં આવે તો હવે સિજદએ સહવ થઈ શકતો નથી.

(આલમગીરી)

મસ્ખલા-(૨૧૯) : સિજદએ સહવનું સાંકિત થવું જો તેના ફેલથી છે તો પુનરાવર્તન વાજિબ છે. નહીં તો નહીં

(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૨૦) : ફર્જ તથા નિફલ બંનેનો એક જ હુકમ છે અર્થાત નિફલમાં પણ વાજિબ તર્ક થવાથી સહવનો સિજદો વાજિબ છે.

(આલમગીરી)

મસ્ખલા-(૨૨૧) : નિફલની બે રકાતો પઢી અને તેઓમાં સહવ થયો, પછી તેના ઉપર જ બિના કરીને બે રકાતો બીજી પઢી તો સિજદએ સહવ કરે અને ફર્જમાં સહવ થયો હતો અને તેના ઉપર ઈરાદા પૂર્વક નિફલની બિના કરી તો સહવનો સિજદો નથી, બલ્કે ફરજનું પુનરાવર્તન કરે. અને જો તે ફર્જની સાથે ભૂલથી નિફલ મેળવી લીધી હોય દા.ત. ચાર રકાત પર કાએદો કરીને ઉભો થઈ ગયો અને પાંચમીનો સિજદો કરી લીધો તો એક રકાત બીજી મેળવે કે આ બે નિફલ થઈ જાય. અને તેઓમાં સિજદએ સહવ કરે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૨૨) : સિજદએ સહવ પછી પણ અતાહિયાત પઢવું વાજિબ છે. અતાહિયાત પઢીને સલામ ફરવે. અને (ઉત્તમ એ છે કે બંને કાએદાઓમાં દુર્દશ શરીરફ પણ પઢે. (આલમગીરી) અને એ પણ અખત્યાર છે કે પહેલા કાએદામાં

અતાહિયાત તથા દુર્દશ શરીરફ પઢે, અને બીજામાં કેવળ અતાહિયાતપઢે.

મસ્ખલા-(૨૨૩) : સિજદએ સહવથી તે પહેલો કાઅદો બાતિલ થયો નહીં, પરંતુ ફરીથી કાઅદો કરવું વાજિબ છે. અને જો નમાજનો કોઈ સિજદો બાકી રહી ગયો હતો તો કાએદા પછી તેને કર્યો અથવા તિલાવતનો સિજદો કર્યો, તો તે કાઅદો જતો રહ્યો, હવે ફરીથી કાઅદો ફર્જ છે. કેમ કે કાએદા વગર નમાજ ખતમ કરી દીધી તો નમાજ થઈ નહીં અને પ્રથમ હાલતમાં થઈ જશે. પરંતુ ફરીથી પઢવું જરૂરી છે.

(દુર્દ મુહ્તાર વિગેરે)

મસ્ખલા-(૨૨૪) : એક નમાજમાં કેટલાક વાજિબો તર્ક થયા તો એજ બે સહવ સિજદા સૌના માટે કાફી છે. (રદ્દુલ મુહ્તાર વિગેરે) નમાજના વાજિબોનું વિગતવાર બયાન આગળ થઈ ગયું છે, પરેતુ અહુકામની વિગત માટે પુનરાવર્તન (ઉત્તમ છે). વાજિબની તાખીર (વિલંબ અથવા પાછળ કરવું) રૂકનતકદીમ (આગળ કરવું) અથવા તાખીર (પાછળ કરવું) અથવા તેનું મુકર્રર કરવું (એક વાંચ્યી વધુ) કરવું અથવા વાજિબમાં પરિવર્તન આ સંઘળા પણ વાજિબના તર્ક છે.

મસ્ખલા-(૨૨૫) : ફર્જની પહેલી બે રકાતોમાં અને નિફલ તથા વિત્રની કોઈ રકાતમાં સૂરાએ અલહિમની એક આયાત પણ રહી ગઈ અથવા સુરતથી પહેલા બે વખત અલહિમ પઢી અથવા સુરત મેળવવું ભૂલી ગયો અથવા સૂરતને ફાટેછા પર અભિમતા આપી અથવા અલહિમદો પછીએક અથવા બે નાની આયતો પઢીને રૂકૂમાં ચાલ્યો ગયો પછી યાદ આવ્યું અને પાછો ફર્જો અને ત્રણ આયતો પઢીને રૂકૂમ કર્યો તો આ સંઘળી હાલતોમાં સિજદએ સહવ વાજિબ છે.

(દુર્દ મુહ્તાર, આલમગીરી)

મસ્ખલા-(૨૨૬) : અલહિમદો પછી કોઈ સૂરત પઢી, તેના પછી ફરીથી અલહિમદો પઢી તો સિજદએ સહવ વાજિબ નથી. એવી જ રીતે ફર્જની પાછળી રકાતોમાં સૂરાએ ફાટેછાની તકરાર (એક વારથી વધારે વાર પઢવું તે) ધી સર્વથા સિજદએ સહવ વાજિબ નથી. અને જો પહેલી રકાતોમાં

અલહમ્રનો અધિક ભાગ પઢી લીધો હતો પછી પુનરાવર્તન કર્યું, તો સિજદાએ સહવ વાજિબ છે.
(આલમગીરી)

મસ્ખલા-(૨૨૭) : “અલહમ્રો” પઠવું ભૂલી ગયો અને સુરત શરૂ કરી દીધી અને એક આયત જેટલું પઢી લીધું, હવે યાદ આવ્યું તો અલહમ્રો પઢીને સુરત પઢે, અને (સહવનો) સિજદો વાજિબ છે. એવીજ રીતે જો સુરત પઠયા પછી અથવા રૂકુઅમાં અથવા રૂકુઅથી ઉભા થયા પછી યાદ આવ્યું તો પછી અલહમ્રો પઢીને સુરત પઢે, અને રૂકુઅનું પુનરાવર્તન કરે અને સિજદાએ સહવ કરે.

(આલમગીરી)

મસ્ખલા-(૨૨૮) : ફર્જની પાછલી રકાતોમાં સુરત મેળવી તો સિજદાએ સહવનથી. અને ઈરાદા પૂર્વક મેળવી તો પણ વાંધો નથી. પરંતુ ઈમામે આવું ન કરવું જોઈએ. એવી જ રીતે જો પાછલી રકાતોમાં અલહમ્રો ન પઢી, તો પણ સહવનો સિજદો નથી. અને રૂકુઅ તથા સુજૂદ તથા કાદામાં કુર્અન પઠયું, તો સિજદો વાજિબ છે.

(આલમગીરી)

મસ્ખલા-(૨૨૯) : સિજદાની આયત પઢી અને સિજદો કરવું ભૂલી ગયો, તો તિલાવતનો સિજદો અદા કરે. અને પછી સિજદાએ સહવ કરે.

(આલમગીરી)

મસ્ખલા-(૨૩૦) : જે ફેલ નમાજમાં મકરૂહ છે તેમાં તસ્તીબ વાજિબ છે. માટે તરતીબના વિરુદ્ધ ફેલ ઘટીત થાય તો સિજદાએ સહવ કરે. દા.ત. કિરાતથી પહેલા રૂકુઅ કરી લીધો અને રૂકુઅ પછી કિરાત પઢી નહીં, તો નમાજ ફાસિદ થઈ ગઈ. કેમ કે ફર્જ તર્ક થઈ ગયું. અને જો રૂકુઅ પછી કિરાત તો કરી, પરંતુ ફરી રૂકુઅ ન કર્યો, તો પણ નમાજ ફાસિદ થઈ ગઈ. કેમ કે કિરાતના કારણે રૂકુઅ જતો રહ્યો, અને જો ફર્જ જેટલી કિરાત કરીને રૂકુઅ કર્યો. પરંતુ વાજિબ-કિરાત અદા થયો નહીં. દા.ત. અલહમ્રો ન પઢી અથવા સૂરત ન મેળવી તો હુકમ એજ છે કે પાછો ફરે (લોટે), અને અલહમ્રો તથા સૂરત પઢીને રૂકુઅ કરે અને સહવનો સિજદો કરે. અને જો ફરીથી રૂકુઅ કર્યો

નહીં, તો નમાજ જતી રહી. કે પ્રથમ રૂકુઅ જતો રહ્યો હતો.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૩૧) : કોઈ રકાતનો કોઈ સિજદો રહી ગયો. અંતમાં યાદ આવ્યો તો સિજદો કરી લે પછી અતાહિયાત પઢીને સિજદાએ સહવ કરે. અને સિજદાની પહેલા જે નમાજના અફાલ અદા કર્યા હતા તે બાતિલ થશે નહીં હા, જો કાદા પછી તે નમાજવાળો સિજદો કર્યા તો કેવળ તે કાદા જતો રહ્યો.

(આલમગીરી, દુર્રમુખ્તાર)

મસ્ખલા-(૨૩૨) : અરકાન ઠીક કરવું ભૂલી ગયો, તો સહવનો સિજદો વાજિબ છે. (આલમગીરી)

મસ્ખલા-(૨૩૩) : ફર્જમાં કાદાએ ઉલા ભૂલી ગયો, તો જ્યાં સુધી સીધો ઉભો થયો ન હોય પાછો લોટી આવે. અને આમાં સહવનો સિજદો નથી, અને જો સીધો ઉભો થઈ ગયો તો લોટે નહીં. અને અંતમાં સહવનો સિજદો કરી લે, અને સીધો ઉભો થઈને લોટયો તો સિજદાએ સહવ કરે. અને સહી.. મજહબમાં નમાજ થઈ જશે, પરંતુ ગુનેહગાર થયો. માટે હુકમ છે કે, જો લોટે તો તુરતજ ઉલા થઈ જાય.

(દુર્રમુખ્તાર, ચુનીયા)

મસ્ખલા-(૨૩૪) : જો મુકતદી ભૂલથી ઉભો થઈ ગયો તો જરૂરી છે કે પાછો લોટી આવે કે, જેથી ઈમામની વિરુદ્ધતા થાય નહીં. (દુર્રમુખ્તાર)

મસ્ખલા-(૨૩૫) : આપરી કાદા ભૂલી ગયો તો જ્યાં સુધી તે રકાતનો સિજદો ન કર્યો હોય, લોટી આવે અને સિજદાએ સહવ કરે. અને જો કાદાએ અખીરામાં બેઠો હતો પરંતુ તશહહુદ જેટલું થયું ન હતું કે ઉભો થઈ ગયો તો લોટી આવે. અને તે જે પહેલા થોડી વાર સુધી બેસ્યો હતો ગણના થશે અથવા લોટયા પછી જેટલી વાર સુધી બેસ્યો તે અને પહેલાનો કાદા બંને મળીને જો તશહહુદ જેટલું થઈ ગયું તો ફર્જ અદા થઈ ગયો, પરંતુ સિજદાએ સહવ એ હાલતમાં પણ વાજિબ છે. અને જો તે રકાતનો સિજદો કરી લીધો તો સિજદાથી માણું ઉઠાવતાજ તે ફર્જ, નિફલ થઈ ગયો. માટે જો ચાહે તો મગારિબ સિવાયની બીજી નમાજોમાં એક રકાત બીજી મેળવી લે કે શકુઅ (બે. રકાતની જોડ) પુર્ણ થઈ જાય, અને એકી રકાત રહે નહીં. ભલે તે

નમાજ ફજર અથવા અસરની હોય. મગરિબમાં બીજી ન મેળવે કે ચાર પૂરી થઈ ગઈ.

(દુર્ભુલ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૩૬) : નિફલનો દરેક કાદો આખરી કાદો છે અથવા ફર્જ છે. જો કાદો ન કર્યો અને ભૂલીને ઉભો થઈ ગયો તો જ્યાં સુધી તે સિજદો ન કર્યો હોય લોટી આવે અને સિજદાએ સહવ કરે. અને વાજિબ નમાજ દા.ત. વિત્ર, ફર્જના હુકમમાં છે માટે વિત્રનો કાદએ ઉલા ભૂલી જાય તો એ જ હુકમ છે, જે ફર્જના કાદએ ઉલા ભૂલી જવાનો છે.

(દુર્ભુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૩૭) : જો 'તશહુદ' એટલો આખરી કાદો કરી લીધો છે. અને ઉભો થઈ ગયો તો જ્યાં સુધી તે રકાતનો સિજદો ન કર્યો હોય લોટી આવે અને સિજદાએ સહવ કરીને સલામ ફરવી દે અને જો કિયામની હાલતમાં સલામ ફરવી લીધી તો પણ નમાજ થઈ જશે, પરંતુ સુન્તત તર્ક થઈ અને તે હાલતમાં જો ઈમામ ઉભો થઈ ગયો તો મુક્તદી તેનો સાથ ન કરે બલકે બેઠેલ ઈન્નેઝાર (પ્રતીક્ષા) કરે. જો લોટી આવે તો સાથે થઈ જાય અને ન લોટયો તો અને સિજદો કરી લીધો તો મુક્તદી સલામ ફરવી દે અને ઈમામ એક રકાત બીજી મેળવે કે આ બે નિફલ થઈ જાય, અને સિજદાએ સહવ કરીને સલામ ફરવે, અને આ બે રકાતો જોહર અથવા ઈશાની સુન્તતના કાયમ મુકામ (સ્થાને) ન થશે. જો આ બે રકાતોમાં કોઈ ઈમામની ઈકતેદા (પેરવી) કરી અથવા સામેલ થયો તો આ મુક્તદી પણ છ (૬) રકાત પઢે. અને જો તેણે તોડી નાંખી તો બે રકાતની કઝ પઢે, અને જો ઈમામ ચોથી રકાત પર બેસ્યો ન હતો, તો આ મુક્તદી છ રકાતની કઝ પઢે અને જો ઈમામે આ રકાતોને ફાસીદ કરી દીધી તો તેના ઉપર સર્વથા કઝ નથી.

(દુર્ભુલ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૩૮) : ચોથી રકાત પર કાદો કરીને ઉભો થઈ ગયો અને કોઈ ફર્જ પઢવાવાળા એ તેની ઈકતેદા કરી તો ઈકતેદાઅ સહીહ નથી. ભલે લોટી આવ્યો અને કાદો ન કર્યો હતો તો જ્યાં

સુધી પાંચમી રકાતનો સિજદો ન કર્યો ઈકતેદા કરી શકે છે કે હજુ સુધી ફર્જમાંજ છે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૩૯) : બે રકાતની નિયત હતી અને તેમાં સહવ થયો અને બીજીના કાદાહમાં સિજદાએ સહવ કરી લીધો તો તેના ઉપર નિફલની બીના મકરુહે તકરીમી છે. (દુર્ભુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૪૦) : મુસાફરે સિજદાએ સહવ પછી ઈકામતની નિયત કરી તો ચાર પદ્ધવું ફર્જ છે અને અંતમાં સિજદાએ સહવનું પુનરાવર્તન કરે.

(દુર્ભુલ મુહ્તાર)

મસ્ખલા-(૨૪૧) : કાદએ ઉલામાં તશહુદ પછી એટલું પદ્ધયું - "અલ્લા હુમા સલ્લેઅલા મોહંમદિન" તો સહવનો સિજદો વાજિબ છે. એના કારણે નહી કે, હુદદ શરીફ પદ્ધયું બલકે એ કારણે કે નીજી રકાતના તિયામમાં તાખીર (વિલંબ) થઈ, તો જો એટલી વાર સુધી સુકૃત (મૌન) કર્યું તો પણ સિજદાએ સહવ વાજિબ છે જેવું કે કાદા, રૂકૂઅ તથા સિજદાએ સહવ વાજિબ છે. જેવું કે કાદા રૂકૂઅ તથા સિજદાઓમાં કુઅનિ પદવાથી સિજદાએ સહવ વાજિબ છે, જો કે તે કલામે ઈલાહી છે. ઈમામે આજમ રદીયલ્લાહો અન્હોએ નભીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસ્લ્લમને ખ્વાબ (સ્વપ્ન) માં જોયા. હુજૂરે પૂછ્યું હુદદ પદનારા પર તેમોએ કેમ સિજદો વાજિબ બતાયો, ઈમામે આજમે અર્જ કરી એટલા માટે કે તેણે ભૂલથી પદ્ધયું. હુજૂરે તેમની પ્રશંસા કરી. (દુર્ભુલ મુહ્તાર રદ્દુલ મુહ્તાર વિગેરે)

મસ્ખલા-(૨૪૨) : કોઈ કાદામાં જો તશહુદમાંથી કાંઈ રહી ગયું તો સિજદાએ સહવ વાજિબ છે. નમાજ નિફલ હોય કે ફર્જ.

(આલમગીરી)

મસ્ખલા-(૨૪૩) : પ્રથમ બે રકાતોના તિયામમાં અલહમ્દો પછી તશહુદ પદ્ધયું તો સિજદાએ સહવ વાજિબ છે. અને અલહમ્દી પહેલાં પદ્ધયુંતો વાજિબ નથી.

(આલમગીરી)

મસ્ખલા-(૨૪૪) : પાછલી રકાતોના તિયામમાં તશહુદ પદ્ધયું તો સિજદો વાજિબ થયો નહી અને જો કાદએ ઉલામાં એટલીક વખત તશહુદ પદ્ધયું તો સિજદો વાજિબ થઈ ગયો. (આલમગીરી)

મસ્ફલા-(૨૪૫) : તશહહુદ પઢ્યું ભુલી ગયો અને સલામ ફેરવી દીધી, પછી યાદ આવ્યું તો લોટી આવે, તશહહુદ પઢે અને સિજદાએ સહવ કરે, એવી જ રીતે જો તશહહુદના સ્થાને અલહમ્દો પઢ્યો તો સિજદો વાજિબ થઈ ગયો.

(આલમગીરી)

મસ્ફલા-(૨૪૬) : રૂક્ષઅના બદલે સિજદો કર્યો અથવા સિજદાના બદલે રૂક્ષઅ કર્યો અથવા કોઈ એવા રૂકનને બે વખત કર્યું જે નમાજમાં મુક્રર (એકથી વધારે વખત) મશરૂઅ (શરીઅતમાં) હતું નહીં, અથવા કોઈ રૂકનને આગળ અથવા પાછળ કર્યું તો તે સધળી હાલતોમાં સિજદાએ સહવ વાજિબ થૈ.

(આલમગીરી)

મસ્ફલા-(૨૪૭) : કુનૂત અથવા તકબીરે કુનૂત અર્થાત કિરાત પછી કુનૂત માટે જે તકબીર કહેવામાં આવે છે તે ભુલી ગયો તો સિજદાએ સહવ કરે.

(આલમગીરી)

મસ્ફલા-(૨૪૮) : ઈદેન (બને ઈદો)ની સધળી તકબીરો અથવા કેટલીક તકબીરો ભુલી ગયો અથવા વધારેકહી અથવા અનુચીત સ્થાનમાં કહી આ સધળી હાલતોમાં સિજદાએ સહવ વાજિબ થૈ.

(આલમગીરી)

મસ્ફલા-(૨૪૯) : ઈમામ ઈદોની તકબીરો ભુલી ગયો અને રૂક્ષઅમાં ચાલ્યો ગયો તો લોટી આવે અને મસ્બૂક રૂક્ષઅમાં શામેલ થયો તો રૂક્ષઅમાં જ તકબીરો કહી લે (આલમગીરી) ઈદેનમાં બીજી રકાતની, તકબીરે રૂક્ષઅ ભુલી ગયો તો સિજદાએ સહવ વાજિબ થૈ અને પહેલી રકાતની તકબીરે રૂક્ષઅ ભુલ્યો તો સિજદાએ સહવ નથી

(આલમગીરી)

મસ્ફલા-(૨૫૦) : જુમા તથા ઈદેનમાં સહવ ઘટિત થયો અને બહુ મોટી જમાઅત હોય તો બહેતર એ છે કે સિજદાએ સંદર્ભ ન કરે.

(આલમગીરી)

મસ્ફલા-(૨૫૧) : ઈમામે જહરી (કિરાતવાળી) નમાજમાં જવાજે નમાજ જેટલું અર્થાત એક આયત ધીમે પઢી, અથવા સિરી (નમાજ)માં જહર (અવાજ)થી પઢી તો સિજદાએ સહવ વાજિબ થૈ અને કલમો (શર્દ) ધીમે અથવા

જહરથી પઢ્યો તો માફ થૈ. (આલમગીરી, દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહતાર, શુનીયા) **મસ્ફલા-(૨૫૨) :** મુનફરિદ સિરી નમાજમાં જહરથી પઢ્યું, તો સહવનો સિજદો વાજિબ થૈ અને જહરી(નમાજ)માં ધીમેથી પઢ્યું તો સિજદાએ સહવ વાજિબ નથી (દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૨૫૩) : સનાતથા દુઆ તથા તશહહુદ બુલંદ અવાજી પઢ્યો તો સુન્તતના વિદુદ્ધ થયું, પરંતુ સિજદાએ સહવ વાજિબ નથી.

(રદ્દુલ મુહતાર)

મસ્ફલા-(૨૫૪) : કિરાત વિગેરે કોઈ પ્રસંગે વિચારવા લાગ્યો કે એક રૂકન જેટલું અર્થાત ત્રણ વખત સુભાનલ્લાહ કહેવા જેટલો વિલંબ થયો, તો સિજદાએ સહવ વાજિબ થૈ. (રદ્દુલ મુહતાર)

મસ્ફલા-(૨૫૫) : ઈમામથી સહવ થયો અને સિજદાએ સહવ કર્યો તો મુક્તદી ઉપર પણ સિજદો વાજિબ થૈ. ભલે મુક્તદી સહવ ઘટિત થયા પછી જમાઅતમાં શામેલ થયો હોય અને જો ઈમામથી સિજદાએ સહવ સાકિત થઈ ગયો (માથે થી ઉતરી ગયો) તો મુક્તદીથી પણ સાકિત (જવાબદારીથી મુક્ત) થયો, પછી જો ઈમામથી સાકિત થવું તેના કોઈ ફેલ (કાર્ય)ના કારણે હોય તો મુક્તદી ઉપર પણ નમાજનું પુનરાવર્તન વાજિબ થૈ નહીં તો માફ થૈ. (રદ્દુલ મુહતાર)

મસ્ફલા-(૨૫૬) : જો મુક્તદીથી ઈકટેદાની હાલતમાં સહવ ઘટિત થયો તો સિજદાએ સહવ વાજિબ નથી. (આમતુલ કુતુબ)

મસ્ફલા-(૨૫૭) : મસ્બૂક ઈમામની સાથે સિજદાએ સહવ કરે. જો કે તેના શરીક થવાથી પહેલા સહવ થયો હોય અને જો ઈમામની સાથે સિજદો ન કર્યો અને બાકીની નમાજ પઢવા ઉભો થઈ ગયો તો અંતમાં સિજદાએ સહવ કરે અને જો આ મસ્બૂકથી પોતાની નમાજમાં પણ સહવ થયો તો અંતનો એજ સિજદો તે, ઈમામના સહવ માટે પણ કાફિ થૈ (આલમગીરી, રદ્દુલ મુહતાર)

મસ્ફલા-(૨૫૮) : મસ્બૂકે પોતાની નમાજ બચાવવા માટે ઈમામ સાથે સિજદાએ સહવ કર્યો નહીં, અર્થાત જાણો છે કે જો સિજદો કરશે તો નમાજ

જતી રહેશે. દા.ત. ફજરની નમાજમાં સુર્યોદય થઈ જશે અથવા જુમ્મામાં અસરનો સમય આવી જશે અથવા માઝુર છે અને સમય ખતમ થઈ જશે અથવા મોજા પર મસાહની મુદ્દત પૂરી થઈ જશે તો આ હાલતોમાં ઈમામની સાથે સિજદો ન કરવામાં કરાહત નથી. બલ્કે તશહફુદ જેટલું બેસ્યા પછી (ઉભો થઈ જાય) (ગુનીયા)

મસખલા-(૨૬૮) : મસબૂકે ઈમામના સહવમાં ઈમામની સાથે સિજદએ સહવ કર્યો, પછી જ્યારે પોતાની નમાજ પઢવા ઉભો થયો અને તેમાં પણ સહવ થયો તો તેમાં પણ સિજદએ સહવ કરે.

(દુર્ભ મુખ્તાર વિગેરે)

મસખલા-(૨૬૦) : મસબૂકે ઈમામની સાથે સલામ ફેરવવું જાઈજ નથી. જો ઈરાદા પુર્વક ફેરવશે તો નમાજ જતી રહેશે, અને જો ભુલથી ફેરવી અને સલામ, ઈમામની સાથે એજ સમયમાં વિલંબ વગર હતી તો તેના ઉપર સિજદએ સહવ નથી. અને જો સલામ ઈમામની થોડીક વાર પછી પણ ફેરવી, તો ઉભો થઈ જાય અને પોતાની નમાજ પૂરી કરીને સિજદએ સહવ કરે. (દુર્ભ મુખ્તાર વિગેરે)

મસખલા-(૨૬૧) : જો કોઈ માણસ ઈમામનાએક સિજદો કર્યો પછી શરીક થયો તો બીજો સિજદો ઈમામની સાથે કરે અને પહેલા સિજદાની કરા નથી. અને જો બંને સિજદાઓ પછી શરીક થયો તો ઈમામના સહવનો તેના માથે કોઈ સિજદો નથી. (રદ્દુલ મુહ્તાર)

મસખલા-(૨૬૨) : ઈમામે સલામ ફેરવી લીધી અને મસબૂક પોતાની નમાજ પૂરી કરવા ઉભો થયો, હવે ઈમામે સિજદાએ સહવ કર્યો તો જ્યાં સુધી મસબૂકે તે રકાતનો સિજદો કર્યો ન હોય, લોટી આવે અને ઈમામની સાથે સિજદો કરે. જ્યારે ઈમામ સલામ ફેરવે તો હવે પોતાની નમાજ પછે અને પહેલા જે ડિયામ તથા કિરાત તથા રૂક્ક કરી લીધા હોય તેની ગણના થશે નહીં બલ્કે હવે ફરીથી તે અફઆલ (કાર્યો) કરે અને જો પાછો ન ફર્યો અને પોતાની નમાજ પછી લીધી તો અંતમાં સિજદએ સહવ કરે અને જો તે રકાતનો સિજદો કરી લીધો તો પાછો ન ફરે જો લોટશે (ફરશે) તો નમાજ

ફાસિદ થઈ જશે (આલમગીરી)

મસખલા-(૨૬૩) : ઈમામતના સહવથી લાલિક ઉપર પણ સિજદએ સહવ વાજિબ છે. પરંતુ લાલિક પોતાની નમાજના અંતમાં સિજદએ સહવ કરશે અને ઈમામની સાથે જે સિજદો કર્યો હોય તો અંતમાં પુનરાવર્તન કરે. (દુર્ભ મુખ્તાર)

મસખલા-(૨૬૪) : જો ત્રણ રકાતમાં મસબૂકથયો અને એક રકાતમાં લાલિક તો એક રકાત કિરાત વગર પઢીને બેસી જાય અને “તશહફુદ” પઢીને સિજદએ સહવ કરે, પછી એક રકાત ભરી (કિરાતવાળી) પઢીને બેસી જાય કે આ તેની બીજી રકાત છે. પછી એક ભરેલી અને એક ખાલી પઢીને સલામ ફેરવી દે. અને જો એકમાં મસબૂક છે, અને ત્રણમાં લાલિક તો ત્રણ પઢીને સિજદએ સહવ કરે, પછી એક રકાત ભરેલી પઢીને સલામ ફેરવી દે. (રદ્દુલ મુહ્તાર)

મસખલા-(૨૬૫) : મુક્કીમે (જે મુસાફીર ના હોય તે) મુસાફીરની ઈક્તેદા કરી અને ઈમામથી સહવ થયો, તો ઈમામની સાથે સિજદએ સહવ કરે, પછી એનાની બે રકાતો પછે અને તેમાં પણ સહવ થાય તો અંતમાં ફરીથી સિજદો કરે. (રદ્દુલ મુહ્તાર)

મસખલા-(૨૬૬) : ઈમામથી “સલાતુલ ખૌફ” (ભયની નમાજ)માં (જેનું વર્ણન અને તરીકો ઈન્શાઅલ્લાહ આગળ મજકૂર થશે) માં સહવ થયો તો ઈમામની સાથે બીજો ગિરોહ સિજદએ સહવ કરે અને પહેલો ગિરોહ તે વખતે કરે જ્યારે પોતાની નમાજ ખતમ કરી લે. (આલમગીરી)

મસખલા-(૨૬૭) : ઈમામને હદસ થયું (વુણુ તુટી ગયું) અને તેનાથી પહેલા, સહવ પણ ઘટિત થઈ ગયો છે, અને તેણે ખલીફા બનાવ્યો તો ખલીફા સિજદએ સહવ કરે. અને જો ખલીફાને પણ સહવ થાય તો એજ સિજદા કાફી છે. અને જો ઈમામથી સહવ થયો નથી પરંતુ ખલીફાથી એ હાલતમાં સહવ થયો તો ઈમામ ઉપર પણ સિજદએ સહવ વાજિબ છે. અને જો ખલીફાનો સહવ ખિલાફતથી પહેલા થાય તો સિજદો વાજિબ નથી. ન તેના ઉપર ન ઈમામ ઉપર. (આલમગીરી)

મસખલા-(૨૬૮) : જેના ઉપર સિજદએ સહવ

વાજિબ છે જો સહવ થવું યાદ ન હતું અને નમાજ કરતાં કરવાની નિયતથી સલામ ફેરવી લીધી તો હજુ નમાજથી બાહર થયો નહીં, એ શર્તે સિજદાએ સહવ કરી લે. માટે જ્યાં સુધી વાતચીત અથવા ઈરાદા પૂર્વકનું હદસ અથવા મસ્જિદથી બહાર નિકળવું અથવા બીજો કોઈ ફેલ નમાજની મનાજી (વિપરીત) કર્યા ન હોય તેના માટે હુકમ છે કે સિજદાએ સહવ કરી લે. અને જો સલામ પછી સિજદાએ સહવ ન કર્યો તો સલામ ફેરવવાના સમયથી નમાજથી બહાર થઈ ગયો. માટે સલામ ફેરવવા પછી જો કોઈ એ તેની ઈક્તેદા કરી અને ઈમામે સિજદાએ સહવ કરી લીધો તો ઈક્તેદા સહીહ છે. અને જો સિજદો ન કર્યો તો સહીહ નથી. અને જો યાદ હતું કે સહવ થયો છે અને નમાજ કરતાં કરવાની નિયતથી સલામ ફેરવી લીધી તો સલામ ફેરવતા જ નમાજની બહાર થઈ ગયો, અને સિજદાએ સહવ કરી શકતો નથી, તે નમાજ ફરી પઢી લે. અને જો તેણે ભૂલથી સિજદો કર્યો અને તેમાં કોઈ શરીક થાય તો ઈક્તેદા સહીહ નથી.

(હર્દી મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ઝલા-(૨૬૮) : તિલાવતનો સિજદો બાકી હતો અથવા આખરી કાદામાંતશહહુદ પદ્યું ન હતું પરંતુ તશહહુદ પદ્યા જેટલું બેસી રહ્યો હતો અને એ યાદ છે કે તિલાવતનો સિજદો અથવા તશહહુદ બાકી છે પરંતુ ઈરાદા પૂર્વક સલામ ફેરવી લીધી તો સિજદો સાકિત થઈ ગયો અને નમાજ થી બહાર થઈ ગયો, નમાજ ફાસિદ થઈ નહીં. કારણે કે સઘણા અરકાન અદી કરી લીધા છે, પરંતુ વાજિબ તક કરવાના કારણે મકરૂહે તહરીમી થઈ. એવી જ રીતે જો તેના માથે સિજદાએ સહવ તથા તિલાવતનો સિજદો બાકી છે આ બંને યાદ છે અથવા કેવળ તિલાવતનો સિજદો યાદ છે. અને ઈરાદા પૂર્વક સલામ ફેરવી લીધી તો બંને સાકિત થઈ ગયા. જો નમાજનો સિજદો તથા સહવનો સિજદો બંને બાકી હતા અથવા કેવળ નમાજનો સિજદો રહી ગયો હતો અને નમાજનો સિજદો યાદ હોવા છતાં સલામ ફેરવી લીધી તો નમાજ ફાસિદ થઈ ગઈ. અને જો નમાજનો સિજદો તથા

તિલાવતનો સિજદો બાકી હતા અને સલામ ફેરવતી વેળા બંને યાદ હતા અથવા એક યાદ હતો, તો પણ નમાજ ફાસિદ થઈ ગઈ.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ઝલા-(૨૭૦) : નમાજનો સિજદો અથવા તિલાવત નો સિજદો બાકી હતો અથવા સિજદાએ સહવ કરવો હતો અને ભૂલથી સલામ ફેરી લીધી તો જ્યાં સુધી મસ્જિદ થી બહાર નિકળ્યા નહીં સિજદો કરી લે. અને મેદાનમાં હોય તો જ્યાં સુધી સફોથી ઉલંઘન ન થાય આગળ સિજદાની જગ્યાએ પસાર થયો નહીં, તો સિજદો કરી લે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ઝલા-(૨૭૧) : રૂક્ખઅમાં યાદ આબુંકે નમાજનો કોઈ સિજદો રહી ગયો છે અને ત્યાથી જ સિજદામાં ચાલ્યો ગયો અથવા સિજદામાં યાદ આબુંકું અને માથું ઉચ્ચ રહી તે સિજદો કરી લીધો તો બેહતર છે કે તે રૂક્ખ તથા સુજૂદનું પુનરાવર્તન કરીલે સિજદાએ સહવ કરે. અને જો તે સમયે ન કર્યો બલ્કે નમાજના અંતમાં કર્યો તો તે રૂક્ખ તથા સુજૂદનું પુનરાવર્તન નથી, સિજદાએ સહવ કરવો પડશે.

(હર્દી મુખ્તાર)

મસ્ઝલા-(૨૭૨) : જોહરની નમાજ પદ્યો હતો અને એ ખ્યાલ કરીને કે ચાર રકાત પૂરી થઈ ગઈ, બે રકાત પર સલામ ફેરવી દીધી, તો ચાર પૂરી કરી લે. અને સિજદાએ સહવ કરી લે. અને જો એ ગુમાન કર્યું કે, મારા ઉપર બેજ રકાતો છે. દા.ત. પોતાને મુસાફિર તરીકે કલ્પના કરી અથવા ગુમાન થયું કે જુઝ્યાની નમાજ છે અથવા નવો મુસલમાન છે અને સમજ્યો કે જોહરના ફર્જ બેજ રકાતો છે, અથવા ઈશાની નમાજને તરાવીહની કલ્પના કરી તી નમાજ જતી રહી. એવી જ રીતે કોઈ રૂકન રહી ગયું અને યાદ હોવા છતાં સલામ ફેરવી લીધી તો નમાજ તુટી ગઈ.

(હર્દી મુખ્તાર)

મસ્ઝલા-(૨૭૩) : જેને રકાતની ગણતરીમાં શંકા હોય દા.ત. ત્રણ થઈ કે ચાર થઈ? અને બાલિગ થયા પછી આ પ્રથમે બનાવ છે તો સલામ ફેરવી અથવા કોઈ નમાજ વિરુદ્ધનું અમલ કરીને, નમાજ તોડી નાખે અથવા ગુમાનની ગણના પ્રમાણે પઢી

લે પરંતુ યેનકેન પ્રકારે આ નમાજને આરંભથી પછે, તેવળ નમાજ તોડવાની નિયત કાફી નથી. અને જો આ શંકા પ્રથમવાર નથી બલ્કે પહેલાં પણ થઈ ચુકી છે, તો જો કોઈ બાજુએ ખાત્રી હોય તો તેના ઉપર અમલ કરે. નહીં તો ઓછા પ્રત્યે ધારણા કરે અર્થાત ત્રણ-ચારમાં શંકા હોય તો ત્રણ ઠેરવે, બે-ત્રણમાં શકા હોય તો બે, તથા ધારણા અનુસાર અને ત્રીજી-ચોથી બંનેમાં કંઘદો કરે. તેચીજી રકાતનું ચોથી હોવું શંકાશીલ છે. અને ચોથીમાં કાઅદા પછી સિજદાએ સહવ કરીને સલામ ફેરવી લે. અને ખાત્રીની છાલતમાં સિજદાએ સહવ નથી, પરંતુ વિચારવામાં એક રૂકન જેટલો વિલંબ કર્યો હોય તો સિજદાએ સહવ વાજિબ થઈ ગયો.

(હિદાયા વિગેરે)

મસ્ઝલા-(૨૭૪) : નમાજ પૂરી કર્યા પછી શંકા ગઈ તો તેનો કોઈ એતબાર (માન્ય) નથી, અને જો નમાજ પછી યકીન (ખાત્રી) છે કે કોઈ ફરજ રહી ગયો, પરંતુ તેમાં શંકા છે કે, તે શું છે, તો નમાજ ફરીથી પછું ફરજ છે (કંતહ-રદ્દુલ મુહતાર)

મસ્ઝલા-(૨૭૫) : જોહરની નમાજ પઢયા પછી એક આદિલ (શરીરાતનો પાબંદ) માણસે ખબર આપી કે (નમાજ પઢનારાઓ એ) ત્રણ રકાતો પછી છે, તો ફરીથી પછે, ભલે તમારા ખ્યાલમાં આ ખબર ગલત (ખોટી) હોય. અને જો કહેનાર આદિલ ન હોય તો તેની ખબરનો એતબાર (માન્ય) નથી. અને જો નમાજીને શંકા હોય અને (૨) બેઆદીલોએ ખબર આપી તો તેમની ખબર (ઉપર અમલ કરવું જરૂરી છે.

(આલમગીરી વિગેરે)

મસ્ઝલા-(૨૭૬) : જો રકાતની સંખ્યામાં શંકા ન હોય થઈ પરંતુ ખૂદ તે નમાજ વિશે શંકા છે, દા.ત. જોહરની બીજી રકાતમાં શંકા થઈ કે આ અસરની નમાજ પહુંછું અને ત્રીજી રકાતમાં નિફલની શંકા થઈ અને ચોથી રકાતમાં જોહરની તો તે જોહરની જ ન નમાજ છે.

(રદ્દુલ મુહતાર)

મસ્ઝલા-(૨૭૭) : તશહૃદ પછી એ શંકા થઈ કે ત્રણ રકાત થઈ કે ચાર? અને એક રૂકન જેટલું ખામોશ રહ્યો, અને વિચારતો રહ્યો પછી યકીન (ખાત્રી) થઈ કે ચાર થઈ ગઈ તો સિજદાએ સહવ

વાજિબ છે. અને જો એક બાજુએ સલામ ફેરવ્યા પછી એવું થયું તો કાંઈ નહીં. અને જો હસદ થયું અને વુઝુ કરવા ગયો હતો કે એ શંકા ઘટિત થઈ અને વિચારવામાં વુઝુમાં યોડી વાર અટકી ગયો તો સિજદાએ સહવ વાજિબ છે. (આલમગીરી)

મસ્ઝલા-(૨૭૮) : એ શંકા ઘટિત થઈ કે, આ સમયની નમાજ પછી કે નહીં? જો સમય બાકી છે તો ફરીથી પઢી લે. નહીં તો નહીં. (આલમગીરી)

મસ્ઝલા-(૨૭૯) : શંકાના કારણે સૂરતોમાં સિજદાએ સહવ વાજિબ છે અને ખાત્રીમાં નહીં. પરંતુ જ્યારે વિચારવામાં એક રૂકનનો વિલંબ થઈ ગયો તો સિજદાએ સહવ વાજિબ થઈ ગયો.

(દુર્દ્રો મુખ્યાર)

મસ્ઝલા-(૨૮૦) : બેવુઝુ હોવાનો અથવા મસોહ ન કરવાનું થકીન થયું અને એજ હાલતમાં એક રૂકન અદા કરી લીધો તો આરંભથી નમાજ પછે. ભલે પછી યકીન થયું કે વુઝુ હતું અને મસોહ કર્યો હતો.

(આલમગીરી)

મસ્ઝલા-(૨૮૧) : નમાજમાં શંકા થઈ કે મુકીમ (જે મુસાફીર ન હોય તે) છે કે મુસાફીર? તો ચાર પછે. અને બીજી રકાત પછી કંઘદો જરૂરી છે.

(આલમગીરી)

મસ્ઝલા-(૨૮૨) : વિત્રમાં શંકા થઈ કે બીજી રકાત છે કે ત્રીજી? તો તેમાં દુઆએ કુનૂત પઢીને કાએદા પછી એક રકાત બીજી પછે. અને તેમાં પણ કુનૂત પછે અને સિજદાએ સહવ કરે. (આલમગીરી)

મસ્ઝલા-(૨૮૩) : ઈમામ નમાજ પડાવી રહ્યો છે કે બીજી રકાતમાં શંકા થઈ કે, પહેલી છે કે બીજી? અથવા ચોથી? અને ત્રીજીમાં શંકા થઈ અને મુક્તાદીઓ તરફ નજર કરી કે તેઓ ઉભા થાપતો ઉભો થઈ જાઉ, બેસે તો બેસી જાઉ તો તેમાં વાંધો નથી. અને તેમાં સિજદાએ સહવ વાજિબ થયો નહીં.

(આલમગીરી)

બીમારની નમાજનું બચાન

હદીસમાં છે કે ઈમાન બિન હસીન રદીયલ્વાહો અન્ધો બીમાર હતા, હુઝુરે અકદસ સલ્લલ્વાહો અલયહે વસ્લ્લામથી નમાજ વિષે પ્રશ્ન પુછ્યો.

આપે ફરમાવ્યું: ઉભા રહીને પઢો જો શક્તિ ન હોય તો બેસીને પઢો અને તેની પણ શક્તિ ન હોય તો લેટીને (આડા પડીને) પઢો, અલ્લાહ તાંબાલા કોઈ નફસ (જીવ) ને તેની શક્તિ કરતાં વધારે તકલીફ આપતો નથી. આ હદ્દીસને મુસ્લિમ સિવાય મુહદિસોની જમાયત કરી છે. બજારે મુસ્નદમાં અને બયહકીએ “મઅરફહ”માં જાબિર રદ્દીયલ્લાહો અન્યોથી રિવાયત કરે છે કે, નભીએ કરીમ સલ્લાલ્લાહો અલયહે વસ્લુલમ એક બીમારની ખબર કાઢવા તશરીફ લઈ ગયા. જોયું કે તે માણસ તકીયા પર નમાજ પઢે છે, અર્થાત સિજદો કરે છે. આપ તેને ફેકી દીધો. તેણે એક લાકડી લઈને તેના ઉપર નમાજ પઢી, આપે તેને પણ લઈને ફેકી દીધી અને ફરમાવ્યું જો શક્તિ હોય તો જમીન પર નમાજ પઢ. નહીં તો ઈશારો કરે અને સિજદાને રૂકુઅ કરતા પસ્ત (વધારે નમે) કરે.

મસ્ફ્લા-(૨૮૪): જે માણસ બીમારીના કારણે ઉભા રહીને નમાજ પઢવા શક્તિમાંન નથી કે ઉભા રહીને પઢવાથી નુકશાન થશે અથવા બીમારી વધી જરી અથવા સારા થવામાં લંબાણ થઈ જરી અથવા ચક્કર આવે છે, અથવા ઉભા રહીને નમાજ પઢવાથી પેશાબનો કતરો (ટીપું) આવશે અથવા સહન થઈ શકે નહીં તેવું સખ્ત દર્દ પૈદા થઈ જરી તો આ સઘળીછાલતોમાં બેસીને રૂકુઅ તથા સુજૂદ સાથે નમાજ પઢે. (હુર્રે મુખ્તાર)

(આના વિપે કેટલાએ મસાઈલ “ફરાઈજે નમાજ” માં વર્ણન થયા છે)

મસ્ફ્લા-(૨૮૫): જો કોઈ માણસ પોતાની જાતે બેસી પણ શકતો નથી પરંતુ છોકરો અથવા ગુલામ કે નોકર અથવા કોઈ અજાયો માણસ ત્યાં છે કે બેસાડી દેશે તો બેસીને નમાજ પઢવું જરૂરી છે. અને બેસી રહી શકતો નથી તો તકીયા અથવા દીવાલ અથવા કોઈ વ્યક્તિ પર ટેકોલગાવી નમાજ પઢે, આમ પણ ન થઈ શકે તો લેટી ને પઢે. અને બેસીને પઢવું શક્ય હોય તો લેટીને નમાજ પઢવાથી નમાજ થશે નહીં.

(આલમગીરી, હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસ્ફ્લા-(૨૮૬): બેસીને નમાજ પઢવામાં કોઈ ખાસ રીતે બેનું જરૂરી નથી, બલ્કે બીમારને જેવી રીતે આસાની (સરળતા) થાય એવી રીતે બેસે. હાં, દોઝાનું (ધૂંટણ ભેર) બેસવું સરળ હોય અથવા બીજી રીતે બેસવાની બરાબર હોય તો બેઝાનું ઉત્તમ છે. નહીં તો જેમાં આસાની હોય ધારણ કરે.

(આલમગીરી વિગેરે)

મસ્ફ્લા-(૨૮૭): નિફલ નમાજમાં થાકી ગયો હોય તો દીવાલ અથવા અસા (લાકડી) પર ટેકો લગાવવામાં વાંધો નથી. નહીં તો મકરુહ છે. અને બેસી ને પઢવામાં કોઈ વાંધો નથી. (હુર્રે મુખ્તાર)

મસ્ફ્લા-(૨૮૮): ચાર રક્ખતવાળી નમાજ બેસીને પઢી, કાદદાએ અભીરાના મોકા પર તશહફુદ પઢવાથી પહેલા કિરાત શરૂ કરી લીધી અને રૂકુઅ પણ કર્યો તો તેનો એજ હુકમ છે કે ઉભા રહીને પઢનાર ચોથી રક્ખત પછી ઉભો થઈ જાય માટે તેણે જ્યાં સુધી પાંચમી રક્ખતનો સિજદો કર્યો ન હોય, તશહફુદ પઢે અને સિજદાએ સહવ કરે. અને પાંચમીનો સિજદો કરી લીધો તો નમાજ તુટી ગઈ.

(આલમગીરી)

મસ્ફ્લા-(૨૮૯): બેસીને નમાજ પઢનારબીજી રક્ખતના સિજદામાંથી ઉઠ્યો અને ડિયામની નિયત કરી પરંતુ કિરાતથી પહેલા યાદ આવી ગયું તો તશહફુદ પઢે અને નમાજ થઈ ગઈ અને તેમાં સિજદાએ સહવ પણ નથી. (આલમગીરી)

મસ્ફ્લા-(૨૯૦): બીમારે બેસીને નમાજ પઢી. ચોથી રક્ખતના સિજદાથી ઉઠ્યો તો એ ગુમાન કરીને કે ત્રીજી રક્ખત છે, કિરાત કરી અને ઈશારાથી રૂકુઅ તથા સુજૂદ કર્યા તો નમાજ તુટી ગઈ અને બીજી રક્ખતના સિજદા પછી એ ગુમાન કરીને કે બીજી રક્ખત છે, કિરાત શરૂ કરી પછી યાદ આવ્યું તો તશહફુદ તરફ પાછો ન ફરે, બલ્કે નમાજ પૂરી કરી લે અને અંતમાં સિજદાએ સહવ કરે. (આલમગીરી)

મસ્ફ્લા-(૨૯૧): ઉભા થઈ શકે છે પરંતુ રૂકુઅ તથા સુજૂદ કરી શકતો નથી દા.ત. ગણા (ગાઈન) વિગેરેમાં ફોડલો છે કે: સિજદો કરવાથી વહેરો તો પણ બેસીને ઈશારાથી નમાજ પઢી શકે છે, બલ્કે

એજ બહેતર છે. અને એ હાલતમાં એવું પણ કરી શકે છે કે ઉની થઈને પઢે અને રૂકુઅ માટે ઈશારો કરે, પછી બેસીને સિજદા માટે ઈશારો કરે.

(આલમગીરી, દુર્ભુખ્તાર, રદ્દુલ મુહ્તાર) મસ્ફલા-(૨૮૨) : ઈશારાની હાલતમાં સિજદાનો ઈશારો રૂકુઅ કરતાં બલકો (નીચો) હોવું જરૂરી છે. પરંતુ એ જરૂરી નથી કે મસ્તકને સાવ જમીનની નિકટ કરી દે. સિજદા માટે તકીયો વગરે કોઈ ચીજ પેશાની (લલાટ) ની નિકટ લાવી તેના ઉપર સિજદો કરવો મકરૂહે તહીરીમી છે. ભલે ખૂદ તેણે તે વસ્તુ મુકી હોય કે બીજાએ.

(દુર્ભુખ્તાર વિગેરે)

મસ્ફલા-(૨૮૩) : જો કોઈ વસ્તુ ઉપાડી તેના પર સિજદો કર્યો અને સિજદામાં રૂકુઅની સરખામણીમાં મસ્તક બધારે ઝુકાવ્યું તો પણ સિજદો થઈ ગયો, પરંતુ શુનેહગાર થયો. અને સિજદા માટે માંથું વધારે નમાજયું નહીં, તો સિજદો થયો જ નહીં.

(દુર્ભુખ્તાર, આલમગીરી)

મસ્ફલા-(૨૮૪) : જો કોઈ ઉચ્ચી વસ્તુ ઝુકાવીન ઉપર મુકેલી છે અને તેના ઉપર સિજદો કર્યો અને રૂકુઅ માટે કેવળ ઈશારો ન થયો બલ્કે પીઠ પણ ઝુકાવી, તો સહીએ છે. એ શર્ત કે સિજદાની શરતો દેખવામાં આવે. દાંત. તે વસ્તુનું સખત હોવું કે જેના ઉપર સિજદો કર્યો હોય કે તે એટલા પ્રમાણમાં પેશાની દબી ગઈ હોય કે, ફરી દબાવવાથી દબે નહીં. અને તેની ઉચ્ચાઈ બાર આંગળાથી વધારે ના હોય, આ શરતો દેખવામાં આવ્યા પછી વાસ્તવમાં રૂકુઅ તથા સુજુદ પામવામાં આવ્યા, ઈશારાથી પઢનાર તેને ન કહીશું અને ઉભા થઈને પઢનાર તેની ઈકટેદા કરી શકે છે, અને આ શાસ્ત્ર જ્યારે આવી રીતે રૂકુઅ તથા સુજુદ કરી શકે છે અને કિયામ માટે શક્તિમાન છે તો તેના ઉપર કિયામ ઉપર ફર્જ છે. અથવા નમાજ દરમ્યાન કિયામ પર શક્તિમાન થઈ ગયો તે જે બાકી છે તેને ઉભા થઈને પઢવું ફર્જ છે માટે જે માણસ જમીન ઉપર સિજદો કરી શકે તેમ નથી, પરંતુ મજફુર શરતો સાથે કોઈ ચીજ જમીન પર મુકીને સિજદો કરી શકે છે તો તેના માટે ફર્જ છે કે, એવી જ રીતે સિજદો કરે; ઈશારો જાઈજ નથી. અને જો તે વસ્તુ જેના

ઉપર સિજદો કર્યો એવી નથી તો વાસ્તવમાં સુજુદ ન ગણાયો બલ્કે સિજદા માટે ઈશારો થયો માટે ઉભો થનાર તેની ઈકટેદા કરી શકતો નથી અને જો તે માણસ નમાજ દરમ્યાન કિયામ માટે શક્તિમાન થયો તો ફરીથી નમાજ પઢે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૨૮૫) : પેશાનીમાં જખમ છે કે સિજદા માટે માંથું જમીન ઉપર લગાવી શકતો નથી, તો નાક ઉપર સિજદો કરે. અને એવું ન કર્યું બલ્કે ઈશારો કર્યો તો નમાજ થઈ નહીં. (આલમગીરી)

મસ્ફલા-(૨૮૬) : જો દર્દી (બીમાર) બેસવા માટે શક્તિમાન નથીતો લેટીને ઈશારાથી જ નમાજ પઢે, ભલે જમણા અથવા ડાબા પડખે સુઈ રહીને કિબલા તરફ મુખ કરે કે ચિત લેટીને કિબલા તરફ પગ કરે, પરંતુ પગો લાંબા કરે નહીં, કે કિબલા તરફ પગ લાંબા કરવું મકરૂહ છે, બલ્કે ધૂંટરાં ઉભા રાખે અને માથા નીચે તકીયો વગરે મુકીને માંથું ઉચ્ચ કરીલે કે, મુખ કિબલા તરફ થઈ જાય. અને આ હાલત અર્થાત ચિત લેટીને નમાજ પઢવું અફઝલ છે.

(દુર્ભુખ્તાર વિગેરે)

મસ્ફલા-(૨૮૭) : જો માથાથી ઈશારો પણ નકરી શકતો નમાજ સાકિત (જીમેથી મુક્ત) છે તેની જરૂરત નથી કે આંખો અથવા દીલના ઈશારાથી પઢે પછી જો છ (૬) સમય એજ સ્થિતિમાં પસાર થઈ ગયા તો તેમની કાજા પણ સાકિત છે અને ફિદ્યાની પણ હાજર નથી. નહીં તો તંદુરસ્ત થયા પછી તે નમાજોની કાજા લાંજિમ છે. જો કે એટલી જ સેહત (સ્વાસ્થ્ય) હોય કે માથાના ઈશારાથી પઢી શકે.

(દુર્ભુખ્તાર વિગેરે)

મસ્ફલા-(૨૮૮) : બીમાર જો કિબલાની તરફ પોતાની જાતે મુખ કરી ન શકે છે ન બીજાની મદદથી, તો એ જ હાલતમાં નમાજ પઢીલે અને સાજો થઈ ગયા પછી તે નમાજ ફરીથી પઢવાની કોઈ જરૂરત નથી. અને જો કોઈ માણસ હાજર છે કે તેના કહેવાથી કિબલા તરફ મુખ કરી દેશો પરંતુ તેણે કહ્યું નહીં તો નમાજ થઈ નહીં. ઈશારાથી જે નમાજો પઢી છે સાજા થઈ ગયા પછી તેમનું પણ પુનરાવર્તન નથી. એવી જ રીતે જો જુબાન (જીબ) બંધ થઈ

ગઈ અને ગુંગા ની જેમ નમાજ પઢી, પછી જુબાન ખૂલી ગઈ તો તે નમારોનું પુનરાવર્તન નથી.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૨૯૮) : બીમાર એ સ્થિતિએ પહોંચી ગયો કે રૂકુઅ અને સુજુદની સંઘ્યા યાદ રાખી શકતો નથી, તો તેના ઉપર નમાજ આદા કરવું જરૂરી નથી. (હુર્રે મુખ્તાર)

મસ્ફલા-(૩૦૦) : તંદુરસ્ત માનવી નમાજ પઢી રહ્યો હતો કે નમાજ દરમિયાન એવી બીમારી પૈદા થઈ ગઈ કે, અરકાનની આદાયળી ઉપર શક્તિ ન રહી તો જેવી રીતે શક્ય હોય બેસીને, લેટીને નમાજ પૂરી કરી લે. આરંભથી પઢવાની હાજત નથી.

(હુર્રે મુખ્તાર, આલમગીરી)

મસ્ફલા-(૩૦૧) : બેસીને રૂકુઅ તથા સુજુદથી નમાજ પઢી રહ્યો હતો, નમાજ દરમિયાન કિયામ પર શક્તિમાન થઈ ગયા તો જે નમાજ બાકી હોય છે તેને ઉભા થઈને પઢે. અને ઈશારાથી પઢતો હતો અને નમાજમાં જ રૂકુઅ તથા સિજદા પરશક્તિમાન થઈ ગયો તો શરૂથી (કરીથી) પઢે. (આલમગીરી, હુર્રે મુખ્તાર)

મસ્ફલા-(૩૦૨) : રૂકુઅ તથા સુજુદ પર શક્તિમાન ન હતો. ઉભો રહીને કે બેસીને નમાજ શરૂ કરી, રૂકુઅ તથા સુજુદ ઈશારાથી કર્યા ન હતા કે, સારો (તંદુરસ્ત) થઈ ગયો તો એજ નમાજને પૂરી કરે, ફરીથી પઢવાની હાજત નથી. અને જો લેટીને નમાજ પઢી હતી અને ઈશારાથી પહેલા ઉભા રહીને કે બેસીને રૂકુઅ તથા સુજુદ પર શક્તિમાન થઈ ગયો તો આરંભથી પઢે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૩૦૩) : ચાલતી નૌકા (હોડી) અથવા જહાજમાં ઉઝ્ર વગર બેસીને નમાજ પઢવું સહીહ નથી, એ શર્ત કે ઉત્તરીને મુસ્કી (જમીન) માં પઢી શકે. અને જો નૌકા-જહાજ જમીન ઉપર બેસી ગયું હોય તો ઉત્તરવાની જરૂરત નથી. અને કિનારા પર બાંધેલો હોય અને ઉત્તરી શકતો હોય તો ઉત્તરીને જમીન પર પઢે. નહીં તો નૌકા માંજ (ઉભા રહીને પઢે. અને દરિયા વચ્ચે લંગર નાખેલું છે તો બેસીને પઢી શકે છે. જો હવાના (વાવાઝોડા)

ના તેજ જપાટા (કુંફાટા) લાગતા હોય કે ઉભા થવામાં ચક્કરનું શુમાન ગાલિબ હોય અને જો હવાથી (પવનથી) વધારે હરકત ન થાય તો બેસીને પઢી શકતો નથી. અને નૌકા પર નમાજ પઢવામાં કિબ્લા રૂખ થવું લાજીમ છે. અને જ્યારે નૌકા ફરી જાય તો નમાજી પણ કિબ્લા પ્રત્યે મુખ કરી લે. અને જો એટલું તેજ ચક હોય કે કિબ્લા તરફ મુખ કરવાથી વિવશ બને છે. તો તે સમયે નમાજ મુલતવી રાખે. હાં, જો સમય જતો રહેતો હોય તો પઢી લે.

(શુનીયા, હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૩૦૪) : જુનુન (ગાંડપણ) અથવા બેહોશી જો પૂરા જ સમય સુધી ચાલુ રહેતો તે નમાજોની કઝા પણ નથી, ભલે બેહોશી (બેભાનતા) આદમી અથવા હીસક જાનવરના ભયથી હોય. અને તેનાથી ઓછા સમય માટે હોય તો કઝા વાજીબ છે. (હુર્રે મુખ્તાર)

મસ્ફલા-(૩૦૫) : જો કોઈ કોઈ સમયે હોશ આવી જાય છે, તો તેનો સમય મુકરર્ (નિયુક્ત) છે કે નહીં? જો સમય મુકરર્ છે અને તેનાથી પહેલા નમાજના પૂરા જ સમય વિત્યા નહીં તો કઝા વાજીબ છે અને જો સમય નિશ્ચિત ન હોય બલ્કે ઓચિંયિતો હોશ આવી જાય છે, પછી એજ હાલત પૈદા થઈ જાય છે તો આ ચેતનાનો એતબાર (માન્ય) નથી. અથવા સધળી બેહોશીઓ મુત્તસિલ (સણંગ) સમજવામાં આવશે.

(આલમગીરી, હુર્રે મુખ્તાર)

મસ્ફલા-(૩૦૬) : શરાબ અથવા ભાંગ પીધી ભલે દવાતરીકે હોય અને બુદ્ધિજાતી રહી, તો તે હાલતમાં પઢેલી નમાજની કઝા વાજીબ છે. જો કે બુદ્ધિનિતા કેટલાએ સમય સુધી હોય એવીજ, રીતે જો બીજાએ મજબુર કરીને શરાબ પીવડાવી દીધી તો પણ કઝા સર્વથા વાજીબ છે. (આલમગીરી, હુર્રે મુખ્તાર)

મસ્ફલા-(૩૦૭) : કોઈ માણસ સુતેલો જ રહ્યો જેના કારણે નમાજ જતી રહી હો કઝા ફર્જ છે. ભલે નિંદ્રા પૂરા જ સમય પર સવાઈ જાય.

(હુર્રે મુખ્તાર)

મસ્ફલા-(૩૦૮) : જો એ હાલતમાં હોય કુરોજો રાખે છે તો ઉભા રહીને નમાજ પઢી શકતો નથી,

અને ન રાખે તો ઉભા રહીને પઢી શકશે, તો રોજો રાખે અને નમાજ બેસીને પછે. (આલમગીરી) મસ્ફુલા-(૩૦૯) : બીમારે એ ખ્યાલથી કે સમયે નમાજ પઢી શકશે નહીં. (એ માટે) સમયની પહેલા નમાજ પઢી લીધી તો નમાજ થઈ નહીં. અને કિરાત વગર પણ નમાજ થશે નહીં, પરંતુ જ્યારે કિરાતથી વિવશ હોય તો નમાજ થઈ જશે.

(આલમગીરી)

મસ્ફુલા-(૩૧૦) : ઔરત બીમાર હોય તો પાતિ ઉપર ફર્જ નથી કે તેને વુઝુ કરાવી દે. અને જો ગુલામ બીમાર હોય તો વુઝુ કરાવી દેવું માલિકના માથે છે.

(આલમગીરી)

મસ્ફુલા-(૩૧૧) : નાનકડા તંબુમાં હોય કે ઉભો થઈ શકતો નથી અને બહાર નીકળે છે તો વરસાદ અને કીચડ છે તો બેસીને નમાજ પછે એવી જ રીતે ઉભા થવામાં દુશ્મનનો ડર છે તો બેસીને પઢી શકે છે.

(આલમગીરી)

મસ્ફુલા-(૩૧૨) : બીમારની નમાજો કઝ થઈ ગઈ હવે સારો થઈને તેમને પઢવા ઈચ્છે છે તો એવી રીતે પછે જેવી રીતે તંદુરસ્ત પછે છે. એવી રીતે નથી પઢી શકતો જે બીમારીમાં પઢતો દા.ત. બેસીને અથવા ઈશારાથી, જો એવી રીતે પઢી તો નમાજ થઈ નહીં. અને તંદુરસ્તીની હાલતમાં કઝ થઈ તેને બીમારીમાં પઢવા ચાહે છે તો જેવી રીતે પઢી શકે છે પછે, નમાજ થઈ જશે. તંદુરસ્તી જેવી પઢવું તે સમયે વાજિબ નથી.

(આલમગીરી)

મસ્ફુલા-(૩૧૩) : કોઈ માઝસ પાણીમાં હુબી રહ્યો છે, જો તે સમયે પણ “અમલે કસીર” વગર, ઈશારાથી નમાજ પઢી શકે છે. દા.ત. તરવેયો છે અથવા લાકડા વિગેરેનો સહારો પ્રાપ્ત થઈ જાય તો પઢવું ફર્જ છે. નહીં તો મઅજુર છે. બચી જાય તો કઝ પછે. (હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૩૧૪) : જો આંખનું ઓપરેશન વિગેરે કરાવ્યું હોય અને મુસલમાન હાજિકતબીબે સુતેલા રહેવાનો હુકમ આઘ્યો તો સુતેલી હાલતમાં ઈશારાથી નમાજ પછે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૩૧૫) : બીમારની નીચે નાપાક પથારી પાથરેલી છે અને એવી હાલત હોય કે બદલવામાં

પણ આવે તો નમાજ પઢતા પઢતા મનાઈ જેટલી નાપાક થઈ જાય, તો તેનો ઉપરંતુ નમાજ પછે. એવી જ રીતે જો બદલવામાં આવે તો એટલી જલ્દી નાપાક થશે. નહીં, પરંતુ બદલવામાં તીવ્ર તકલીફ થશે તો એજ નાપાક પથારી પર પઢી લે.

(આલમગીરી, હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

જરૂરી ચેતવણી. મસલમાનો આ પ્રકરણના મસ્ફુલા જો દેખે તો તેમનું સાંચે રાત સમજાઈ જશે કે, પાક શરીરાતે કેટલીક નાદર હાલત સિવાય કોઈ પણ હાલતમાં નમાજ માફ કરી નથી. બલ્કે એ હુકમ આઘ્યો છે કે જેવી રીતે પણ શક્ય હોય પછે. આજ કાલ જે મોટા નમાજી કહેવાય છે તેમની આ હાલત દેખવામાં આવી રહી છે કે તાવ આબ્યો, જરાક તિવ્ર થયો કે નમાજ છોડી દીધી, સખત દર્દ થયું નમાજ છોડી દીધી કોઈ ગુમું નીકળ્યું નમાજ છોડી દીધી, ત્યાં સુધી કે, માથાના દુખાવા તથા જુકામ (શરીર)માં નમાજ છોડી દે છે. અને જો કે જ્યાં સુધી ઈશારાથી પણ પઢી શકે છે. અને ન પછે તો એ જ વર્ષદો (ચેતવણીઓ)ને પાત્ર છે, જે કિતાબના આરંભમાં નમાજ છોડનાર માટે હાર્દિસોથી બયાન થઈ છે. વલઅયાજો બિલ્લાહે તાખાલા

અલ્લાહુમજાલના મિમ મુકીમિસ્લાતે વ મિન સાદેહી અહલહા અહયાઅંવ વ અમ્બાતન વરઝુકના ઈતેબાઅ શરીરાતે હબીબેકલ્કરીમ અલૈહે અફઝલુસ્લાતે વત્તસ્લીમ. આમીન (અથ) : અય અલ્લાહ તુ અમોને નમાજ કાયમ કરનારાઓમાં અને નિંદગી અને મૃત્યુ પછી સારા નમાજવાળાઓમાં કર, અને પોતાના હબીબ કરીમની શરીરાતની પૈરવી રોજી કર. તેમના ઉપર બેહતર દુરદો-સલામ, આમીન.

તિલાવતના સિજદાનું બચાન

સહીહ મુસ્લિમમાં અબુ હુરૈરહ રદ્દુલ્લાહો અન્હોથી રિવાયતછે કે, હુસુરે અકદસ સત્ત્વલ્લાહો અલયહે વસ્ત્વલ્લમ ઈરશાદ ફરમાવે છે કે, જ્યારે ઈબ્ને આદમ (આદમી) સિજદાની આયત પઢીને સિજદો કરે છે, તો શયતાન હઠી જાય છે અને રડીને કહે છે, હાય મારી બરબાઈ, ઈબ્ને આદમને સિજદાનો હુકમ થયો તો તેણે સિજદો કર્યો, તેના માટે જન્મત છે. અને મને હુકમ થયો તો મેં ઈન્કાર

કર્યો, મારા માટે દોઝખ છે.

મસ્સલા-(૩૧૬) : (કુર્અન શરીફમાં) સિજદાની ચૌટ (૧૪) આયતો છે. તે આ પ્રમાણે છે.

(૧) સુરએ અઅરાફની અંતિમ આયત : “ઈન્નલ્લજીના ઈન્દ રબ્બેકા લા પસ્તકબેરુના અન એબાદતેહિ વ યોસબેદુનહુ વલહુ પસ્તો હુન.”

(૨) સુરએ રાઘની આ આયત : “વલિલ્લાહે પસજોદો મન ફીસ્સમાવાતે વલઅર્દ્દ તો અંવ્યકર્હયુ જેલાલોહુમ બિલ-ગુદ્વ્યે વલબાસાલ.”

(૩) સુરએ નહલની આ આયત : “વલિલ્લાહે પસજોદો માફીસ્સમાવાતે વ માફી અર્દ મિન દાખ્યતિવ્યલભાઈકતો વહુમ લા પસ્તક બેરુન”

(૪) સુરએ બની ઈસરાઈલની આ આયત : ઈન્નલ્લજીના ઉત્તરલ્લભ મિન કબદ્દિહિ ઈઝા યુત્લા અલૈહિમ યખિર્ઝના લિલ્યાજકાને સુજજદંયુ યકૂલુના સુખ્ષીન રબ્બેના ઈન કાન વઅદોરબ્બેના લમફકુલા વ યખિર્ઝન લિલ અજકાને યજ્ઞના વ યજીદોહુમ ખોશ્યા”

(૫) સુરએ મરયમની આ આયત : વ ઈઝા યુત્લા અલૈહિમ આયતુર્હમાને ખર્ઝ સુજજદન વ બુકીયા.

(૬) સુરએ હજજમાં પ્રથમ જગ્યા જ્યાં સિજદાનો જિક છે તે આ આયત : “અલમતરઅન્નલ્લાહ પસજોદો લહુ મૈન ફીસ્સમાવાતે વ મન ફીલઅર્દ વ રશમસો વલ કમરો વન્નુજુમો વલજ્જભાલો વશજરો વદવાબ્બો વ કસીરુન મિનનાસે વ કસીરુન હક્ક અલૈહિલ અજાબો વ મય યોહિનીલ્લાહો ફિમાલહુ ભિમ્ભુકરમીન ઈન્નલ્લાહ યફઅલો મા યશાઓ.”

(૭) સુરએ ફુરકાની આ આયત : “વ ઈઝા કિલ લહુમુસજોહુ લિરહમાને કાલુ વ મરહમાનો અનસજોદો લેમા તામોરોના વ જાદહુમ નુકૂરા.”

(૮) સુરએ નમલની આ આયત : “અલા પસજોહુ લિલ્લાહિલ્લજી યુખરેજુલ-ખબ્બો ફિસ્સમવાતે વલઅર્દ વ યાઅલમો મા તુખ્ખુના વમા તોઅદેનુન અલ્લાહો લાઈલાઈહા ઈલ્લાહુવા રખ્ખુલ્લારિલ્લાજીમ.”

(૯) સુરએ અલમતનજીલની આ આયત :

“ઈન્નમા યુમેનો બેઆયાતેનલ્લજીના ઈઝા ગુક્કેરુ બેહા ખર્ઝ લહુ સુજજદંયુ સબેહુ બેહમે રબ્બેહિમ વહુમ લાયપસ્તકબેરુના.”

(૧૦) સુરએ સાદમાં સિજદાની આયત : “ફસ્તગ્ફર રબ્બેહુ વ ખર્ઝ રાકેઅંવ અનાબ ફગફરના લહુ જાલિકા વર્દિન લહુ ઈન્દના ગુલ્ફા વ હુસ્ના માબાબ.”

(૧૧) સુરએ હામભિમ સિજદાની આ આયત : “વમીન આયતેહિલ્લેલો વન્નાડારો વશમસો વલકમરો લાતસજોદુ લિશમશો વલા લિલ્ખમરે વરજોહુ લિલ્લાહિલ્લજી ખલકહુન ઈન કુનતુમ ઈયાહો તથબોદૂન. ફઈનિસ્તકબરુ ફિલ્લજીના ઈન્દ રબ્બેકા યુસબેદુન લહુ બિલ્લેલે વન્નાડારે વ હુમ લાયપસ્તમુન”

(૧૨) સુરએ નજમની આયત : “ફસજોહુ લિલ્લાહે વઅબોદુ.”

(૧૩) સુરએ ઈનશેકાક ની આ આયત : “ફમા લહુમ લાયુ’ મેનુનાવઈજા કોરેઅ અલૈહિમુલ્લુર્માનો લા પસજોહુન.”

(૧૪) સુરએ ઈકઅની આ આયત : “વસજોહુ વકતરીબુ.”

મસ્સલા-(૩૧૭) : સિજદાની આયત પઢવા અથવા સાંભળવમાંથી સિજદો વાજિબ થઈ જાય છે. પઢવામાં એ શર્ત છે કે એટલા અવાજથી હોય કે જો કોઈ ઊરન હોય તો ખુદ સાંભળી શકે. સાંભળ વવાળા માટે આ જરૂરી નથી કે, ઈરાદાંપૂર્વક સાંભળી હોય. વગર ઈરાદે સાંભળવાથી પણ સિજદો વાજિબ થઈ જાય છે. (હિદયા, દુર્ભુતારવિગ્રહ)

મસ્સલા-(૩૧૮) : સિજદો વાજિબથવા માટે પૂરી આયત પઢવું જરૂરી નથી, બલ્કે તે લફજ (શર્જ) જેમાં સિજદાનો માદો પામવામાં આવે છે. અને તેની સાથે પહેલા અથવા પાછળનો કોઈ શર્જ મેળવી પઢવું કાફી છે. (રદ્દુલ મુહતાર)

મસ્સલા-(૩૧૯) : જો એટલા અવાજથી આયત પઢી કે સાંભળી શકતો હતો, પરંતુ કોલાહોલ અથવા બહેરો હોવાને કારણે સાંભળી નથી. તો સિજદો વાજિબ થઈ ગયો. અને જો કેવળ હોઈ હાલ્યા અવાજ ઉત્પન્ન થયો નહીં, તો સિજદો વાજિબ

થયો નહીં. (આલમગીરી વિગેરે)
મસ્ફુલા-(૩૨૦) : કારીએ આયત પઢી પરતુ બીજાએ સાંભળી નહીં, તો જો કે એ જ મજલિસમાં હોય તો પણ તેના ઉપર સિજદો વાજિબ થયો નહીં. અલબત્ત નમાજમાં ઈમામે આયત પઢી તો મુક્તદીઓ પર સિજદો વાજિબ થઈ ગયો, ભલે ન સાંભળી હોય, બલે જો કે આયત પઢતી વખતે તે હાજર પણ ન હતો પઢવા પછી સિજદાની પહેલા શામેલ થયો. અને જો ઈમામથી આયત સાંભળી પરંતુ ઈમામના સિજદો કરવા પછી એ જ રકાતમાં શામેલ થયો તો ઈમામનો સિજદો તેના માટે પણ કાફી છે. અને બીજી રકાતમાં શામેલ ગયો તો નમાજ પછી સિજદો કરે. એવી જ રીતે જો શામેલ જ થયો નહીં, છતાં પણ સિજદો કરે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર, આલમગીરી)
મસ્ફુલા-(૩૨૧) : “સુરએ હજજ” ની આખરી આયતમાં જેમાં સિજદાનો ઉલ્લેખ છે તે પઢવા અથવા સાંભળવાથી સિજદો વાજિબ નથી. કે તેના સિજદાથી મુરાદ નમાજનો સિજદો છે. અલબત્ત જો શાફેઈ મજહબના ઈમામ ની ઈકતેદારી કરી અને તેણે આ મોકા ઉપર પણ સિજદો કર્યો તો તેની તાબેદારીમાં મુક્તદી ઉપર પણ સિજદો વાજિબ છે.

(દુર્ભ મુખ્તાર)

મસ્ફુલા-(૩૨૨) : ઈમામે સિજદાની આયત પઢી અને સિજદો કર્યો નંહી, તો મુક્તદી પણ તેના અનુસરણ માં સિજદો કરે નહીં. જો કે આયત સાંભળી હોય. (ગુનીયા)

મસ્ફુલા-(૩૨૩) : મુક્તદીએ સિજદાની આયત પઢી તો ન પોતાના ઉપર સિજદો વાજિબ છે ન ઈમામ ઉપર ન બીજા મુક્તદીઓ ઉપર ન નમાજમાં બાદમાં અલબત્ત જો બીજા નમાજીએ કે જે તેની સાથે નમાજમાં શરીક ન હતો, આયત સાંભળી ભલે તે મુનફરિદ હોય કે બીજા ઈમામનો મુક્તદી અથવા બીજો ઈમામ તેમના ઉપર નમાજ પછી સિજદો વાજિબ છે. એવી જ રીતે તેના ઉપર પણ વાજિબ છે. જે નમાજમાં ન હોય

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર, આલમગીરી)

મસ્ફુલા-(૩૨૪) : જે માણસ નમાજમાં નથી અને સિજદાની આયત પઢી અને નમાજીએ સાંભળ

િ તો નમાજ પછી સિજદો કરે. નમાજમાં કરે નહીં. અને જો નમાજમાં કરી લીધો તો કાફી થશે નહીં. નમાજ પછી ફરીથી કરવો પડશે, પરંતુ નમાજ ફાસિદ થશે નહીં. હા જો તિલાવત કરવાવાળા સાથે સિજદો કર્યો અને ઈત્તેબાઅ (પેરવી) નો કસદ (નિશ્ચય) પણ કર્યો તો નમાજ તુટી ગઈ. (ગુનીયા વિગેરે)

મસ્ફુલા-(૩૨૫) : જે માનવી નમાજમાં ન હતો, સિજદાની આયત પઢીને નમાજમાં શામેલ થઈ ગયો તો સિજદો સાકિત (૨૬) થઈ ગયો. (દુર્ભ મુખ્તાર)

મસ્ફુલા-(૩૨૬) : રૂક્ષા અથવા સિજદામાં સિજદાની આયત પઢી તો સિજદો વાજિબ થઈ ગયો, એજ રૂક્ષા અથવા સુજુદથી અદાપણ થઈ ગયો અને તશહહુદમાં પઢી તો સિજદો વાજિબ થઈ ગયો, માટે સિજદો કરે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૩૨૭) : સિજદાની આયત પઢનાર પર તે સમયે સિજદો વાજિબ થાય છે કે તે ન નમાજના વજુબ (વાજુબપણ) નો અહલ (યોગ્ય) હોય. અર્થાત અદા અથવા કજાનો તેને હુકમ હોય માટે જો કાફિર અથવા ગાંડા અથવા નાબાલીગ અથવા ડેઝતથા નિફાસવાળી સ્ત્રીએ આયત પઢી તો તેમના ઉપર સિજદો વાજિબનથી. અને આકિલ-બાલિગ મુસલમાન એહેલે ન નમાજે તેમનાથી સાંભળી તો તેના ઉપર વાજિબ થઈ ગયો. અને જો ગાંડપણ એક હિવસ કરતાં વધારે ન હોય તો ગાંડા પર પઢવા અથવા સાંભળવાથી વાજિબ છે. બે વુજુ અથવા જનાબતવાળાએ સિજદાની આયત પઢી અથવા સાંભળી તો સિજદો વાજિબ છે. નશાવાળાએ સિજદાની આયત પઢી અથવા સાંભળી તો સિજદો વાજિબ છે, એવી જ રીતે નિદ્રાવસ્થામાં સિજદાની આયત પઢી, જાગૃત થયા પછી તેને કોઈએ ખબર આપી તો સિજદો કરે. નશાવાળા અથવા નિદ્રાધીને આયત પઢી તો સાંભળવાવાળા પર સિજદો વાજિબ થઈ ગયો. (દુર્ભ મુખ્તાર, આલમગીરી)

મસ્ફુલા-(૩૨૮) : સ્ત્રીએ નમાજમાં સિજદાની આયત પઢી અને સિજદો ન કર્યો ત્યાં સુધી કે ડેઝ(માસિક) આવી ગયું તો સિજદો સાકિત (૨૬)

થઈ ગયો.

મસ્ફલા-(ઉ૨૮) : નિફલ પઢનારાએ સિજદાની આયત પઢી અને સિજદો પણ કરી લીધો, પછી નમાજ ફાસિદ થઈ ગઈ તો તેની કાજમાં સિજદાનું પુનરવર્તન નથી. અને જો સિજદો કર્યો ન હતો તો નમાજની બહાર કરે. (દુર્ભુખ્તાર, આલમગીરી)

મસ્ફલા-(ઉ૨૯) : ફારસી અથવા કોઈ બીજી ભાષામાં સિજદાની આયતનો તરજુમો પઢ્યો તો પઢનાર અને સાંભળનાર પર સિજદો વાજિબ થઈ ગયો. સાંભળનારે એ સમજ્યું હોય કે નહીં કે સિજદાની આયતનો તરજુમો છે. અલબત્ત એ જરૂરી છે કે તેને ખબર ન હોય તો બતાવી દેવામાં આવ્યું હોય કે આ સિજદાની આયતનો તરજુમો હતો, અને જો આયત પઢવામાં આવી હોય તો તેની જરૂરત નથી કે સાંભળનારને સિજદાની આયત હોવું બતાવવામાં આવ્યું હોય. (આલમગીરી)

મસ્ફલા-(ઉ૩૧) : કેટલાક માણસોએ એક શર્જ પઢ્યો કે સૌની મજમુઓ (સમૃદ્ધ) સિજદાની આયત બની ગયો તો કોઈ ઉપર સિજદો વાજિબ થયો નહીં. એવીજ રીતે આયતની હિજજે (અલગ અલગ શર્જદો પઢવા) અથવા સાંભળવાથી પણ સિજદો વાજિબ થશે નહિં. એવી રીતે પક્ષીથી સિજદાની આયત સાંભળી અથવા જંગલ અને પહાડ વિગેરેમાં અવાજ ગુંજ્યો અને આયતના પડ્યાના અવાજ કાનમાં પડ્યો તો સિજદો વાજિબ નથી.

(ગુનીયા, આલમગીરી, દુર્ભુખ્તાર)

મસ્ફલા-(ઉ૩૨) : સિજદાની આયત પઢ્યા પછી મઅાઝલ્લાહ (કોઈ) મુરતદ થઈ ગયો પછી ફરીથી મુસલમાન થયો તો સિજદો વાજિબ ન રહ્યો.

(આલમગીરી)

મસ્ફલા-(ઉ૩૩) : સિજદાની આયત લખવા અને તેની તરફ નજર કરવાથી સિજદો વાજિબ નથી. (આલમગીરી, ગુનીયા)

મસ્ફલા-(ઉ૩૪) : તિલાવતના સિજદા માટે તહરીમા સિવાય સધળી તે શરતો છે જે નમાજ માટે છે. દા.ત. તહારત, ઈસ્તિકબાલે કિલા (કિલા તરફ મુખ રાખવું) નિયત, સમય, તે અર્થમાં કે આગળ આવે છે. સતરે ઓરત, માટે જો

પાછી પર શક્તિમાન છે તો તથમ મુમુક્ષુ કરીને સિજદો કરવું જાઈજ નથી. (દુર્ભુખ્તાર વિગેરે)

મસ્ફલા-(ઉ૩૫) : તેની નિયતમાં એ શર્ત નથી કે, ફલાંખી આયતનો સિજદો છે બલ્કે સર્વથા તિલાવતના સિજદાની નિયત કાફી છે.

(દુર્ભુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસ્ફલા-(ઉ૩૬) : જે ચીજો નમાજને ફાસિદ કરે છે, તેનાથી સિજદો પણ ફાસિદ થઈ જશે. દા.ત. હડસે અમદ (બે વુંઘું થવું) તથા કલામ (વાતચીત) તથા અહારય. (દુર્ભુખ્તાર વિગેરે)

મસ્ફલા-(ઉ૩૭) : સિજદાનો મસ્નુન તરીકો એ છે કે ઉભા થઈને “અલ્લાહો અકબર” કહેતા સિજદામાં જાય. અને ઓછામાં ઓછું ગ્રાણ વાર “સુભાન રબ્બેયલ આ’લા” કહે પછી “અલ્લાહો અકબર” કહેતા ઉભો થઈ જાય. પહેલા-પાછળ બને વખત “અલ્લાહો અકબર” કહેવું સુન્તત છે. અને ઉભા થઈને સિજદામાં જવું અને સિજદા પછી ઉભા થવું આ બને તિયામ મુસ્તહબ છે.

(દુર્ભુખ્તાર, આલમગીરી વિગેરે)

મસ્ફલા-(ઉ૩૮) : મુસ્તહબ એ છે કે તિલાવત કરનાર આગળ અને સાંભળનાર તેની પાછળ સફ બાંધીને સિજદો કરે. અને એ પણ મુસ્તહબ છે કે, સામેઈન (શ્રોતાજનો) તેનાથી પહેલા માંથું ઉપાડે નહીં. અને જો તેના વિરુદ્ધ કર્યું દા.ત. પોતાના સ્થળે સિજદો કર્યો, ભલે તિલાવત કરનારની અગાઉ અથવા તેનાથી પહેલા સિજદો કર્યો, અથવા માથું ઉપાડી લીધું અથવા તિલાવત કરનારાએ તે સમયે સિજદો કર્યો નહીં અને સામેઈન (શ્રોતાજનો.) કરી લીધો તો વાંધો નથી. અને તિલાવત કરનારાનો સિજદો ફાસિદ થઈ જાય તો તેમના સિજદા ઓ ઉપર તેની કોઈ અસર નથી. કે આ વાસ્તવમાં ઈકતેદા નથી, માટે સ્ત્રીએ જો ઈકતેદા કરી તો પુરુષોની ઈમામ અર્થાત સિજદામાં આગળ થઈ શકે છે. અને સ્ત્રી પુરુષોના જોડા જોડ થઈ જાય તો ફાસિદ થશે નહીં. (ગુનીયા, આલમગીરી)

મસ્ફલા-(ઉ૩૯) : જો સિજદાથી પહેલા અથવા પછી ઉભો થયો નહીં, અથવા “અલ્લાહો હકબર” કહું નહીં, અથવા “સુભાન” ન પઢ્યું તો સિજદો

થઈ જશે, પરંતુ તકબીર છોડવી જોઈએ નહીં.
કેમકે સલફના (તરીકાથી) ખિલાફ છે.

(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૩૪૦) : જો એકલો સિજદો કરે તો
સુન્નત એ છે કે તકબીર એટલા અવાજથી કહે કે,
ખુદ સાંભળી લે. અને બીજા લોકો પણ તેના સાથે
હોય તો સુસ્તહબ એ છે કે, એટલા અવાજથી કહે
કે બીજા પણ સાંભળે. (રદ્દુલ મુહ્તાર)

તિલાવતના સિજદાઓની દુઆઓ

મસ્ફુલા-(૩૪૧) : આ જે કહેવામાં આવે છે કે,
તિલાવત સિજદામાં, “સુખાન રજીયલ આ’લા”
પઢે. તે ફર્જ ન નમાજમાં છે અને નિફલ ન નમાજમાં
સિજદો કર્યો તો ચાહે એદુઆ પઢે અથવા હદીસોમાં
જે દુઆઓ આવેલી છે તે પઢે. દા.ત.

(૧) “સજદ વજહેય લિલ્લાજી ખલકહુ વ સપ્વર હુ
વ શક્ક સંઘર્ષ વ બસરહુ બેહોલેહી વ કુવ્વતેહિ
ફત્ખા રક્લાહો અહસનુલ ખાલેકીન.”

તરજુમો :- મારા ચહેરાએ સિજદો કર્યો તેના માટે
જેડો તેને પૈંદા કર્યો અને તેની સુરત બનાવી અને
પોતાની તાકતથી કાન અને આંખોની જગ્યા ફાડી,
બરકતવાળો છે અલ્લાહ જે સારો ઉત્પન્ન કરનાર
છે. અથવા...

(૨) “અલ્લાહુ મ કતુબલી ઈન્દકા બેહા
અજરંય્યદય અન્ની બેહા વિજરંય્યજલહાલી ઈન્દકા
ઝુર્ભ્રવ્યતકલ્લહા મિની કમા તંકબલ્લહા
મિનઅબ્દેકા દાઉદ.”

તરજુમો :- અય અલ્લાહ આ સિજદાના કારણે તુ
મારા માટે પોતાની નજીદીક સવાબલખ અને તેના
કારણે મારાથી ગુનાહીને દુર કર અને તેને તુ મારા
માટે પોતાની પાસે સંગ્રહ બનાવ અને તેને તુ મારાથી
કુબુલ કર જેવું તે તારા બંદા દાઉદથી કુબુલ કર્યું.
અથવા આ કહો.

(૩) સુખાના રજીના ઈન્કાના વઅદો રજીના લ
મફ઼ઉલા.

તરજુમો :- પાક છે અમારો રજી. બેશક અમારા
પરવરદિગારનો વઅદો થઈને રહેશે.

અને જો નમાજથી બહાર હોય તો ભલે આ
પઢે અથવા સહાબા તથા તાબેઈનથી જે આસાર

રિવાયત થયેલા છે તે પઢે. દા.ત. ઈજને ઉમર
રદ્દીયલ્લાહો અન્હોમાંથી રિવાયત છે, તેઓ
કહેતા હતા.

(૪) “અલ્લાહુ મલકા સજદ સવાદી વબેકા આમન
ફોવાદી અલ્લાહુ મરગુકની ઈલમંય-યન્ફાઓની વ
અમલંય યરફાઓની

તરજુમો :- અય અલ્લાહ મારા શરીરે તને સિજદો
કર્યો અને મારું દિલ તારા ઉપર ઈમાન લાવ્યું, અય
અલ્લાહ તું મને લાભદાયક ઈલમ અને ઉન્ત કરનાર
અમલ અતા કર. (ગુનીયા, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૩૪૩) : તિલાવતના સિજદા માટે
અલ્લાહો અકબર કહેતી વેળાન હાથ ઉઠાવવાના
છે ન તેમાં તશહહુદ છે ન સલામ. (તનવીરુલ
અબસાર)

મસ્ફુલા-(૩૪૪) : સિજદાની આયત ન નમાજની
બહાર પઢી તો તુરત જ સિજદો કરી લેવું વાજિબ
નથી. હાં, બેહતર છે, કે તુરત જ સિજદો કરી લે
અને વુજુહોય તો તાખિર (વિલંબ) મકરુહેતનગીહી
છે.

(હુર્ર મુહ્તાર)

મસ્ફુલા-(૩૪૫) : તે સમયે જો કોઈ કારણસર
સિજદો કરી શકે નહીં તો તિલાવત કરનાર અને
સાંભળનારે આ કહી લેવું સુસ્તહબ છે. “સુમેઅના
વ અતઅના ગુફરાનક, રબ્બના વ ઈલૈકલ્મસીર.”

તરજુમો :- અમોએ સાંભળ્યું અને હુકમ માન્યો
તારી મગફેરતનો સવાલ કરતા અય પરવર દિગાર
અને તારી તરફ જ ફરવું છે. (રદ્દુલ મુહ્તાર)

નમાજમાં સિજદાની આયત પટવાના મસાઈલ

મસ્ફુલા-(૩૪૬) : તિલાવતનો સિજદો ન નમાજમાં
તુરત જ કરવું વાજિબ છે. તાખીર કરશે તો ગુનેહગાર
થશે અને સિજદો કરવું ભુલી ગયો તો જ્યાં સુધી
હુરમત (અથવા કોઈ એવું કામ જે ન નમાજને બાધક
છે.) ન નમાજમાં છે સિજદો કરી લે. ભલે સલામ
કરવી લીધી હોય અને સિજદાએ સહવ કરે.
(હુર્ર મુહ્તાર, રદ્દુલ મુહ્તાર) તાખીરથી મુરાદ
ત્રણ આયત કરતાં વધારે પઢી લેવું છે ઓછામાં

તાખીર નથી પરંતુ સુરતના અંતમાં જોસિજદો વાકેએ (ધટિત) છે. દા.ત., “ઈનશક્કત” તો આ સુરત પૂરી કરીને સિજદો કરશે. તો પણ વાંધો નથી. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૩૪૭) : નમાજમાં સિજદાની આયત પઢી તો તેનો સિજદો નમાજમાં વાજિબ છે નમાજ બહાર નથી. નમાજની બહાર થઈ શકતો નથી. અને ઈરાદા પૂર્વક સિજદો ના કર્યો તો ગુનેહગાર થયા તૌબા લાજીમ છે. એ શર્તે કે સિજદાની આયત પછી તુરતજ રૂકુઅ તથા સુજુદ ન કર્યો હોય નમાજમાં સિજદાની આયત પઢી અને સિજદો ન કર્યો, પછી તે નમાજ ફાસિદ થઈ ગઈ અથવા ઈરાદા પૂર્વક ફાસિદ કરી તો નમાજ બહાર સિજદો કરી લે. અને સિજદો કરી લીધો હતો તો છાજત નથી. (હુર્રે મુહ્તાર)

મસ્ફલા-(૩૪૮) : જો આયત પઢ્યા પછી તુરતજ નમાજનો સિજદો કરી લીધો અથવા સિજદાની આયત પછી ત્રણ આયત કરતાં વધારે ન પઢ્યો અને રૂકુઅ કરીને સિજદો કર્યો તો જો કે તિલાવતના, સિજદાની નિયત ન હોય (તો પણ) અદા થઈ જશે. (આલમગીરી, હુર્રે મુહ્તાર)

મસ્ફલા-(૩૪૯) : નમાજનો તિલાવતનો સિજદો, સિજદાથી પણ અદા થઈ જાય છે અને રૂકુઅથી પણ પરંતુ રૂકુઅથી ત્યારે અદા થશે કે તુરતજ કરીલે, જો તુરતજ ન કર્યો તા સિજદો કરવું જરૂરી છે. અને જો રૂકુઅથી તિલાવતનો સિજદો અદા કર્યો બલે તે રૂકુઅ નમાજની રૂકુઅ હોય કે તે સિવાયની જો નમાજની રૂકુઅ છે તો તેમાં સિજદાના અદાની, નિયત કરીલે અને જો ખાસ સિજદા માટે જ આ રૂકુઅ કર્યો તો આ રૂકુઅથી ઉઠયા પછી મુસ્તહબ એ છે કે, બે ત્રણ આયતો અથવા અધિક પઢીને રૂકુઅ કરે, તુરતજ ન કરે અને જો સિજદાની આયત પર સુરત ખતમ છે અને સિજદા માટે રૂકુઅ કર્યો તો બીજી સુરતની આયતો પઢીને રૂકુઅ કરે. (ગુનીયા, આલમગીરી, હુર્રે મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૩૫૦) : સિજદાની આયત સુરતની વચ્ચે છે તો અફજલ (સારું) એ છે કે તેને પઢીને રૂકુઅ કરે, જો સિજદો ન કર્યો અને રૂકુઅ કરી

લીધો અને આ રૂકુઅમાં સિજદો અદા કરવાની પણ નિયત કરી લીધો તો કાફી છે. અને જો ન સિજદો કર્યો ન રૂકુઅ કર્યો બલે સુરત ખતમ કરીને રૂકુઅ કર્યો તો ભવે નિયત કરે ના કાફી છે, અને જ્યાં સુધી નમાજમાં છે સિજદાની કળા કરી શકે છે.

(આલમગીરી)

મસ્ફલા-(૩૫૧) : સિજદા પર સુરત ખતમ છે, અને સિજદાની આયત પઢી સિજદો કર્યો તો સિજદાથી ઉઠવા પછી બીજી સુરતની કેઠલીક આયતો પઢીને રૂકુઅ કરે અને વગર પછે રૂકુઅ કરી દીધો તો પણ જાઈજ છે. (આલમગીરી)

મસ્ફલા-(૩૫૨) : જો સિજદાની આયત પઢી સુરતના ખતમમાં બે ત્રણ આયતો બાકી છે તો બલે તુરતજ રૂકુઅ કરીએ અથવા સુરત ખતમ કરવા પછી અથવા તુરતજ સિજદો કરી લે પછી બાકી રહેલી આયતો પઢીને રૂકુઅમાં જાય અથવા સુરત ખતમ કરીને સિજદામાં જાય. સધળી રીતે ઈખેયાર છે, પરંતુ આપરી સુરતમાં સિજદાથી ઉઠીને કેટલીક આયતો બીજી સુરતની પઢીને રૂકુઅ કરે.

(ગુનીયા, આલમગીરી)

મસ્ફલા-(૩૫૩) : રૂકુઅમાં જતી વખતે સિજદાની નિયત કરી નથી. બલે રૂકુઅમાં અથવા ઉઠયા પછી નિયત કરી તો આ નિયત કાફી નથી.

(આલમગીરી)

મસ્ફલા-(૩૫૪) : તિલાવત પછી ઈમામ રૂકુઅમાં ગયો અને સિજદાની નિયત કરી લીધી પરંતુ મુક્તદીએ નિયત કરી નહીં, તો તેમનો સિજદો અદા થયો નહીં. માટે ઈમામ જ્યારે સલામ ફેરવે. ત્યારે મુક્તદી સિજદો કરીને કાબ્ડો કરે, અને સલામ ફેરવે. અને આ કાબ્ડામાં તશાહહુદ વાજિબ છે. જો કાબ્ડો ન કર્યો તો નમાજ ફાસીદ થઈ ગઈ કેમકે કાબ્ડો જતો રહ્યો આ હુકમ જહરી નમાજનો છે. સિર્રાં કેમકે મુક્તદીને ખબર નથી માટે માઝુર છે. અને જો ઈમામે રૂકુઅથી તિલાવતના સિજદાની નિયત ન કરી તો એજ નમાજના સિજદાથી મુક્તદીઓનો પણ તિલાવતનો સિજદો અદા થઈ ગયો જો કે નિયત ન હોય માટે ઈમામે રૂકુઅમાં સિજદાની નિયત ન કરી તો તેમનો સિજદો અદા

થશે નહીં. અને રૂકુઅ પછી તિલાવતનો સિજદો અદાથઈજશે. નિયતકરે કેન કરે. પછી નિયતની શું જરૂરત?

(આલમગીરી, હર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર) મસ્ખલા-(૩૫૫) : જહરી નમાજમાં ઈમામે સિજદાની આયત પઢી તો સિજદો કરવું ઔલા (બહેતર) છે અનુસારી નમાજમાં રૂકુઅ કરવું કે મુક્તદીઓને ધોકો (છેતરામણી) થાય નહીં.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૩૫૬) : ઈમામે તિલાવતનો સિજદો કર્યો, મુક્તદીને રૂકુઅનું ગુમાન (ધારણા) થયું અને રૂકુઅમાં ગયો તો રૂકુઅ તોડીને સિજદો કરે, અને જેણે રૂકુઅ અને એક સિજદો કર્યો તો પણ થઈ ગયો. અને જો રૂકુઅ કરીને બે સિજદા કરી લીધા તો તેની નમાજ અદા થઈ ગઈ. (હર્રે મુખ્તાર)

મસ્ખલા-(૩૫૭) : મુસલ્લી (નમાજી) તિલાવતનો સિજદો ભૂલી ગયો. રૂકુઅ અથવા સિજદા અથવા કઅદામાં યાદ આવ્યો તો એ જ વખતે સિજદો કરીલે, પછી જે રૂકનમાં હોય તેની તરફ પાછો ફરે (પ્રત્યાગમન કરે), અર્થાત રૂકુઅમાં હતો તો સિજદો કરીને રૂકુઅમાં પાછો ફરે. અને જો તે રૂકુઅનું પુનરાવતન ન કર્યું તો પણ નમાજ થઈ ગઈ. (આલમગીરી) પરંતુ કઅદાએ આખી રાનું પુનરાવતન ફર્જ છે. કે સિજદાથી કઅદો બાતિલ થઈ જાય છે.

એક મજલિસમાં સિજદાની આયત પઠવા અથવા સાંભળવાના મસાઈલ

મસ્ખલા-(૩૫૮) : એક મજલિસમાં સિજદાની એક આયતને વારંવાર પઢી અથવા સાંભળી તૈ એક જ સિજદો વાજિબ થશે. ભલે કેટલાક શખ્સોએ સાંભળ્યું હોય એવી જ રીતે જો આયત પઢી અને એજ આયત બીજા માણસથી સાંભળી તો પણ એક જ સિજદો વાજિબ થશે.

(હર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૩૫૯) : પઠનારાએ કેટલીએ મજલિસો બેઠકમાં એક આયત વારંવાર પઢી અને સાંભળનારાની મજલિસ (બેઠક) ન બદલાઈ, તો

પઠનાર જેટલી મજલિસોમાં પઠશે તેના ઉપર તેટલા જ સિજદા વાજિબ થશે. અને સાંભળનાર પર એક, જો તેનાથી વિરુદ્ધ છે. અર્થાત પઠનાર એક મજલિસમાં વારંવાર પઠતો રહ્યો અને સાંભળનારની મજલિસો (બેઠકો) બદલાતી રહી તો પઠનારા પર એક સિજદો વાજિબ થશે. અને સાંભળનાર પર તેટલા, જેટલી મજલિસોમાં સાંભળ્યું (આલમગીરી)

મસ્ખલા-(૩૬૦) : મજલિસમાં સિજદાની આયત પઢી અથવા સાંભળી અને સિજદો કરી લીધો, પછી એ જ મજસ્સિલમાં એજ આયત પઢી અથવા સાંભળી તો એ જ પહેલો સિજદો કાફી છે.

(હર્રે મુખ્તાર)

મસ્ખલા-(૩૬૧) : એક મજલિસમાં કેટલીક વાર સિજદાની આયત પઢી અથવા સાંભળી અને અંતમાં ઝેટલાજ વાર સિજદો કરવા ચાહે તો એ પણ મુસ્તહબની વિરુદ્ધ છે. બલ્કે એક જ વખત તેનાથી તેલટુંદરુદ શારીરકમાં હુંસેરનું નામે અકદસ લેવામાં આવે અથવા સાંભળવામાં આવે. તો એક વખત દુરુદ શારીરક પઠવું વાજિબ અને દરેક વાર મુસ્તહબ છે.

(રદ્દુલ મુહ્તાર).

મજલિસ બદલવા અને ન બદલવાની હાલતો

મસ્ખલા-(૩૬૨) : બે એક કોળીયા ખાવા બે એક ધૂંપ પાણી પીવા, ઉભા થઈ જવા, બે એક વાત કરવા, મકાનના એક ખૂણાથી બીજા ખૂણા તરફ ચાલ્યા જવાથી મજલિસ બદલાઈ નહીં. હાં, જો મકાન મોટુંછે, જેવુંકે શાહી મહેલ તો એવા મકાનમાં એક ખૂણાથી બીજા ભાગમાં જવાથી મજલિસ બદલાઈ જશે. કસ્તી (નૌકા)માં છો અને નૌકા ચાલી રહી છે, મજલિસ બદલાશે નહીં. રેલ્વેનો જીણ એજ હુકમ હોવો જોઈએ. જાનવર પર સવાર છો અને તે ચાલી રહ્યું છે. તો મજલિસ બદલાઈ રહ્યી છે હાં, જો સવારી પર નમાજ પઢી રહ્યા છો તો બદલાશે નહીં. ત્રણ કોળીયા ખાવા, ત્રણ ધૂંપ પાણી પીવા, ત્રણ વાક્યો બોલવા, ત્રણ કદમ્બ ચાલવા, નિકાલ અથવા ખરીદ-વેચાણ કરવા,

લેટીને સુઈ જવાથી મજલિસ બદલાઈ જશે.

(આલમગીરી, ગુનીયા, દુર્ભ મુખ્તાર વિગેરે)

મસ્ફ્ફલા-(૭૬૩) : સવારી પર નમાઝ પઢી રહ્યો છે અથવા તે પણ સવાર છે પરંતુ નમાઝમાં નથી, એવી હાલતમાં સિજદાની હાલતમાં જો સિજદાની આયત વારંવાર પઢ્યો તો તેના ઉપર એક સિજદો વાજિબ છે અને સાથવાળા પર તેટલા જેટલી વાર સાંભળ્યું.

(રદ્દુલ મુહ્તાર, દુર્ભ મુખ્તાર)

મસ્ફ્ફલા-(૭૬૪) : તાણોં તુશવું, નહેર અથવા હોજમાં તરવું, વૃક્ષની એક ડાળથી બીજી ડાળ ઉપર જવું, હળ ચલાવવું, હાલરુ (ખળમાં બળ દોની જોરી) ચલાવવું, ચક્કિના બળદ પાછળ ફરવું, સ્ત્રીનું બાળકને દુધપીવડાવવું આ સઘણી હાલતોમાં મજલિસ બદલાઈ જાય છે. જેટલી વાર સિજદાની આયત પઢશે અથવા સાંભળશે તેટલા સિજદા વાજિબ થશે. (ગુનીયા, દુર્ભ મુખ્તાર વિગેરે) એજ હુકમ કોલુના બળદની પાછળ ચાલવાનો હોવો જોઈએ.

મસ્ફ્ફલા-(૭૬૫) : એક બાજુએ બેઠા બેઠા તાણો તાણી રહ્યો છે તો મજલિસ બદલાઈ રહી છે, જો કે ફતહુલકદરીમાં તેનાથી વિરુદ્ધ લખ્યું છે. એટલા માટે કે આ અમલે કસીર છે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફ્ફલા-(૭૬૬) : કોઈ મજલિસમાં બહુ સમય સુધી બેસવું, કિરાત, તરખીઠ, તહીલીલ દર્સ, વઅજમાં મસગુલ થવું તેનાથી મજલિસ બદલાશે નહીં. અને જો બંને વખત પઢવા દરમિયાન કોઈ દુનિયાનું કામ કર્યું દા.ત કપું સીવવું વિગેરે તો મજલિસ બદલાઈ ગઈ. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફ્ફલા-(૭૬૭) : સિજદાની આયત નમાઝની બહાર તિલાવત કરી અને સિજદો કરીને પાછી નમાઝ શરૂ કરી અને નમાઝમાં ફરીથી એજ આયત પઢી તો તેના માટે બીજી વાર સિજદો કરો અને પહેલા સિજદો કર્યો ન હતો તો આ સિજદો જ તેનો પણ કાયમ મુકામ થઈ ગયો એ શર્ત કે આયત પઢવા અને નમાઝની વચ્ચે કોઈ અજનબી ફેલ (ફાસિલ) અંતર નાખનાર ન થાય. અને જો ન પહેલા સિજદો કર્યો ન નમાઝમાં તો બંને સાકિત થઈ ગયા અને ગુનેહગાર થયો, તૌબા કરે.

(રદ્દુલ મુહ્તાર, દુર્ભ મુખ્તાર)

મસ્ફ્ફલા-(૭૬૮) : એક રકાતમાં વારંવાર એજ આયત પઢી તો એક જ સિજદો કાફી છે, ભલે કેટલીક વખત પઢીને સિજદો કર્યો અથવા એક વાર પઢીને સિજદો કર્યો પછી બે વાર, ત્રણ વાર આયત પઢી, એવી જ રીતે જો એક નમાઝની સઘણી રકાતોમાં અથવા બે-ત્રણ રકાતોમાં એજ આયત પઢીને સિજદો કર્યો અથવા બે-ત્રણમાં એજ આયત પઢી તો સૌના માટે એક સિજદો કાફી છે.

(આલમગીરી)

મસ્ફ્ફલા-(૭૬૯) : નમાઝમાં સિજદાની આયત પઢી અને સિજદો કરી લીધો, પછી સલામ પછી એક મજલિસમાં એજ આયત પઢી તો જો વાત કરી ન હતીતો એજ નમાઝવાળો સિજદો તેના કાયમ મુકામ પણ છે. અને વાત કરી લીધી હતી તો ફરીથી સિજદો કરે. અને જો નમાઝમાં સિજદો કર્યો ન હતો પછી સલામ ફરવ્યા પછી એજ આયત પઢી તો જો સિજદો કરે, નમાઝવાળો સિજદો સાકિત થઈ ગયો. (ખાનીયા, ગુનીયા, આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

મસ્ફ્ફલા-(૭૭૦) : નમાઝમાં સિજદાની આયત પઢી અને સિજદો કર્યો પછી બે વુનુ થયો અને વુનુ કરીને બિના કરી, ફરી એજ આયત પઢી તો બીજો સિજદો વાજિબ થયો નહીં. અને જો બિના પછી બીજા માણસથા એજ આયત સાંભળી તો બીજો સિજદો વાજિબ છે. અને આ સિજદો નમાઝ પછી કરે. (આલમગીરી)

મસ્ફ્ફલા-(૭૭૧) : એક મજલિસમાં સિજદાની કેટલીક આયતો પઢી તો એટલા જ સિજદા કરે, એક કાફી નથી.

(આમાએ કુતુબ)

મસ્ફ્ફલા-(૭૭૨) : પૂરી સુરત પઢવું અને સિજદાની આયત છોડી દેવું મકરુણે તહરીમી છે. અને કેવળ સિજદાની આયત પઢવામાં કરાહત નથી, પરંતુ બહેતર એ છે કે બે એક આયતો પહેલા અથવા પાછળની મેળવી લે. (દુર્ભ મુખ્તાર)

મસ્ફ્ફલા-(૭૭૩) : શ્રોતાજનો ઓ સિજદાનો નિશ્ચય કર્યો હોય અને સિજદો કરવું તેમના ઉપર ભાર રૂપ ન હોય તો આયત બુલંદ અવાજથી પઢવી ઉત્તમ છે. નહીંતો ધીમેથી પઢે. અને સાંભળનારાઓનો

હાલ ખબર ન હોય કે તત્પર છે કે નહીં તો પણ ધીમે પઢવું બહેતર થવું જોઈએ.

(આલમગીરી, ગુનીયા, દુર્વેસુખ્તાર વિગેરે)
મસ્થલાં-(૩૭૪) : સિજદાની આયત પઢવામાં આવી, પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે સાંભળી નહીં, તો ખરુ એ છે કે સિજદો વાજિબ નથી, પરંતુ કેટલાક ઉલમાઓ કહે છે કે ભવેને સાંભળી નહિ (છતાં) સિજદો વાજિબ થઈ ગયો.

(દુર્વેસુખ્તાર, રદ્દુલ મુહ્તાર)
મહત્વનો ફાયદો : જે મકસદ (પ્રયોજન) માટે એક મજલિસમાં સિજદાની સધળી આયતો પઢીને સધળા સિજદા કરે. અલ્લાહ અજઝ વ જલ્લ તેનો મકસદ પૂરો કરી દેશે. ભવે એક એક આયત પઢીને તેનો સિજદો કરતો જાય અથવા સધળી પઢીને અંતમાં (૧૪) સજદાઓ કરી લે.

(ગુનીયા, દુર્વેસુખ્તાર વિગેરે)
મસ્થલાં-(૩૭૫) : જમીન પર સિજદાની આયત પઢી તો આ સિજદો સવારી પર કરી શકતો નથી, પરંતુ ભયની હાલત હોય તો થઈ શકે છે. અને સવારી પર સિજદાની આયત પઢી તો પ્રવાસની હાલતમાં સવારી ઉપર પણ સિજદો કરી શકે છે.
(આલમગીરી)

મસ્થલાં-(૩૭૬) : બીમારીની હાલતમાં ઈશારાથી પણ સિજદો અદાથઈ જશે. એવી જ રીતે પ્રવાસમાં સવારી પર ઈશારાથી સિજદો થઈ જશે.

(આલમગીરી)

મસ્થલાં-(૩૭૭) : જુમ્બા તથા બન્ને ઈદોમાં અને બીજી નમાઝોમાં અને જે નમાઝમાં મોટી જમાઅત હોય (અસંખ્ય લોકો હોય) ઈમામે સિજદાની આયત પઢવું મકરૂહ છે. હા, જો આયત પછીતુરતજ રૂકુઅતથા સુજૂહ કરી દે, અને રૂકુઅમાં નિયત ન કરે, તો કરાહ્ત નથી.

(ગુનીયા, દુર્વેસુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્થલાં-(૩૭૮) : મિઅર પર સિજદાની આયત પઢી તો ખૂદ તેના ઉપર અને સાંભળવાવાળાઓ ઉપર સિજદો વાજિબ છે. અને જેમણે સાંભળી નહીં તેમના ઉપર સિજદો વાજિબ નથી.

(દુર્વેસુખ્તાર રદ્દુલ મુહ્તાર)

મસ્થલાં-(૩૭૯) : શુક (આભાર) નો સિજદો દા. ત ઔલાદ પેદા થઈ અથવા માંલ પ્રાપ્ત થયો, અથવા ખોવાયેલી વસ્તુ મળી ગઈ અથવા બીમારને તંદુરસ્તી પ્રાપ્ત થઈ અથવા મુસાફર પાછો આવ્યો સારાંશ કે કોઈ નેઅમત (ન્યામત) પર સિજદો કરવું મુસ્તલબ છે. અને તેનો તરીકો એજ છે જે તિલાવતના સિજદાનો છે. (આલમગીરી, રદ્દુલ મુહ્તાર)
મસ્થલાં-(૩૮૦) : કારણ વગરનો સિજદો જેવો કે બહુધા લોકો કરે છે. ન સવાબ છે ન મકરૂહ.
(આલમગીરી)

મુસાફિરની નમાંગનું બચાન

અલ્લાહ અજઝ વ જલ્લ ફરમાવે છે :- “વ ઈજા દરબુમ ફીલ્બર્ડ ફ્લૈસા અલૈફુન જોનહુન અનું નક્સોરુ મિનસ્સલાતે ઈન પિફતુમ અંય પફતેન કોમુલ્લાજીના કફ્રૂ.”

તરજુમો :- જ્યારે તમો ધરતી ઉપર પ્રવાસ કરો તો તમારા ઉપર તેનો ગુનોહ નથી કે, નમાંગમાં કસર કરો, જો ભય હોય કે, કાફિર તમને ફિનામાં નાંખશો.

હદીસ (૧) : સહીહ મુસ્લિમાં છે કે, યઅલા બિન ઉમ્મયા રદિયલ્લાહો અન્ધો કહે છે કે, અમીરુલ મોમેનીન ફારૂકે આજમ રદિયલ્લાહો અન્હોને મેં અર્જ કરીકે, અલ્લાહ અજઝ વ જલ્લ તો એ ફરમાવ્યું છે. “અન તકસોરુ મિનસ્સલાતે ઈન પિફતુમ અંય પફતેનકોમુલ્લાજીના કફ્રૂ.” અને હવે તો લોકો અમનમાં છે. (અર્થાત અમનની હાલતમાં કસર ન હોવી જોઈએ) આપે ફરમાવ્યું તેનું મને પણ આશ્રય થયું હતું મેં રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસ્ત્વમને સવાલ કર્યો તો આપે ઈરશાદ ફરમાવ્યો કે, આ એક સદકો (ભલાઈ) છે કે અલ્લાહ તાલાએતમારા ઉપર તસદુદક (ભલાઈ) ફરમાવી તેનો સદકો (મહેરબાની) કબૂલ કરો.

હદીસ (૨) : સહીહ બુખારી તથા સહીહ મુસ્લિમમાં રિવાયત છે કે, હારિસા બિન વહબ ખુઝાઈ રદિયલ્લાહો અન્ધો કહે છે કે, રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસ્ત્વમે મિનામો બે રકાત નમાઝ પઢાવી જો કે અમારી એટલી વધું સંઘ્યા કરારે હતી નહીં, ન તેના જેવો અમન.

હદીસ (૩) : સહીહેનમાં અનસ રદ્દિયલ્લાહો અન્ધાથી રિવાયત છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસ્ત્રમે મદીનામાં જોહરની ચાર રકાતો પઢી, અને જીલહુલૈકા (મદીના મુન્જવરાથી ત્રણ માઈલના અંતરે એક સ્થળનું નામ છે. એજ વધારે ખરું છે) માં અસરની બે રકાતો પઢાવી.

હદીસ (૪) : તિરમિઝીમાં અખુલ્લાહ બિન ઉમર રદ્દિયલ્લાહો અન્ધામાંથી રિવાયત છે. તેઓ કહે છે, કે મેં નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસ્ત્રમ સાથે હજર તથા સફર (કિયામ તથા પ્રવાસ) બંનેમાં નમાઝો પઢી. હજરમાં હુસુરની સાથે જોહરની ચાર રકાતો પઢી અને તેના પછી બે રકાત અને પ્રવાસમાં જોહરની બે અને તેના પછી બે અને અસરની (ફર્જ) બે અને તેના પછી કાંઈ નહીં. અને મગરિબની હજર તથા પ્રવાસમાં બરાબર ત્રણ રકાતો. પ્રવાસ તથા કિયામમાં મગરિબની નમાઝમાં કસર કરતા નહીં. અને તેના પછી બે રકાતો.

(‘હજર’ એટલે પજા માઈલની અંદરની સફર. શરઈસફર એટલે પજા માઈલથી વધારે સફર એટલી સફર થવાથી કસર વાળું થઈ જશે.)

હદીસ (૫) : સહીહેનમાં ઉમ્મુલ મોમીનીન સિદ્દીકા રદ્દિયલ્લાહો અન્ધાથી રિવાયત છે. તેઓ ફરમાવે છે. બે રકાત નમાજ ફર્જ કરવામાં આવી પછી જ્યારે હુસુરે હિજરત કરી તો ચાર ફર્જ કરી દેવામાં આવી, અને પ્રવાસની નમાઝ એજ પહેલા ફર્જ પર રાખવામાં આવી.

હદીસ-(૬) : સહીહ મુસ્લિમમાં અખુલ્લાહ બિન અખ્બાસ રદ્દિયલ્લાહો અન્ધામાથી રિવાયત છે. કહે છે કે અદ્ધાહ અજ્જ વ જલ્લે નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસ્ત્રમની જ્ઞાને હજર (કિયામ) માં ચાર રકાતો ફર્જ કરી. અને પ્રવાસમાં (પજા માઈલ અથવા તેથી વધુ) બે. અને ખૌફ (ભય) માં એક અર્થાત ઈમામની સાથે.

હદીસ-(૭) : ઈબ્ને માજાએ અખુલ્લાહ બિન ઉમર રદ્દિયલ્લાહો અન્ધાથી રિવાયત કરી કે રસૂલુલ્લાહે સફર (પ્રવાસ) ની નમાઝની બે રકાતાતો મુકર્રર કરી અને આ પૂરી છે, કમ નથી. અર્થાત જો કે જાહેરમાં બે રકાતો ઓછી થઈ ગઈ, પરંતુ

સવાબમાં આ બે જ ચારની બરાબર છે.

કિકહીમસાઈલ : શરીરાત અનુસાર મુસાફિર તે માણસ છે જે ત્રણ દિવસના અંતર સુધી (પગપાળાનો માર્ગ) જવાના ઈરાદાથી વસ્તીથી બહાર નીકળ્યો (મતુન) (આ હદ સાડા સત્તાવન માઈલ, કિ. મિ. ૮૮ જેટલી થાય છે. અનુ.)

મસ્ફ્લાન-(૩૮૧) : દિવસથી મુરાદ વર્ષનો સૌથી નાનો દિવસ અને ત્રણ દિવસના માર્ગથી એ આશય નથી કે, સવારથી સાંજ સુધી ચાલે કે, ખાવા-પીવા, નમાઝ અને બીજી જરૂરતો માટે રોકાંબું તો જરૂરી છે. બલ્કે તેનાથી આશય દિવસનો અકસર ભાગ છે. દા.ત. શુરુઅ સુષ્પ સાદિકથી બપોર ઢળવા સુધી ચાલ્યો પછી રોકાંઈ ગયો પછી બીજા અને ત્રીજા દિવસે એમ જ કર્યું, તો એટલા અંતર સુધીના માર્ગને પ્રવાસનું અંતર કહીશું. બપોર પછી સુધી ચાલવામાં પણ સતત ચાલવું આશય નથી બલ્કે ટેવ અનુસાર જેટલો આરામ લેવો જોઈએ તેટલો તે દરમિયાન રોકાતો પણ જાય. અને ચાલવાથી મુરાદ મધ્યમ ચાલ છે. કે ન તેજ હોય ન સુસ્ત ખુશ્કી (જમીનમાર્ગ) માં આદમી અને ઉટની વચ્ચગાળાની ચાલનો એટેબાર છે. અને પહાડીમાર્ગમાં એજ હિસાબથી જે તેના માટે ઉચિત હોય. અને દરિયામાં નૌકાની ચાલ તે વેળાની કે, હવાન સાવ રોકાએલી હોય ન તેજ (ઝડપી) હોય.

(દુર્ભ મુખ્તાર, આલમગીરી વિગેરે)

મસ્ફ્લાન-(૩૮૨) : વર્ષનો નાનો દિવસ તેજયાનો વિશ્વાસ પાત્ર છે જ્યાં દિવસ-રાત મુઅતદિલ (મધ્યમ) હોય, અર્થાત નાના દિવસના અકસર ભાગમાં મંજિલ તથ કરી શકતો હોય, જેથી જે શહેરોમાં બહુ નાનો દિવસ હોય છે, જેવું બલગારયા કે ત્યાં બહુ નાનો દિવસ હોય છે માટે ત્યાંના દિવસનો એટેબાર નથી.

(રદ્દુલ મુહતાર)

મસ્ફ્લાન-(૩૮૩) : કોસનો એટેબાર નથી કે કયાંક નાના હોય છે કયાંક મોટા બલ્કે ત્રણ મંજિલો (પડાવ) નો એટેબાર છે. અને ખુશ્કીમાં માઈલના હિસાબે તેની માત્રા પજ ૧/૨ (સાડા સત્તાવન) માઈલ છે.

(ફતવા રિજવીયા)

મસ્ફ્લાન-(૩૮૪) : કોઈ સ્થળે જવાના બે રસ્તા છે એકથી પ્રવાસ કરવાનો છે, અને બીજાથી નહીં, તો

જે રસ્તાથી જશે તેનો એતબાર છે, નજીદીક વાળા રસ્તાથી ગયા તો મુસાફિર નથી. હુરવાળા રસ્તાથી ગયો તો છે. જો કે તે માર્ગને ધારણા કરવામાં તેની કોઈ ગરજ સહી ન હોય.

(હુર્ઝ મુખ્તાર, આલમગીરી, રદ્દુલ મુહતાર)
મસાલા-(૩૮૫) : કોઈ સ્થળે જવાના બે રસ્તા છે એક દરિયાનો અને બીજો મુશ્કીનો તે પૈકી એક બે દિવસનો છે બીજા ત્રણ દિવસનો તો ત્રણ દિવસવાળા માર્ગથી જાય તો મુસાફિર છે, નહીં તો મુસાફિર નથી. (આલમગીરી)

મસાલા-(૩૮૬) : ત્રણ દિવસના રસ્તાને ઝડપી સવારીથી બે દિવસ અથવા તેનાથી ઓછામાં તથ કરે, તો મુસાફિર જ છે અને ત્રણ દિવસથી ઓછા રસ્તાને વધારે દિવસોમાં પસાર કર્યો તો મુસાફિર નથી. (હુર્ઝ મુખ્તાર, આલમગીરી)

મસાલા-(૩૮૭) : ત્રણ દિવસના રસ્તાને કોઈ વલીયુલ્લાહે પોતાની કરામતથી બહુ ઓછા સમયમાં તથ કર્યો તો ઝડપે એજ છે કે, મુસાફિરના એહકામ તેના માટે સાબિત થાય પરંતુ ઈમામ ઈન્દેહુમામે તેજુ મુસાફિર હોલું મુસ્તાબદ (હુષ્કર) ફરમાયું. (રદ્દુલ મુહતાર)

મસાલા-(૩૮૮) : કેવળ પ્રવાસની નિયતથી મુસાફિર ન થશે બલ્કે મુસાફિરનો હુકમ તે સમયથી છે કે, વસ્તીની આબાદીથી બહાર થઈ જાય. શહેરમાં છે તો શહેરથી, ગામડામાં છે. તો ગામડાથી અને શહેરવાળા માટે એ પણ જરૂરી છે કે શહેરની આસપાસ જે આબાદી શહેરથી અડીને છે તેનાથી પણ બહાર થઈ જાય. (હુર્ઝ મુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસાલા-(૩૮૯) : ફનાએ શહેરથી જે ગામ સમીપ છે, શહેરવાળાઓ માટે તે ગામથી બહાર થઈ જરૂરી નથી એવી જ રીતે તે શહેરની સમીપ બગીચા હોય, જો કે તેના રખેવાળ અને કામ કરનારાઓ તેમાં રહેતા હોય, તેમણે તે બગીચાઓ માંથી નીકળી જરૂર જરૂરી નથી. (રદ્દુલ મુહતાર)

મસાલા-(૩૯૦) : ફનાએ શહેર અર્થાત શહેરથી બહાર જે જગ્યા શહેરના કામો માટે હોય દા.ત. કબ્રસ્તાન, ઘોડદોડનું મેદાન, કચરો ફેંકવાની જગ્યા (ઉકરડા), જો આ શહેરથી સમીપ હોય તો તેનાથી

બહાર થઈ જરૂરી છે. અને જો શહેર તથા શહેર પાસેની જગ્યા વચ્ચે અંતર હોય તો બહાર થઈ જરૂરી નથી. (રદ્દુલ મુહતાર)

મસાલા-(૩૯૧) : આબાદીથી બહાર થવાનો અર્થ એ છે કે જે બાજુએ જઈ રહ્યો છે તે બાજુએ આબાદી ખતમ થઈ જાય, ભલે તેની બરાબરમાં બીજી દિશાએ ખતમ ન થઈ હોય.

(ગુનિયા)

મસાલા-(૩૯૨) : કોઈ મહોલ્લો પહેલાથી શહેરથી મળેલો હતો, પરંતુ હવે જુદો થઈ ગયો તો તેનાથી બાર થઈ જરૂર પણ જરૂરી છે, અને જે મહોલ્લો વેરાન થઈ ગયો ભલે શહેરથી પહેલા મળેલો હતો અથવા અત્યારે પણ મળેલો છે તેનાથી બહાર થવું શર્ત નથી. (ગુનિયા, રદ્દુલ મુહતાર)

મસાલા-(૩૯૩) : જ્યાં સ્ટેશન આબાદીથી બહાર હોય તો સ્ટેશન પર પહોંચવાથી મુસાફિર થઈ જશે. જ્યારે કે પ્રવાસની માત્રા સુધી જવાનો ઈરાદો હોય.

મસાલા-(૩૯૪) : પ્રવાસ માટે એ પણ જરૂરી છે કે જ્યાંથી ચાલ્યો ત્યાંથી ત્રણ દિવસના માર્ગનો ઈરાદો હોય, અને જો બે દિવસના માર્ગના ઈરાદાથી નીકળ્યો, ત્યાં પહોંચીને બીજી જગ્યાનો ઈરાદો થયો કે તે પણ ત્રણ દિવસથી ઓછાનો રસ્તો છે. એવી જ રીતે સમગ્ર વિશ્વ ધૂમી આવે (ફરી આવે) તો મુસાફિર નથી. (ગુનિયા, હુર્ઝ મુખ્તાર)

મસાલા-(૩૯૫) : એ પણ શર્ત છે કે, ત્રણ દિવસની સફરનો ઈરાદો હોય, જો એવો ઈરાદો કર્યો કે બે દિવસની સફરે પહોંચીને કોઈ કામ કરવું છે. તે કરીને પછી એક દિવસની સફરે જઈશ તો ત્રણ દિવસના માર્ગનો સમીપતર ઈરાદો થયો નહીં. આથી (શરઈ) મુસાફિર થયો નહીં.

(ફત્તાવા રિઝવીયા)

મુસાફિરના એહકામ

મસાલા-(૩૯૬) : મુસાફિર માટે વાજિબ છે કે, નમાજમાં “કસ્ર” કરે, અર્થાત ચાર રકાતવાળા ફર્જને બે પઢે. તેના માટે બેજ રકાતનો પૂરી નમાજ છે. અને ઈરાદા પુર્વક ચાર પઢી અને બે ઉપર કરાદો કર્યો, તો ફર્જ અદા થઈ ગયા, અને પાછલી બે રકાતનો નિફલ થઈ. પરંતુ ગુનેહગાર થયો અને

જહન્નમની આગનો હક્કદાર થયો. કે વાળ્જિબને તર્ક કરી. માટે તૌબા કરે અને બે રકાત પર કાશદો ન કર્યો તો ફર્જ અદા થયા નહીં અને તે નમાજ નિફલ થઈ ગઈ. હા, જો ત્રીજી રકાતનો સિજદા કરવા પહેલા ઈકમતની નિયત કરી લીધી તો ફર્જ બાતલ થશે નહીં. પરંતુ કિયામતથા રૂકૂમનું પુનરાવર્તન કરવું પડશે. અને જો ત્રીજના સિજદામાં નિયત કરી તો હવે ફર્જ જતા રહ્યા. એવી જ રીતે જો પહેલી બાંને રકાતો અથવા એકમાં કિરાત કરી નહીં, તો નમાજ ફાસિદ થઈ ગઈ. (હિદાયા, દુર્ભ મુખ્તાર, આલમગીરી)

મસ્ઝલા-(૩૮૭) : આ. રૂખસદ (ધૂટી) મુસાફિર માટે છે. સર્વથા જ તેનો પ્રવાસ જાઈજ માટે હોય કે ના જાઈજ માટે. દરેક હાલમાં મુસાફિરના એહકમતેના માટે સાબિત થશે. (આમતુલકુતુબ)

મસ્ઝલા-(૩૮૮) : કાફિર માણસ ત્રણ દિવસના ઈરાદાથી નિકળ્યો. બે દિવસ પછી મુસલમાન થઈ ગયો, તો તેના માટે “કસર” છે. અને નાભાલિગ ત્રણ દિવસના પ્રવાસના નિર્ણયથી નિકળ્યો અને રસ્તામાં બાલિગ થઈ ગયો તો હવે અહીંથી જ્યાં જવું છે, ત્રણ દિવસનો માર્ગ ન હોય તો નમાજ પૂરી પઢે. હેઝવાળી સ્ત્રી પાદ થઈ અને અહીંથી ત્રણ દિવસનો માર્ગ નહોય તો નમાજ પૂરી પઢે. (દુર્ભ મુખ્તાર)

મસ્ઝલા-(૩૮૯) : બાદશાહે રેયતની હાલતની તપાસ માટે દેશમાં પ્રવાસ કર્યો, તો કસર ન કરે, જ્યારે કે પ્રથમ ઈરાદો સંણગ ત્રણ મંજિલનો ન હોય. અને જો કોઈ બીજા કામ માટે હોય અને પ્રવાસની માત્રા હોય તો કસર કરે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહિતાર)

મસ્ઝલા-(૪૦૦) : સુન્નતોમાં કસર નથી, બલ્દે પૂરી પઢવામાં આવશે. અલબત્ત ખૌફ અને રવારવી (ભાગ દોડ) ની હાલતમાં માઝાફ છે. અને અમનની હાલતમાં પઢવામાં આવે. (આલમગીરી)

મસ્ઝલા-(૪૦૧) : મુસાફિર ત્યાં સુધી મુસાફિર છે જ્યાં સુધી પોતાની વસ્તીમાં પહોંચી જાય નહીં. અથવા આબાઈમાં પૂરા પંદર દિવસ રોકાવાની નિયત ન કરે. અથવા તે સમયે છે જ્યારે ત્રણ મંજિલ પહોંચવા અગાઉ પાછા ફરવાનો ઈરાદો

કરી લીધો તો મુસાફિર રહ્યો નહીં, ભલે જંગલમાં હોય. (આલમગીરી, દુર્ભ મુખ્તાર)

ઈકમત (નિવાસ) ની નિયતની શર્તો

મસ્ઝલા-(૪૦૨) : ઈકમતની નિયત સહીએ હોવા માટે છ (૬) શર્તો છે.

(૧) ચાલવું છોડી દે. જો ચાલવાની હાલતમાં ઈકમતની નિયત કરી તો મુકીમ નથી. (મુસાફિર ગણવમાં આવશે-અનુ)

(૨) તે સ્થળ ઈકમતની યોગ્યતા ધરાવતું હોય ઈકમતની નિયત કરી તો મુકિમ ન થયો

(૩) પંદર દિવસ રોકાવાની નિયત હોય તેનાથી ઓછો સમય રોકાવાની નિયતથી મુકિમ (સ્થાયી) ન થશે.

(૪) આ નિયત એક જ સ્થળે રોકાવાની હોય, જો બે સ્થળોમાં પંદર દિવસ રોકાવાનો ઈરાદો હોય દા.ત. એક સ્થળે દસ દિવસ અને બીજા સ્થળે પાચ દિવસ, તો મુકિમ ન ગણારે.

(૫) પોતાનો ઈરાદો ક્રદ રાખવો અર્થાત કોઈના તાબે ન હોય.

(૬) તેની હાલત તેના ઈરાદાની વિપરીત ન હોય (આલમગીરી, દુર્ભ મુખ્તાર)

મસ્ઝલા-(૪૦૩) : મુસાફિર જઈ રહ્યો છે. અને હજુ શહેર અથવા ગામમાં પહોંચ્યો નથી અને ઈકમતની નિયત કરી લીધી તો મુકિમ ન થયો. અને પહોંચ્યા પછી નિયત કરી તો મુકીમ થઈ ગયો ભલે હજુ મુકામ વિગેરેની શોધમાં ફરી રહ્યો હોય. (આલમગીરી)

મસ્ઝલા-(૪૦૪) : મુસલમાનોનું લશ્કર કોઈ જંગલમાં પઢાવ નાખી દે અને તેરા-તંબુ બાંધીને પંદર દિવસ રોકાવાની નિયત કરી લે તો મુકિમ ન થયો અને જે લોકો જંગલમાં તંબુઓમાં રહે છે તેઓ જો જંગલમાં તંબુ બાંધીને પંદર દિવસની નિયતથી રોકાય તો મુકીમ થઈ જશે. એ શર્તે કે ત્યાં પાણી અને ઘાસ વિગેરે પર્યાપ્ત હોય કે, તેમના માટે જંગલ એવું જ છે. જેવું અમારા માટે શહેર અને ગામ. (દુર્ભ મુખ્તાર)

મસ્થલા-(૪૦૫) : બે સ્થળોએ પંદર દિવસ રોકવાની નિયત કરી અને મુસ્તકિલ(અલગ - અલગ વસતી હોય) જેવા કે મકાતથા મિના, તો મુકીમ ન થયો. અને એક બીજાના તાબે હોય દા.ત. શહેર અને તેની ફિના (પરા વિસ્તાર) ની જગ્યા તો મુકીમ થઈ ગયો. (આલમગીરી)

મસ્થલા-(૪૦૬) : એ નિયત કરી કે આ બે વસતીઓમાં પંદર દિવસ રોકાશો. એક સ્થળે દિવસમાં રહેશે અને બીજા સ્થળે રાતમાં, તો જો પહેલા ત્યાં ગયો જ્યાં દિવસમાં રોકવાનો ઈરાદો છે. તો મુકીમ થયો નહીં. અને જો પહેલાં ત્યાં ગયો જ્યાં રાતમાં રહેવાનો ઈરાદો છે, તો મુકીમ થઈ ગયો પછી ત્યાંથી બીજી વસ્તીમાં ગયો, તો પણ મુકીમ છે. (આલમગીરી, રદ્દુલ મુહૃતાર)

મસ્થલા-(૪૦૭) : મુસાફિર જો પોતાના ઈરાદમાં દ્રઘ ના હોય તો પંદર દિવસની નિયતથી મુકીમ થશે નહીં દા.ત. સ્વી, જેની મહેરે મુઅજજલ (તે મહેર જે નિકાહની સાથે જ ખિલવતથી પહેલાં અદા કરવામાં આવે) શોહરના જિમ્મે બાકી ન હોય કે તે શોહરને તાબેઅ છે તેની પોતાની નિયત બેકાર છે અને ગુલામ (ગેર મુકાતીબ) કે પોતાના માલિકના તાબે છે અને લશકરી જેને બયતુલ માલ અથવા બાદશાહ તરફથી ખોરાકી મળે છે કે તે પોતાના સરદારના તાબે છે અને નોકર કે તે પોતાના માલિકના તાબે છે અને કેદી કે તે કેદ કરનારના તાબે છે અને જે માલદાર પર તાવાન લાઝિમ આવ્યું અને શાર્જિદ કે જેને ઉસ્તાદના ત્યાંથી ખાણું મળે છે કે તે પોતાના (ઉસ્તાદના તાબે છે અને નેક બેટો, પોતાના બાપના તાબે છે આ સધળાઓની પોતાની નિયત બેકાર છે બલ્કે જેમના તાબે છે તેમની નિયતોનું એતબાર છે. તેમની નિયત ઈકામતની નથી, તો તેઓ પણ મુસાફિર છે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહૃતાર, આલમગીરી)

મસ્થલા-(૪૦૮) : ઔરતની મહેરે મુઅજજલ બાકી છે, તો તેને અભીયાર છે કે પોતાના નફસ (જાત) ને રોકી લે માટે તે વખતે તાબે નથી. એવી જ રીતે તે મુકાતિબ ગુલામને માલિકની પરવાનગી વગર પ્રવાસનો અધિકાર છે માટે તે તાબે નથી. અને

જો સૈનિક બાદશાહ અથવા બયતુલ માલથી ખોરાકી લેતો નથી તે તાબે નથી અને જે મજૂર માસિક અથવા વાર્ષિક પગાર પર નોકર નથી બલ્કે ઈનિક મજૂરી જેની ડેરવેલી છે તે આખો દિવસ કામ કર્યા પછી કોન્ટ્રાક્ટ રદ કરી શકે છે માટે તાબે નથી અને જે મુસલમાનને શત્રુએ કેદ કર્યો પરંતુ જો ખબર છે કે, ત્રણ દિવસના માર્ગ લઈ જશે તો કસર કરે. અને ખબર ન હોય તો તેને પુછે તે જેનું જતાવે તે અનુસાર અમલ કરે અને બતાવે નહીં તો જો ખબર છે કે તે દુર્મન મુકીમ છે; તો પૂરી નમાજ પઢે અને મુસાફિર છે તો કસર કરે અને એ પણ ખબર ન થઈ શકે તો જ્યાં સુધી ત્રણ દિવસનો માર્ગ પસાર ન કરી લે, ન માજ પૂરી પઢે અને જેના ઉપર તાવાન (નુકશાનીનો બદલો) લાઝિમ આવ્યો તે પ્રવાસમાં હતો અને પકડાઈ ગયો, જો નાદાર છે તો કસરકરે અને માલદાર છે અને પંદર દિવસની અંદર દંડ આપવાનો ઈરાદો છે અથવા કાંઈ ઈરાદો નથી તો પણ કસર કરે અને એ ઈરાદો છે કે આપશે નહીં તો પૂરી પઢે. (રદ્દુલ મુહૃતાર વિગેરે)

મસ્થલા-(૪૦૯) : તાબેઅ ને જોઈએ કે મત્બુઅ ને સવાલ કરે. તે જે કહે તે અનુસાર અમલ કરે અને જો તેણે કાંઈ કહ્યું નહીં તો જુએ કે મુકીમ છે કે મુસાફિર. જો મુકીમ છે તો પોતાને મુકીમ સમજે અને મુસાફિર છે તો મુસાફિર. અને એ પણ ખબર ન હોય તો ત્રણ દિવસોના માર્ગ પસાર કર્યો પછી કસર કરે તેનાથી પહેલા પૂરી પઢે અને જો પુછી ન શકે તો એજ હુકમ છે, કે પુછ્યું અને કાંઈ જવાબ ન મળ્યો. (રદ્દુલ મુહૃતાર)

મસ્થલા-(૪૧૦) : આંધળા સાથે કોઈ હાથ પકડીને લઈ જનાર છે, જો તે તેનો નોકર છે તો અંધજનની પોતાની નિયતનો એ' તેબાર છે અને જો કેવળ ઉપકારની રીતે તેની સાથે છે તો તેની નિયતનો એ' તેબાર છે. (રદ્દુલ મુહૃતાર)

મસ્થલા-(૪૧૧) : જે સૈનિક સરદારના તાબે હતો અને લશકરને પરાજય થયો અને સૌ વિભરાઈ ગયા તો હવે તેઓ તાબે નથી બલ્કે ઈકામત તથા સફર (પ્રવાસ) માં ખુદ તેની પોતાની નિયતનો લેલાજ છે. (રદ્દુલ મુહૃતાર)

મસ્ખલા-(૪૧૨) : ગુલામ પોતાના માલિક સાથે પ્રવાસમાં હતો કે માલિકે કોઈ મુકીમના હાથે તેને વેચી નાખ્યો જો નમાજમાં તેને તેની ખબર હતી અને બે રકાત પઢી તો ફરીથી પઢે, એવી જ રીતે જો ગુલામ નમાજમાં હતો અને માલિકે ઇકામતની નિયત કરી લીધી તો જાણી જોઈને બે રકાત પઢી તો ફરીથી પઢે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૪૧૩) : ગુલામ બે માણસોમાં સંયુક્ત છે, અને તે બંને પ્રવાસમાં છે એકે ઇકામતની નિયત કરી, બીજાએ નહીં, તો જો તે ગુલામથી ખિદમત-સેવા લેવામાં વારા ઠેરવેલા છે તો મુકીમના વાસના દિવસે ચાર રકાત પઢે અને મુસાફિરના વારાના દિવસે બે પઢે અને જો વારા ઠેરવેલા ન હોય તો દરરોજ ચાર પઢે અને બે રકાત પર કાંદો ફર્જ છે. (આલમગીરી)

મસ્ખલા-(૪૧૪) : જેણે ઇકામતની નિયત કરી પરંતુ તેની હાલત બાતાવે છે કે પંદર દિવસ રોકાશે નહીં, તો નિયત સહીએ નથી દા.ત. હજુજ કરવા ગયો અને જિલહિજની શરૂઆતમાં પંદર દિવસ મક્કા મોઅઝજમાં રોકાવાનો ઈરાદો કર્યો આ નિયત બેકાર છે કેમકે જ્યારે હજુજનો ઈરાદો છે તો અરફાત તથા મિના જરૂર જરૂર પછી એટલા દિવસ મક્કા મોઅઝજમાં કેવી રીતે રોકાઈ શકે છે. અને મિનાથી પાછા ફરીને નિયત કરે તો સહીએ છે. (આલમગીરી, હર્રે મુહ્તાર)

મસ્ખલા-(૪૧૫) : જે માણસ કયાંક ગયો અને ત્યાં પંદર દિવસ રોકાવાનો ઈરાદો નથી પરંતુ કાફલા સાથે જવાનો ઈરાદો છે. અને એ ખબર છે કે કાફલો પંદર દિવસ પછી જરૂર તો મુકીમ છે ભલે ઇકામતની નિયત કરી નથી. (હર્રે મુહ્તાર)

મસ્ખલા-(૪૧૬) : મુસાફિર કોઈ કામ માટે અથવા સાથીઓના ઈતેજાર (પ્રતિક્ષા)માં બે ચાર દિવસ અથવા તેરા-ચૌદ દિવસની નિયતથી રોકાયો અથવા ઈરાદો છે કે કામ થઈ જરૂર તો ચાલ્યા જરૂર. અને બંને હાલતોમાં જો આજકાલ કરતા વર્પો શુજરી જાય તો પણ મુસાફિર છે કસર નમાજ પઢે. (આલમગીરી વિગેર)

મસ્ખલા-(૪૧૭) : મુસલમાનોનું લશ્કર દારુલહર્બ

ગયું અથવા દારુલહર્બમાં કોઈ ડિલ્લાનો ઘેરો નાખ્યો તો મુસાફિર જ છે. ભલેને પંદર દિવસની નિયત કરી લીધી હોય, ભલે જાહેરી ગલ્બો હોય એવી જ રીતે જો દારુલ ઈસ્લામમાં બળવો ખોરોનો ઘેરાવ કર્યો હોય તો મુકીમ નથી અને જે શાખ્સ દારુલહર્બમાં અમાન લઈને ગયો અને પંદર દિવસની ઇકામતની નિયત કરી તો ચાર રકાત પઢે.

(ગુનીયા, હર્રે મુહ્તાર)

મસ્ખલા-(૪૧૮) : દારુલહર્બનો રહેનાર ત્યાંજ મુસલમાન થઈ ગયો અને કુફ્ફાર તેને મારી નાંખવાની કોશીશમાં હોય તો ત્યાંથી ત્રણ દિવસના પ્રવાસનો ઈરાદો કરી ભાગ્યો તો નમાજ કસર કરે અને જો ક્યાંક બે એક મહીનાના ઈરાદાથી છુપી ગયો તો પણ કસર પઢે. અને જો એજ શહેરમાં છુપાયો તો પૂરી પઢે અને જો મુસલમાન દારુલહર્બમાં કેદ હતો ત્યાંથી નાસીને કોઈ ગુફામાં સંતાપો તો કસર પઢે જો કે પંદર દિવસનો ઈરાદો હોય અને જો દારુલહર્બના કોઈ શહેરના સધળા રહેનારા મુસલમાન થઈ જાય અને હબીઓએ તેમનાથી લડવા ચાહું તો તે સૌ મુકીમ જ છે. એવી જ રીતે જો કુફ્ફાર તેમના શહેર ઉપર ગાલીબ આવે અને આ લોકો શહેર છોડીને એક દિવસના માર્ગના ઈરાદાથી ગયા તો પણ મુકીમ છે અને ત્રણ દિવસના માર્ગનો ઈરાદો હોય તો મુસાફિર છે. પછી જો પાછા આવ્યા અને કુફ્ફારે તેમના શહેર પર કંઈએ ન કર્યો હોય તો મુકીમ થઈ ગયા અને જો મુશરીકોનું શહેર પર આધિપત્ય થઈ ગયું. અને ત્યાં રહ્યા પણ પરંતુ મુસલમાનોના પાછા આવવાથી તે શહેર છોડી દીધું તો જો આ લોકો ત્યાં રહેવા ચાહે તો દારુલ ઈસ્લામ થઈ ગયું ન માઝો પુરી કરે અને જો ત્યાં રહેવાનો ઈરાદો નથી. બલે કેવળ એકાદ મહીને દારુલ ઈસ્લામમાં ચાલ્યા જરૂર તો કસર કરે. (આલમગીરી)

મસ્ખલા-(૪૧૯) : મુસલમાનોનું લશ્કર દારુલ હર્બમાં ગયું અને ગાલીબ આવ્યું અને તે શહેરને દારુલ ઈસ્લામ બનાવ્યું તો કસર ન કરે. અને જો કેવળ બે એક મહીના રહેવાનો ઈરાદો છે તો કસર કરે. (આલમગીરી)

મસ્ખલા-(૪૨૦) : મુસાફિરે નમાજની અંદર

ઇકામતની નિયતકરી તો આ નમાજ પણ પુરી પઢે. અને જો એ હાલત થઈ કે એક રકાત પઢી હતી કે સમય ખતમ થઈ ગયો અને બીજી રકાતમાં ઇકામતની નિયતકરી તો આ નમાજ બે જરકાત પઢે. અને પછીની ચાર પઢે. એવી જ રીતે જો મુસાફિર લાહિક હતો અને ઈમામ પણ મુસાફિર હતો તો ઈમામના સલામ ફેરવ્યા પછી ઈકામતની નિયત કરી તો બે જ પઢે. અને ઈમામના સલામ ફેરવ્યા પહેલા નિયત કરી તો ચાર પઢે.

(દુર્ઘટાર, રદ્દુલ મુહતાર)

મુસાફિરે મુકીમની ઈકાતેદા કરી અથવા મુકીમે
મુસાફિરની ઈકાતેદા કરી તેના એહેકામ

મસાલા-(૪૨૧) : અદા તથા કળા બંનેમાં મુકીમ મુસાફિરની ઈકાતેદા કરી શકે છે. અને ઈમામના સલામ ફરવ્યા પછી પોતાની બાકીની બે રકાતો પઢી લે. અને આ રકાતોમાં કિરાત બીલુકુલ ન કરે. બલ્કે ફાતેહાની સૂરત પઢવા જેટલા સમય માટે ચુપ ઉભો રહે. (દુર્ઘટાર)

મસાલા-(૪૨૨) : ઈમામ મુસાફિર છે, અને મુક્તદી મુકીમછે, ઈમામના સલામ ફેરવવા પહેલા મુક્તદી ઉભો થઈ ગયો અને સલામથી પહેલા ઈમામે ઇકામતની નિયત કરી લીધી તો જો મુક્તદી

ત્રીજી રકાતનો સિજદો કર્યો ન હોય તો ઈમામની સાથે થઈ જાય નહીં. તો નમાજ જતી રહી. અને ત્રીજી રકાતના સિજદા પછી ઈમામે ઇકામતની નિયત કરી તો અનુસરણ ન કરે: જો અનુસરણ કરશે, તો નમાજ જતી રહેશે. (રદ્દુલ મુહતાર)

મસાલા-(૪૨૩) : એ પહેલા જાહી લીધું છે કે, સેહતનો હુકમ ઈકાતેદા માટે શર્ત છે કે, ઈમામનું મુકીમ અથવા મુસાફિર હોવું માલમ હોય. ભલે નમાજ શરૂ કરતી વેળા ખબર પડી હોય કે પાછળ થી માટે ઈમામે નમાજ શરૂ કરતી વેળા પોતાનું મુસાફિર હોવું જાહેર કરી દેવું જોઈએ. અને જો શરૂમાં ન કહું તો નમાજ પછી કહી દે કેંત્તમારી નમાજ પુરી કરી લો, હું મુસાફિર છું (દુર્ઘટાર)
(અને જો શરૂઆતમાં કહી દીધું છે તો પણ પાછળ થી પણ કહી દે કે જે લોકો તે સમયે હાજર ન હતા

તેમને પણ ખબર પડી જાય.)

મસાલા-(૪૨૪) : સમય ખતમ થયા પછી મુસાફિર, મુકીમની ઈકાતેદા કરી શકતો નથી. સમય દરમિયાન કરી શકે છે, અને આ હાલતમાં મુસાફિરના ફર્જ પણ ચાર થઈ ગયા. અને જે નમાજોમાં કશ્શ નથી સમયમાં તથા સમય પછી બંને હાલતોમાં ઈકાતેદા કરી શકે છે. સમયની અંદર ઈકાતેદા કરી હતી અને નમાજ પુરી કરવા પહેલા સમય ખતમ થઈ ગયો તો પણ ઈકાતેદા સહીંહ છે.

(દુર્ઘટાર, રદ્દુલ મુહતાર)

મસાલા-(૪૨૫) : મુસાફિર મુકીમની ઈકાતેદા કરી અને ઈમામના મજહબ અનુસાર તે નમાજ કરી છે, અને મુક્તદીના મજહબ પર અદા છે. દા.ત. ઈમામ શાફી મજહબનો છે અને મુક્તદી હન્ફી છે અને એક મિસ્લ (દરેક વસ્તુનો મુળ સાયો છોડીને તે વસ્તુ જેટલો સાયો છોય તે) પછી જોઈરની નમાજ તેણે તેની પાછળ પઢી તો ઈકાતેદા સહીંહ છે.

(રદ્દુલ મુહતાર)

મસાલા-(૪૨૬) : મુસાફિર મુકીમની પાછળ નમાજ શરૂ કરીને ફાસિદ કરી નાખી, તો હવે બે (૨)જ રકાત પઢશે અર્થાત જ્યારે કે એકલો પઢે, અથવા કોઈ મુસાફિરની ઈકાતેદા કરે અને જો ફરીથી મુકીમની ઈકાતેદા કરી તો ચાર પઢે.

(રદ્દુલ મુહતાર)

મસાલા-(૪૨૭) : મુસાફિર મુકીમની ઈકાતેદા કરી તો મુક્તદી ઉપર પણ કાચદાએ ઉલા (પહેલો કાચદા) વાજિબ થઈ ગયો. ફર્જ ન રહ્યો તો જો ઈમામે કાચદો ન કર્યો, તો નમાજ ફાસિદ થઈ નહીં. અને મુકીમે મુસાફિરની ઈકાતેદા કરી તો મુક્તદી ઉપર પણ કાચદાએ ઉલા ફર્જ થઈ ગયો.

(દુર્ઘટાર, રદ્દુલ મુહતાર)

મસાલા-(૪૨૮) : કશ્શ અને પૂરી નમાજ પઢ વામાં આભિર (અંતિમ) સમયનો એ'તબાર છે, જ્યારે કે નમાજ પઢી ન શુક્યો હોય. ધારી લો કે કોઈએ નમાજ પઢી ન હતી અને સમય એટલો બાકી રહી ગયો છે કે “અલ્લાહો અકબર” કહી લે, હવે મુસાફિર થઈ ગયો તો કશ્શ કરે. અને મુસાફિર હતો તે સમયે ઈકામતની નિયત કરી તો ચાર પઢે.

(દુર્ભ મુખ્તાર)

મસાલા-(૪૨૯) : ઝોડરની નમાજ સમય દરમિયાન પછ્વા પછી સફર(પ્રવાસ) કર્યો અને અસરની બે રકાત પઢી પછી કોઈ કારણોસર મકાન પર પાછો આવ્યો અને હજૂઅસરનો સમય બાકી છે. હવે ખબર પડી કે બંને નમાજો વુઝુ વગર પઢી હતી તો ઝોડરની બે રકાત પઢે અને અસરની ચાર રકાત પઢે. અને જો ઝોડર તથા અસરની નમાજ પઢીને સુર્યાસ્તથી પહેલા સફર કરી અને ખબર પડી કે બંને નમાજો બે વુઝુ (વુઝુ વગર) પઢી હતી તો ઝોડરની ચાર પઢે અને અસરની બે

(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૪૩૦) : મુસાફિરને સહવથ્યો અને બે રકાત પર સલામ ફેરવ્યા પછી ઈકામતની નિયત કરી તો તે નમાજના હકમાં મકીમ ન થયો અને સહવનો સિજદો સાક્રિત (રદ) થઈ ગયો. અને સિજદો કરવા પછી નિયત કરી તો સહીહ છે. અને ચાર રકાત પછ્વનું ફરજ ભલે એક જ સિજદો કર્યા પછી નિયત કરી હોય. (આલમગીરી)

મસાલા-(૪૩૧) : મુસાફિરે મુસાફિરોની ઈમામત કરી. નમાજ દરમિયાન ઈમામ બે વુઝુ થયો અને કોઈ મુસાફિરને ખલીફા બનાવ્યો ખલીફાએ ઈકામતની નિયત કરી તો તેની પાછળ જે મુસાફિર છે તેમની નમાજો બેજ રકાત રહેશે. એવી જ રીતે જો મુકીમને ખલીફા બનાવ્યો તો પણ મુકતદી મુસાફિર બે જ પઢે. અને જો ઈમામે હદસ પછી મસિજદથી નિકળવાથી પહેલા ઈકામતની નિયત કરી તો ચાર પઢે. (આલમગીરી)

અસલી વતન અને ઈકામતે વતનના મસાઈલ મસાલા-(૪૩૨) : વતનના બે પ્રકાર છે. (૧) વતને અસલી, અને (૨) વતને ઈકામત અસલી (મુળ) વતન તે જગ્યાછે જ્યાં તેની પૈદાઈશ (જન્મ) છે અથવા તેના ઘરના લોકો ત્યાં રહે છે, અથવા ત્યાં નિવાસ કરી લીધો અને એ ઈરાદો છે કે ત્યાંથી જશે નાલી. વતને ઈકામત તે સ્થળ છે કે મુસાફિરે પંદર દિવસ અથવા તેના કરતાં વધારે દિવસ ત્યાં રોકાવાનો ઈરાદો કર્યો હોય. (આલમગીરી)

મસાલા-(૪૩૩) : મુસાફિરે કોઈ સ્થળે શાદી કરી

લીધી જો કે ત્યાં પંદર દિવસ રહેવાનો ઈરાદો ન હોય તો પણ મુકીમ થઈ ગયો, અને બે શહેરોમાં તેની પત્નીઓ રહેતી હોય તો બંને સ્થળે પહોંચતાં જ મુકીમ થઈ જશે. (રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૪૩૪) : એક જગ્યાએ આદમીનું વતને અસલી છે, હવે તેણે બીજી જગ્યાએ વતને અસલી બનાવ્યું. જો પહેલા સ્થળે બાલ-બચ્ચા હાજર હોય તો બંને વતને અસલી છે. નહીં તો પ્રથમ સ્થળ અસલી વતન રહ્યું નહીં ભલે તે બંને સ્થળો દરમિયાન મુસાફિર તે સફર (પ્રવાસનું અંતર) હોય કે ન હોય.

(દુર્ભ મુખ્તાર વિગેરે)

મસાલા-(૪૩૫) : એક વતને ઈકામત, બીજા વતને ઈકામતને બાતલ (નાટ) કરી દે છે. અર્થાત એક સ્થળે પંદર દિવસના ઈરાદાથી રોકાયા પછી બીજા સ્થળે એટલાજ દિવસના ઈરાદાથી રોકાયો તો પ્રથમ સ્થળ હવે વતન રહ્યું નહીં. બંને વચ્ચે શરીર પ્રવાસનં અંતર હોય કે ન હોય એવી જ રીતે વતને ઈકામત, વતને અસલી તથા સફરથી બાતલ થઈ જાય છે.

(દુર્ભ મુહ્તાર વિગેરે)

મસાલા-(૪૩૬) : જો પોતાના ઘરના માણસોને લઈને બીજા સ્થળે ચાલયો ગયો અને પ્રથમ જગ્યાએ મકાન તથા સરસામાન વિગેર બાકી છે તો તે પણ વતને અસલી છે. (આલમગીરી)

મસાલા-(૪૩૭) : વતને ઈકામત (સ્થાયી થવાના સ્થળન) માટે એ જરૂરી નથી કે ત્રણ દિવસના પ્રવાસ પછી ત્યાં ઈકામત (નિવાસ) કર્યો હોય બલે પ્રવાસની મુદ્દત પૂરી કરવા પહેલા ઈકામત કરી લીધી તો “વતને ઈકામત” થઈ ગયું

(આલમગીરી, દુર્ભ મુખ્તાર)

મસાલા-(૪૩૮) : બાલિગના માં -બાપ કોઈ (બીજા) શહેરમાં રહેછે અને તે શહેર તેનું જન્મસ્થળ નથી. ન તેના કુટુંબીઓ ત્યાં હોય, તો તે સ્થળ તેના માટે વતન નથી. (દુર્ભ મુખ્તાર)

મસાલા-(૪૩૯) : મુસાફિરે જ્યારે વતને અસલી (મુળવતન) માં પહોંચી ગયો તો પ્રવાસ ભતમ થઈ ગયો. ભલે ઈકામતની નિયત કરી ન હોય.

(આલમગીરી)

મસાલા-(૪૪૦) : સ્ત્રી પરણીને સુસરાલ ગઈ અને

ત્યાંજ રહેવા લાગી, તો તેના માટે વતને અસળી ન રહ્યું અર્થાત જો સાસરીયું ગ્રાણ મંજિલ પર છે, અને ત્યાંથી પીપર આવી અને પંદર દિવસ રોકાવાની નિય્યત ન કરી તો કસર નમાજ પઢે. અને જો પીપરિયામાં રહેવું છોડ્યું નથી, બલ્કે શ્વસુરગૃહે આરજી રીતે ગઈ તો પીપરમાં પ્રવાસ ખતમ થઈ ગયો નમાજ પુરી પઢે.

મરસાલા-(૪૪૧): સ્ત્રીએ મહેરમ વગરત્રાણ દિવસ અથવા અધિક દિવસના પ્રવાસે જવું નાજાઈજ છે, બલ્કે એક દિવસના માર્ગ જવું પણ નાજાઈજ છે. ના બાલિગ બાળક અથવા મઅતુવહની સાથે પણ પ્રવાસ કરી શકતી નથી, સાથીદારમાં મહરમ બાલિગ અથવા પતિનું હોવું જરૂરી છે (આલમગીરી વિગેરે) મહરમ માટે આવશ્યક છે કે, સપ્તફાસિક, બેબાક, અસુરક્ષિત ન હોય.

જુમાનું બચાન

અલ્લાહ અગ્ર વ જલ્લ ફરમાવે છે:-

“ચા એચોહલલગીના આમનૂઈગ્રા નુદેય લિસ્સલાતે મિંબ્યોમિલ જુમાઅતે ફસ્થાવ ઈલા જિંકિલ્લાહે વગરિલ્લેઅ ઝાલેકુમ ઐઝલ લફુમ ઈન કુન્નુમ તાચલમુન.”

(તરજુમો: અય ઈમાનવાળાઓ જ્યારે નમાજ માટે જુમાના દિવસે અજાન આપવામાં આવે, તો ખુદાના જિક તરફ દોડો અને ખરીદ-વેચાણ છોડી દો. આ તમારા માટે બેહતર છે જો તમે જાણતા હોય.)

જુમાના દિવસના ફરજાઈલ

હદીસ-૧ (તથા ૨): સહીફેનમાં અખુ હુરૈરહ રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે, હુરૂરે એકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, અમો પાછલા છીએ. અર્થાત હુનિયામાં આવવાની ગણનાથી અને કિયામતના દિવસે પહેલા છીએ. સિવાય તેના કે તેમને અમારાથી પહેલા કિતાબ મળી અને અમને તેમના પછી, આ જુમા એ દિવસ છે કે તેમના ઉપર ફર્જ કરવામાં આવ્યો અર્થાત એ કે તેની તઅજીમ (આદર) કરે. તેઓ તેનાથી વિરુદ્ધ થઈ ગયા. અને અમને અલ્લાહે બતાવી દીધું. બીજા લોકો અમારા તાબેઅ છે.

યહુદીઓએ બીજા દિવસને તે દિવસ ઠેરબ્યો અર્થાત શનિવારને. અને નસારા (પ્રિસ્તીઓ) એ ત્રીજા દિવસને એટલે રવીવારને. અને મુસ્લિમ શરીફની બીજા રિવાયત તેમનાથી જ અને હુરેઝ રદીયલ્લાહો અન્હોથી રિવાયત એ છે કે, હુરૂર ફરમાવે છે કે અમો હુનિયાવાળાઓથી પાછળ છીએ, અને કિયામતના દિવસે હુનિયાની સધળી મખલુકથી પહેલા, અમારા માટે ફેસલો થઈ જશે.

હદીસ-(૩): મુસ્લિમ, અખુદાઉદ, તિરમિઝી તથા નિસાઈ અખુદૂરેરહ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુરૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, બહેતર દિવસ જેના પર સૂર્યાદય થયો તે જુમાનો દિવસ છે. તેમાંજ આદમ અલહિસ્સલામ પૈદા કરવામાં આવ્યા અને એજ દિવસે જન્નતમાં દાખલ કરવામાં આવ્યા અને એજ દિવસમાં જન્નતથી ધરતી ઉપર ઉત્તરવાનો તેમને હુકમ થયો અને કિયામત જુમાના જ દિવસે કાયમ થશે.

હદીસ-(૪ - ૫): અખુ દાઉદ, નિસાઈ, ઈબ્નેમાજા તથા બયહડી ઓસબિન ઓસ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુરૂર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે તમારા ઉત્તમ દિવસો પૈકી જુમાનો દિવસ ઉત્તમ છે. તેમાંજ આદમ અલયહિસ્સલામ પૈદા કરવામાં આવ્યા અને એજ દિવસે ઈન્નેકાલ થયો, અને તેમાંજ નફખહ છે (બીજા વાર સૂરકુકાવું), અને તેમાંજ સઅકાછે. (એટલે પ્રથમવાર સૂરકુકાવું) તે દિવસે મારા ઉપર હુરુદની કસરત (અધિકતા) કરો કે તમારું હુરુદ મારી પાસે રજુ કરવામાં આવે છે. લોકોએ અર્જ કરી યા રસૂલલ્લાહ તે સમયે હુરૂર પર અમારું હુરુદ કેવી રીતે પેશ કરવામાં આવેશે. જ્યારે કે હુરૂર ઈન્નેકાલ ફરમાવી ગયા હશે. આપે ફરમાયુંકે અલ્લાહતાલાઓ જમીન માટે અંબિયા અલયહિમુસ્સલામના શરીરને ખાવું હરામ કરી દીધું છે. અને ઈબ્ને માજાની રિવાયતમાં છે કે આપ ફરમાવે છે. કે જુમાહના દિવસે મારા ઉપર હુરુદની કસરત કરો કે આ દિવસ મશહુદ (ગવાહીઆપેલ) છે. તેમાં ફરિશતા હાજર થાય છે. અને મારા ઉપર જે હુરુદ પદ્દે તે રજુ કરવામાં આવશે, અખુ દરદા રદીયલ્લાહો અન્હો કહે છે કે, મેં અર્જ કરી કે આપના

વિસાલ પછી, આપે ફરમાવ્યું “બેશક અલ્લાહે જમીન માટે અંબિયાના શરીર ખાવું હરામ કરી દીદું છે. અલ્લાહનો નબી જીવંત છે, તેને રોજી આપવામાં આવે છે.”

હદ્દીસ-(૬-૭) : ઈને માજા અબુ લોબાબદ બિન અખ્દુલ મન્જર અને અહમદ સાચદ બિન મુઆજ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે. કે, હુઝુર સલ્લાહો અલયહે વસ્ત્લભ ફરમાવે છે કે જુમાનો દિવસ સધણા દિવસોનો સરદાર છે, અને અલ્લાહની નજીદીક ઈંડ અદહા તથા ઈંડુલિફ્રથી મોટો છે. તેમાં પાચ ખસલતો (સદગુણો) છે. (૧) અલ્લાહતાલાએ તેમાં આદમ અલયહિરસલામને પૈદા કર્યા. (૨) તેમાંજ તેમને જમીન પર ઉતાર્યા (૩) તેમાંજ તેમને વફાત (મૃત્યુ) આપી (૪) તેમાં એક કષા એવી છે કે બંદો તે સમયે જે વસ્તુનો સવાલ કરે તે તેને આપશે જ્યાં સુધી હરામનો સવાલ (માંગણી) ન કરે અને (૫) એજ દિવસે કયામત કાયમ થશે, કોઈ મુકર્બ (નિકટસ્થ) ફરિશ્તો તથા આસમાન તથા જમીનઅને હવા અને પહાડ અને દરિયો એવા નથી કે જુમાના દિવસથી ડરતા ન હોય **જુમાની એક મહત્વની ધરી :**

હદ્દીસ-(૮ થી ૧૦) : બુખારી તથા મુસ્લિમ અબુ હુરેરહ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે હુઝુર સલ્લાહો અલયહે વસ્ત્લભ ફરમાવે છે કે, જુમામાં એક એવી સાઅત-ધરીછે કે મુસલમાન બંદો જો તેને પામી લે અને તે વખતે અલ્લાહ તાલાથી ભલાઈનો સવાલ ફરે, તો તેને આપશે અને મુસ્લિમની રિવાયતમાં એ પણ છે કે તે સમય બહુ થોડો છે. રહ્યું એ કે તે કયો સમય છે તેમાં વધારે રિવાયતો છે. તે પેકી બે કંઈ છે એક એકે, ઈમામના ખુતબા માટે બેસવાથી નમાજના ખત્મ સુધી છે. આ હદ્દીસને મુસ્લિમ અબુ બુરદહબિન અલી મુસાથી, તેઓ પોતાના વાલદ (પોતા)થી, તેઓ હુઝુરે અકદસ સલ્લાહો અલયહે વસ્ત્લભથી રિવાયત કરે છે અને બીજી રિવાયત એ કે તે જુમાની પાછળી સાઅત છે.

ઈમામ માલિક, અબુ દાઉદ તિરમિજી

નિસાઈ તથા અહમદ અબુ હુરેરહ રદીયલ્લાહો અન્ધોથી રાવી, તેઓ કહે છે, હું કોહેતુર તરફ ગયો અને કાબા અહબારથી મળ્યો, તેમની પાસે બેસ્યો, તેમણે મને તૌરેતની રિવાયતો સંભળાવી અને મેં તેમને રસૂલલ્લાહ સલ્લાહો અલયહે વસ્ત્લભમની હદ્દીસો બયાન કરી તેમાં એક હદ્દીસ એ પણ હતી કે રસૂલલ્લાહ સલ્લાહો અલયહે વસ્ત્લભ ફરમાવ્યું, બહેતર દિવસ કે સુર્ય તેના ઉપર ઉદ્ય કર્યો તે જુમાનો દિવસ છે તેમાંજ આદમ અલયહિસલામ પૈદા કરવામાં આવ્યા અને તેમાંજ તેમને જમીન ઉપર ઉત્તરવાનો હુકમ થયો અને તેમાંજ તેમની તૌબા કુબુલ થઈ અને તેમાંજ તેમનું અવસાન થયું અને તેમાંજ ડિયામત કાયમ થશે અને કોઈ જાનવર એવું નથી કે જુમાના દિવસે સવારના સમયે સુરજ નિકળવા સુધી ડિયામતના ડરથી ચીખતું ન હોય આદમી અને જિન્ન સિવાય અને તેમાં એક એવો એક સમય છે કે મુસલમાન બંદો નમાજ પઢવા તેને પામી લેતો અલ્લાહથી જે વસ્તુની માંગણી કરે તો તેને આપશે.

કાબે કહ્યું : વર્ષમાં એવો એક દિવસ છે ? મેં કહ્યુંનહી, બલ્કે દરેક જુમામાં છે. કાબે તવરત પઢીને કહ્યું કે રસૂલલ્લાહ સલ્લાહો અલયહે વસ્ત્લભ સાચું ફરમાવ્યું. અબુ હુરેરહ રદીયલ્લાહો અન્ધો કહે છે, “પછી હું અખુલલ્લાહ બિન સલામ રદીયલ્લાહો અન્ધોથી મળ્યો અને કાબા અહબારની મુલાકાત અને જુમા વિષે જે હદ્દીસ બયાન કરી હતી તેનો ઉલ્લેખ કર્યો અને તે કે કાબે કહ્યું હતું કે તે દરવર્ષમાં એક દિવસ છે” અખુલલ્લાહ બિન સલામે કહ્યું કાબે ગલત કહ્યું. મેં કહ્યું પછી કાબે તવરત વાંચીને કહ્યું, બલ્કે તે સાઅત (ધળી) દરેક જુમામાં છે, આપે કહ્યું, કાબે સાચું કહ્યું પછી અખુલલ્લાહ બિન સલામે કહ્યું તમને ખબર છે તે કચી સાઅત છે? મેં કહ્યું : “મને બતાવો અને કંજુરી ન કરો,” તેમણે કહ્યું જુમાના દિવસની પાછળી સાઅત છે. મેં કહ્યું પાછળી સાઅત કેવી રીતે હોઈ શકે ? હુઝુરે તો ફરમાવ્યું છે મુસલમાન બંદો નમાજ પઢતામાં તેને પામે અને તે નમાજનો સમય નથી. અખુલલ્લાહ બિન સલામે કહ્યું શું હુઝુરે એમ નથી ફરમાવ્યું કે, જે

માણસ મજલિસમાં નમાજના ઈન્ટેજાર (પ્રતિક્ષા) માં બેસે, તે નમાજમાં છે મેં કહ્યું હા, ફરમાવ્યું તો છે. તેમણે કહ્યું તો તે એજ છે. અર્થાત નમાજ પઢ વાથી નમાજનો ઈન્ટેજાર મુરાદ છે.

હદ્દીસ-૧૧ : તિરમિઝી અનસ રદીયલ્લાહો અન્હોથી રાવી કે હુસુર સલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે, જુમાના દિવસે જે સાઅત (ઘણી) ઈચ્છા કરવામાં આવે છે તેને અસરની નમાજ પછીથી સુર્યાસ્ત સુધી શોધો.

હદ્દીસ-૧૨ : તિબ્રાની ઓસતમાં હસન સનદથી અનસ બિન માલિક રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુસુર સલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે : અલ્લાહ તબારક વ તાબાલા કોઈ મુસલમાનને જુમાના દિવસે મગફેરત કર્યાવગર છોડશે નહીં.

હદ્દીસ-૧૩ : અબુ યઅલા તેમનાથી જ રિવાયત કરે છે હુસુર ફરમાવે છે : જુમાના દિવસ તથા રાતમાં ચોવીસ કલાકમાં કોઈ કલાક એવો નથી જેમાં અલ્લાહ, જહન્નમથી છ લાખ માણસોને (મુસલમાનોને) આગાદ (મુક્ત) ન કરતો હોય, જેમના ઉપર જહન્નમ વાળિબ થઈ ગઈ હતી.

જુમાના દિવસે ઈન્ટેકાલ કરવાના ફળાઈલ

હદ્દીસ-૧૪ : અહમદ તથા તિરમિઝી અખુલ્લાહ બિન ઉમર રદીયલ્લાહો અન્હોમાંથી રિવાયત કરે છે કે, હુસુર ફરમાવે છે કે જે મુસલમાન જુમાના દિવસે અથવા જુમાની રાતમાં મરશે અખ્લાહ તાબાલા તેને કબ્રના ફિલાથી બચાવશે.

હદ્દીસ-૧૫ : અબુ નઈએ જાબિર રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરી કે, હુસુર ફરમાવે છે, જે માણસ જુમાના દિવસે અથવા જુમાની રાતમાં મરણ પામશે, કબ્રના અઝાબથી બચાવી લેવામાં આવશે, અને કિયામતના દિવસે ઐવી રીતે આવશે કે તેના ઉપર શહીદોની મહોર હશે.

હદ્દીસ-૧૬ : હમીએ તરગીબમાં અયાસ બિન બુકેરથી રિવાયત કરી કે, હુસુર ફરમાવે છે કે જે માણસ જુમાના દિવસે મરણ પામશે તેના માટે શહીદનો અજ લખવામાં આવશે અને કબ્રના ફિલાથી બચાવી લેવામાં આવશે.

હદ્દીસ-૧૭ : અતાથી રિવાયત છે કે, હુસુર

ફરમાવે છે, જે મુસલમાન પુરુષ અથવા મુસલમાન સ્ત્રી જુમાના દિવસે અથવા જુમાની રાતમાં મરણ પામે અઝાબે કબ્ર અને ફીલના કબ્રથી બચાવી લેવામાં આવશે અને ખુદાથી એ હાલતમાં મરણ કે તેના ઉપર કોઈ હિસાબ ન થશે. અને તેની સાથે ગવાહ (સાક્ષી) હશે કે તેના માટે ગવાહી આપશે અથવા મોહર હશે.

હદ્દીસ-૧૮ : બયહકીની રિવાયત અનસ રદીયલ્લાહો અન્હોથી છે કે હુસુર ફરમાવે છે જુમાની રાત રોશન રાત છે અને જુમાનો દિવસ ચમકદાર દિવસ છે.

હદ્દીસ-૧૯ : તિરમિઝી ઈઞ્ચે અખ્બાસ રદીયલ્લાહો અન્હોથી રાવી કે તેમણે આ આયત પઢી.

"અત્યોમ અકમલો લફુમ દીનફુમ વ અત્મમ્લો અલેફુમ નેઅમતી વરદીતો લકોમુલ ઈસ્તામા દીના."

(અર્થ : આજે મેં તમારો દીન (મજહબ) કામિલ પૂર્ણ કરી દીધો અને તમારા ઉપર પોતાની નેઅમત પૂર્ણ કરી દીધી, અને તમારા માટે ઈસ્તામને દીન પસંદ કર્યો)

તેમની સેવામાં એક યહુદી હાજર હતો તેણે કહ્યું આ આયત જો અમારા ઉપર નાજિલ થતી (ઉત્તરતી) તો અમો તે દિવસને ઈદ બનાવતા. ઈઞ્ચે અખ્બાસ રદીયલ્લાહો અન્હોએ ફરમાવ્યું : આ આયત બે ઈદોના દિવસે ઉત્તરી. જુમા અને અરફાના દિવસે અર્થાત અમારે તે દિવસને ઈદ બનાવવાની જરૂરત નથી કે, અલ્લાહે જે દિવસે આ આયત ઉત્તરી તે દિવસે બમણી ઈદ હતી કે જુમા તથા અરફો આ બંને દિવસ મુસલમાનોની ઈદના છે અને તે દિવસે આ બંને એકત્ર હતા કે જુમાનો દિવસ હતો અને નવમી જિલહિજજહનો દિવસ.

જુમાની નમાજના ફળાઈલ :

હદ્દીસ-૨૦ : મુસિલમ અબુદાઉદ, તિરમિઝી તથા ઈઞ્ચે માજા અબુ હુરેરહ રદીયલ્લાહો અન્હોથી રાવી કે હુસુરે અકદસ સલ્લાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે, જેણે સાંચી રીતે વુઝુ કર્યું પછી જુમાની નમાજ માટે આવ્યો અને ખુટ્બો સાંભળ્યો અને ચુપ રહ્યો, તેના માટે મગફેરત થઈ જશે તે ચુનાહોની જે આ જુમાની અને બીજી જુમાની વચ્ચે છે, અને ત્રણ દિવસ બીજા અને જે માણસે કંકરીઓને

સ્પર્શ કર્યો તેણે લગ્વ (વ્યર્થ) કર્યું, અથવા ખુત્બો સાંભળવાની હાલતમાં એટલું કામ પડા વ્યર્થમાં દાખલ છે કે કંકરી પડી હોય તેને હઠાવી દે.

હદ્દીસ- (૨૧) : તિથાનીની રિવાયત અબૂ માલિક અશારી રદીયલ્લાહો આંદોથી છે કે હુલુર ફરમાવે છે જુમ્મા તે શુનાહોનો કફકારો (ભુલનો બદલો) છે જે આ જુમ્મા અને તેના પછી વાળી જુમ્માની વચ્ચે છે અને ત્રણ દિવસ વધારાના અને આ એટલા માટે કે અલ્લાહ ફરમાવે છે જે નેકી કરે તેના માટે તેની દસ સમાન છે.

હદ્દીસ-૨૨ : ઈને હજ્બાન પોતાની સહીહમાં અખુ સહીદ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુણુર ફરમાવે છે જે માણસ પાંચ વસ્તુઓ એક દિવસમાં કરશે અલ્લાહ તાલા તેને જન્મતી લખી દેશે,

- (૧) જે માણસ બીમારની ખબર કાઢવા જ
(૨) જનાગામાં હાજર થાય.
(૩) રોઝો રાખે.
(૪) જુઘાણની નમાજ પઠવા જાય. અને
(૫) ગુલામ આગાદ કરે.

હદ્દીસ- (૨૩) : તિરમિજી બ ઈશ્વાદએ તસહીહ તથા તહુસીન રિવાયત કરે છે કે યજીદ બિન અબી મરયમ કહે છે, હું જુમ્માની નમાઝ પદ્ધવા જતો હતો (રસ્તામાં) અભાયહ બિન રોફાખાબિન રાફેઅ મળ્યા તેમણે કહ્યું, તમને બશારત થાય કે તમારા આ કદમ અલ્લાહની રાહમાં છે. મેં અખુ અબસરે કહેતા સાંભળ્યો કે રસુલુલ્લાહ સલલ્લાહો અલયહે વસલ્લભે ફરમાવ્યું: જેના કદમ અલ્લાહની રાહમાં ધુપળાળા થાય તે કદમ આગ માટે હરામ છે. અને બુખારીની રિવાયતમાં કેવી રીતે છે કે, અભાયહ કહેછે. હું જુમ્માની નમાઝ પદ્ધવા જઈ રહ્યો હતો, અખુ અબાસ રદીયલ્લાહો અન્હો મળ્યા અને હુઝરનો ઈશ્વાદ (કથન) સંભળાવ્યો.

જુમાનો ત્યાગ કરવા
પર ચેતવણીઓ

હદ્દીસ-(૨૪ થી ૨૬) : મુસ્લિમ અબુ હુરેરહ તથા ઈબ્ને ઉમરથી અને નસાઈ તથા ઈબ્ને માજા ઈબ્ને અખ્ભાસ તથા ઈબ્ને ઉમર રહીયલ્લાહો અન્હુમ થી. રિવાyat છે કે હુસ્તુરે અકદસ સલ્લલ્લાહો અલયહે

વસત્તુમ ફરમાવે છે, લોકો જીમાં ત્યજવાથી બાજ આવશે અથવા અલ્લાહ તાઓલા તેમના દિલો ઉપર મુહર (સીલ) કરી દેશે પછી તેઓ ગાડેલ વૈકી થઈ જશે.

હદીસ-(૨૭ થી ૩૧) : હુશુર સલ્વલ્વાહો અલયહે
વસલ્વમ ફરમાવે છે જે માણસ સુસ્તિના કારણે ત્રણ
જીમ્બા છોડી દે અલ્વાહ તથાલા તેના દિલ ઉપર
મુહર મારી દેશે તેને અબુ દાઉદ, તિરમિઝી, નિસાઈ,
ઈબ્ને માજા, દારોમી ઈબ્ને પુરેમહ, ઈબ્ને હુબ્બાન
તથા હાડિમ અખુલજાહ દમોરીથી અને ઈમામ
માલિકે સફવાન બિન સલ્વિમથી અને ઈમામ અહમદે
અખુત્કતાદહ રદીયલ્વાહો અન્હુમથી રિવાયત કરી.
તિરમિઝીએ કહ્યું : મુસ્લિમની શર્ત પર સહીહ છે.
અને ઈબ્ને પુરેમહ તથા ઈબ્ને હુબ્બાનની રિવાયતમાં
છે કે, જે માણસ ત્રણ જીમ્બા ઉજર વગર છોડી દે તો
મુનાફિક છે અને રજીનની રિવાયતમાં છે કે તે
અલ્વાહથી બે ઈલાકા (અસંબધિત) છે. અને
તિભાનીની રિવાયત ઓસામા રદીયલ્વાહો અન્હોથી
છે કે, તે મુનાફિકોમાં લખી દેવામાં આવ્યો. અને
ઈમામ શાફી રદીયલ્વાહો અન્હોની રિવાયત
અખુલ્વાહ બિન અબ્બાસ રદીયલ્વાહો તથાલા
અન્હોમાંથી છે કે, તે મુનાફિક લખી દેવામાં આવ્યો.
તે કિતાબમાં જે ન નાચ થાય ન બદલવામાં આવે.
અને એક રિવાયતમાં છે જે માણસ સતત ત્રણ જીમ્બા
છોડી દે, તેણે ઈસ્લામને પીઠ પાછળ ફંકી દીધો, તેને
અખૂ યઅલાએ ઈબ્ને અબ્બાસ રદીયલ્વાહો
અન્હોમાંથી સહીહ સનદથી રિવાયત કર્યું.

ਛੀਦੀਸ- (ਤ੨) : ਅਹਮਦ, ਅਖੂਦਾਉਂਦ ਤਥਾ ਈਂਡੇ ਮਾਜ਼ ਸਮੌਰਾਹ ਬਿਨ ਜੁਨ੍ਹੁਬ ਰਈਧਲਕਾਈ ਅਨੱਖੋਥੀ ਰਿਵਾਯਤ ਕਰੇ ਛੇ ਕੇ ਹੁਣ੍ਹੁਰੇ ਫਰਮਾਵੇ ਛੇ ਕੇ ਜੇ ਮਾਝਾ ਸ ਕੋਈ ਜਾਤਨਾ ਉੱਝਰ ਵਗਰ ਜੁ ਮਾਨੀ ਨ ਮਾਝ ਛੋਤੇ ਤੇ ਏਕ ਦੀਨਾਰ ਸਦਕੋ ਕਰੇ ਅਨੇ ਜੀ ਏਕ ਦੀਨਾਰਨੀ ਸ਼ਾਕਿਤ ਨਥੀ ਤੋ ਅਰਧੀ ਦੀਨਾਰ ਆਪੇ. ਅਨੇ ਆ ਦੀਨਾਰ ਸਦਕੋ ਕਰਵੁਂ ਕਈ ਏਟਲਾ ਮਾਟੇ ਹੋਇ ਕੇ ਤੌਬਾ ਕੁਖੂਲ ਥਵਾ ਮਾਟੇ ਨਿਧਤ ਹੋਇ. ਨਹੀਂ ਤੋ ਵਾਸਤਵਮਾਂ ਤੋ ਤੌਬਾ ਕਰਵੁਂ ਝੂਝ੍ਹ ਛੇ.

ਛਈਸ-ਤੁਰੇ : ਸਹੀਂ ਮੁਸ਼ਿਲਮਾਂ ਇੰਜੇ ਮਸ਼ਉਦ
ਰਾਵੀਧਲਾਈ ਅਨ੍ਹੋਥੀ ਰਿਵਾਯਤ ਛੇ ਕੇ ਹੁਣੂਰ
ਸਲਲਾਈ ਅਲਾਖੇ ਵਸਲਬ ਫਰਮਾਵੇ ਛੇ ਤੇ, ਮੌਜੂਦਾ

ઈરાદો કર્યો કે એક શખ્સને નમાજ પઢાવવાનો હુકમ આપું અને જે લોકો જુમાના નમાજ પડ વાથી પાછળ રહી ગયા છે તેમના ઘરોને સળગાવી દઉ.

હદ્દીસ-(૩૪) : ઈબ્ને માઝાએ જાબિર રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરી કે, રસુલુલ્લાહ સલ્લાલ્હાહો અલયહે વસલ્લમ મુત્બો પદ્યો અને ફરમાવ્યું : “અય લોકો મૃત્યુથી પહેલા અલ્લાહ તરફ તૌબા કરો અને મશગુલ થવાથી પહેલા નેક કામો પ્રત્યે અગ્રેસરતા કરો અને પુદાની યાદની અધીકતા કરો અને જાહેર તથા ગુપ્ત સદકાની કસરત (અધીકતા)થી તમારા અને તમારા રખ્ય વચ્ચે જે સંબંધ છે તેને મેળવો આવું કરશો તો તમને રોજ આપવામાં આવશે અને તમારી પરાધિનતા હુર કરવામાં આવશે અને જાણીલોકે, આ સ્થળે, આ દિવસે આ વર્પમાં કિયામત સુધી માટે અલ્લાહે તમારા ઉપર જુમાના ફર્જ કરી.”

“જે માણસ મારી હ્યાતીમાં અથવા મારા પાછળ તેને હલ્કું સમજ્ય અને ઈન્કારની રીતે જુમાના છોડે, અને તેના માટે કોઈ ઈમામ અર્થાત હાકિમે ઈસ્લામ હોય, આદિલ કે જાલિમ તો અલ્લાહ તથાલા તેના અસ્તવ્યસ્તાને ન એકત્ર કરશે ન તેના કામમાં બરકત આપશે. સાવધાન, તેના માટે ન નમાજ છે ન જકાત ન હજજ ન રોજા ન નેકી જ્યાં સુધી તૌબા ન કરે અને જે તૌબા કરે અલ્લાહ તેની તૌબા કુભૂલ કરશે.”

હદ્દીસ-(૩૫) : દારોકુતની તેમનાથી જ રિવાયત કરે છે કે હુસુર સલ્લાલ્હાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, જે માણસ અલ્લાહ અને પાછળા દિવસ (કિયામત) પર ઈમાન લાવે છે તેના ઉપર જુમાના દિવસે (નમાજે) જુમાના ફર્જ છે, પરંતુ બીમાર અથવા મુસાફિર અથવા સ્ત્રી અથવા બાળક ગુલામ પર જુમાના ફર્જ નથી. અને માનવી જેલ-તમાશા અથવા વેપારમાં વ્યસ્ત રહ્યો તો અલ્લાહ તેનાથી બે પરવાહ છે અને અલ્લાહ ગાની-હમીદ છે.

જુમાના દિવસે નહાવાનું અને

ખુશ્બુ લગાડવાનું બયાન :

હદ્દીસ-(૩૬ થી ૩૮) : સહીહ ખુખારીમાં સલમાન

ફારસી રદીયલ્લાહો અન્ધોથી રિવાયત છે કે, હુસુર સલ્લાલ્હાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, જુમાના દિવસે નહાય અને જે તહારતની યોગ્યતા હોય કરે અને તેલ લગાડે અને ઘરમાં જે ખુશ્બુ (સુગંધી) હોય તે લગાડે પછી નમાજ માટે નીકળે અને બે શખ્સોમાં જુદાઈ ન કરે અર્થાત બેમાણસો બેઠેલા હોય તેમને હઠાવી વચ્ચે ન બેસે અને જે નમાજ તેમના માટે લખવામાં આવી છે તેને પઢે. અને ઈમામ જ્યારે ખુલ્બો પઢે તો ચુપ રહે. તેના માટે ગુનાહોની જે આ જુમાના અને બીજી જુમાની વચ્ચે છે મગફિરત થઈ જશે અને અબુ સહિદ ખુદરી તથા અબુ હુરેરહ રદીયલ્લાહો અન્ધોમાંથી અનેક રીતે તેના જેવીજ રિવાયતો આવી છે.

હદ્દીસ-(૩૯ થી ૪૦) : અહમદ, અબુ દાઉદ તથા તિરમિઝી બર્દજાદે તહસીન તથા નિસાઈ, ઈબ્ને માઝ, ઈબ્ને પુઝેમહ, ઈબ્ને હલ્બાન તથા હાકિમ બર્દજાદે તસેહીહ ઔસ બિન ઔસ અને તિબ્રાની ઔસતમાં ઈબ્ને અભ્યાસ રદીયલ્લાહો અન્ધોમાંથી રિવાયત કરે છે કે, જે માણસ નવડાવે અને નહાય અને અવ્યલ સમયમાં આવે અને ખુલ્બાના આરંભમાં શરીક થાય અને ચાલીને આવે, સવારી પર ન આવે અને ઈમામની નિકટ હોય અને કાન લગાવી (ધ્યાનથી) ખુલ્બો સાંભળે અને લગ્વ (વ્યર્થ) કામ ન કરે, તેના માટે દરેક કદમ (પગલા)ના બદલામાં વર્પ ભરનો અમલ છે. એક વર્પના દિવસોના રોજા અને રાતોની (ઇબાદત માટેનું) કિયામતનું તેના માટે અજર (સવાબ-બદલો) છે. અને તેના જેવી જ બીજા સાહબાઓએ કિરામથી પણ રિવાયતો છે.

હદ્દીસ-(૪૧) : ખુખારી તથા મુસ્લિમ, અબુ હુરરહ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે, હુસુર સલ્લાલ્હાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, દરેક મુસલમાન પર સાત દિવસમાં એક દિવસમાં એક (જુમાના) ગુસ્લ છે કે તે દિવસે માધ્યમાં અને શરીર ધૂવે.

હદ્દીસ-(૪૨) : અહમદ, અબુ દાઉદ, તિરમિઝી, નિસાઈ તથા દારોમી, સમોરહ બિન જુન્દુબ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરે છે કે હુસુર ફરમાવે છે જેણે જુમાના દિવસે વુઝુ કર્યું સારું છે, અને જેણે ગુસ્લ કર્યું તો ગુસ્લ અફજલ છે.

હદ્દીસ-(૪૩) : અબુ દાઉદ, ઈકરમાથી રિવાયત કરે

છે કે ઈરાકથી કેટલાક લોકો આવ્યા, તેમણે ઈંબે અખ્ભાસ રદીયલ્લાણો અન્હોમાને પૂછ્યું કે, જીમાના દિવસે આપ ગુસ્લને વાજિબ સમજો છો ? આપે ફરમાવ્યું નહીં. હા, તે વધુ તહારત (પાકી) છે અને જે માણસ નહાય તેના માટે બેહતર (ઉત્તમ) છે અને જે માણસ ગુસ્લ ન કરે, તો તેના ઉપર વાજિબ નથી.

હદ્દીસ-(૪૪) : ઈંબેમાજા હસન સનદથી ઈંબે અખ્ભાસ રદીયલ્લાણો અન્હોમાથી રિવાયત કરે છે, હુઝુર ફરમાવે છે કે તે દિવસને (જીમાને) અલ્લાહે મુસલમાનો માટે ઈંદ બનાવી તો જે માણસ જીમાની નમાજ માટે આવે તે નહાય અને જો ખુશભુ હોય તો લગાવે.

હદ્દીસ-(૪૫) : અહમદ તથા તિરમિઝી હસન સનદ સાથે બરાબર રદીયલ્લાણો અન્હોથી રિવાયત કરે છે કે હુઝુર ફરમાવે છે કે મુસલમાનો પર હક્ક છે કે, જીમાના દિવસે નહાય અને ઘરમાં ખુશ્બુ-સુગંધીહોય તેલગાવે અને જો ખુશભુ પ્રયાપ્ત ન હોય તો પાણી અર્થાત નહાવું ખુશભુનો બદલો છે.

હદ્દીસ-(૪૬ થી ૪૭) : તિબ્રાની કબીર તથા ઓસતમાં સિદ્ધાતે અકુબર તથા ઈંગ્રાન બિન હસીન રદીયલ્લાણો અન્હોથી રિવાયત કરે છે કે, હુઝુર ફરમાવે છે કે, જે માણસ જીમાના દિવસે નહાય તેનું ગુનાહ અને ભુલો મિટાવ્યું હેવામાં આવે છે. અને જ્યારે ચાલવું આરંભ કર્યું તો પ્રત્યેક કદમ પર વીસ (૨૦) નેકીઓ લખવામાં આવે છે. અને બીજી રિવાયતમાં છે કે દરેક કદમ પર વીસ (૨૦) વર્ષનો અમલ લખવામાં આવે છે અને જ્યારે નમાજથી ફારેગ થાય તો તેને બસો (૨૦૦) વર્ષના અમલનો અજર (બદલો) મળે છે.

હદ્દીસ-(૪૮) : તિબ્રાની કબીરમાં વિશ્વાસપાત્ર રિવાયત આધારે અબુ ઓમામા રદીયલ્લાણો અન્હોથી રિવાયત કરે છે કે હુઝુર ફરમાવે છે જીમાનું ગુસ્લ (નહાવું), વાળની જડોમાંથી ખતાઓ (સગીરા ગુનાહ) ખેંચી લે છે.

જીમાના દિવસે પ્રથમ જવાનો સવાબ અને

ગાઈન ફલાંગવા (ઓળંગવા) ની મનાઈ :

હદ્દીસ-(૪૯) : બુખારી, મુસ્લિમ, અબુ દાઉદ તિરમિઝી, માલિક, નિસાઈ તથા ઈંબે માજા અબુ હુરેરહ રદીયલ્લાણો અન્હોથી રિવાયત કરે છે હુઝુર સલ્લાહાણો અલયણે વસ્ત્લલમે ફરમાવ્યું જે માનવી જીમાના દિવસે ગુસ્લ કરે, જેવું કે જનાબાતનું ગુસ્લ પછી પ્રથમ સાચત (ધળી) માં જાય તો જાણે તેણે ઉટની કુરબાની કરી અને જે બીજી સાચત (ધળી) માં ગયો તેણે ગાયની કુરબાની કરી અને જે ત્રીજી ધળીમાં ગયો તેણે શાંગડાવાળા વેંટાની કુરબાની કરી અને ચોથી ધળીમાં ગયો તો જાણે તેણે મુરદી નેક કામમાં ખર્ચ કરી. અને જે માણસ પાંચમી ધળીમાં ગયો તો જાણે ઈંદું (નેક કામમાં) ખર્ચ કર્યું. પછી જ્યારે ઈમામ ખુલ્બા માટે નીકળ્યો, મલાએકા (ફરિશતાઓ) જિક સાંભળવા હાજર થઈ જાય છે.

હદ્દીસ-(૫૦ થી ૫૨) : બુખારી મુસ્લિમ તથા ઈંબે માજાની બીજી રિવાયત તેમનાથી જ છે. હુઝુર ફરમાવે છે. જ્યારે જીમાના દિવસ હોય છે ફરિશતા મસ્તિજ્જદના દરવાજા ઉપર ઉભા રહે છે અને હાજર થનારાઓના નામ લખે છે. સૌથી પહેલો પછી તેના પછી વાળો (તેના પછી એજ સવાબ જે ઉપરની રિવાયતમાં મજકુર થયા, ઉલ્લેખ કર્યો) પછી ઈમામ જ્યારે ખુલ્બા માટે નીકળ્યો ફરિશતાઓ પોતાના રજીસ્ટર લપેટી લે છે અને જિક સાંભળે છે. તેના જેવું જ સમારોહ બિન જીનુંબ તથા અબુ સઈદ ખુદરા રદીયલ્લાણો અન્હોમાંથી પણ રિવાયત છે.

હદ્દીસ-(૫૩) : ઈમામ અહમદ તથા તિબ્રાનીની રિવાયત અબુ ઓમામા રદીયલ્લાણો અન્હોથી છે કે, જ્યારે ઈમામ ખુલ્બા માટે નીકળે છે તો ફરિશતાઓ દફતર (રજીસ્ટર) વાળી લે છે. કોઈએ તેમને કહ્યું તો જે માણસ ઈમામના નીકળવા પછી આવે તેની જીમાના નમાજ થઈ નહીં ? આપે જવાબ આય્યો : હા, નમાજ તો થઈ પરંતુ તે રજીસ્ટરમાં લખવામાં આવી નહીં.

હદ્દીસ-(૫૪) : જે માણસ જીમાના દિવસે લોકોની ગાઈન ફલાંગે તેણે જહાનમની તરફ પુલ બનાવ્યો. આ હદ્દીસને તિરમિઝી તથા ઈંબે માજા, માજા

બિન અનસ, જુહનીથીતેઓ પોતાના વાલિદ (પિતા)થી રિવાયત કરે છે અને તિરમિઝી એ કહ્યું હદીસ ગરીબ છે અને સધળા ઈલમશાળીઓની નજરમાં તેના ઉપર જ અમલ છે.

હદીસ-(૫૫) : અહુમદ અબુડાઉદ તથા નિસાઈ અબુલ્લાલ બિન બસર રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે એક માનવી લોકોની ગઈનો ફલાંગતો આવ્યો એ હાલતમાં કે હુલુર ખુત્બો પઢી રહ્યા હતા. આપે ઈરશાદ ફરમાવ્યો (કહ્યું) : બેસી જા, તેં (લોકોને તકલીફ પહોંચાડી.)

હદીસ-(૫૬) : અબુ દાઉદ અમ્રબિન આસ રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુલુર ફરમાવે છે કે જુમ્મામાં ગ્રણ પ્રકારના લોકો હાજર થાય છે એક તે કે જે લગ્વ (વથ્થ) ની સાથે હાજર થયો (અર્થાત કોઈ ઐવું કામ કર્યું જેનાથી સવાબ થતો જતો રહ્યો દા.ત. ખુત્બાના સમયે વાત કરી અથવા કંકારીઓનો સ્પર્શ કર્યો) તો તેનો હિસ્સો જુમ્માથી એજલગ્વ છે. અને એક તે માણસ છે કે અલ્લાહથી દુઓ કરી તો જો ચાહે તો આપે અને ચાહે તો ન આપે. અને એક તે કે જે સુકૂત (મૌનતા) ની સાથે હાજર થયો, અને કોઈ મુસલમાનની ન ગઈન ફલાંગી ન કોઈને તકલીફ પહોંચાડી તો જુમ્મા તેના માટે આવતી જુમ્મા અને તે પછીના ગ્રણ દિવસો સુધીનો કફફારો (બદલો) છે.

જુમાના ફિકલી મસાઈલ :

જુમ્મા ફર્જ અયન છે. અને તેની ફરજિયત જોહરથી અધીક મોઅક્કદદ છે. તેનો મુનક્કિર કાફિર છે. (દુર્ભુખારવિગેરે)

મિસરની ઓળખ તથા અહેકામ (શહેરની ઓળખ)

મસાલા-(૪૪૨) : જુમ્મા પદવા માટે છ શર્તો છે. કે તે પૈકી એક શર્ત પણ વિલુપ્ત હોય તો જુમ્મા થશે જ નહીં.

(૧) મિસર (શહેર) અથવા ફનાએ મિસર :- મિસર તે સ્થળ છે જેમાં અનેક ગલીઓ અને બજાર હોય અને તે જલ્લો અથવા પરગણું હોય તેનાં સંબંધિત ગામડાઓ ગણવામાં આવતાં હોય, અને ત્યાં કોઈ હાકિમ (ઓફિસર) હોય કે પોતાના દબદબા તથા પ્રતાપના કારણો મજલુમનો ન્યાય

જાલિમ (અત્યાચારીથી) લઈ શકે, અર્થાત ઈન્સાફ પર કુદરત-શક્તિ ધરાવે છે. ભલે ને અન્યાય કરતો હોય અને બદલો ન લેતો હોય. મિસર (શહેર)ના આસપાસની જગ્યા જે મિસરની મસલેહતો માટે (જરૂરતો માટે) હોય, તેને “ફનાએ મિસર” કહે છે. જેવું કે કબ્રસ્તાન, રેસનું મેદાન, ફૌજના રહેઠાણની જગ્યા, કચેરીઓ, સેશનકે આ વસ્તુઓ શહેરથી બહાર હોય, તો “ફનાએ મિસર” માં તેમની ગણના છે. અને ત્યાં જુમ્મા જાઈજ છે. (ગુનીયા વિગેરે) માટે જુમ્મા શહેરમાં પદવામાં આવે કે, કસબામાં અથવા તેમની ફનામામાં. પરંતુ ગામડામાં જાઈજ નથી. (ગુનીયા)

મસમલા-(૪૪૩) : જે શહેર પર કુફફારનો કબજે થઈ ગયો ત્યાં પણ જુમ્મા જાઈજ છે. જ્યાં સુધી દારૂલ ઈસ્લામ રહે. (રદ્દુલ મુહતાર)

મસમલા-(૪૪૪) : મિસર માટે હાકિમનું ત્યાં રહેવું જરૂરી છે. જો દોરા (પેટ્રોલિંગ) ની રીતે ત્યાં આવી ગયો તો તે જગ્યા મિસર ન થશે, ત્યાં જુમ્મા કાયમ કરવામાં આવશે નહીં. (રદ્દુલ મુહતાર)

મસમલા-(૪૪૫) : જે સ્થળ શહેરની નિકટ છે, પરંતુ શહેરની જરૂરતો માટે ન હોય અને તેના અને શહેરની વચ્ચે બેતર વગેરે આંતરિકો હોય તો ત્યાં જુમ્મા જાઈજ નથી ભલે જુમ્માની અજાનનો અવાજ ત્યાં પહોંચતો હોય (આલમગરી), પરંતુ અકસર ઈમામો કહે છે કે જો અજાનનો અવાજ પહોંચતો હોય તો તે લોકો ઉપર જુમ્મા પદવું ફર્જ છે. બલ્કે કેટલાકોએ તો ફરમાવ્યું કે શહેરથી દુર જગ્યા હોય પરંતુ તકલીફ વગર પાછો જઈ શકે છે તો જુમ્મા પદવું ફર્જ છે. (દુર્ભુખતાર) માટે જે લોકો શહેરની નિકટના ગામમાં રહે છે તેમણે શહેરમાં આવી જુમ્માની નમાજ પઠવી જોઈએ.

મસમલા-(૪૪૬) : ગામડાનો રહેનાર શહેરમાં આવ્યો અને જુમ્માના દિવસે ત્યાં જ રહેવાનો ઈરાદો છે તો જુમ્મા ફર્જ છે અને એજ દિવસે પાછા જવાનો ઈરાદો હોય, જવાલથી પહેલાં અથવા પછી તો જુમ્મા ફર્જ નથી પરંતુ પઢેતો સવાબનો હકદાર છે. એવી જ રીતે મુસાફિર શહેરમાં આવ્યો અને ઈકામત (રહેવા)ની નિયત ન કરી, તો જુમ્મા ફર્જ નથી ગામડા વાળો જુમ્મા માટે શહેરમાં આવ્યો અને

કોઈ બીજું કામ પણ ધ્યેય છે તો આ ગ્રયાસ (અર્થાત જીમાના માટે આવવા) નો પણ સવાબ પામશે અને જીમાના પઠયો તો જીમાનો પણ

(રદ્દુલ મુહતાર, દુર્ભુખાર, આલમગીરી)
મસાલા-(૪૪૭) : હજજના દિવસોમાં મિનામાં

જીમાના પઠવામાં આવશે જ્યારે કે ખલીકા અથવા અમીરે હુજજાજ અર્થાત શરીરે મક્કા ત્યાં મોજુદ (હાજર) હોય. અમીરે મોસમ અર્થાત તે કે જે હાજુઓ માટે હાકિમ બનાવવામાં આવ્યો છે, તે જીમાના કાયમ કરી શકતો નથી. હજજ સિવાયના બીજા દિવસોમાં મિનામાં જીમાના થઈ શકતી નથી અને અરફાતમાં સર્વથા થઈ શકતી નથી. ન હજજના જમાનામાં ન બીજા દિવસોમાં.

(આલમગીરી)

મસાલા-(૪૪૮) : શહેરમાં અનેક જગ્યાઓએ જીમાના થઈ શકે છે. ભલે તે શહેર નાનું હોય કે મોટું અને જીમાના બે મસ્જિદોમાં હોય કે વધારે. (દુર્ભુખાર વિગેરે) પરંતુ વગર જરૂરતે વધારે જગ્યાએ જીમાના કાયમ કરવામાં ન આવે કે, જીમાના શાયાઈરે (ચિનન્હ) ઈસ્લામ પૈકી છે. અને જમાયતોને એકત્રિત કરનાર છે અને કેટલીએ મસિજદોમાં જવાથી તે ઈસ્લામી શૌકૃત બાકી રહેતી નથી, જે સમુહમાં-જથ્થામાં હોય છે. હાનિને દુર કરવા માટે પણ અનેક સ્થળોએ જોઈજ રાખવામાં આવ્યું છે, તો અમસ્તા જ જમાયત વિભેરવી અને મહોલ્યે મહોલ્યે જીમાના કાયમ કરવી જોઈએ નહીં. તદ ઉપરાંત એક બહુ જ જરૂરી અભ્ર (હુકમ) કે જેની પ્રત્યે અવામનું બિલકુલ ધ્યાન નથી, તે છે કે જીમાની નમાજને બીજી નમાજોની જેમ સમન્હ લીધી અને જેની ઈચ્છા થઈ પઢાવી લીધી આ નાજાઈજ છે. એટલા માટે કે જીમાના કાયમ કરવું ઈસ્લામી બાદશાહ અથવા તેના નાયબનું કામ છે, આનું બધાન આગળ આવે છે. જ્યાં સુધી હુકૂમત ન હોય ત્યાજે સૌથી મોટો સહીહ અકીદાવાળો સુની ફકીહ હોય તે શરીર અહકામ લાગુ કરવામાં સુલ્તાને ઈસ્લામના કાયમ મુકામ છે. જેથી એજ જીમાના કાયમ કરે, તેની ઈજાજત વગર જીમાના થઈ શકતી નથી. અને આ પણ ન હોય તો આમ

લોકો જેને ઈમામ બનાવે. આલિમ હોવા છતાં અવામ (લોકો) પોતાની રીતે કોઈને ઈમામ બનાવી શકતાનથી. ન એ થઈ શકે છે કે બેચાર માણસો કોઈને ઈમામ ઠેરવી લે. એવી જીમાના કયાંયથી પણ સાબિત નથી.

મસાલા-(૪૪૯) : “એહેતેયાતી ઝોહર” (કે જીમાના પછી ચાર રક્ખત નમાજ એ નિયતથી કે સૌથી પાછલી ઝોહર જેનો સમય પામ્યો અને પઢી નહીં) ખાસ લોકો માટે છે. જેમને જીમાના ફર્જ અદા થવામાં શંકા ન હોય. અને અવામ કે એહેતેયાતી ઝોહર પછે તો જીમાના અદા થવામાં તેમેને શંકા થશે. માટે તે ન પછે. અને તેની ચારે રક્ખતો ભરેલી પઠવામાં આવે. અને બેહતર એ છે કે જીમાની પાછલી ચાર સુન્નતો પઢીને એહેતેયાતી ઝોહર પછે. પછી બે સુન્નતો. અને આ છ સુન્નતોમાં સુન્નત સમયની નિયત કરે.

(આલમગીરી, સંગીરી, રદ્દુલ મુહતાર વિગેરે)

શર્ત બીજી-બાદશાહ ઈસ્લામ :

(૨) સુલ્તાને ઈસ્લામ અથવા તેનો નાયબ જેને જીમાના કાયમ કરવાનો હુકમ આપ્યો.

મસાલા-(૪૫૦) : સુલ્તાન આદિલ હોય કે આલિમ, જીમાના કાયમ કરી શકે છે એવી જ રીતે જો બળ જબરીએ બાદશાહ બની ગયો અર્થાત તેને શરઅન ઈમામતનો હક ન હોય દા.ત. કુરેશી ન હોય અથવા બીજી કોઈ શર્ત વિલુપ્ત હોય, તો પણ તે જીમાના સ્થાપિત કરી શકે છે. એવી જ રીતે જો સ્ત્રી બાદશાહ બની બેઠી તો તેના હુકમથી જીમાના કાયમ થશે. તે પોતે કાયમ કરી શકતી નથી.

(દુર્ભુખાર, રદ્દુલ મુહતાર વિગેરે)

મસાલા-(૪૫૧) : બાદશાહ જેને જીમાનાનો ઈમામ નિયુક્ત કરી દીધો તે બીજા પાસે પણ નમાજ પઢાવી શકે છે, ભલે તેને તેનો અધીકાર ન આપ્યો હોય કે બીજાથી પઢાવે.

(દુર્ભુખાર)

મસાલા-(૪૫૨) : જીમાના ઈમામની ઈજાજત (પરવાનગી) વગર કોઈએ જીમાના પઢાવી તેમાં જો ઈમામ અથવા તે બ્યક્ટિન જેના હુકમથી જીમાના કાયમ થાય છે શરીક થઈ ગયો તો જીમાના થશે. નહીં તો થશે નહીં.

(દુર્ભુખાર)

મસ્યલા-(૪૫૩) : હાડિમે શહરનો ઈન્જોકાલ થઈ ગયો અથવા ફિલ્ટરાના કારણે કયાંક ચાલ્યો ગયો અને તેના ખલીફા (ઉત્તરાધિકારી) અથવા ઈજાઝત આપેલ કાળીએ, જુમા કાયમ કર્યો તો જાઈ છે. (હુર્રે મુખ્તાર વિગેરે)

મસ્યલા-(૪૫૪) : જો કોઈ શહેરમાં બાદશાહે ઈસ્લામ વિગેરે જેના હુકમથી જુમા કાયમ થાય છે, ન હોય તો આમ (સામાન્ય) લોકો જેને ઈચ્છે ઈમામ બનાવી દે. એવી જ રીતે જો બાદશાહથી ઈજાઝત લઈ શકતાન હોય તો પણ કોઈને નિયુક્ત કરી શકે છે. (આલમગીરી, હુર્રે મુખ્તાર)

મસ્યલા-(૪૫૫) : હાડિમે શહેર, નાબાલિગ અથવા કાફિર છે. અને હવે તે નાબાલિગ બાલિગ થયો કાફિર મુસ્લિમાન થયો તો હવે જુમા કાયમ કરવાનો તેને હક નથી. અલબત્ત જો નવીન હુકમ તેના માટે આવ્યો અથવા બાદશાહે કહી દીધું હતું કે બાલિગ થવા અથવા ઈસ્લામ લાવ્યા પછી જુમા કાયમ કરવો તો કાયમ કરી શકે છે.

(આલમગીરી)

મસ્યલા-(૪૫૬) : ખુત્બાની ઈજાઝત, જુમાની ઈજાઝત છે. અને જુમાની ઈજાઝત ખુત્બાની ઈજાઝત છે. ભલેને કહી દીધું હોય કે ખુત્બો પઢે જો અને જુમા કાયમ કરશો નહીં. (આલમગીરી)

મસ્યલા-(૪૫૭) : બાદશાહ લોકોને જુમા કાયમ કરવાની મના કરી દે તો લોકો ખુદ કાયમ કરી લે, અને જો તેણે કોઈ શહેરની શહેરીયત બાતલ કરી દીધી તો લોકોને હવે જુમા પઢવાનો અધીકાર નથી. (રદ્દુલ મુહૃતાર) આતે સમયે છે કે બાદશાહે ઈસ્લામે શહેરીયત બાતિલ કરી હોય અને કાફિરે બાતિલ કરી તો જુમા પઢે.

મસ્યલા-(૪૫૮) : જુમાના ઈમામને બાદશાહે બરતરફ કરી દીધો તો જ્યાં સુધી બરતરફીનો પરવાનો (ઓર્ડર) ન આવે અથવા ખુદ બાદશાહ ન આવે, બરતરફ (પદભ્રષ્ટ) થશે નહીં.

(આલમગીરી)

મસ્યલા-(૪૫૯) : બાદશાહ પ્રવાસ કરીને પોતાના દેશના કોઈ શહેરમાં પહોંચ્યો તો ત્યાં જુમા ખુદ કાયમ કરી શકે છે. (આલમગીરી)

શર્ત ગ્રીજા-ઝોહરનો સમય :

(૩) ઝોહરનો સમય અર્થાત ઝોહરના સમયમાં નમાજ પુરી થઈ જાય તો નમાજ દરમિયાન જો કે તશહેર પછી અસરનો સમય આવી ગયો તો જુમા બાતિલ થઈ ગઈ. ઝોહરની કઝા પઢે.

(આમ્મતુલ ફુતુબ)

મસ્યલા-(૪૬૦) : મુકતદી નમાજમાં સુઈ ગયો હતો, આંખ તે વખતે ખુલી કે ઈમામે સલામ ફેરવી દીધી હતી તો જો સમય બાકી છે તો જુમા પુરી કરી લે. નહીં તો ઝોહરની કઝા પઢે અર્થાત નવી તહેરીમા બાંધી નમાજ પઢે (આલમગીરી વિગેરે) એવી જ રીતે જો એટલી ભિડ હતી કે રૂક્ખ તથા સુજુદ કરી શક્યો નહીં. ત્યાં સુધી કે ઈમામે સલામ ફેરવી દીધી તો તેમાં પણ એ જ હાલત છે (ઉપર મુજબ કરે) (હુર્રે મુખ્તાર)

ચોથી શર્ત-ખુત્બો :

મસ્યલા-(૪૬૧) : જુમાના ખુત્બામાં શર્ત છે કે (૧) સમયમાં થાય, (૨) નમાજ પહેલા થાય. (૩) એવી જમાઅત ના સામે થાય કે જે જુમા માટે શર્ત છે. અર્થાત ઓછામાં ઓછા ખતીબ સિવાય ત્રણ પુરુષો હોય. (૪) એટલા અવાજથી થાય કે પાસેના માણસો સાંભળી શકે જો કોઈ અવરોધક કાર્ય ન હોય તો જો જવાલથી અગાઉ ખુત્બો પઢી લીધો અથવા નમાજ પછી પઢ્યો અથવા એકલાએ પઢ્યો અથવા સ્ત્રીઓ તથા બાળકોની સામે પઢ્યો તો તે સથળી હાલતોમાં જુમા થઈ નહીં. અને જો બહેરાઓ અથવા સુઈ રહેનારા સામે પઢ્યો અથવા ઉપસ્થિત લોકો દૂર છે કે, ખુત્બો સાંભળતા નથી. અથવા મુસાફિર અથવા બીમારોની સામે પઢ્યો જે આકિલ-બાલિગ પુરુષ છે તો ખુત્બો થઈ જશે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહૃતાર)

મસ્યલા-(૪૬૨) : જિકે ઈલાહીનું નામ ખુત્બો છે. ભલે કેવળ એકવાર અલહમ્ડોલિલ્હાહ અથવા સુખ્દાનલ્હાહ અથવા લા ઈલાહા ઈલ્હલ્હાહ કહ્યું એટલા પ્રમાણમાં કહેવાથી ફર્જ અદા થઈ ગયું પરંતુ એટલા ઉપર જ સંતોષ માનવું મકરૂહ છે (હુર્રે મુખ્તાર)

મસ્યલા-(૪૬૩) : છીક આવી અને તેના માટે અલહમ્ડોલિલ્હાહ કહ્યું અથવા આશર્યની રીતે

સુભૂતાનલ્લાહ અથવા લા ઈલાહા ઈલ્લાહ કહું
તો ખુલ્લાનો ફર્જ અદા થયો નહીં. (હર્ષ મુખ્તાર)

મસાલા-(૪૬૪) : ખુલ્લાતથા નમાજમાં જો અધીક
ફાસલો (અંતર) થઈ જાય, તો તે ખુલ્લો કાફી
નથી. (હર્ષ મુખ્તાર)

મસાલા-(૪૬૫) : સુન્નત એ છે કે બે ખુલ્લા પછી
વામાં આવે અને મૌટા મૌટા ન હોય. જો બંને
મળીને સવિસ્તર લંબાણથી વધી જાય તો મકરૂહ
છે. ખાસ કરીને શાદીની મોસમમાં.

(હર્ષ મુખ્તાર, ગુનિયા)

મસાલા-(૪૬૬) : ખુલ્લામાં આ વસ્તુઓ સુન્નત
છે: (૧) ખતીબનું પાક હોવું (૨) ખતીબનું (ઉભા
થવું) (૩) ખુલ્લાથી પહેલા ખતીબનું બેસવું (૪)
ખતીબનું મિમ્બર પર હોવું (૫) શામે ઈન
(શ્રોતાઓ) તરફ મુખ કરવું. અને (૬) કિલ્લાતરફ
પીઠ કરવી અને બહેતર એ છે કે મિમ્બર મહેરાબની
ડાબી બાજુએ હોય. (૭) હાજરીનોનું ઈમામ પ્રત્યે
ધ્યાનિત થવું. (૮) ખુલ્લાથી પહેલા
'આઉઝોબિલ્લાહ' ધીમેથી પદવું. (૯) એટલા
ઉચ્ચા સ્વરે ખુલ્લો પદવું કે લોકો સાંભળે. (૧૦)
'અલહમ્દ' થી શરૂ કરવું. (૧૧) અલ્લાહની સના
(સુતિ) કરવું. (૧૨) અલ્લાહની વહદાનિયત (એ
એકલો છે) અને રસૂલુલ્લાહ સલ્લાલ્લાહો અલયહે
વસ્ત્વમની રિસાલતની શહાદત (સાક્ષી) આપવી.
(૧૩) હુઝુર પર હુરુદ મોકલવું. (૧૪) ઓછામાં
ઓછું એક આયતની તિલાવત કરવું. (૧૫) પ્રથમ
ખુલ્લામાં વઅજ તથા નસીહત હોવું. (૧૬) બીજા
ખુલ્લામાં હમ્દ તથા સના (સુતિ) તથા શહાદત
તથા હુરુદનું પુનરાવર્તન કરવું. (૧૭) બીજા
ખુલ્લામાં મુસલમાનો માટે દુલ્હા કરવું. (૧૮) બંને
ખુલ્લા હલકા હોવું. (૧૯) બંની વચ્ચે ત્રણ આયતં
જોટલું બેસવું. મુસ્તહબ એ છે કે બીજા ખુલ્લામાં
પહેલા ખુલ્લાની સરખામણીમાં અવાજ ધીમો હોય
અને ખુલ્લાએ રાશોટીન તથા હુઝુરના બંને કાકા
હજરત હમજા તથા હજરત અભ્યાસ રદીયલ્લાહો
અન્ધુમનો ઉલ્લેખ હોય. બેહતર એ છે કે બીજો
ખુલ્લો આવી રીતે શરૂ કરે:

"અહુમ્દો લિલ્લાહે નહિદોહું વ નસ્તાઈનોહું વ
નસ્તગફ્રોહું વ નૂ મેનોબેહી વ વ નતવક્કલો

અલેહે વ અઉઝો મિલ્લાહે મિન શોરુરે અનફોસેના
વ મિન સેયેઆતે અઅમાલેના મંચ-યહદિલ્લાહો
ફલામુદિલ્લાહુ વમંચ યુદ્ધિલિલ્લો ફલા હાદેય લહુ."
(તરજુમો : હમ્દ (સુતિ) છે અલ્લાહ માટે, અમે
તેની હમ્દ (ગુજરાત) કરીએ છીએ અને તેનાથી
મદદ માંગીએ છીએ. અને મગફીરત (મોક્ષ) ચાહીએ
છીએ અને તેના ઉપર ઈમાન લાવીએ છીએ અને
તેના ઉપર તવક્કુલ (ભરોસો) કરીએ છીએ અને
અલ્લાહની પનાહ (શરાઝ) માંગીએ છીએ, પોતાના
નક્સો (મન) ની બુરાઈઓથી અને ખુદાની પનાહ
માંગીએ છીએ. પોતાના આ'માલની બદીથી
જેને અલ્લાહ હિદાયત (સન્માર્ગ) કરે તેને કોઈ
ગુમરાહ (પથબ્રાહ) કરનાર નથી. અને જેને ગુમરાહ
કરે તેને હિદાયત કરનાર કોઈ નથી.)

પુરુષો જો ઈમામની સામે હોય, તો ઈમામની
તરફ મુખ કરે અને ડાબે જમણે હોય તો ઈમામની
તરફ ફરી જાય અને ઈમામની નિકટ હોવું અફ્જાલ
(ઉત્તમ) છે, પરંતુ એ જાઈજ નથી કે ઈમામથી
નિકટ થવા માટે લોકોની ગઈનો ફલાંગે, અલબત્ત
જો ઈમામ હજુ ખુલ્લા માટે ગયો નથી અને આગળ
જગ્યા બાકી છે તો આગળ જઈ શકે છે, અને ખુલ્લો
શરૂ થયા પછી મસ્જિદમાં આવ્યો તો મસ્જિદના
કિનારા પાસેજ બેસી જાય, ખુલ્લો સાંભળવાના
હાલતમાં બેઝાનું બેસે, જેવું નમાજમાં બેસીએ છીએ.

(આલમગીરી, હર્ષ મુખ્તાર, ગુનિયા વિગેરે)
મસાલા-(૪૬૭) : બાદશાહે ઈસ્લામની એવી પ્રશંસા
કરવી જે તેમનામાં ન હોય, હરામ છે. દા.ત. માલિકે
રેકાબુલ ઉમમ (ઉમતની ગરદનોનો માલિક) કે
આ કેવળ જુઠ અને હરામ છે. (હર્ષ મુખ્તાર)

મસાલા-(૪૬૮) : ખુલ્લામાં આયતન પદવું અથવા
બંને ખુલ્લાઓ વચ્ચે ન બેસવું અથવા ખુલ્લા
દરમિયાન વાત કરવું મકરૂહ છે. અલબત્ત જો ખતીબે
નેક વાતનો હુકમ કર્યો અને બુરી વાતથી મના કર્યુ,
તો તેને તેની મનાઈ નથી. (આલમગીરી)

મસાલા-(૪૬૯) : ગેરઅરબીમાં ખુલ્લો પદવું અથવા
અરબીની સાથે બીજી ભાષા ખુલ્લામાં બેળસેળ કરવું
સુન્નતે મુતવારેસા (પ્રણાલિકાગત ચાલતો આવતો
સારો તરીકો) ની વિરુદ્ધ છે, એવી જ રીતે ખુલ્લામાં
અશઆર (પંક્તિઓ) પણ ન પદવા જોઈએ. ભલે

અરબીના જ હોય. હા, બે એક શેઅર બોધ નસ્થિતના જો ક્યારેક પઢી દીધા તો વાંધો નથી.
(૫) જમાઅત અર્થાત ઈમામ ઉપરાંત ઓછામાં ઓછા ત્રણ પુરુષો હોવા જરૂરી છે.

મસ્ઝલા-(૪૭૦) : જો ત્રણ ગુલામ અથવા મુસાફર અથવા બીમાર અથવા મુંગા અથવા અનપઢ મુક્તદી હોય તો જુમ્મા થઈ જશે. અને જો કેવળ સ્ત્રીઓ અથવા બાળકો હોય તો જુમ્મા થશે નહીં.
(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

મસ્ઝલા-(૪૭૧) : ખુત્બાના સમયે જે લોકો હાજર હતા તે નાસી ગયા અને બીજા ત્રણ માણસો આવી ગયા તો તેમની સાથે ઈમામ જુમ્માની નમાજ પઢે. અર્થાત જુમ્માની જમાઅત માટે તે લોકોનું હાજર હોવું જરૂરી નથી જે ખૂત્બાના સમયે હાજર હતા, બલ્કે તે સિવાયના બીજાઓથી પણ જુમ્મા થઈ જશે.
(હુર્રુ મુહ્તાર)

મસ્ઝલા-(૪૭૨) : પહેલી રકાતનો સિજદો કરવા અગાઉ સૌ મુક્તદી નાસી ગયા અથવા કેવળ બે માણસો રહી ગયા તો જુમ્માં બાતિલ થઈ ગઈ મથાળેથી જોડરની નિયત બાંધે. અને જો સધળા નાસી ગયા પરંતુ ત્રણ પુરુષ બાકી છે. અથવા સિજદા પછી ભાગ્યા અથવા તહીમા પછી નાસી ગયા હતા પરંતુ પહેલી રુક્ખામાં આવીને શામિલ થઈ ગયા અથવા ખુત્બા પછી નાસી ગયા અને ઈમામે બીજા ત્રણ પુરુષો સાથે જુમ્મા પઢી તો આ સધળી હાલતોમાં જુમ્મા જાઈજ છે.
(હુર્રુ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ઝલા-(૪૭૩) : ઈમામે જ્યારે “અલ્લાહો અકબર” કહું તે વખતે મુક્તદી બાબુજુ હતા, પરંતુ તેમજો નિયત બાંધી નહીં, પછી આ સધળા બેબુજુ થઈ ગયા અને બીજા લોકો આવી ગયા અને આ લોકો ચાલ્યા ગયા તો જમાઅત થઈ ગઈ. અને જો તહરીમાના જ સમયે સૌ મુક્તદી બેબુજુ હતા પછી બીજા લોકો આવી ગયા તો ઈમામ આરંભથી જ તહરીમા બાંધે (ખાનિયા)

(૬) ઈજને આમ અર્થાત મસ્ઝિદનો દરવાજો ખોલી દેવામાં આવે કે જે મુસલમાનની ઈચ્છા થાય તે આવે. કોઈની રોક ટોક ન થાય. અને જો જામેઅ મસ્ઝિદમાં બધા લોકો ભેગા થઈ ગયા અને દરવાજો

બંધ કરીને જુમ્મા પઠાય તો જુમ્મા થઈ નહીં.
(આલમગીરી)

મસ્ઝલા-(૪૭૪) : બાદશાહે પોતાના ઘરમાં જુમ્મા પઢી અને દરવાજો ખોલી દીધા, લોકોને આવવાની આમ ઈજાત છે તો જુમ્મા થઈ ગઈ. લોકો આવે કે ન આવે અને દરવાજો બંધ કરીને પઢી અથવા દરબાનો (ચોકીદારો) ને બેસાડી દીધા કે લોકોને આવવા ન હે, તો જુમ્મા થઈ નહીં.
(આલમગીરી)

મસ્ઝલા-(૪૭૫) : સ્ત્રીઓને જો જામેઅ મસ્ઝિદમાંથી રોકવામાં આવે, ઈજને આમ (જાહેર પરવાનગી) વિરુદ્ધ થશે નહીં. કે તેમના આવવામાં ફિલાનો ડર છે.
(રદ્દુલ મુહ્તાર)

જુમ્મા વાજિબ થવાની શર્તો:

જુમ્મા વાજિબ થવા માટે અગ્રિયાર શર્તો છે. તે પૈકી એક પણ વિલુપ્ત થાય તો ફર્જ નથી, તે છિતાં જો પઢી તો નમાજ થઈ જશે, બલ્કે આકિલ-બાલિગ પુરુષ માટે જુમ્મા પદવું અફ્જલ છે. હા, સ્ત્રીનું મકાન જો મસ્ઝિદની લગ્નોલગ છે કે, ઘરમાં મરિઝિદના ઈમામની ઈક્તેદા કરી શકે છે તો તેના માટે પણ જુમ્મા અફ્જલ છે. અને નાબાલિગે જુમ્માં પઢી તો નિફલ છે. કે તેના ઉપર નમાજ ફર્જ જ નથી.
(હુર્રુ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

(૧) શહેરમાં મુક્તીમ હોવું
(૨) સેહત, અર્થાત દર્રી ઉપર જુમ્મા ફર્જ નથી. દર્રિથી મુરાદ તે બીમાર માણસ છે કે, જે મસ્ઝિદ સુધી જરૂર શકતો ન હોય અથવા ચાલ્યો તો જશે પરંતુ બિમારી વધી જશે અથવા બીમારી લંબાઈ જશે. લાંબા ગાળે સારો થશે (ગુનીયા) શેખે ફાની (વયોવૃદ્ધ-મૃત્યુ નજીક) બીમારીના હુકમમાં છે.
(હુર્રુ મુહ્તાર)

મસ્ઝલા-(૪૭૬) : જે માણસ બીમારની સારવાર કરનાર હોય અને જાણો છે કે, જો જુમ્માની નમાજ માટે જશે તો દર્રી મુશ્કેલીમાં મુકાઈ જશે અને તેની કોઈ ખબર લેનાર ન હશે તો તે સારવાર કરનાર પર જુમ્મા ફર્જ નથી.
(હુર્રુ મુહ્તાર વિગેરે)
(૩) આજાદ હોવું, ગુલામ પર જુમ્મા ફર્જ નથી અને તેનો માલિક તેને મના કરી શકે છે.
(આલમગીરી)

મસ્ફલા-(૪૭૭) : મકાતિબગુલામ (જેણે અમુક રકમ માલિકને આપવાથી આજાદ કરી દેવાનો કરાર કર્યો હોય તે) પર જુમ્મા વાજિબ છે. એવી જ રીતે જે ગુલામનો કેટલોક ભાગ આજાદ થઈ ગયો હોય, બાકી માટે પ્રયત્ન કરતો હોય અર્થાત બાકીની રકમ આજાદ થવા માટે કમાઈને પોતાના માલિકને આપતો હોય તેના ઉપર પણ જુમ્મા ફર્જ છે. (આલમગીરી, હુર્રે મુખ્તાર)

મસ્ફલા-(૪૭૮) : જે ગુલામને તેના માલિકે વેપાર કરવાની પરવાનગી આપી હોય અથવા તેના માથે કોઈ ખાસ માત્રાની રકમ કમાઈને લાવવાનું કેરવ્યું હોય તેના ઉપર જુમ્મા વાજિબ છે. (આલમગીરી)

મસ્ફલા-(૪૭૯) : માલિક પોતાના ગુલામ સાથે લઈને જુમ્મા મસ્ફિદે ગયો અને ગુલામને દરવાજા પર ઉભો રાખ્યો કે સવારીની રક્ષા કરે, તો જો જાનવરની રક્ષામાં ખલલ ન આવે તો જુમ્મા પડી લે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૪૮૦) : માલિકે ગુલામને જુમ્મા પઢવાની પરવાનગી આપી દીધી તો પણ જુમ્મા વાજિબ ન થઈ. અને માલિકની પરવાનગી વગર જો જુમ્મા અથવા ઈદની નમાજ પઢવા ગયો, અને જો જાણે છે કે માલિક નારાજ થશે નહીં, તો જાઈજ છે. નહીં તો જાઈજ નથી. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૪૮૧) : નોકર અને મજૂરને જુમ્મા પઢવાથી રોકી શકતા નથી. અલબત્ત જો જામેઅ મસ્ફિદ હુર છે તો જેટલું નુકશાન થયું છે તેની મજૂરીમાં ઓછુ કરી શકે છે. અને મજૂર તેની માંગણી પણ કરી શકતો નથી. (આલમગીરી)

(૪) મર્દ (પુરુષ) હોવું (૫) બાંદિગ હોવું (૬) આડિલ હોવું આ બંને શરતો ખાસ જુમ્મા માટે નથી, બલ્કે દરેક ઈબાદતના વુજુબ (વાજિબ થવા)માં અકલ તથા બુલેગ શર્ત છે. (૭) આંખો વાળું હોવું.

મસ્ફલા-(૪૮૨) : એક આંખવાળો અને જેની દ્વાચિ કમજોર હોય તેના ઉપર જુમ્મા ફર્જ છે. એવી જ રીતે જે આંખણો મસ્ફિદમાં અઝાનવેળા બા વુણુ હોય તેના ઉપર જુમ્મા ફર્જ છે, અને તે અંધજન જે પોતે જુમ્મા મસ્ફિદ સુધી વિના વાંધે

જઈ શકતો ન હોય, ભલે મસ્ફિદ સુધી કોઈ લઈ જનાર હોય. મહેનતાણું લઈને લઈ જાય કે વગર મહેનતાણે તેના ઉપર જુમ્મા ફર્જ નથી.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૪૮૩) : કેટલાક અંધજનો વિના વાંધે કોઈની સહાય વગર બજારો, માર્ગોમાં ચાલતા ફરે છે અને વગર પુછે કોઈ પણ મસ્ફિદમાં જઈ શકે છે તેમના ઉપર જુમ્મા ફર્જ છે. (રદ્દુલ મુહ્તાર)

(૮) ચાલવા માટે શક્તિમાન હોવું :

મસ્ફલા-(૪૮૪) : અપંગ પર જુમ્મા ફર્જ નથી ભલે કોઈ એવું હોય કે તેને ઉપાડી મસ્ફિદમાં મુકી આવશે

(રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૪૮૫) : જેનો એક પગ કપાઈ ગયો હોય અથવા લકવાથી બેકાર થઈ ગયો હોય, જો મસ્ફિદ સુધી જઈ શકતો હોય તો તેના ઉપર જુમ્મા ફર્જ છે. નહીં તો નહીં.

(હુર્રે મુખ્તારવિગેરે)

(૯) કેદમાંનહોવું, પરંતુ જ્યારેકે કોઈ દેણ (દેવા)ના કારણે કેદ કરવામાં આવ્યો અને માલદાર છે, અર્થાત અદા કરવા પર શક્તિમાન છે તો તેના ઉપર જુમ્મા ફર્જ છે.

(રદ્દુલ મુહ્તાર)

(૧૦) બાદશાહ અથવા ચોર વિગેરે કોઈ જાલિમનો ભયન હોવું. મુફ્લિસ કરજદારને જો કેદની આંશકા હોય તો તેના ઉપર જુમ્મા ફર્જ નથી.

(રદ્દુલ મુહ્તાર)

(૧૧) વરસાદ અથવા અંધકાર અથવા કરા (બરફવપણ) અથવા શર્દીનું ન હોવું અર્થાત એટલા પ્રમાણમાં કે તેનાથી નુકશાનનો સાચો ડર હોય.

મસ્ફલા-(૪૮૬) : જુમ્માની ઈમામત દરેક પુરુષ કરી શકે છે, જે બીજી નમાજોમાં ઈમામ થઈ શકતો હોય. જોકે તેના ઉપર જુમ્મા ફર્જ ન હોય, જેવું કે બીમાર, મુસાફિર, ગુલામ (હુર્રે મુખ્તાર) અર્થાત જ્યારેકે સુલતાને ઈસ્લામ અથવા તેનો નાયબ અથવા જેને તેણે ઈજાયત આપી, બીમાર હોય કે મુસાફિર અથવા ગુલામ અથવા કોઈ ઈમામાતને લાયક માણસને પરવાનગી આપી હોય અથવા જરૂરત વેળા આમ લોકોએ કોઈ એવા માણસને ઈમામ નિયુક્ત કર્યો હોય જે ઈમામાત કરી શકતો હોય. એમ નહીં કે પોતાની મેળે જેની ઈચ્છા થાય જુમ્મા

પઢાવી દે. આવી રીતે કરવાથી જુમ્મા થશે નહીં.
**શહેરમાં જુમ્માના દિવસે ઝોહર
પઢવાના મસાઈલ :**

મસખલા-(૪૮૭) : જેના ઉપર જુમ્મા ફર્જ છે તેણે શહેરમાં જુમ્મા થઈ ગયા પહેલા ઝોહર પઢવું મકડુણે તહરીમી છે. બલ્કે ઈમામ ઈન્દ્ર હુમામ રદીપલ્લાણો અન્હોએ ફરમાયું : હરામ છે અને ઝોહર પઢી લીધી તો પણ જુમ્મા માટે જુમ્મા ફર્જ છે. અને જુમ્મા થઈ ગયા પછી ઝોહર પઢવામાં કરાહત નથી. બલ્કે હવે ઝોહર જ પઢવું ફર્જ છે. જો જુમ્મા બીજી જગ્યાએ ન મળે તો, પરંતુ જુમ્મા તર્ક કરવાનો ગુનોહ તેના માથે રહ્યો.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસખલા-(૪૮૮) : તે માણસ કે જેણે જુમ્મા થવાથી પહેલા ઝોહરની નમાજ પઢી લીધી હતી, નાદિમ (લાન્જિજિત) થઈને ઘેરથી જુમ્માની નિયતથી નિકળ્યો, જો તે સમયે ઈમામ ન માજમાં હોય તો ઝોહરની નમાજ જતી રહી. જુમ્મા મળી જાય તો પઢી લે. નહીં તો ઝોહરની નમાજ ફરીથી પઢે. ભલે મસ્જિદ દુર હોવાના કારણે જુમ્મા ન મળી હોય.

(દુર્ભ મુખ્તાર)

મસખલા-(૪૮૯) : જામેઅ મસ્જિદમાં તે શખ્સ છે, જેણે ઝોહરની નમાજ પઢી લીધી છે અને જે જગ્યાએ નમાજ પઢી ત્યાં જ બેઠેલો છે તો જ્યાં સુધી જુમ્મા શરૂ ન કરે, ઝોહર બાતિલ નથી, અને જો જુમ્માના ઈરાદાથી ત્યાંથી હઠ્યો તો બાતિલ થઈ ગઈ.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસખલા-(૪૯૦) : તે માણસ જો મકનમાંથી નિકળ્યો જ નથી અથવા કોઈ બીજી જરૂરતથી નિકળ્યો અથવા ઈમામના ફારેગ થવાના સમયે અથવા ફારેગ થયા પછી નિકળ્યો અથવા તે દિવસે જુમ્મા પઢવામાં જ ન આવી અથવા લોકોએ જુમ્મા પઢવું તો શરૂ કર્યું હતું પરંતુ કોઈ દુર્ઘટનાના કારણે પુરી ન કરી શક્યા તો આ સધળી છાલતોમાં ઝોહર બાતલ નથી.

(આલમગીરી વિગેરે)

મસખલા-(૪૯૧) : જે છાલતોમાં ઝોહર બાતલ થવું કહેવામાં આવ્યું, તેનો ભાવાર્થ, ફર્જ જતા રહેવું છે કે, તે નમાજ હવે નિફલ થઈ ગઈ.

(દુર્ભ મુખ્તાર)

મસખલા-(૪૯૨) : જેના ઉપર જુમ્મા ફર્જ હતી તેણે ઝોહરની નમાજમાં ઈમામત કરો, પછી જુમ્મા માટે નિકળ્યો તો તેની ઝોહર બાતિલ છે, પરંતુ મુકતદીઓમાંથી જે જુમ્મા માટે નિકળ્યો તેના ફર્જ બાતિલ થયા નહીં.

(દુર્ભ મુખ્તાર)

મસખલા-(૪૯૩) : જેના .પર કોઈ ઉજરના કારણે જુમ્મા ફર્જ ન હોય તે જો ઝોહર પઢી જુમ્મા માટે નિકળ્યો તો તેની નમાજ પણ જતી રહી. તે શર્તો સાથે કે ઉપર મજકુર થઈ.

(દુર્ભ મુખ્તાર)

મસખલા-(૪૯૪) : બીમાર અથવા મુસાફિર અથવા કેદી અથવા કોઈ બીજો કે જેના ઉપર જુમ્મા ફર્જ નથી તે લોકોને પણ જુમ્માના દિવસે શહેરમાં જમાઅત સાથે ઝોહર પઢવી મકડુણે તહરીમી છે, ભલે જુમ્માની નમાજ થવાથી પહેલાં જમાઅત કરે, કે બાદમાં, એવી જ રીતે જેમને જુમ્માની નમાજ ન મળી તે પણ અજાન તથા ઈકામત વગર ઝોહરની નમાજ એકલા પઢે. તેમના માટે પણ જમાઅત મના છે.

(દુર્ભ મુખ્તાર)

મસખલા-(૪૯૫) : ઉભ્યા ફરમાવેછે : જે મસ્જિદોમાં જુમ્મા થતી નથી તેમને જુમ્માના દિવસે ઝોહરના સમયે બંધ રાખો.

(દુર્ભ મુખ્તાર)

મસખલા-(૪૯૬) : ગામડામાં જુમ્માના દિવસે પણ ઝોહરની નમાજ અજાન તથા ઈકામત સાથે બા જમાઅત પઢો.

(આલમગીરી)

મસખલા-(૪૯૭) : મા'સુર (વિવશ) જો જુમ્માના દિવસે ઝોહર પઢે તો મુસ્તહબ એ છે કે, જુમ્માની નમાજ થઈ ગયા પછી પઢે અને વિલંબ નાં કર્યો તો મકરૂહ છે.

(દુર્ભ મુખ્તાર)

મસખલા-(૪૯૮) : જેણે જુમ્માનો કાઅદો મેળવી લીધો અથવા સહવનો સિજદા પછી શર્દીક થયો, તેને જુમ્મા મળી ગઈ. માટે પોતાની બેજ રકાતો પૂરી કરે.

(આલમગીરી વિગેરે)

મસખલા-(૪૯૯) : જુમ્માની નમાજ માટે વહેલા જવું, મિસ્વાક કરવું, સારા અને સફેદ કપડાં પહેરવા તેલ અને ખુશુલગાડવું અને પહેલી સફમાં બેસંબું મુસ્તહબ છે. અને ગુસ્લ સુન્ત છે.

(આલમગીરી, ગુનીયા)

ખુત્બાના કેટલાક બીજા મસાઈલ :

મસાલા-(૫૦૦) : જ્યારે ઈમામ ખુત્બા માટે ઉભો થાય તે સમયથી લઈને ખત્મે નમાજ સુધી નમાજ તથા જિકો અને દરેક પ્રકારની વાતચીત મના છે. અલબત્ત તરતીબશાળી મોતાની કાં નમાજ પઢી લે. એવી જ રીતે જે શાખ સુન્નત અથવા નિઝલ પઢી રહ્યો છે જલ્દી જલ્દી પુરી કરી લે.

મસાલા-(૫૦૧) : જે વસ્તુઓ નમાજમાં હરામ છે. દા.ત. ખાવું-પીવું, સલામ તથા જવાબ વિગેરેઆ સધણું ખુત્બાની હાલતમાં પણ હરામ છે. ત્યાં સુધી કે અન્ન બિલ મારુક(નેક કામોનો હુકમ) પણ, હા, ખતીબ, “અન્ન બિન અરુફ” કરી શકે છે. જ્યારે ખુત્બો પઢેછે ત્યારે સહધા હાજરીન (ઉપસ્થિતો) પર સાંભળવું અને ચુપ રહેવું ફરજ છે. જે લોકો ઈમામ થી દુર હોય કે ખુત્બાનો અવાજ તેમના સુધી પહોંચતો નથી તેમણે પણ ચુપ રહેવું વાજિબ છે. જો કોઈને બુરી (ખરાબ) વાત કરતાં દેખે, તો હાથ અથવા માથાના ઈશારાથી મના કરી શકે છે. જબાનથી નાજાઈ છે. (હુર્રે મુહ્તાર)

મસાલા-(૫૦૨) : ખુત્બો સાંભળવાની હાલતમાં જોયું કોઈ આંધળો કુવામાં પડી રહ્યો છે, અથવા કોઈને વિદ્ધુ વગેરે કરડવા જાય છે, તો જીભથી કહી શકે છે. જો ઈશારાથી અથવા દબાવવાથી બતાવી શકો તો આ હાલતમાં પણ જીભથી કહેવાની ઈજાજત નથી. (હુર્રે મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૫૦૩) : ખતીબે મુસલમાનો માટે દુઃખ કરીનો સામેઠન (શ્રોતાઓ) ને હાથ (ઉદાવવું) અથવા આમીન કહેવું મના છે. કરશે તો ગુનાછ થશે. ખુત્બામાં દુરુદ શરીફ પઢતી વખતે ખતીબનું જમણી-ડાબી બાજુ મુખ ફેરવવું બિદઅત છે.

(રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૫૦૪) : હુતુરે-અકદસ સલ્લલલ્હાહો અલયહે વસ્ત્લ્લમનું નામે પાક ખતીબે લીધું તો હાજેરીન દિલમાં દુરુદ શરીફ પઢે, જીભથી પઢવાની તે સમયે ઈજાજત નથી. એવી જ રીતે સહાબાએ કિરામના જિક પર તે વખતે ‘રદ્દિયલ્લાહો અન્હુમ’ જબાનથી કહેવાની ઈજાજત નથી. (હુર્રે મુહ્તાર, વિગેરે)

મસાલા-(૫૦૫) : જુમ્માના ખુત્બા ઉપરાંત બીજા ખુત્બાઓનું સાંભળવું પણ વાજિબ છે. દા.ત. ઈટેન તથા નિકાહ વિગેરેના ખુત્બા. (હુર્રે મુહ્તાર)

મસાલા-(૫૦૬) : પ્રથમ અજાન થતાં જ સર્હી (કોશીશ) વાજિબ છે. અને વેપાર વિગેરે કે ‘સર્હી’ ના વિરુદ્ધ હોય ત્યા દેવું વાજિબ છે. ત્યાં સુધી કે રસ્તામાં ચાલતા જો ખરીદ-વેચાડા કર્યું તો તે પણ ના જાઈય છે. અને મસ્ઝિદમાં ખરીદ-વેચાડા તો સખત ગુનોહ છે. અને ખાણું ખાઈ રહ્યો હતો કે જુમ્માની અજાનનો અવાજ આવ્યો તો જો એ આશંકા હોય કે, ખાણું પાશે તો જુમ્માની નમાજ છુટી જશે તો ખાણું છોડી દે, અને જુમ્માની નમાજ પઢવા માટે જાય જુમ્મા માટે ઈતમીનાન તથા વકાર સાથે જાય. (આલમગીરી, હુર્રે મુહ્તાર)

મસાલા-(૫૦૭) : ખતીબ જ્યારે મિભર પર બેસે તો તેની સામે ફરીથી બીજીવાર અજાન પઢવામાં આવે (મતુન) આ અમો આગળ બયાન કરી ગયા છીએ, કે, સામેનો અર્થ એનથી કે, મસ્ઝિદની અંદર મિભરની નજિક થઈને મસ્ઝિદની અંદર અજાન પઢવામાં આવે. બલ્કે મસ્ઝિદની અંદર અજાન પઢવાને કુકદાએ કિરામ મકરૂહ ફરમાવે છે.

મસાલા-(૫૦૮) : અકસર જગ્યાઓએ દેખવામાં આવ્યું છે કે, “અજાને સાની” ધીમા અવાજથી કહે છે. આમ ન કરવું જોઈએ, બલ્કે તેને પણ બુલંદ અવાજથી પઢે. કે તેનાથી પણ એવાન કરવું મકરૂહ છે. અને જેણે પહેલા ન સાંભળી હોય તેને સાંભળીને હાજર થાય. (બહર વિગેરે)

મસાલા-(૫૦૯) : ખુત્બો ખતમ થઈ જાય તો તુરત જ ઈકામત કહેવામાં આવે. ખુત્બા તથા ઈકામત દરમિયાન દુનિયાની વાતો કરવું મકરૂહ છે.

(હુર્રે મુહ્તાર)

મસાલા-(૫૧૦) : જેણે ખુત્બો પઢ્યો એ જ નમાજ પઢાવે, બીજો ન પઢાવે. અને જો બીજાએ નમાજ પઢાવી દીધી તો પણ નમાજ થઈ જશે, જ્યારે કે તેને ઈજાજત મળેલી હોય એવી જ રીતે જો નાબાલિગે બાદશાહના હુકમથી ખુત્બો પઢ્યો. અને બાલિગે નમાજ પઢાવી તો જાઈ છે.

(હુર્રે મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્યલા-(૫૧૧) : જીમ્બાની નમાજમાં બહેતર એ છે કે પહેલી રકાતમાં ‘સૂરાએ જુમ્મા’ અને બીજી રકાતમાં ‘સુરાએ મુનાફેકુન’ અથવા પહેલીમાં ‘સબ્બેહિસ્મ’ અને બીજીમાં ‘હલ અતાકા’ પઢે, પરંતુ હંમેશા તેમને જન પઢે, કયારેક બીજી સુરતો પણ પઢે. (રદ્દુલ મુહ્તાર)

મસ્યલા-(૫૧૨) : જીમ્બાના દિવસે જો પ્રવાસ કર્યો અને જવાલથી પહેલા શહેરની આબાદીથી બહાર નીકળી ગયો તો વાંધો નથી. નહીં નો મમનૂંઅ (મનાઈ) છે. (દુર્રુતુર વિગેરે)

મસ્યલા-(૫૧૩) : હજામત બનાવવું નખ કાપવા જીમ્બાની નમાજ પછી અફઝલ છે. (દુર્રુતુર)

મસ્યલા-(૫૧૪) : સવાલ કરનાર જો નમાજીઓની આગળથી પસાર થતો હોય અથવા ગઈનો ફલાંગતો હોય અથવા વગર જરૂરતે માંગતો હોય તો સવાલ પણ નાજાઈજ છે, અને એવા સાઈલ (મિક્ષુક) ને આપવું પણ નાજાઈજ છે. (રદ્દુલ મુહ્તાર). ‘બલ્કે મસ્ઝિદમાં પોતાના માટે સર્વથા સવાલની ઈજાજત નથી.’ (પોતાની જાત સિવાય દા. ત. મદ્રસા, મસ્ઝિદ વિગેરે માટે ચંદાની ટહેલ નાંખવામાં આવે તો તેમાં વાંધો નથી અનુ.)

જીમ્બાના દિવસ તથા રાતના

કેટલાક અચમાલ :

મસ્યલા-(૫૧૫) : જીમ્બાના દિવસ તથા રાતમાં સુરાએ કહેફની તિલાવત અફઝલ છે અને અધિક બુઝુંગી રાતમાં પઠવાની છે. નિસાઈતથા બયહડી, સહીહ સનદ્ધી અબૂ સઈટ પુદરી રદ્દુલલાહો અન્ધોથી રિવાયત કરે છે કે જે માણસ જીમ્બાની રાતમાં સુરાએ કહેફ પઢે તેના માટે ત્યાંથી કા ‘બા સુધી નુર રોશન થશે. અને અબૂબક ઈબ્ને મરવીયહની રિવાયત ઈબ્ને ઉમર રદ્દુલલાહો અન્ધોમાથી છે કે હુલુર ફરમાવે છે કે, જીમ્બાના દિવસે સુરાએ કહેફ પઢે તેના કદમથી આસમાન સુધી નુર બુલંદ થશે. જે કિયામતમાં તેના માટે રોશન થશે. અને બે જીમ્બાઓની વચ્ચે જે ગુનાહ થયા છે તે બખ્સી દેવામાં આવશે.

આ હદીસની સનદોમાં કાંઈ વાંધો નથી. ‘હામિમ અદ્વોભાન’ પઠવાની પણ ફગીલત આવી છે. તિબ્રાની અબુ ઓમામા રદ્દુલલાહો અન્ધોથી રિવાયત કરી કે, હુલુરે ફરમાવું જે શાસ જીમ્બાના દિવસે અથવા રાત્રે ‘હામિમ અદ્વોભાન’ ની સુરત પઢે તેના માટે અલ્લાહ તાસાલા જન્નતમાં ઘર બનાવશે અને અબૂ હુરરાહ રદ્દુલલાહો અન્ધોથી મરવી છે કે, તેની મગફેરત થઈ જશે. અને એક રિવાયતમાં છે કે જે માણસ કોઈ રાતમાં ‘હામિમ અદ્વોભાન’ ની સુરત પઢે, તેના માટે (૭૦) સ્થિતેર હજાર ફરિશતા ઈસ્તિગફાર કરશે. જીમ્બાના દિવસે અથવા રાત્રે જે માણસ સુરાએ યાસીન પઢે, તેની મગફેરત થઈ જાય.

ફાયદો : જીમ્બાના દિવસે રૂહો (આત્માઓ) ભેગી થાય છે માટે તેમાં જિયારતે કુબૂર (કબ્રોની જિયારત) કરવી જાઈએ. અને તે દિવસે જહનમ ભળકાવવામાં આવતી નથી. (દુર્રુતુર)

ઇદેનનું બચાન :

(ઈદુલ ફિત્ર અને ઈટ અદહા)

અલ્લાહ અઝા વ જલ્લ ફરમાવે છે :- “વ લે તુકમેલુદ્દીતદ્વત વ લે તોકબ્બે રૂલ્લાહ અલા માહદુકુમ”

અર્થ : રોજાઓની ગણતરી પૂરી કરો અને અલ્લાહની મોટાઈ બોલો કે તેણ તેમને હિદાયત ફરમાવી. અને ફરમાવે છે:

“ફસ્સલે લે રબ્બેકા વન્હર”

અર્થ : પોતાના રબ્બ માટે નમાજ પઢ અને કુરબાની કરો

હદીસ (૧) : ઈબ્ને માજા અબૂ અમામા રદ્દુલલાહો અન્ધોથી રિવાયત કરે છે રસુલુલ્લાહ સલ્લાલ્લાહો અલયથે વસલ્લમ ફરમાવે છે કે જે માણસ ઈન્ટન (ઈદુલ ફિત્ર તથા ઈટ અદહા) ની રાતોમાં કિયામ કરે તેનું દિલ ન મરશે કે જે દિવસે લોકોનું દિલ મરશે. (કિયામ એટલે નિફલ નમાજો પછવું અનુ.)

હદીસ (૨) : અરબ્બાની માજા બિન જબલ રદ્દુલલાહો અન્ધોથી રિવાયત કરે છે કે, હંજુર ફરમાવે છે કે માણસ પાંચ રાતોમાં શબદેદાર (રાત જાગરણ) કરે તો તેના માટે જન્નત વાજીબ છે. તે

રાતો આ છે. જિલહિજ્જાની આઠવી નવમી દસવી રાતો અને ઈદુલફિત્રની રાત અને શાખાનાની પંદરવી રાત અર્થાત શબેબરાત.

હદ્દીસ (૩) : અબુ દાઉદ અનસ રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુસુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ જ્યારે મદીનામાં પધાર્યા તે જમાનામાં મદીનાવાસીઓ વર્પમાં બે દિવસ ખુશી મનાવતા હતા. (મહેરગાન તથા નવ રોજ) આપે ફરમાવ્યું; આ ક્યા દિવસો છે? લોકોએ અર્જ કરી. જાહેરિયતમાં અમો આ દિવસોમાં ખુશી મનાવતા હતા. આપે ફરમાવ્યું અલ્લાહ તાલાએ તેમના બદલામાં તેનાથી શ્રેષ્ઠ બે દિવસ તમને આપ્યા (૧) ઈદ અદહા અને. (૨) ઈદુલ ફિત્રનો દિવસ.

હદ્દીસ (૪-૫) : તિરમિજી, ઈબ્ને માજા તથા દારોમી ખુરયદા રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હુસુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ઈદુલ ફિત્રના દિવસે કાંઈક ખાઈન ઈદની નમાજ માટે તશરીફ લઈ જતા અને ઈદઅદહાના દિવસે કાંઈ ખાતા નહિ જ્યાં સુધી કે ઈદની નમાજ ન પઢી લેતા. અને બુખારીની રિવાયત અનસ રદ્દિયલ્લાહો અન્હોથી છે કે ઈદુલ ફિત્રના દિવસે જ્યાં સુધી થોડીક ખજૂર ન ખાઈ લેતા ત્યાં સુધી નમાજ માટે ન જતા અને આ તાક (એકી સંખ્યા) હોતી.

હદ્દીસ (૬) : તિરમિજી તથા દારોમીએ અબુ હુરેરહ રદ્દિયલ્લાહો અન્હોથી રિવાયત કરી કે ઈદની નમાજ માટે એક રસ્તાથી તશરીફ લઈ જતા અને બીજા રસ્તાથી પાછા આવતા.

હદ્દીસ (૭) : અબુ દાઉદ તથા ઈબ્ને માજાની રિવાયત તેમનાથી જ છે કે એક વખતે ઈદના દિવસે વરસાદ થયો તો હુસુરે ઈદની નમાજ મસ્ઝિદમાં પઢી.

હદ્દીસ (૮) : સહીહયનમાં ઈબ્ને અખ્બાસ રદ્દિયલ્લાહો અન્હોમાથી રિવાયત છે કે હુસુરે ઈદની નમાજ બે રકાત પઢી. તેના પહેલા કે પછી કોઈ નમાજ ન પઢી.

હદ્દીસ (૯) : સહીહ મુસ્લિમ શરીફમાં છે જાખીર

બિન સમોરહ રદ્દિયલ્લાહો અન્હો કહે છે કે મેં હુસુરની સાથે ઈદની નમાજ પઢી, એક બે વાર નહિ (બલ્કે અનેકવાર) ન અજાન થઈ ન ઈકામત.

ફિક્હી મસાઈલ

ઇદનાની નમાજ વાજિબ છે, પરંતુ સૌના ઉપર નહીં. બલ્કે તેમના ઉપર જ જેમના ઉપર જુમ્મા વાજિબ છે. અને તેની અદાયગીની એજ શર્તો છે જે જુમ્મા માટે છે. કેવળ એટલો તફાવત છે કે જુમ્મામાં ખુલ્બો શર્ત છે અને ઈદનમાં ખુલ્બો સુન્નત. જો જુમ્મામાં ખુલ્બો ન પઢ્યો તો જુમ્મા થઈ નહીં. અને આમાં (ઇદનમાં) ન પઢ્યો તો નમાજ થઈ ગઈ, પરંતુ ખોટું કર્યું. બીજો તફાવત એ છે કે જુમ્માનો ખુલ્બો નમાજથી પહેલાં છે અને ઈદનનો ખુલ્બો નમાજ પછી છે, જો પહેલા પઢી લીધો તો ખરાબ કર્યું પરંતુ નમાજ થઈ ગઈ, લોટાવવામાં આવશે નહીં. અને ખુલ્બાનું પણ પુનરાવર્તન નથી. અને ઈદનમાં ન અજાન છે ન ઈકામત, કેવળ બે વખત એટલું કહેવાની ઈજાત છે, “અસ્સલાતો જામેઅતુન” (આલમગીરી દુર્ઘતાર વિગેર) વગર કારણે ઈદની નમાજ છોડવું ગુમરાહી તથા બિદાત છે. (જોહેરે નેયરહ)

મસ્ખલા-(૫૧૫) : જામડામાં ઈદનાની નમાજ પઢ વું મકરૂહે તહરીમી છે. (દુર્ઘતાર)

ઇદના દિવસના મુસ્તાહબો :

મસ્ખલા-(૫૧૬) : ઇદના દિવસ આ કાર્યો મુસ્તાહબ છે. (૧) હજામત બનાવવું (૨) નખ કાપવા (૩) ગુસ્લ કરવું (૪) મિસ્વાક કરવું (૫) સારા કપડાં પહેલા (નવા હોય તો નવા, નહીં તો ધોયેલા) (૬) અંગુઠી (વિટી) પહેરવું (૭) ખુશ્બુ લગાવવું (૮) સવારની નમાજ મહોલ્લાની મસ્ઝિદમાં પઢવું (૯) ઈદગાહ જલ્દી ચાલ્યા જવું (૧૦) નમાજથી પહેલા સંદકએ ફિત્ર અદા કરવું (૧૧) ઈદગાહે પગપાળા જવું (૧૨) બીજા રસ્તાથી પાછા આવવું (૧૩) નમાજ પઢવા જવાથી પહેલા થોડીક ખજૂરો ખાઈ લેવું. ત્રણ પાંચ, સાત અથવા ઓછાવત્તુ પરંતુ એકી હોય. ખજૂરો ન હોય તો કોઈ મીઠી ચીજ ખાઈ લે, નમાજથી પહેલા કાંઈ ન ખાંધું હોય તો ગુનેહગાર થયો નહીં, પરંતુ ઈશા સુધી ન ખાંધું તો

એતાબ (પ્રકોપ) કરવામાં આવશે.

(કુતુખે કસીરહ)

મસ્ફુલા-(૫૧૭) : સવારી ઉપર જવામાં પણ વાંધો નથી પરંતુ જેનામાં પગપાળા જવાની શક્તિ હોય તેના માટે પેદલ જવું અફઝલ છે. અને પાછા ફરવામાં સવારી પર આવવામાં વાંધો નથી.

(જોહરહ, આવભગીરિ)

મસ્ફુલા-(૫૧૮) : ઈદગાહે નમાજ માટે જવું સુન્નત છે ભલે મસ્જિદમાં ગુંજાઈશ હોય અને ઈદગાહમાં મિઅર બનાવવા અથવા મિઅર લઈ જવામાં વાંધો નથી. (રદ્દુલ મુહિતાર વિગેરે)

મસ્ફુલા-(૫૧૯) : (૧૪) ખુશી જાહેર કરવું (૧૫) કસરતથી (બહુ પ્રમાણમાં) સદકો આપવું (૧૬) ઈદગાહે ઈતમેનાન તથા વકાર અને નીચી નજરોએ જવું (૧૭) પરસ્પર મુખારકબાદ દેવું મુસ્તહબ છે અને રસ્તામાં બુલંદ અવાજથી તકબીર ન કરે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહિતાર)

મસ્ફુલા-(૫૨૦) : ઈદની નમાજથી પહેલા નિફલ નમાજ સર્વથા મકરૂહ છે, ઈદગાહમાં હોય કે ઘરમાં તેના ઉપર ઈદની નમાજ વાજિબ હોય કે ન હોય, ત્યાં સુધી કે સ્ત્રી જો ચાસ્તની નમાજ ઘરમાં પઢવા હીચું તો ઈદની નમાજ થઈ ગયા પછી પઢે અને ઈદની નમાજ પછી ઈદગાહમાં નિફલ નમાજ પઢવું મકરૂહ છે. ઘરમાં પઢી શકે છે. બલ્કે મુસ્તહબથી કે ચાર રકાતો પઢે. આ અહેકામ ખાસ લોકો માટે છે. અવામ જો નિફલ નમાજ પઢે જો કે ઈદની નમાજથી પહેલાં, જો કે ઈદગાહમાં તો તેમને મના કરવામાં ન આવે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહિતાર)

મસ્ફુલા-(૫૨૧) : ઈદની નમાજનો સમય, એક નેતા બરાબર સૂરજ બુલંડ થવાથી શરદી મધ્યાહન સુધી છે, પરંતુ ઈદુલ ફિત્રમાં વાર કરવું અને ઈદ અદહામાં જલ્દી પઢી લેવું મુસ્તહબ છે. અને સલામ ફેરવવાથી પહેલા જવાલ થઈ ગયો તો નમાજ જતી રહી. (હુર્રે મુખ્તાર વિગેરે) જવાલથી મુરાદ શરદી મધ્યાહન છે જેનું વર્ણન “બાબુલ અવકાત” (સમય પ્રકરણ) માં થઈ ગયું છે.

ઈદની નમાજની તરકીબ : -

ઈદની નમાજનો તરીકો એ છે કે બે રકાત વાજિબ ઈદુલ ફિત્રની અથવા ઈદ અદહાની નિયત કરીને કાનો સુધી હાથ ઉઠાવીને “અલ્લાહો અકબર” કહીને હાથ બાંધી લે. પછી સના પઢે પછી કાનો સુધી ઉઠાવે અને અલ્લાહો અકબર કહેતા હાથ છોડી દે, પછી હાથ ઉઠાવે અને અલ્લાહો અકબર કહીને હાથ છોડી દે, પછી હાથ ઉઠાવે અને અલ્લાહો અકબર કહીને હાથ બાંધી લે. અર્થાત પહેલી તકબીરમાં હાથ બાંધે તેના પછી બે તકબીરોમાં હાથ લટકાવે પછી ચોથી તકબીરમાં બાંધી લે. તેને આવી રીતે યાદ રાખે કે, જ્યાં તકબીર પછી કાંઈ પઢવું છે ત્યાં હાથ બાંધી લેવામાં આવે અને જ્યાં પઢવું નથી ત્યાં હાથ છોડી દેવામાં આવે. પછી ઈમામ અઉઝો અને બિસિમ્બાઓ ધીમેથી પઢીને જહર સાથે (આવાજથી) અલહામ્દો અને બીજી સુરત પઢે, પછી રૂકુઅ કરે અને બીજી રકાતમાં પહેલાં અલહામ્દો તથા કોઈ સુરત પઢે, પછી ત્રણ વખત કાનો સુધી હાથ લઈ જઈને ‘અલ્લાહો અકબર’ કહે અને હાથ બાંધે નહીં. અને ચોથી વાર હાથ ઉઠાવ્યા વગર અલ્લાહો અકબર કહેતાં રૂકુઅમાં જાય.

આનાથી માલુમ પડી ગયું કે, ઈદૈનમાં વધારાની તકબીરો છ (૬) થઈ. ત્રણ પહેલી રકાતમાં ડિરાતથી પહેલાં અને તકબીરે તહરીમા પછી અને ત્રણ બીજમાં ડિરાત પછી અને તકબીરે રૂકુઅથી પહેલાં અને આ છ (૬) એ તકબીરોમાં હાથ ઉઠાવવામાં આવશે. અને દરેક બે તકબીરોની વચ્ચે ત્રણ તસ્ખીછ જેટલું શકતો (વિલંબ) કરે અને ઈદૈનમાં મુસ્તહબ એ છે કે પહેલી રકાતમાં “સૂરએજુઅ” અને બીજી રકાતમાં “સૂરએ મુનાફેકુન” પઢે અથવા પહેલીમાં “સભેહિસ્મ” અને બીજમાં “હલઅતાકા” પઢે. (હુર્રે મુખ્તાર વિગેરે)

મસ્ફુલા-(૫૨૨) : ઈમામે છ (૬) તકબીરો કરતા વધારે તકબીરો કહી, તો મુકતદી પણ ઈમામની પેરવી કરે, પરંતુ તેર (૧૩) કરતાં વધુમાં ઈમામની પેરવી નથી. (રદ્દુલ મુહિતાર)

મસ્ફુલા-(૫૨૩) : પહેલી રકાતમાં ઈમામના તકબીર કહેવા પછી મુકતદી શામેલ થયો તો એજ

વેળા તકબીરો કહી લે ભલે ઈમામે કિરાત શરૂ કરીદીધી હોય અને ત્રણ જ કહે ભલે ઈમામે ત્રણ કરતાં વધારે કહી હોય અને જો તેણે તકબીરો ન કહી કે ઈમામ રૂકુઅમાં ચાલ્યો ગયો, તો ઉભા ઉભા ન કહે બલ્કે ઈમામની સાથે રૂકુઅમાં જાય અને રૂકુઅમાં તકબીર કહી લે અને જો ઈમામને રૂકુઅમાં છોયો અને વધુ ધારણા છે કે, તકબીરો કહીને ઈમામને રૂકુઅમાં પામી લેશો તો ઉભા ઉભા તકબીરો કહે, પછી રૂકુઅમાં જાય નહીંતો અલ્લાહો અકબર કહીને રૂકુઅમાં જાય અને રૂકુઅમાં તકબીરો કહે. પછી જો તેણે રૂકુઅમાં તકબીરો પૂરી ન કરી હતી કે ઈમામે માયું ઉચ્ચું કરી લીધું તો બાકીની તકબીરો સાકિત (માયેથી ઉત્તરી ગઈ) થઈ ગઈ અને જો ઈમામના રૂકુઅથી ઉઠવા પછી શામેલ થયો તો હવે તકબીરો ન કહે બલ્કે જ્યારે પોતાની પઢે તે વખતે કહે, અને રૂકુઅમાં જ્યાં તકબીર કહેવું બતાવવામાં આવ્યું તેમાં હાથ ન ઉઠાવે. અને જો બીજી રકાતમાં શામેલ થયો તો પહેલી રકાતની તકબીરો હવે ન કહે બલ્કે જ્યારે પોતાની છુટી ગએલી પઢવા ઉભો થાય તે વેળા કહે. અને બીજી રકાતની તકબીરો જો ઈમામની સાથે પામી લે, તો બેહતર. નહીં તો તેમાં પણ એજ તફસીલ છે, જે પહેલી રકાત વિપે મજફુર થઈ.

(દુર્ભ મુખ્તાર,આલમગીરી)

મસ્ઝલા-(૫૨૪): જે શાખ્સ ઈમામની સાથે શામેલ થયો પછી સુઈ ગયો અથવા તેનું વુજુ જતું રહ્યું જો પઢે તો તકબીરો એટલી કહે જેટલી ઈમામે કહી. જો કે તેના મજહબમાં એટલી ન હતી.

(આલમગીરી)

મસ્ઝલા-(૫૨૫): ઈમામ તકબીર કહેવું ભૂલી ગયો અને રૂકુઅમાં ચાલ્યો ગયો તો કિયામની તરફ ન લોટે, ન રૂકુઅમાં તકબીર કહે.

(ગદ્દલ મુહ્તાર)

મસ્ઝલા-(૫૨૬): પહેલી રકાતમાં ઈમામ તકબીરો ભૂલી ગયો અને કિરાત શરૂ કરી દીધી તો કિરાત પછી કહીલે અથવા રૂકુઅમાં અને કિરાતનું પુનરાવર્તન ન કરે.

(ગુનીયા,આલમગીરી)

મસ્ઝલા-(૫૨૭): ઈમામે વધારાની તકબીરોમાં

હાથ ન ઉઠાવ્યો તો મુકતદી તેની પેરવી ન કરે, બલ્કે મુકતદી હાથ ઉઠાવે. (આલમગીરી વિગેર)

મસ્ઝલા-(૫૨૮): નમાજ પછી ઈમામ બે ખુત્બા પઢે અને જીમ્બાના ખુત્બામાં જે વસ્તુઓ સુન્નત છે આમાં પણ સુન્નત છે. અને જે ત્યાં મકરૂહ છે. અહીં પણ મકરૂહ છે. કેવળ બે વાતોમાં તફાવત છે. એક એક જીમ્બાના પહેલા ખુત્બાથી પહેલા ખતીબનું બેસવું સુન્નત હતું અને આમાં ન બેસવું સુન્નત છે. બીજું એક આમાં પહેલા ખુત્બાથી, પહેલા નવ વાર અને બીજા ખુત્બા પહેલાં સાત વાર અને મિઅરથી ઉત્તરવાના પહેલા ચૌદ (૧૪) વાર “અલ્લાહો અકબર” કહેવું સુન્નત છે. પરંતુ જીમ્બામાં (સુન્નત) નથી.

(દુર્ભ મુખ્તાર,આલમગીરી વિગેર)

મસ્ઝલા-(૫૨૯): ઈદુલફિત્રના ખુત્બામાં સદકએ ફિત્રના એહ્કામની તખલીમ કરે, તૈ પાંચ વાતો છે (૧) કોના ઉપરવાજિબ છે (૨) કોના માટે (૩) કયારે (૪) કેટલો અને (૫) કઈ વસ્તુથી બલ્કે ઉચિત એ છે કે, ઈદથી પહેલા જે જીમ્બા પઢે તેમાં પણ આ એહ્કામ બતાવી દેવામાં આવે કે, અગાઉથી લોકો વાકેફ થઈ જાય. અને ઈદ અદહાના ખુત્બામાં કુરબાનીના એહ્કામ અને તશરીકની તકબીરોની તખલીમ આપવામાં આવે.

(દુર્ભ મુખ્તાર,આલમગીરી)

મસ્ઝલા-(૫૩૦): ઈમામે નમાજ પછી લીધી અને કોઈ શાખ્સ બાકી રહી ગયો, ભલે તે શામેલ જ થયો નહતો અથવા શામેલ તો થયો પરંતુ તેની નમાજ ફાસિદ થઈ ગઈ, તો જો બીજી જગ્યાએ મળી જાય તો પછી લે. નહીં તો પછી શકતો નથી. હા બહેતર એ છે કે આ માણસ ચાર રકાત ચાશ્તની નમાજ પઢે.

(દુર્ભ મુખ્તાર)

મસ્ઝલા-(૫૩૧): કોઈ ઊરના કારણે ઈદના દિવસે નમાજ થઈ શકી નહીં. દા.ત. અતિશય વરસાદ થયો અથવા વાદળના કારણે ચાંદ દેખાયો નહીં અને ગવાડી એવા વખતે આવી કે નમાજ થઈ શકી નહીં અથવા વાદળ હતું અને નમાજ એવા ટાઈમે પત્તમ થઈ કે જવાલ થઈ ગયો હતો તો બીજા દિવસે પછી વામાં આવે. અને બીજા દિવસે પણ થઈ નહીં તો ઈદુલફિત્રની નમાજ ત્રીજા દિવસે થઈ શકતી નથી. અને બીજા દિવસે પણ ન માઝનો એજ સમય છે જે

પહેલા દિવસે હતો અર્થાત સૂરજ એક નેત્રા બુલંદ થવાથી શરદી મધ્યાહન સુધી. અને ઉઝર વગર ઈદુલફિત્રની નમાજ પહેલા દિવસે પઢી નહીં, તો બીજા દિવસે પઢી શકતા નથી.

(દુર્ભુષ્ટાર, આલમગીરી વિગેરે)

મસ્ખલા-(૫૩૨) : ઈદ અદહા, તમામ અહેકમમાં ઈદુલફિત્રની જેમ છે. કેવળ કેટલીક વાતોમાં તરફાવત છે. આમાં મુસ્તહબ એ છે કે ઈદની નમાજથી પહેલા કાંઈ ખાય નહીં, ભલે કુરબાની ન કરે. અને ખાઈ લીધું તો કરાહત નથી. અને રસ્તામાં બુલંદ અવાજથી તકબીર કહેતો જાય અને ઈદ અદહાની નમાજ ઉજરના કારણે બારમી તારીખ સુધી કરાહત વગર વિલંબિત કરી શકે છે. બારમી પછી ફરી થઈ શકતી નથી. અને ઉઝર વગર દસમી પછી મકરૂહ છે.

(આલમગીરી વિગેરે)

મસ્ખલા-(૫૩૩) : કુરબાની કરવી હોય તો મુસ્તહબ એ છે કે પહેલીથી દસમી જિલહિજાન સુધી ન હજામત બનાવે, ન નખ કપાવે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૫૩૪) : અરજાના દિવસે અર્થાત નવન. જિલહિજાના દિવસે લોકોનું કોઈ જગ્યાએ ભેગા થઈને, હાજ્ઞાઓની જેમ વુકુફ કરવું અને જિક તથા દુઆમાં મશગુલ રહેવું. સહીહ એ છે કે (તેમાં) કાંઈ મુઝાએકા (વાંધો) નથી. જ્યારે કે લાજિમ તથા વાજિબ ન સમજે. અને જો કોઈ બીજા ઉદ્દેશ્યથી એકત્રિત થયા દા.ત. ઈસ્ટિસ્ટસ્કા (વરસાદ માંગવા)ની નમાજ પઠવી છે ત્યારે તો મતભેદ વગર જાઈએ છે. સર્વથા હરજ (વાંધો) નથી.

(દુર્ભુષ્ટાર, વિગેરે)

મસ્ખલા-(૫૩૫) : ઈદની નમાજ પછી મુસાફિહ તથા મુઆનેકહ (ગળે મળવું) કરવું, બેહતર છે, કે તેમાં ખુશીનું પ્રકટીકરણ છે. (વશાહુલ જચ્યિદ)

તશરીકની તકબીરોના મસ્ખલાઓ:

મસ્ખલા-(૫૩૬) : નવમી જિલહિજાહની ફજરથી તેરમીની અસરની નમાજ સુધી દરેક ફર્જ નમાજ પછી એક વાર તકબીર બુલંદ અવાજથી (તકબીર તશરીક) કહેવું વાજિબ છે, અને ત્રણ વાર અફજલ. તેને તકબીરે તશરીક કહે છે. તે આ છે.

"અલ્લાહો અકબર-અલ્લાહો અકબર,
લાઈલાહો ઈલલાહો વલ્લાહો અકબર અલ્લાહો
અકબર, વલિલાહીલ હમ"

(તનવીરુલ અબસાર વિગેરે)

મસ્ખલા-(૫૩૭) : તકબીરે તશરીક સલામ ફેરવ્યા પછી તુરતજ વાજિબ છે. અર્થાત જ્યાં સુધી કોઈ એવો ફેલ (કાથ) ન કર્યો હોય કે તે નમાજ ઉપર બિના ન કરી શકે. જો મસ્ઝિદથી બહાર થઈ ગયો અથવા ઈરાદા પૂર્વક વુઝુ તોડી નાંખ્યું અથવા વાત કરી, ભલે ભૂલથી હોય તો તકબીર સાકિત થઈ ગઈ. અને ઈરાદા વગર વુઝુ તુટી ગયું તો તકબીર કહી લે. (રદ્દુલ મુહ્તાર, દુર્ભુષ્ટાર)

મસ્ખલા-(૫૩૮) : તકબીરે તશરીક તના ઉપર વાજિબ છે જે શહેરમાં મુકીમ (મુસાફીરના હોય તો) હોય અથવા જેણે તેની ઈકતેદા કરી. જો કે સ્ત્રી અથવા મુસાફીર અથવા ગામડામાં રહેનાર અને જો તેની ઈકતેદા ન કરે તો તેમના ઉપર વાજિબ નથી.

(દુર્ભુષ્ટાર)

મસ્ખલા-(૫૩૯) : નિફલ પઢનારાએ ફર્જ નમાજવાળાની ઈકતેદા કરી, તો ઈમામની પેરવીમાં તે મુકતાદી ઉપર પણ તકબીર વાજિબ છે. ભલે ઈમામની સાથે તેણે ફર્જ નમાજ ન પઢી હોય. અને મુકીમે, મુસાફિરની ઈકતેદા કરી તો મુકીમ પર વાજિબ છે. જો કે ઈમામ પર વાજિબ નથી.

(દુર્ભુષ્ટાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૫૪૦) : શુલામ પર તકબીરે તશરીક વાજિબ છે. અને સ્ત્રીઓ પર વાજિબ નથી, ભલે જમાઅતથી નમાજ પઢી હોય. હા, જો મર્દ (પુરુષ) ની પાછળ, સ્ત્રીએ નમાજ પઢી અને ઈમામે તેના ઈમામ હોવાની નિયત કરી તો સ્ત્રી પર પણ વાજિબ છે. પરંતુ (સ્ત્રી) ધીમેથી કહે. એવીજ રીતે જે લોકોએ નરન હાલતમાં નમાજ પઢી તેમના ઉપર પણ વાજિબ નથી, ભલે જમાઅત કરે. કેમ કે તેમની જમાઅત, જમાઅતે મુસ્તહબહ નથી.

(દુર્ભુષ્ટાર, જોહરહ વિગેરે)

મસ્ખલા-(૫૪૧) : નિફલ તથા સુન્તત તથા વિત્રની પછી તકબીર વાજિબ નથી. અને જુસ્મા પછી વાજિબ છે અને ઈદની નમાજ પછી પણ કહીલે.

મસ્ખલા-(૫૪૨) : મસ્ખૂક તથા લાલિક પર તકબીર વાજિબ છે, પરંતુ જ્યારે તે પોતે સલામ ફેરવે તે વખતે કહે. અને જો ઈમામની સાથે કહી લીધી તો નમાજ ફાસિદ થઈ નહીં. અને નમાજ ખતમ કરવા પછી તકબીરનું પુનરાવર્તનપણ નથી.

(રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૫૪૩) : બીજા દિવસોમાં નમાજ કરા થઈ ગઈ હતી, તશરીકના દિવસોમાં તેની કરા પઢી, તો તકબીર વાજિબ નથી. એવી જ રીતે આ દિવસોની નમાજો બીજા દિવસોમાં પઢી તો પણ વાજિબ નથી. એવી જ રીતે પાછલા વર્ષની તશરીકના દિવસોની કરા નમાજો આ વર્ષ તશરીકના દિવસોમાં પઢી, તો પણ વાજિબ નથી. હા. જો ચાલુ વર્ષના તશરીકના દિવસોની કરા નમાજો ચાલુ વર્ષના એ દિવસોમાં જમાઅતથી પઢે તો વાજિબ છે. (રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૫૪૪) : મુનફરિદ (ઓકલા) પર તકબીર વાજિબ નથી. (જોહરહ વિગેર) પરંતુ મનફરિદ પણ કહીતે કે સાહેબેન (હઝરત ઈમામ અબ્યુસુફ અને હઝરત ઈમામ મુહમ્મદ) ની નજીક તેના ઉપર પણ વાજિબ છે.

મસ્ખલા-(૫૪૫) : ઈમામે તકબીર ન કહી તો પણ મુક્તદી પર કહેવું વાજિબ છે. જો કે મુક્તદી મુસાફિર અથવા ગામીયો અથવા સ્ત્રી હોય.

(હુર્ર મુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસ્ખલા-(૫૪૬) : આ દિવસોમાં જો આમ લોકો બજારોમાં એલાન પૂર્વક તકબીરો કહે, તો તેમને મના કરવામાં ન આવે. (હુર્ર મુખ્તાર)

ગ્રહણની નમાજનું બચાન :

હદ્દીસ-(૧) : સહીહ્યનમાં અબૂ અશાઅરી રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુલ્લુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના સમયમાં એક વખત સૂર્યમાં ગ્રહણ લાગ્યું. આપ મસ્જિદમાં તશરીફ લાવ્યા અને બહુ લાંબો કિયામ તથા રુકુઅ તથા સુજૂદ સાથે નમાજ પઢી કે મેં આપને આવું કરતા કયારેય દેખ્યાન નહતા. અને આપે એ ફરમાવ્યું કે અલલાહ અજા વ જલ્લ કોઈના મૃત્યુ તથા જીવનના કારણે પોતાની આ નિશાનીયો જહેર ફરમાવતો નથી, પરંતુ તેનાથી પોતાના બંદાઓને

ડરાવે છે. માટે જ્યારે તે પૈકી કાંઈ દેખો તો જીક તથા હુઆ તથા ઈસ્તિગફારની તરફ ગલ્ભરાઈને ઉઠો.

હદ્દીસ-(૨) : તેઓ પૈકી જ ઈન્ને અભ્યાસ રદીયલ્લાહો અન્હોમાથી રિવાયત છે કે, લોકોએ અર્જ કરી કે, યા રસૂલલ્લાહ ! અમોએ હુલ્લુરે જોયા. કે કોઈ વસ્તુને લેવાનો ઈરાદો ફરમાવે છે. પછી આપને પાછા હક્તા જોયા. આપે ફરમાવ્યું : મેં જન્મના દેખી અને તેનાથી એક ગુચ્છો લેવા ચાહ્યું, અને જો કાંઈ લઈ લેતાં જ્યાં સુધી દુનિયા બાકી રહેતી તમો તેનાથી ખેંતા. અને દોગ્રાને દેખી અને આજના જેવું કોઈ ભયાનક દ્રશ્ય કયારેય નીછાયું નહીં. અને મેં જોયું કે અકસર (બહુધા) દોજખી, સ્ત્રીઓ છે. તેમજે અર્જ કરી કેમ યા રસૂલલ્લાહ ! આપે ફરમાવ્યું કે, કુફ કરે છે ? તેમજે અર્જ કરી કે શું તેણીઓ અલ્લાહ સાથે કુફ કરે છે ? આપે ફરમાવ્યું : નહીં, તેઓ શોહર (પતિ) ની નાશુકી કરે છે અને એહસાન (ઉપકાર)ની કૂતુંબતા (એહસાન ફરામોશી) કરે છે. જો તમો તેણીની સાથે જીવન પર્યત એહસાન કરો, પછી કોઈ વાત પણ (તેના મિજાજ વિરુદ્ધ) જુબે તો કહેશે, “મેં કયારેય ભલાઈ તમારાથી જોઈ જ નથી.”

હદ્દીસ-(૩) : સહીહ બુખારીમાં હઝરત અસ્મા બિન્ને સિદ્દીક રદીયલ્લાહો અન્હોમાથી રિવાયત છે કે, હુલ્લુરે સૂર્ય ગ્રહણમાં ગુલામ આજાદ કરવાનો હુકમ ફરમાવ્યો.

હદ્દીસ-(૪) : સુનને અરબઅહમાં સમોરહ બિન જુન્દુબ રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે, હુલ્લુરે ગ્રહણની નમાજ પઢાવી અને અમો હુલ્લુરનો અવાજ સાંભળતા નહતા, અર્થાત આપે ધીમી કિરાત કરી.

(ગ્રહણના) ફિક્હી મસાઈલ :

સૂર્ય ગ્રહણની નમાજ સુન્નતે મોઅક્કદાછે અને ચંદ્ર ગ્રહણની મુસ્તહબ સૂર્ય ગ્રહણની નમાજ જમાઅતથી પઠવું મુસ્તહબ છે. અને એકલા પણ પઢી શકાય છે. અને જમાઅતથી પઢવામાં આવે તો ખુલ્લા સિવાય જુભાની સઘળી શરતો તેના માટે શર્ત છે. અર્થાત એજ માણસ તેની જમાઅત સ્થાપિત કરી શકે છે, જે જુભાની કરી શકે છે. તે ન હોય તો

એકલા-એકલા ઘરમાં અથવા મસિજદમાં પઢે.

(દુર્દુર્ભાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૫૪૭) : ગ્રહણની નમાજ એજ સમયે પઢે જ્યારે સુરજને ગ્રહણ લાગેલું હોય, ગ્રહણ છુટ્ટયા પછી પઢે નહીં અને જો ગ્રહણ છુટ્ટું (મોક્ષ) શરૂ થઈ ગયું, પરંતુ હજુ બાકી છે, તે સમયે પણ નમાજ શરૂ કરી શકો છો. અને ગ્રહણની હાલતમાં તેના ઉપર વાદળા આવી જાય તો પણ નમાજ પઢે.

(જોહરહ વિગેરે)

મસ્ખલા-(૫૪૮) : તેવા સમયે ગ્રહણ લાગ્યું કે, તે સમયમાં નમાજ મના છે તો નમાજ પઢે નહીં. બલ્કે દુઓ માટે મશગુલ રહે અને એજ હાલતમાં સુધીસ્ત થઈ જાય તો દુઓ ખત્મ કરી દે. અને મગરિબની નમાજ પઢે.

(જોહરહ, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૫૪૯) : આ નમાજ બીજી નિફલોની જેમ બે રકાત પઢે, અર્થાત દરેક રકાતમાં એક રૂકુઅ અને બે સિજદા કરે. આમાં ન અર્જાન છે ન ઈકામત, ન બુલંદ અવાજથી કિરાત, અને ન નમાજ પછી દુઓ કરે, ત્યાં સુધી કે સુર્ય ગ્રહણમાંથી છુટી જાય. અને બે રકાત કરતાં વધારે પણ પછી શકે છે, બલે બે-બે રકાત પર સલામ ફેરવે કે ચાર પર.

(દુર્દુર્ભાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૫૫૦) : જો લોકો બેગા થયા ન હોય તો આ શર્જોમાં પોકારો. અસ્સલાતો જામેઅતુન

(દુર્દુર્ભાર)

મસ્ખલા-(૫૫૧) : અફઝલ એ છે કે ઈદગાહ અથવા જામેઅ મસિજદમાં તેની જમાઅત કાયમ કરવામાં આવે. અને જો બીજી જગ્યાએ કાયમ કરો તો પણ વાંધો નથી.

(આલમગીરી)

મસ્ખલા-(૫૫૨) : જો યાદ હોય તો સૂરાએ બકરહ અને આલે ઈમાન જેવી મોટી સૂરતો પઢે. અને રૂકુઅ તથા સિજદામાં પણ લંબાણ કરે. અને નમાજ પછી દુઓ મશગુલ રહે ત્યાં સુધી કે સંપ્રગ સૂરજ ખૂલી જાય અને એ પણ જોઈએ છે કે નમાજમાં દુંકાણ કરો અને દુઓ માટે લંબાણ. બલે ઈમામ ડિલા રૂપ દુઓ કરે કે મુક્તદીયોની તરફ મુખ કરીને ઉભો હોય, અને એ બહેતરછે, અને સૌંમુકતદીઓ “આમીન” કહે. જો દુઓ માટે અસો (લાકડી) અથવા કમાન (ધનુષ્ય) પર ટેકો લગાવી ઉભો રહે

તો તે પણ સારું છે. દુઓ માટે મિથ્યર પર ન બેસે.

(દુર્દુર્ભાર વિગેરે)

મસ્ખલા-(૫૫૩) : સુર્ય ગ્રહણ અને જનાગાનું સંમેલન થઈ જાય, તો પ્રથમ જનાગાની નમાજ પઢે.

(જોહરહ)

મસ્ખલા-(૫૫૪) : ચંદ્ર ગ્રહણની નમાજમાં જમાઅતનથી, બલે ઈમામ હાજર હોય કેન હોય. વસ્તુત એકલા-એકલા પઢે. (દુર્દુર્ભાર) ઈમામ ઉપરાંત બે ગ્રામ માણસો જમાઅત કરી શકે છે.

મસ્ખલા-(૫૫૫) : તેજ આંધી (વાવાજોંનું) આવે અથવા દિવસે સખત અંધકાર છિવાઈ જાય અથવા રાતમાં ભયાનક રોશની થાય અથવા લગાતાર મુશણધાર વરસાદ વર્ષે અથવા અધિકતમ બરફ પડે અથવા આકાશ લાલ (રકતવણું) થઈ જાય અથવા વીજળીઓ પડે અથવા અધિકતાથી તારા તૂટે અથવા તાઉન (પલેગ મહામારી) વિગેરેનો રોગચાળો ફેલાય અથવા ધરતીંકપ થાય અથવા શત્રુનો ભય હોય અથવા બીજું કોઈ ભયજનક કાર્ય દેખાવામાં આવે, આ સધણા માટે બે રકાત નમાજ મુસ્તહબ છે. (દુર્દુર્ભાર, આલમગીરી વિગેરે) કેટલીક હદ્દીસો જેમાં આંધી (વાવાજોંનું) વિગેરેનો ઉલ્લેખ છે આ પ્રસંગે બધાન કરી દેવું ઉચિત લાગે છે કે, મુસલમાનો તેના ઉપર અમલ કરે. અલ્લાહ તૌફીક બધો.

હદ્દીસ-(૧) : ઉમ્મલ મોમેનીન હજરત આઈશા સિદ્દીકા રદીયત્વાલો અન્દાથી, સહીએ બુખારી તથા સહીએ મુર્સિલમ વિગેરેમાં રિવાયત છે કે આપ ફરમાવે છે કે જગારે તેજ હવા (વાવાજોંનું હુકાનું) ચાલતી તો હુજુર આ દુઓ પઠતાઃ

અલ્લાહુમ્મા ઈન્ની અસ્ખલોકા ઐરહા વ પૈરા માઝીહા વ પૈરા માઝીહા વ પૈરા મા ઉર્સેલત બેહિ વ અઊરો-બકા મિન શર્ઈછા વશર્ई મા ઉર્સેલત બેહિ. તરજુમો :- અય અલ્લાહ હું તારાથી તેની પૈરનો (ભલાઈનો) સવાલ કરું છું અને તેની પૈરનો જે આનામાં છે અને તેના પૈરનો જેની સાથે આ મોકલવામાં આવી છે અને તારી પનાઈ માંગું છું તેના શર (ઉપદ્રવ)થી અને તે ચીજના શરથી જે આમાં છે અને તેના શરથી જેની સાથે મોકલવામાં આવી.

હદ્દીસ-(૨) : ઈમામ શાફીઈ તથા અબુ દાઉદ તથા ઈન્ઝે માજા તથા બયહકીએ ફરમાવત કબીરમાં રિવાયત કરી કે, હુસુર સલ્લાહાહો અલયહે વસ્તુલમ ફરમાવે છે કે, હવા અલ્લાહ તાઆલાની રહેમત પૈડી છે. રહેમત તથા અજાબ લાવે છે. તેને બુરી ન કહો અને અલ્લાહથી તેનો ઘેર (ભલાઈ)નો સવાલ કરો અને તેના શર (બુરાઈ)થી પનાહ માંગો.

હદ્દીસ-(૩) : તિરમિઝીમાં અબુ લ્લાહ બિન અબ્બાસ રદીયલ્લાહો અન્ધોમાંથી રિવાયત છે કે, એક માણસે હુસુરની સામે હવા પર લાનત મોકલી તો આપે ફરમાવ્યું : હવા પર લાનત મોકલો નહીં કે તે નિયુક્ત કરેલ છે. અને જે માણસ કોઈ વસ્તુ પર લાનત મોકલે અને તે લઅનતના પાત્ર ન હોય તો તે લઅનત તે મોકલનાર ઉપર જ પાછી ફરે છે.

હદ્દીસ-(૪) : અબુ દાઉદ, નિસાઈ, ઈન્ઝે માજા તથા ઈમામ શાફીઈ એ ઉમ્મુલ મોમેનીન સિદ્દીકા રદીયલ્લાહો અન્ધાથી રિવાયત કરી કે તેઓ કહે છે કે જ્યારે આકાશ ઉપર વાદળ આવતું તો હુસુર વાતચીત બંધ કરી દેતા અને તેની પ્રત્યે ધ્યાનિત થઈને આ હુઅા પઢતા. “અલ્લાહુમ્મા ઈન્ની અઉઝોબેકા બિન શર્રે મા ફીહે” (અય અલ્લાહ ! હું તારી પનાહ માંગુ હું તે ચીજના શર (બુરાઈ) થી જે તેમાં છે.)

જો વાદળ ખુલી જતું તો હમદ (સ્તુતિ) કરતા અને વરસતું તો આ હુઅા પઢતા. અલ્લા હુભ્મા સક્ષયન નાફેઅન (અય અલ્લાહ એવું પાણી વરસાવ જે લાભ પહોંચાડે).

હદ્દીસ-(૫) : ઈમામ અહમદ તથા તિરમિઝી એ અબુ લ્લાહ બિન ઉમર રદીયલ્લાહો અન્ધોમાંથી રિવાયત કરી કે, હુસુર જ્યારે વાદળની ગર્જના અને વિજળીની કળક સાંભળતા તો આમ કહેતા. “અલ્લાહુમ્મા લા કા તકતુલના બે ગદબેકા વલા નુહ લેકના બે અજાબેકા વ આ ફેના કબ્લ જાલેકા”

(અય અલ્લાહ ! તારા ગજબથી તું અમોને કતલ ન કર અને તારા અજાબથી અમને હલાક ન કર અને તેનાથી પહેલાં અમોને આફીયત (ભેરીયત માં રાખ)).

હદ્દીસ-(૬) : ઈમામ માલિકે અબુ લ્લાહ બિન જુબૈર રદીયલ્લાહો અન્ધોથી રિવાયત કરી કે હુસુર જ્યારે

વાદળનો અવાજ સાંભળતા તો વાતચીત ત્યજી દેતા અને કહેતા “સુખાનલ્લાહી યુસબ્બેહુરખ્રાદ્દો બેહમ્દેહિ વલ મલાઈકો બિન ખીફ્તેહિ ઈન્નલ્લાહ અલા કુલે શૈર્ઠન કદીર.” (પાક છે તે કે હમણની સાથે મેધનાદ તેની તસ્ખીહ કરે છે અને ફરિથતા તેના ડરથી (તસ્ખીહ કરે છે) બેશક અલ્લાહ સર્વ કાંઈ કરી શકે છે).

હદ્દીસ-(૭) : આપ ફરમાવે છે કે જ્યારે વાદળની ગર્જના સાંભળો તો અલ્લાહની તસ્ખીહ (સુખાનલ્લાહ) કરો. તકબીર ન કહો.

ઈસ્તિષ્કા (પાણી માંગવા) ની નમાગ્રનું બચાન :

અલ્લાહ અગ્રા વ જલ્લ ફરમાવે છે. “વમા અસાબકુમ બિમ મુસીબતિન બેમા કસબત અયદીકુમ વયઅસુ અન કસીર.

(તમને જે મુસીબત પહોંચે છે તે તમારા હાથોના કરતુથી છે અને (અલ્લાહ) કેટલીકને માફ કરી દે છે) આ હુષ્કાળ પણ અમારા જ ગુનાહોના કારણો છે. માટે એવી હાલતમાં ઈસ્તિગફારની અધિકતાની જરૂરત છે અને તે પણ તેનો ફિઝલ છે કે કેટલાએ (ગુનાહ) માફ કરી દે છે. નહીં તો જો સંઘળી વાતો ઉપર પૂછ-પકડ કરે તો કયાં ઠેકાણું પડે ?

અલ્લાહ તાલાફ ફરમાવે છે :- લવ યોઆખે શુલ્લાહુનાસ બેમા કસબે માતરપ અલા જહેરા, બિન દાખ્બતિન

(અર્થ : જો લોકોને તેમના કર્મો પર પકડતો તો ધરતી પર કોઈ ચાલનારને નશોડતો.) અને ફરમાવે છે.

ઈસ્તિષ્કા રબ્બકુમ ઈન્નહુ કાન ગફ્કારા પુર્સિલિસ્માઅ અલૈકુમ મિદરારા, વ યુસીદ્કુમ બે અમ્વાલિબ્વ બનીના વ યજઅલ લકુમ જન્નાતિબ્વ યજઅલ લકુમ અન્ધારા.

(પોતાના રબ્બથી ઈસ્તિષ્કાર કરો બેશક તે બહુજ બખણાર છે. મુશળધાર વરસાદ તમારા ઉપર મોકલશે અને માલો તથા પુત્રોથી તમારી સંધાપતા કરશે અને તમને બાગ-બગીચા આપશે અને તમને (જન્નતની) નહેરો આપશે.)

હદ્દીસ-(૧) : ઈખ્ને માજાની રિવાયત ઈખ્ને ઉમર રદીયલ્લાહો અન્ધોમાથી છે કે હુઝુર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે જે લોકો તોલમામપમાં ઉણપ કરે છે તેઓ દુષ્કાળ અને મૃત્યુની તીવ્રતામાં અને જાલિમ બાદશાહમાં ગિરફ્તાર થાય છે. જો જાનવરો ન હોત તો તેમના ઉપર બર્ષા થાત નહીં.

હદ્દીસ-(૨) : સહીહ મુસ્લિમ શરીરફમાં અખુ હુરેરહ રદીયલ્લાહો અન્ધોથી રિવાયત છે કે હુઝુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે દુષ્કાળ તેનુંજ નામ નથી કે વરસાદ ન થાય મોટો દુષ્કાળ તો એ છે કે વરસાદ થાય અને જમીન કાંઈ ઉગાડે નહીં.

હદ્દીસ-(૩) : સહીહયનમાં છે કે હજરત અનસ રદીયલ્લાહો અન્ધો કહે છે કે, હુઝુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ કોઈ દુઅમાં એટલા પ્રમાણમાં હાથ ઉઠાવતા ન હતા જેટલા ઈસ્તિસ્કા (વરસાદ માંગવા)માં ઉઠાવતા હતા. ત્યાં સુધી હાથ ઉચ્ચા કરતા કે બગલોની સફેદી દેખાતી.

હદ્દીસ-(૪) : સહીહ મુસ્લિમ શરીરફમાં તેમનાથી રિવાયત છે કે હુઝુરે વરસાદ માટે દુઅા કરી અને ઉલ્ટા હાથોએ આકાશ તરફ ઈશારો કર્યો (અર્થાત બીજી દુઅાઓમાંનો કાયદો એ છે કે હથેળી આકાશ તરફ હોય અને આમાં હાથ ફેરવી નાંખો કે, હાલ બદલાવાનો ફાલ થાય.)

હદ્દીસ-(૫) : સુનને અરબઅહુમાં ઈખ્ને અખ્બાસ રદીયલ્લાહો અન્ધોમાથી રિવાયત છે કે તેઓ કહે છે કે, રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ જીના વસત્રો પહેલીને ઈસ્તિસ્ક માટે તશરીફ લઈ ગયા. નમ્રતા તથા ખુશુઅ (આજીવી) સાથે.

હદ્દીસ-(૬) : અખુ દાઉદ ઉભુલ મોમેનીન હજરત સિદ્દીકા રદીયલ્લાહો અન્ધાથી રિવાયત કરી કે, તેઓ કહે છે કે લોકોએ હુઝુરની મિદમતમાં દુષ્કાળ ની શિકાયત કરી. હુઝુરે મિદર લાવવા માટે હુકમ કર્યો તે ઈદગાહમાં મુકવામાં આવ્યો અને લોકોને એક દિવસનો વાયદો કર્યો કે તે દિવસે સંઘણા લોકોને આવવા માટે કહ્યું. તે દિવસે જ્યારે સુરજની ડિનારી ચમકી તે સમ્યે હુઝુર તશરીફ લઈ ગયા અને મિદર

ઉપર બેસ્યા, તકબીર કહી અને હમે ઈલાહી બજાવી લાવ્યા પછી ફરમાવ્યું: તમોએ પોતાના દેશના દુષ્કાળની ફરિયાદ કરી છે અને એમ કહ્યું છે કે વરસાદ પોતાના સમયથી વિલંબિત થઈ ગયો છે. અને અલ્લાહ અખુ વ જલ્દે તમને હુકમ આપ્યો છે કે તેની દુઅા કરો અને તેણે વાયદો કરી લીધો છે કે તમારી દુઅા કબુલ કરશે. તેના પછી ફરમાવ્યું.

હદ્દીસ-(૭) : અલ્હમ્બો લિલ્લાહે રહિબલ આલમીન. અર્઱મા નિર્઱હીમ. માલિક યોમિદીન. લા ઈલાહા ઈલ્લલ્લાહો યફાલો મા યોરીદ. અલ્લાહુમ ! અનતલાહો. લાઈલાહા ઈલા અનતલાહીયો વ નહનુલ ફોકરાયો અગ્નીલ અલેનલોસ વ જાલ મા અનજલ કુલ્યંત વ્યાબાગન ઈલા હીન.

તરજુમો :- હમે છે અલ્લાહ માટે જે રબ્બ છે સમગ્ર જગતનો રહેમાન તથા રહીમ છે, કિયામતના દિવસનો માલિક છે. અલ્લાહ સિવાય કોઈ મઅબુદ (પૂજ્ય) નથી. તે જે ઈચ્છે છે તે કરે છે, યા અલ્લાહ તું જ મઅબુદ છે, તારા સિવાય કોઈ મઅબુદ નથી, તુ ગનીછે અને અમો મોહતાજ છીએ. અમારા ઉપર વરસાદ ઉતાર અને જેકાંઈ તું ઉતારે તેને અમારા માટે શક્તિ અને એક સમય સુધી પહોંચવાના કારણ રૂપ કરી દે.

પછી હાથ બુલંદ ફરમાવ્યા (ઉચ્ચા કર્યો) ત્યાં સુધી કે બગલની સફેદી જાહેર થઈ (દેખાવા લાગ્યા) પછી લોકો તરફ પીઠ કરી અને ચાદર મુબારક ઉલટાવી દીધી. પછી લોકો તરફ ધ્યાનિત થયા અને મિદર ઉપરથી ઉત્તરને બે રક્ખત નમાજ પઢી. અલ્લાહ તાલાદે એજ વેળા વાદળ (ઉત્પન્ન કર્યું), તે ગર્જયું અને ચમક્યું અને વરસ્યું અને હુઝુર હજુ મરિજદમાં તશરીફ પણ લાવ્યા ના હતા કે નાળાઓ વહેવા લાગ્યા.

હદ્દીસ-(૮) : ઈમામ માલિક તથા અખુદાઉદ અપ્રાધિન શુઅયબ અન અબીહે અન જદીદીની રિવાયતથી રિવાયત કરે છે કે હુઝુર ઈસ્તિસ્કાની દુઅામાં એમ કહેતા. “અલ્લાહુમસ્કે ઈબાદક વ બહીમકા વન્શુર રહમતકા વ અહ્યે બલદક લ્યેયેત”

(અથ અલ્લાહ ! તું પોતાના બંદાઓ અને જાનવરોને તુપ્ત (સખરાબ) કરી દે અને પોતાની

રહેમતને ફેલાવી દે અને પોતાના મુર્દા શહેરને સળવન કરી દે)

હદીસ-(૮) : સુનન અબુ દાઉદ માં જાબિર રદીયલ્લાહો અન્હોથી રિવાયતકરે છે કે, મેં રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમને જોયા કે હાથ ઉઠાવી (ઉચ્ચા કરી) આ દુઆ કરી.

અલ્લાહ મ્ખસ્કેના ગૈસમ મુગીસમ મરીઅમ-નાફેઅન ગૈર દાર્દિન આજિલન ગૈર આજેલિન.

(અય અલ્લાહ ! અમોને તૃપ્ત કર સંપૂર્ણ વરસાદથી જે ઉલ્લાસમય તાજગી લાવનાર હોય, ફાયદાકારક હોય, નુકશાન ન કરે, જલ્દી થાય વિલંબ થી ન થાય.)

હુસુરે આ દુઆ પઢી જ હતી કે આકાશમાં વાદળો ચઢી આવ્યાં.

હદીસ-(૯) : સહીહ બુખારીમાં અનસ રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે લોકો જ્યારે દુષ્કાળમાં સપદાઈ જતાં તો અમીરુલ મોમેનીન ફરુકે આજામ, હજરત અબ્બાસ રદીયલ્લાહો અન્હોના વસીલા (માધ્યમ)થી વરસાદની યાચના કરતા. તેઓ અર્જ કરતા : અય અલ્લાહ ! તારી તરફ અમો અમારા નભીનો વસીલો કર્યા કરતા હતા અને તુ વરસાદ વરસાવતો હતો. હવે અમો તારી તરફ નભી સલ્લલ્લાહો અલયહે વસ્તુલમના કાકાને વસીલો કરીએછીએ, તું વરસાદ મોકલ. અનસ રદીયલ્લાહો અન્હો કહે છે કે જ્યારે આમ કરતા તો વર્ષા થતી. અર્થાત હુસુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમની હ્યાતીમાં હુસુર આગળ હોતા અને અમો હુસુરની પાછળ સફો બાંધીને દુઆ કરતા, હવે તે ઉપલબ્ધ નથી. જેથી હુસુરના કાકાને આગળ કરીને દુઆ કરીએ છીએ કે, આ પણ હુસુરથી જ વસીલો છે, સુરતન ઉપલબ્ધ નથી. તો માયનારૂપે.

ફિક્ટી મસાઈલ (ઈસ્તિસ્કા)

ઈસ્તિસ્કા દુઆ તથા ઈસ્તિગફારનું નામ છે. ઈસ્તિસ્કાની નમાજ જમાઅતથી પદ્ધવું જાઈજ છે. પરંતુ જમાઅત તેના માટે સુન્તત નથી. ભવે જમાઅતથી પઢે કે એકલા એકલા પઢે. બંને રીતે અખત્યાર છે. (દુર્ભુખ્તાર વિગેરે)

મસાલા (૫૫૬) : ઈસ્તિસ્કા માટે જીના અથવા

થીગડાં લાગેલ કપડાં પહેરી શરમિદગી તથા ખુશુઅ ખુશુઅ (વિનગ્રતા) તથા તવાજોઅ (આજિઝી) સાથે ઉઘાડા માથે પગપાળા જાય અને પગો ઉઘાડા હોય તો ઉત્તમ છે. અને જવાથી અગાઉ ઐરાત કરે, કુફ્ફારને સાથે ન લઈ જાય. કેમકે જઈએ છીએ રહેમત માટે અને કાફિર પર લખનત ઉત્તરે છે. ત્રણ દિવસ અગાઉથી રોજા રાપે અને તૌબા તથા ઈસ્તિગફાર કરે. પછી મેદાનમાં જાય અને ત્યાં તૌબા કરે અને જ્યાની (જીભથી) તૌબા કાફીનનથી, બલ્યે દિલથી કરે અને જેમના હક્કો તેના માથે છે સધણા અદા કરે અથવા માફ કરાવે. કમજોરો (નિર્બળો) વૃદ્ધો, વૃદ્ધાઓ બાળકોનો વસીલો પકડી દુઆ કરે અને સૌ આમીન કહે કે, સહીહ બુખારી શરીફમાં છે કે હુસુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસ્તુલમે ઈશ્રદિફરમાયો—“તમને રોજી અને મદદ નિર્બળો દ્વારા મળે છે.” અને એક રિવાયતમાં છે જો જવાન ખુશુઅ કરવાવાળા અને ચોપગાં જી નરા ચરાવવાવાળા અને રૂકુઅ કરવાવાળા વૃદ્ધો અને દુધ પીતાં બાળકોન હોતો તો તમારા ઉપર ઉગ્રતાથી અજાબની વર્ષા થત. તે સમયે બાળકોને તેમની માતાઓથી અલગ રાખવામાં આવે અને પશુઓ પણ સાથે લઈ જાય. સારાંશ એ છે કે રહેમતની તવજોહના સધણા કારણો પૂરા પાડે અને સતત ત્રણ દિવસ સુધી જંગલમાં જાય અને દુઆ કરે.

અને એમ પણ થઈ શકે છે કે ઈમામ બે રકાત જહર (કિરાત)ની સાથે નમાજ પઠાવે અને બેહતર એછે કે પહેલી રકાતમો સભેહિસ્મની સુરત અને બીજીમાં હલઅતાકાની સુરત પઢે અને નમાજ પછી જમીન ઉપર ઉભો રહી ખુલ્બો પઢે અને બંને ખુલ્બાઓની વચ્ચે જલ્સો (બેઠક) કરે. અને એમ પણ થઈ શકે છે કે, એકજ ખુલ્બો પઢે અને ખુલ્બામાં દુઆ તથા તસ્ખીહ તથા ઈસ્તિગફાર કરે અને ખુલ્બા દરમિયાન ચાદર ઉલ્ટાવી નાખે અર્થાત ઉપરનો ડિનારો (છેડો) નીચે અને નીચેનો ઉપર કરી દે, કે હાલ બદલવાનો ફાલ થાય.

ખુલ્બાથી ફારેગ થઈ લોકો તરફ પીઠ અને કિલ્લાતરફ મુખ કરીને દુઆ કરે, બહેતર તે દુઆઓ છે જે હદીસોમાં આવેલી છે. અને દુઆમાં હાથોને ખુબ બુલંદ કરે અને હાથની પીઠ આકાશ તરફ

રાખે. (આલમગીરી, ગુનીયા, દુર્ઘતાર, જોહરણ વિગેરે)

મસ્ફળા (૫૫૭) : જો વરસાદ માંગવા જવાથી પહેલા વર્પાથઈ ગઈ તો પણ જાય અને અલ્લાહનો શુક્ક બજાવી લાખે. અને વરસાદના સમયે હદીસમાં જે દુઅા ઈરશાદ થઈ છે તે પછે અને વાદળ ગર્જે તો તેની દુઅા પઢે. અને વરસાદમાં થોડીકવાર ઉભો રહે કે શરીર પર પાણી પહોંચે.

(દુર્ઘતાર રદ્દુલ મુહતાર)

મસ્ફળા (૫૫૮) : અવિકતાથી વરસાદ થાય કે નુકસાન કરનાર જજાય તો તેના રોકવા માટે દૂઅા કરી શકે છે અને તેની દુઅા હદીસમાં આ છે :

“અલ્લાહુમ હવાલૈના વલા અલૈના અલ્લા હુમ અલલ-આકાએ વજાએ રાખે વબોતુનિલ અવહેયતે વ મનાબેતિશજરે. (બુખારી-મુસ્લિમ)

તરજુમો : અય અલ્લાહ ! મારા આસપાસ વરસાદ વરસાવ, અમારા ઉપર ન વરસાવ. અય અલ્લાહ ટેકરીઓ અને પહાડો ઉપર વરસાદ વરસાવ અને નાણાઓમાં જ્યાં વૃષ્ટો ઉગે છે.

આ હદીસને બુખારી તથા મુસ્લિમે અનસ રદ્દીયલ્લાહો અન્હોથી રિવાયત કરી.

ખોઝ (ભય)ની નમાજનું બચાન

અલ્લાહ અજાવ જલ્લ ફરમાવે છે :- ફર્જન બિફતુમ ફરેજાલન અવ રુકબાન ફર્જા અમિન્જુમ ફર્જકોર્લલાહ કમા અલ્લમકુમ માલમ તક્કુનું તઅલમુન.

(જો તમને ખોઝ (ડર, ભય) હોય તો પેદલ અથવા સવારી પર નમાજ પઢો પછી જ્યારે ભય દૂર થઈ જાય તો અલ્લાહને એવી રીતે યાદ કરો જેવું કે તેણે શીખવું કે જે તમો જાણતા ન હતા) અને ફરમાવે છે :- વર્જા કુન્ત ફીહિમ ફ અકમત લદોમુસ્લાત ફલતકુમ તાઅેફતુન બિન્હુમ મઅકા - (થી માંઠી) ઈન્સસલાતા કાનત અલલ-મુમેનીના કિતાબમ મૌકુતા”

અર્થ : અને જ્યારે તમો તેમનામાં છો અને નમાજ કાયમ કરો તો તેમનામાંનો એક ગિરોહ (ટોળું) તમારી સાથે આવીને ઉભો રહે અને તેઓ એ પોતાના હથિયાર સાથે રાખવા જોઈએ પછી જ્યારે એક રકાત જો સિજદો કરી લેતો તેઓ તમારી પાછળ

હોય અને હવે બીજો ગિરોહ (ટોળું) આવે જેમણે તમારા સાથે નમાજ પઢી ન હતી તેઓ તમારી સાથે નમાજ પઢે અને પોતાની પનાહ અને પોતાના હથિયાર પાસે રાખે. કાફિરોની તમના છે કે ક્યાંક તમો પોતાના હથિયારા અને પોતાના સાધનોથી ગાડેલ થઈ જાવ તો એક સામટા તમારા ઉપર તુટી પડે અને તમારા ઉપર કોઈ દુઅા નથી, જો તમને વરસાદથી તકલીફ હોય કે બીમાર હોય કે પોતાના હથિયાર મુકી દો, પરંતુ પનાહ (આશ્વય) ની ચીજો લીધેલ રહેણે. નિશ્ચક અલ્લાહે કાફિરો માટે જિલ્લતનો અજાબ તૈયાર રાખ્યો છે, પછી જ્યારે નમાજ પૂરી કરી લો તો અલ્લાહને યાદ કરો, ઉભા અને બેસેલા અને પાસાલેર સુતેલા, પછી જ્યારે નિશ્ચિત થઈ જાવ તો નિયમાનુસાર નમાજ કાયમ કરો, બેશક નમાજ મુસલમાનો ઉપર બાંધેલા સમયે ફરજ છે.

તિરમિઝી તથા નિસાઈ અખુ હુરૈરહ રદીયલ્લાહો અન્હોથી મરવી છે કે, રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ અસ્ફાન તથા દજનાની વચ્ચે ઉત્તર્યા, મુશરીકોએ કહ્યું તેમના માટે એક નમાજ છે. જે બાપ અને બેટાઓથી પણ અધીક ખારી છે. અને તે અસરની નમાજ છે. માટે સધણા કામ ઠીક (બરાબર) રાખો, જ્યારે તેઓ નમાજ માટે ઉભા થાય એકદમ હુમલો કરી દે. જિબ્રિલ અલયહિસ્સલામ નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમની બિદમતમાં હાજર થયા અને અર્જ કરી કે, હુજુર પોતાના અસ્ફાનના બે ભાગ કરે, એક ગિરોહની (ટુકડી) સાથે નમાજ પઢે અને બીજો ગિરોહ તેમની પાછળ દાલ અને હથિયારો લઈને ઉભો રહે, તો તેમની એક એક રકાત થશે (અથવા હુજુરની સાથે) અને રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમની બે રકાતો

સહીહ બુખારી તથા સહીહ મુસ્લિમમાં જાબિર રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે. તેઓ કહે છે કે અમો રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસલ્લમની સાથે ગયા જ્યારે જાતુર્રિકામાં પહોંચ્યા એક છાંપવાણું વૃક્ષ હુજુર માટે છોડી દીધું, તેના ઉપર હુજુરે પોતાની તલવાર લટકાવી દીધી

હતી. એક મુશર્ખિક આવ્યો અને તલવાર લઈ લીધી અને ખેંચીને કહેવા લાગ્યો આપ મારાથી ડરો છો? આપે ફરમાવ્યું નહીં. તેણે કહ્યું તો અપને મારાથી કોણ બચાવશે? આપે ફરમાવ્યું - અલ્લાહ સહભાએ કિરામે જ્યારે જોયું તો તેને ઘમકાવ્યો તેણે તલવાર ભ્યાનમાં મુકી લટકાવી દીધી. તે પછી અજાન થઈ, હુસુરે એક ગિરોહની સાથે બે રકાત નમાજ પડી. પછી તે ગિરોહ પાછળ હઠથો અને બીજા ગિરોહની સાથે બે રકાત પઢી તો હુસુરની ચાર રકાત થઈ અને લોકોની બે-બે, અર્થાત હુસુરની સાથે.

ફિક્ષણ મસાઈલ : (નમાજ પૌફના)

નમાજ પૌફ જાઈજ છે જ્યારે કે દુશ્મનોનું નિકટમાં હોય યક્ષિન સાથે ખબર હોય. અને જો એ ગુમાન હતું કે દુશ્મન નજીકમાં છે અને નમાજ પૌફ પઢી, પાછળથી ગુમાનની ભુલ જાહેર થઈ તો મુક્તદી નમાજનું પુનરાવર્તન કરે. એવી જ રીતે જો શરૂ હુર હોય તો આ નમાજ જાઈજ નથી. અર્થાત મુક્તદીની નમાજ થશે નહીં. અને ઈમામની થઈ જશે.

નમાજ પૌફ નો તરીકો એ છે કે જ્યારે દુશ્મન સામે હોય અને આશંકા હોય કે સૌએક સાથે નમાજ પઢશો તો દુશ્મન હુમલો કરી દે. તેવા સમયે ઈમામ જમાઅતના બે ભાગ હોય. જો કોઈ ટુકડી તે વાત પર રાજી હોય કે અમો પછીથી નમાજ પઢી લઈશું તો તેને દુશ્મનના મુકાબલામાં રાખે, અને બીજી ટુકડી સાથે પૂરી નમાજ પઢીલે. પછી જે ટુકડીએ નમાજ પઢી નથી તે માંથી કોઈ ઈમામ બની જાય અને આ લોકો તેની સાથે બાજમાઅત નમાજ પઢીલે. અને જો બંનેમાંથી પછીથી પદ્ધવા માટે કોઈ રાજી ન હોય તો ઈમામ એક ગિરોહ (ટુકડી) ને દુશ્મનના મુકાબલામાં રાખે અને બીજો ગિરોહ ઈમામની પાછળ નમાજ પઢે. જ્યારે ઈમામ આ ગિરોહની સાથે એક રકાત પઢી લે અર્થાત પહેલી રકાતના બીજા સિજદાથી માયું ઉઠાવે તો આ લોકો દુશ્મનના મુકાબલામાં ચાલ્યા જાય અને જે લોકો ત્યાં હતા તે લોકો ચાલ્યા આવે, હવે તેમની સાથે ઈમામ એક રકાત પઢે અને તશહેદ પઢીને સલામ ફેરવી દે, પરંતુ મુક્તદી સલામ ફેરવે નહીં,

બલ્કે આ લોકો દુશ્મનના મુકાબલામાં ચાલ્યા જાય અથવા અહિયાંજ પોતાની નમાજ પૂરી કરીને જાય અને તે લોકો આવે અને એક રકાત કિરાંઅત વગર પઢીને તશહેદ પછી સલામ ફેરવે અને એમ પણ થઈ શકે છે કે, આ ગિરોહ અહિયાં ન આવે બલ્કે ત્યાંજ પોતાની નમાજ પૂરી કરી લે. અને બીજા ગિરોહ જો નમાજ પૂરી દીધી હોય તો ઠીક. નહીં તો હવે પૂરી કરે. ભલે ત્યાંજ અથવા અહિયાં આવીને અને આ લોકો કિરાંઅત સાથે પોતાની એક રકાત પઢે અને તશહેદ પછી સલામ ફેરવે.

આ તરીકો બે રકાતવાળી નમાજનો છે, ભલે બે રકાતની જ નમાજ હોય દા.ત. ફજર, ઈદ, જુમા અથવા સફર (પ્રવાસ)ના કારણે ચારની બે થઈ ગઈ હોય અને ચારવાળી નમાજ હોય તો દરેક ગિરોહની સાથે ઈમામ બે-બે રકાત પઢે. અને મગરિભમાં પહેલા ગિરોહની સાથે બે અને બીજા ગિરોહની સાથે એક પઢે. જો પહેલા ગિરોહની સાથે એક રકાત પઢી અને બીજાની સાથે બે પઢી તો નમાજ બાતિલ થઈ ગઈ.

(હુર્રે મુખ્તાર, આલમગીરી વિગેરે)

મસબલા-(૫૫૮) : આ સધણા અહેકામ એ હાલતમાં છે જ્યારે ઈમામ તથા મુક્તદી મુક્તીમ હોય (મુસાફરના હોય) અથવા સધણા મુસાફિર, અથવા ઈમામ મુક્તીમ છે અને મુક્તદી મુસાફિર, અને જો ઈમામ મુસાફિર હોય ને મુક્તદી મુક્તીમ તો ઈમામ એક ગિરોહની સાથે એક રકાત પઢે અને બીજા ગિરોહની સાથે એક પઢીને સલામ ફેરવી દે. પછી પહેલો ગિરોહ આવે અને ત્રણ રકાત કિરાંઅત વગર પઢે પછી બીજો ગિરોહ આવે અને ત્રણ રકાત પઢે. પછી બીજો ગિરોહ આવે અને ત્રણ રકાત પઢે. પહેલી રકાતમાં સુરસે ફાતેહા તથા કોઈ સુરત પઢે અને જો ઈમામ મુસાફિર છે અને મુક્તદીઓમાં કેટલાક મુક્તીમ છે અને કેટલાક મુસાફિર તો મુક્તીમ, મુક્તીમની રીતે અમલ કરે અને મુસાફિર, મુસાફિરની રીતે અમલ કરે.

(આલમગીરી વિગેરે)

મસબલા-(૫૬૦) : એક રકાત પછી દુશ્મનના મુકાબલામાં જવાથી, ભાર્વાથ પૈદલ જવું છે. સવારી

પર જશે તો નમાજ ચાલી જશે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(પ્ર૬૧) : જો ખૌફ (ડ્ર) અધીકતમ હોય કે સવારી ઉપરથી ઉત્તરી ન શકે તો સવારી ઉપર એકલા એકલા ઈશારાથી જે દિશાએ પણ મુખ કરી શકે એજ દિશાએ નમાજ પઢે, સવારી પર જમાઅતથી પઢી શકતા નથી હા, જો એક ઘોડા ઉપર બે સવાર હોય તો પાછળવાળો, આગળવાળાની ઈક્તેદા કરી શકે છે. અને સવારી પર ફરજ નમાજ એ સમયે જ જાઈજ થશે કે દુશ્મનો તેમનો પીછો કરી રહ્યા હોય. અને જો તેઓ દુશ્મનની પાછળ પડ્યા હોય તો સવારી ઉપર નમાજ થશે નહીં. (જોહરહ, દુર્ભુત્તાર)

મસ્ફુલા-(પ્ર૬૨) : નમાજે ખૌફમાં કેવળ દુશ્મનના મુકાબલામાં જવું અને ત્યાંથી ઈમામની પાસે સક્રમાં આવવું અથવા વુસુ તુટી ગયું તો વુસુ માટે ચાલવું માફ છે. તે સિવાય, ચાલવું નમાજને ફાસિદ કરી દેશે. જો દુશ્મને તેને દોડાયો અથવા તેણે દુશ્મનને ભગાડાયો તો નમાજ તુટી ગઈ. અલબાત પ્રથમ હાલતમાં જો સવારી પર હોય તો માફ છે.

(દુર્ભુત્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(પ્ર૬૩) : સવારી પર હતો નહીં, હવે નમાજ દરમિયાન સવાર થઈ ગયો તો નમાજ તુટી ગઈ, ભલે કોઈ પણ કારણોસર સવાર થયો હોય, અને લડવું પણ નમાજને ફાસિદ કરી દે છે. પરંતુ એક તીર ફેંકવાની ઈજાજત છે. (દુર્ભુત્તાર) એવી જ રીતે આજકાલ બંદુકનો એક ફેર કરવાની ઈજાજત છે.

મસ્ફુલા-(પ્ર૬૪) : દરિયામાં તરવાવાળો જો થોડીક વાર અવયવોને ડલાવ્યા સિવાય રહી શકે છે તો ઈશારાથી નમાજ પઢે, નહીં તો નમાજ થશે નહીં.

(દુર્ભુત્તાર)

મસ્ફુલા-(પ્ર૬૫) : જંગ-યુધ્યમાં મશગુલ છે. દા.ત. તલવાર વિઝી રહ્યો છે અને નમાજનો સમય ખલાસ થઈ રહ્યો છે તો નમાજ (પઢવા) માં વિલંબ કરે, લડાઈથી ફારેગ થઈને નમાજ પઢે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(પ્ર૬૬) : બાળીઓ (બળવાખોરો) અને તે માણસ માટે જેનો પ્રવાસ કોઈ ગુનાહ માટે હોય ખૌફની નમાજ તેના માટે જાઈજ નથી. (દુર્ભુત્તાર)

મસ્ફુલા-(પ્ર૬૭) : નમાજે ખૌફ થઈ રહી હતી કે નમાજ દરિમયાન ખૌફ ચાલ્યો ગયો અર્થાત દુશ્મન ચાલ્યા ગયા તો જે નમાજ બાકી છે તે અમન જેવી પઢે. હવે ખૌફની પઢવું જાઈજ નથી. (આલમગીરી)

મસ્ફુલા-(પ્ર૬૮) : દુશ્મનોના ચાલ્યા જવા પછી કોઈ એ કિબ્લા તરફથી છાતી ફેરવી તો નમાજ તુટી ગઈ. (આલમગીરી)

મસ્ફુલા-(પ્ર૬૯) : નમાજે ખૌફમાં હથિયાર સાથે રાખવું મુસ્તાહ છે, અને ખૌફની અસર કેવળ એટલી છે કે જરૂરત માટે ચાલવું જાઈજ છે. બાકી કેવળ ખૌફથી નમાજમાં કસર થશે નહીં.

(આલમગીરી, દુર્ભુત્તાર)

મસ્ફુલા-(પ્ર૭૦) : નમાજે ખૌફ જેવી રીતે દુશ્મનના ડરના સમયે જાઈજ છે એવી જ રીતે હિસ્ક પશુ અને મોટા સર્પ વિગેરેથી ખૌફ હોય તો પણ જાઈજ છે. (દુર્ભુત્તાર)

બીમારીનું બધાન :

બીમારી પણ એક બહુ મોટી નેઅમત છે. તેના લાભો અસંખ્ય છે. જો કે મનુષ્યને દેખીતી રીતે તેનાથી તકલીફ પહોંચે છે પરંતુ વાસ્તવમાં રાહત તથા આરામનો એક મોટો જથ્થો હાથ આવે છે. આ જાહેરી બીમારી જેને માનવી બીમારી સમજે છે. વાસ્તવમાં રૂહાની (આધ્યાત્મિક) બીમારીઓનો એક બહુ મોટો જબરદસ્ત ઈલાજ છે. વાસ્તવિક બીમારી રૂહાની બીમારીઓ છે કે તે અલબત્ત બહુ જ ભયની વસ્તુ છે અને તેને જ ઘાતક બીમારી સમજવું જોઈએ. બહુજ સાધારણ વાત એ છે કે જે માનવી જાણે છે કે કોઈ કેટલોએ ગાફીલ હોય પરંતુ જ્યારે બીમારીમાં સપદાય છે તો કેટલું ખુદાને યાદ કરે છે અને તૌબા-ઈસ્તિગ્ફાર કરે છે. અને આ તો બહુ મોટા રૂત્બા-પદ વાળાઓની શાન છે કે તકલીફનું પણ એવી રીતે જ સ્વાગત કરે છે જેવું કે રાહતનું પરંતુ આપણા જેવા ઓછામાં ઓછું એટલું તો કરે કે સબજ તથા ઈસ્તિગ્ફારથી કામ લો અને જગાઅ-ફિઝા (બેસધી) કરીને આવનાર સવાબને ખોઈ ન ભેસે અને દરેક માનવી એટલું જાણે છે કે બેસબરીથી આવી પડેલ મુસીબત જતી રહેશે નહીં પછી તે મોટા સવાબથી મહેરુભી (વંચિતતા) ડલ

મુસીબત છે.

કેટલાક નાદાનો બીમારીમાં બહુજ અનુચિત શબ્દો બોલી નાખે છે બલ્કે કેટલાક તો કુઝ સુધી પહોંચી જાય છે. માઝલ્લાહ (અલ્લાહની પનાઈ) અલ્લાહ અજાવ જલ્લાની તરફ જુલ્લનો સંબંધજોડી દે છે. આ તો સાવ ખસેરણ દુનિયા વલ આભિરહ (દુનિયા અને આખેરતમાં નુકશાનમાં રહેનાર) ના પ્રમાણાક બની જાય છે. હવે અમે તેના કેટલાક ફાયદાઓ જે હટીસોમાં આવેલા છે, બયાન કરીએ છીએ કે મુસલમાન પોતાના ઘારા અને બરગુજીદા (ચુનાંદા) રસૂલના ઈરશાદાત (કથનો) દિલના કાનોથી સાંભળે અને તેના ઉપર અમલ કરે. અલ્લાહ તૌફીક અતા કરે.

હટીસ (૧-૨) : સહીહ બુખારી તથા સહીહ મુસ્લિમમાં અખુહુરેરહ તથા અખુહુરેરહ રદ્દીયલ્લાહો અન્હોમાથી રિવાયત છે કે મુસલમાનોને જે તકલીફ, શોક, દુઃખ, કષ્ટ તથા ગમ પહોંચે, ત્યાં સુધી કે તેના પગમાં જે કાંઠો વાગે અલ્લાહ તથાલા તેમના કારણે તેના ગુનાહ મિટાવી દે છે.

હટીસ (૩) : સહીહ યનમાં અખુહુરેરહ બિન મસઉદ રદ્દીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુલ્લુર ફરમાવે છે, મુસલમાનને જે કષ્ટ પહોંચે છે, બીમારી હોય કે તેના સિવય બીજું કાંઈ તો અલ્લાહ તથાલા તેની બુરાઈઓને પેરવી નાખે છે જેવું કે વૃક્ષ ઉપરથી પાંદડા ખરી પડે છે.

હટીસ (૪-૫) : સહીહ મુસ્લિમમાં જાબિર રદ્દીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુલ્લુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ઉમ્મુસાઈબ પાસે તશરીફ લઈ ગયા. તેણીને પૂછ્યું તને શું થયું છે? કે કાંપી (ધુજી) રહી છે. તેમણે અર્જ કરી મને તાવ છે, ખુદાતેમાં બરકત ન કરે. આપે ફરમાવું બુખાર (તાવ) ને બુરો ન કહો કે તે આદમીની ખતાઓ (ભુલો) ન એવી રીતે હુર કરે છે જેમ ભકી લોખંડના મેલને હુર કરે છે. તેનાજ અનુરૂપ સુનન ઈઞ્ચે માજામાં અખુહુરેરહ રદ્દીયલ્લાહો અન્હોથી પણ રિવાયત છે.

હટીસ (૬) : સહીહ બુખારીમાં અનસ રદ્દીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુલ્લુર ફરમાવે છે કે અલ્લાહ

અજાજ વજલ્લ ફરમાવે છે, જ્યારે પોતાના બંદાની આંખો લઈ લઉં પછી તે સબ્ર કરે તો આંખોના બદલે તેને જન્મત આપીશ.

હટીસ (૭) : તિરમિજીમાં છે કે ઉમદ્ધા એ હજરત આઈશા સિદ્દીકા રદ્દીયલ્લાહો અન્હાને આ બે આયતોના મતલબ (ભાવાર્થ) પૂછ્યો-ઈન તુખુદુ માઝી અન કુસેકુમ અવતુખફૂહો યોછા સિબુમ બેહિલ્લાહો. (જે તમારા નફસમાં છે તેને જાહેર કરો યા છુપાવો અલ્લાહ તમારાથી તેનો હિસાબ લેશો. અને મંયુઅમલમુંઅંય-યુજા બેહિ (જો કોઈ પ્રકારની બુરાઈ કરશે તેનો બદલો આપવામાં આવશે) (કે જ્યારે દરેક બુરાઈની જગ્યા છે અને જે ખતરો દિલમાં ગુજરે તેનો પણ હિસાબ છે તો મોટી મુશ્કેલી છે કે તેનાથી કોણ બચશો.)

હજરત આઈશા સિદ્દીકાએ ફરમાવ્યું : જ્યારથી મેં તેનો સવાલ હુલ્લુરને કર્યો ત્યારથી કોઈ એ પણ મને પૂછ્યું નહીં. હુલ્લુર ફરમાવ્યું તેનાથી મુરાદ એતાબ (પ્રકોપ) છે કે અલ્લાહ તથાલા બંદાઓ ઉપર કરે છે કે તેને બુખાર તકલીફ પહોંચાડે છે, ત્યાં સુધી કે માલ જે ખમીસની બાંધમાં હોય અને ખોવાઈ જાય અને તેના કારણે ગભરાઈ જાય. આ કાર્યોના કારણો ગુનાહોથી એવો નીકળી જાય છે. જેવું ભકીથી લાલ સોનું નીકળે છે. અર્થાત ગુનાહોથી એવો પાક તથા સાફ થઈ જાય છે કે જેવું ભકીથી સોનું મેલથી પાક-સાફ થઈને નીકળે છે.

હટીસ (૮) : તિરમિજીમાં અખુહુરેરહ સલ્લલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુલ્લુર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે બંદાને કોઈ તકલીફ ઓછી-વત્તી તેના ગુનાહોના કારણ વગર પહોંચતી નથી. અને અલ્લાહ તથાલા જે માફ કરી દે છે તે બહુ જ અધિક છે. અને આ આયત પઢી.

“વ મા અસાખુમ મિમ મુસીબતિન ફ બેમા કસબત અયદીકુમ વયઅકુ અન કસીર.”

(અર્થ : તમને જે મુસીબત પહોંચી તે તેનો બદલો છે જે તમારા હાથોની કરણી છે અને અધિકતમ ગુનાહ માફ કરી દે છે.)

હટીસ (૯-૧૦) : શરહે સુન્નહમાં અખુહુરેરહ બિન અમ રદ્દીયલ્લાહો અન્હોમાથી રિવાયત છે કે, હુલ્લુર

સલ્લલ્વાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, બંદો જ્યારે ઈબાદતના સારા તરીકા ઉપર હોય પછી બીમાર થઈ જાય તો જે ફરિશ્તો તેના ઉપર મુવક્કિલ છે તેને ફરમાવવામાં આવે છે કે તેના માટે એવા જ આ'માલ લખ જ્યારે કે તે બીમારીમાં સપદાયેલો ન હોય, ત્યાં સુધી કે હું તેને બીમારીમાંથી મુક્ત કરી દઉં અથવા પોતાની તરફ બોલાવી લઉં અર્થાત મૌત આપું અને અનસ રહિયલ્વાહો અન્હોની રિવાયત છે કે હુસુર ફરમાવે છે કે જ્યારે મુસલમાન કોઈ શારીરિક બીમારીમાં સપદાઈ જાય છે તો ફરિશ્તાને હુકમ થાય છે જે નેક કામ પહેલા કર્યા કરતો હતો તે લખ, જો તેને (અલ્વાહ) શિફા આપે છે તો ધોઈ નાંખે અને પાક કરી દે છે અને મૃત્યુ આપે તો બખ્ષી દે છે અને રહેમ (કૃપા) કરે છે.

હદ્દીસ (૧૧): તિરમિઝી બધીફાદએ તસહીહ તથા તહસીન તથા ઈબ્ને માજા તથા દારોમી હજરત સાદ રહિયલ્વાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુસુરને પૂછવામાં આવ્યું કોના ઉપર બલા (વિપત્તિ) અધિક સખત હોય છે. આપે ફરમાવ્યું અંબિયા ઉપર, પછી જે ઉત્તમ છે, પછી જે ઉત્તમ છે. આદમીઓમાં જેટલું દીન હોય છે તેના જ અનુસાર બલા (આજમાયેશ) માં વ્યસ્ત કરવામાં આવે છે. જો દીનમાં પ્રબળ છે તો બલા (મુસીબત) પણ તેના ઉપર સખ્ત હશે. અને દીનમાં નિર્બળ છે તો તેના ઉપર આસાની કરવમાં આવે છે. તો સર્વદા બલામાં વ્યસ્ત કરવમાં આવે છે ત્યાં સુધી કે જમીન ઉપર એવી તે રીતે ચાલે છે કે તેના ઉપર કોઈ ગુનોહ રહ્યો નથી.

હદ્દીસ (૧૨): તિરમિઝી તથા ઈબ્ને માજા અનસ રહિયલ્વાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુસુર ફરમાવે છે કે, જેટલી બલા (મુસીબતો) અધિક એટલો જ સવાબ વધારે. અને અલ્વાહ અઝા વ જલ્લ જ્યારે કોઈ કોમને મહિબુબ (પ્રિય) રાખે છે તો તેને બલા (વિપત્તિ) માં નાંખે છે. જે તેનાથી રાજી હોય તેના માટે રાજી છે અને જે તેનાથી નારાજ થયો તેના માટે નાખુશી, અને બીજી રિવાયત તિરમિઝીની તેમનાથી જ એમ છે કે, હુસુર ફરમાવે છે કે, જ્યારે અલ્વાહ તાલા પોતાના બંદા સાથે

ઘેર (ભલાઈ) નો ઈરાદો રાખે છે તો તેને હુનિયામાં જ સજા આપી દે છે જ્યારે શાર (બુરાઈ) નો ઈરાદો ફરમાવે છે તો તેને ગુનાહનો બદલો આપતો નથી અને ડિયામતના દિવસે તેનો પુરો બદલો આપશે. **હદ્દીસ (૧૩):** ઈમામ માલિક તથા તિરમિઝી અબુ હુરેરહ રહિયલ્વાહો અન્હોથી રિવાયત કરે છે કે, હુસુર સલ્લલ્વાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, મુસલમાન પુરુષ તથા સ્ત્રી ના જંન માલ તથા ઔલાદમાં જિત્ય બલા (યાતના) રહે છે ત્યાં સુધી કે અલ્વાહ તાલાથી એ હાલતમાં મળે છે કે તેના ઉપર ખતા (નાના ગુનાહ) કાંઈ નથી.

હદ્દીસ (૧૪): અહમદ તથા અબુ દાઉદ મોહંમદ બિન ખાલિદ અન અબીહે અનજાદદેહથી રિવાયત કરે છે કે હુસુર સલ્લલ્વાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે, બંદા માટે ઈલ્મે ઈલાહીમાં કોઈ મરતબો (પદવી) મુકર્રર હોય છે અને ત આ' મલના કારણો તે રૂતબાએ (પદે) ન પહોંચ્યો તો બદન અથવા માલ અથવા ઔલાદમાં તેની ઈબ્બેલા (આજમાઈશ) કરે છે. ત્યાં સુધી કે તેને તે મરતબાએ પહોંચાડી દે છે જે તેના માટે ઈલ્મે ઈલાહીમાં છે. **હદ્દીસ (૧૫):** તિરમિઝીએ જાબિર રહિયલ્વાહો અન્હોથી રિવાયત કરી કે, હુસુર ફરમાવે છે કે “જ્યારે ડિયામતના દિવસે બલાવણા (વિપત્તગ્રસ્ત) ને સાવબ આપવામાં આવશે તો આ ફિયતવાળા (રાહતવાળા) તમના કરશે કે કદાચ હુનિયામાં કાતરોથી ખાલો (ચામડી) કાપવામાં આવતી.” (તો કેટલું સારું થાત કે આજે સવાબના હકદાર થાત.)

હદ્દીસ (૧૬): અબુ દાઉદ આમેરૂર્મ રહિયલ્વાહો અન્હોથી રિવાયત કરે છે કે, રસુલુલ્વાહ સલ્લલ્વાહો અલયહે વસલ્લમે બીમારીયોનો ઉલ્લેખ કરીને ફરમાવ્યું કે, મોમિન જ્યારે બીમાર થાય પછી સારો થઈ જાય તો તેની બીમારી ગુનાહોનો કફફારો (પ્રાયશ્વિત) થઈ જાય છે. અને ભવિષ્ય માટે નસીહત. અને મુનફિક જ્યારે બીમાર થાય પછી સારો થાય તો તેનું દખાંત ઉટ જેવું છે કે માલિકે તેને બાંધ્યું ફરી દુટું કરી દીધું તો ન તેને એ ખબર છે કે કેમ બાંધ્યું અને ન એ ખબર છે કે કેમ છોડી દીધું.

એક માણસે અર્જ કરી, યા રસુલુલ્લાહ - બીમારી શું વસ્તુ છે ? હું તો ક્યારેય બીમાર થયો નથી. આપે ફરમાવ્યું “અમારી પાસેથી ઉઠી જી. કે તું અમારા પૈકી નથી.” (કારણ કે બીમારી પણ એક નેઅમત છે અને તુ તેનાથી મહરૂમ છે અનુ.)

હદ્દીસ (૧૭) : ઈમામ અહ્મદ, શાદ બિન ઔસ રદિયલ્લાહો અનંદોથી રિવાયત કરે છે કે, હું જુરે ફરમાવે છે કે, અલ્લાહ અગ્ર વજલ ફરમાવે છે કે જ્યારે હું મારા મોમિન બંદાને બલા (આપત્તિ) માં નાંખું અને તેઓ આ વિપત્તિ પર મારી સુત્તિ કરે તો તે પોતાના શયન ખંડમાંથી ગુનાહોથી એવો પાક થઈને ઉઠશે કે જેવો એજ દિવસે તેની માતાની કુઝે જન્મયો અને રબ્બતબારક વતાનાલા ફરમાવે છે, મેં મારા બંદાને બંદીવાન અને વિપત્તગ્રસ્ત કર્યો તેના માટે અમલ એવો જ ચાલુ રાખો જેવો તંદુરસ્તીમાં હતો.

દર્દીની એયાદત (બીમારની ખબર કાઢવા) માટે જવું સુન્નત છે. આ હદ્દીસમાં તેની બહુ જ ફરીલત આપી છે.

એચાદતના ફુર્ગાઈલ (બીમાર પુરી)

હદ્દીસ (૧) : બુખારી મુસ્લિમ, અબુદાઉદ તથા ઈબ્ને માજા અબુહુરેરહ રદિયલ્લાહો અનંદોથી રિવાયત કરે છે કે, હું જુરે અકદસ સલ્લલાહો અલ્યાહે વસ્તુલ્લમ ફરમાવે છે કે, મુસલમાન પર મુસલમાનના પાંચ હક્ક છે.

(૧) સલામનો જવાબ આપવો. (૨) દર્દીની ખબર કાઢવા જવું. (૩) જનાઃની સાથે જવું. (૪) દાવત કબુલ કરવી. (૫) છીકવાવાળાનો જવાબ આપવો. (જ્યારે તે અલહિમ્દો, લિલ્લાહ કહે.)

હદ્દીસ (૨) : સહીહયનમાં બરાઅબિન અન્જિબ રદિયલ્લાહો અનંદો કહે છે કે, અમોને હું જુરે સાત વાતોનો હુકમ આંખો, ઉપરોક્ત પાંચ વાતોનો ઉલ્લેખ કરીને કહ્યું :

(૬) કસમ (સોગંદ) ખાવાવાળાની કસમ પૂરી કરવી. (૭) મજલુમ (પીડિત) ની સહાયતા કરવી.

હદ્દીસ (૩) : બુખારી તથા મુસ્લિમ, સૌબાન રદિયલ્લાહો અનંદોથી રિવાયત છે, હું જુરે હક્કદસ સલ્લલાહો અલ્યાહે વસ્તુલ્લમ એક એ'રાબી (ગામડીય સહાબી) ની એયાદત (બીમારપુરી) માટે તશરીફ લઈ ગયા અને આદત મુબારક એ હતી કે જ્યારે કોઈ દર્દીની એયાદત માટે તશરીફ લઈ જતા તો આમ ફરમાવતા - “લા બાસ

સલ્લલાહો અલ્યાહે વસ્તુલ્લમ ફરમાવે છે કે, મુસલમાન જ્યારે પોતાના મુસલમાન ભાઈની બીમારીની ખબર કાઢવા ગયો તો પાછા ફરવા સુધી નિત્ય જન્નતના ફળ વિજાવામાં રહ્યો.

હદ્દીસ (૪) : સહીહ મુસ્લિમ શરીફમાં, અબુહુરેરહ રદિયલ્લાહો અનંદોથી રિવાયત છે કે, રસુલુલ્લાહ સલ્લલાહો અલ્યાહે વસ્તુલ્લમ ફરમાવે છે કે અલ્લાહ અગ્ર વજલ કિયામતના દિવસે ફરમાવશે. અથ ઈબ્ને આદમ ! હું બીમાર થયો તો તેમારી એયાદત કરી નહીં ? તે અર્જ કરશે અથ અલ્લાહ ! હું તારી એયાદત કેવી રીતે કરતો તું તો રખ્યુલ આલમીન (જગતનો પાલનહાર) છે. (અર્થાત્-પુદા કેવી રીતે બીમાર થઈ શકે છે કે તેની એયાદત કરવામાં આવે.) અલ્લાહ ફરમાવશે. શું તને ખબર નથી કે મારો ફલાણો બંદો બિમાર થયો અને તે તેની એયાદત કરી નહીં શું તું નથી જાણતો કે જો તું તેની એયાદત માટે જતો તો તું મને તેની પાસે પામત. અને અલ્લાહ ફરમાવશે-અથ ઈબ્ને આદમ ! મેં તારી પાસે બોજન માંયું તો તે આચ્યુનહીં. તે અર્જ કરશે અથ અલ્લાહ ! તને બોજન કેવી રીતે આપતો. તું તો રખ્યુલ આલમીન છે. અલ્લાહ ફરમાવશે શું તને ખબર નથી કે મારા ફલાણા બંદાએ તારાથી ખાણું માંયું અને તે આચ્યુનહીં શું તને ખબર નથી કે જો તેં ખાણું આચ્યું હોત તો તેને (અર્થાત તેના સવાબને) મારી પાસે પામત. અલ્લાહ ફરમાવશે-અથ ઈબ્ને આદમ ! મેં તારાથી પાણી માંયું તો તે આચ્યુનહીં. તે અર્જ કરશે અથ અલ્લાહ ! હું તને કેવી રીતે પાણી આપત તું તો રખ્યુલ આલમીન છે. અલ્લાહ ફરમાવશે. મારા ફલાણા બંદાએ તારી પાસે પાણી માંયું તો તે તેને પીવડાવ્યું નહીં. જો પીવડાવ્યું હોતો મારી પાસે પામત.”

હદ્દીસ (૫) : સહીહ બુખારી શરીફમાં ઈબ્ને અખ્બાસ રદિયલ્લાહો અનંદોમાથી રિવાયત છે, હું જુરે અકદસ સલ્લલાહો અલ્યાહે વસ્તુલ્લમ એક એ'રાબી (ગામડીય સહાબી) ની એયાદત (બીમારપુરી) માટે તશરીફ લઈ ગયા અને આદત મુબારક એ હતી કે જ્યારે કોઈ દર્દીની એયાદત માટે તશરીફ લઈ જતા તો આમ ફરમાવતા - “લા બાસ

તહુરુન ઈનશા અલ્લાહો ત્યાલા” અર્થાત કંઈ વાંધા જનક વાત નથી ઈન્શા અલ્લાહો ત્યાલા આ બીમારી ગુનાહોથી પાક કરનાર છે.) તે એ’ રાખીને પડા એ ફરમાવ્યું “લાબાસ તહુરુન ઈનશા અલ્લાહો ત્યાલા.”

હદીસ (૬) : અબુ દાઉદ તથા તિરમિઝી અમીરુલ મોમેનીન મૌલા અલી રદ્દીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે, રસુલુલ્લાહ સલ્લાલ્લાહો અલયહે વસ્તુભે ફરમાવે છે કે-જે મુસ્લિમાન કોઈ મુસ્લિમાનની એયાદત (બીમાર પુસી) માટે સવારે જાય તો સાંજ સુધી તેના માટે સિત્તેર (૭૦) હજાર ફરિશ્તા ઈસ્તિગફાર કરે છે, અને સાંજે જાય તો સવાર સુધી સિત્તેર હજાર ફરિશ્તા તેના માટે ઈસ્તિગફાર કરે છે. તેના માટે જન્નતમાં એક બગાચો હશે.

હદીસ (૭) : અબુ દાઉદ અનસ રદ્દીયલ્લાહો અન્હોથી રિવાયત કરી કે, હુલ્લુરે ફરમાવે છે કે-જે માણસ સારી રીતે વુલ્લુ કરીને સવાબની નિયતથી પોતાના મુસ્લિમાનભાઈની એયાદત (બીમાર પુસી) માટે જાય તો તેને જહન્નમથી સાઈઠ (૬૦) વર્પના માર્ગ જેટલો દૂર કરી દેવામાં આવ્યો.

હદીસ (૮) : તિરમિઝી બ ઈફાદાએ તહસીન તથા ઈબ્ને માજા અબુ હુરરહ રદ્દીયલ્લાહો અન્હોથી રાવીકે હુલ્લુરે ફરમાવે છે કે, જે માણસ દઈની એયાદતે જાય છે તો આકાશથી મુનાદી (નાદકતી) નિદા (ધોપણા) કરે છે, તું સારો છે અને તારું ચાલવું સારું છે અને જન્નતની એક મંજિલ (પડાવ) ને તેં ઠેકાણું બનાવ્યું.

હદીસ (૯) : ઈબ્ને માજા અમીરુલ મોમેનીન ફારુક આજમ રદ્દીયલ્લાહો અન્હોથી રાવી કે, હુલ્લુરે ફરમાવ્યું- જ્યારે તું દઈ પાસે જાય તો તેને કહે કે તારા માટે હુઆ કરે કારણ કે તેની હુઆ, ફરિશ્તાઓની હુઆ જેવી છે.

હદીસ (૧૦) : બયહકીએ સર્હિદબિન અલમુ સૈયબથી મુરસલન રિવાયત કરી કે હુલ્લુરે ફરમાવે છે કે, ઉત્તમ એયાદત એ છે કે જહ્વી ઉઠી જાય અને તેના જેવું જ અનસ રદ્દીયલ્લાહો અન્હોથી પણ રિવાયત છે.

હદીસ (૧૧) : તિરમિઝી તથા ઈબ્ને માજા અબુ

સર્હિદ ખુદરી રદ્દીયલ્લાહો અન્હોથી રાવી છે કે, હુલ્લુરે ફરમાવે છે કેમ, જ્યારે દર્દી પાસે જાવ તો તેના આયુષ્ય માટે દિલને ખુશ કરનારી વાત કરો કે તે કોઈ ચીજને રદ કરશે નહીં. અને તેના આત્માને સારું લાગશે.

હદીસ (૧૨) : ઈબ્ને હબ્બાન પોતાની સહીહમાં તેમનાર્થી જ રાવી કે, હુલ્લુર ફરમાવે છે કે, પાંચ વસ્તુઓ જે એક દિવસમાં કરશે અલ્લાહ ત્યાલા તેને જન્નતીઓમાં લખી દેશે.

(૧) બીમારની એયાદત (બીમાર પુસી) કરે. (૨) જનાજામાં હાજર થાય. (૩) રોજો રાખે. (૪) જુમ્માની નમાઝ પઢવા જાય. (૫) ગુલામ આજાદ કરે.

હદીસ (૧૩-૧૪) : અહમદ, તિબાની અબુ યઅલા, ઈબ્ને પુઝ્યમા, ઈબ્ને હબ્બાન, માઝા બિન જબલ અને અબુ દાઉદ, અબુ એમામા રદ્દીયલ્લાહો અન્હોથી રાવી કે હુલ્લુર ફરમાવે છે કે પાંચ ચીજો એવી છે કે જે માણસ તે પૈકી એક પણ કરે તો અલ્લાહ અજાદ જહ્વાની જમાનતમાં આવી જશે.

(૧) દઈની એયાદત કરે અથવા (૨) જનાજાની સાથે જાય અથવા (૩) ગજવહમાં જાય અથવા (૪) ઈમામની પાસે તેની તાજીમ તથા તૌકીર (આદર-સન્માન) ના ઈરાદાથી જાય અથવા (૫) પોતાના ધરમાં જેસી રહે કે લોકો તેનાર્થી સલામત રહે અને તે લોકોથી (સલામત રહે).

હદીસ (૧૫) : ઈબ્ને પુઝ્યમહ પોતાની સહીહમાં અબુ હુરયરહ રદ્દીયલ્લાહો અન્હોથી રાવી કે હુલ્લુરે એકરમ સલ્લાલ્લાહો અલયહે વસ્તુભે ફરમાવ્યું આજે તમારામાંથી કોણ રોજાદાર છે. અબુબક રદ્દીયલ્લાહો તાખાલા અન્હોએ અર્જ કરી કે હુલ્લુરે ફરમાવ્યું : આજે તમારામાંથી કોણે મિસ્કીન (ગરીબ) ને ખાણું ખવડાવ્યું? હજરત અબાબકે અર્જ કરી મેં. હુલ્લુરે ફરમાવ્યું : કોણો આજે દઈની એયાદત (બીમાર પુસી) કરી. હજરત અબાબકે અર્જ કરી, મેં. હુલ્લુરે ફરમાવ્યું : આ ખસલતો (લક્ષ્ણો) તે માણસમાં એકગ થશે જે જન્નતમાં દાખલ થશે.

હદીસ (૧૬) : અબુ દાઉદ તથા તિરમિઝી અખુલ્લાહ ઈબ્ને અખ્બાસ રદ્દીયલ્લાહો અન્હોમાથી રાવી કે

હુંગુર સલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે “જ્યારે મુસલમાન કોઈ મુસલમાનની એયાદત (બીમાર પુસી) માટે જાય તો સાત વખત આ દુઓ પઢે. : અસઅલુલ્લાહલ્યાજીમ રષ્ભલ્યાર્શિલ્કરીમ, અંય-પથફયકા !”

(તરજુમો - અલ્લાહ અજીમ (મહાન)થી દુઓ કરું છું જે અર્શ કરીમનો માલિક છે તે તને શિફા (તદુરસ્તી) આપે.)

મૃત્યુ આવવાનું બ્યાન :

જગત ગુજરાવા યોગ્ય તથા ત્યજવા (છોડવા) ઘોગ્ય છે. અંતે એક દિવસ મૃત્યુ આવવાનું છે. જ્યારે અહીંથી કુચ કરવાની જીછ તો ત્યાંની તૈયારી જોઈએ જ્યાં સર્વદા રહેવાનું છે અને તે સમયને પ્રત્યેકક્ષણ નજર સમક્ષ રાખવો જોઈએ.

હુંગુરે અકદસ સલ્લાહો અલયહે વસલ્લમે અભુલ્લાહબિન ઉમર રદ્ડીયલ્લાહો અન્ધોમાને ફરમાવ્યું - દુનિયામાં એવી રીતે રહો જેવા કે મુસાફિર, બલ્કેવાતમાર્ગુ. તો મુસાફિર જેવી રીતે એક અજાણ વ્યક્તિ હોય છે અને વાટમાર્ગ, માર્ગના ખેલ-તમારાઓમાં વ્યસ્ત થતો નથી કે ખોટી થશે અને ધ્યેય સુધી પહોંચવામાં અસકળ રહેશે. એવી રીતે મુસલમાનોએ દુનિયામાં ફસુંન જોઈએ અને એવા સંબંધો બાંધે નહીં કે મુખ ધ્યેયના પ્રાપ્ત કરવામાં આડખીલી રૂપ થાય. અને મૃત્યુને અધિકતમ યાદ કરે કે તેની યાદ દુન્યવી સંબંધોની જડ કાપે છે.

હદીસમાં ઈશ્રદ્ધ ફરમાવ્યો :- “અકસેરુ જિકર હાજીમીલ્લગ્ગાતિલ્મૌત”

(તરજુમો - લિજજતોને તોડી નાંખનાર મૃત્યુને અધિકતાથી યાદ કરો.)

પરંતુ કોઈ મુસીબત પર મૃત્યુની આરજી કરે નહીં કે તેની મનાઈ આવી છે. અને જો લાચારીએ એવી આરજી કરવી જ છે તો એમ કહે કે ઈલાહી મને ત્યાં સુધી જીવતો રાખ જ્યાં સુધી કે જીવન મારા માટે ઘેર હોય. અને જ્યારે મારા માટે મૃત્યુ ઉત્તમ હોય ત્યારે મૃત્યુ આપ. આ હદીસને બુખારી તથા મુસ્લિમે અનસ રદ્ડીયલ્લાહો અન્ધોથી રિવાયત કરી છે. અને મુસલમાનોએ અલ્લાહથી નેક ગુમાન રાખવું જોઈએ, તેની રહેમતનો ઉમેદવાર રહે.

હદીસમાં ફરમાવ્યું છે કે કોઈ મરે નહીં પરંતુ

તે હાલતમાં કે અલ્લાહ અગ્ર વ જલ્લથી નેક ગુમાન રાખતો હોય. કે ઈરશાદ ઈલાહી છે. “અના ઈન્દ્ર જન્મે અબ્દી બી.” (અર્થ : મારો બંદો મારાથી જેવું ગુમાન રાખે છે હું એવી જ રીતે તેના સાથે વર્તાવ કરું છું) આપ એક નવજવાન પાસે તશરીફ લઈ ગયા અને તે અંતિમ શાસ લઈ રહ્યો હતો. આપે ફરમાવ્યું, “તું પોતાને કઈ હાલતમાં દેખી રહ્યો છે ?” તેણે અર્જ કરી યા રસુલલ્લાહ, અલ્લાહથી મને આશા છે અને પોતાના ગુનાહોથી મને ડર છે,

આપે ફરમાવ્યું, આ બેને (૧) ખૌફ (૨) તથા (૨) રજા (ઉમીદ) આ સમયે જે બંદાના દિલમાં હશે અલ્લાહ તેને તે આપશે જેની તે આશા રાખે છે. અને તેનાથી અમનમાં રહેશે જેનાથી ડર રાખે છે. રૂહ કળું થવાનો સમય બહુ જ સખત સમય છે કે, તેના ઉપર જ સધળા અમલનો આધાર છે, બલ્કે ઈમાનના સધળા આપિત સંબંધી પરિણામો તેના ઉપર જ કમબદ્ધ છે કે, એતેબાર (માન્ય) ખાત્માનો જ છે. અને શયતાન ઈમાન છીનવાની ચિત્તામાં છે. અલ્લાહ તથાલા જેને તેના મક (ફરેબ)થી બચાવે અને ઈમાન પર ખાત્માઓ નસીબ કરે તે મુરાહે પહોંચ્યો. “ઈન્નમલ્લિબ્રતો બિલ ખવાતીમ” (અર્થ : એતેબાર ખાત્માનો જ છે.) “અલ્લાહુમ્મ રૂકના હુસ્લલ-ખાતેમતે.” હુંગુર સલ્લાહો અસયહે વસલ્લમ ઈશ્રદ્ધ ફરમાવે છે, જેનો આપરી કલામ (વાક્ય) “લાઈલાહ ઈલ્લાહલ્લાહ” થયો અર્થાત કલમએ તથ્યબદ્ધ, તે જન્મતમાં દાખલ થયો.

ફિકલી મલાઈલ (મૃત્યુના)

જ્યારે મૃત્યુનો સમય નજીક આવે અને તેના ચિન્હો દ્વારા યોગ્ય તો સુન્નત એછે કે જમણા પાસા પર સુવડાવી કિબ્લા તરફ મુખ કરી દો અને એ પણ જાઈજ છે કે ચિત્ત સુવડાવો અને કિબ્લા તરફ પગ કરો કે, એવી રીતે પણ મોહું કિબ્લા તરફ થઈ જશે, પરંતુ આ હાલતમાં મસ્તકને થોહુંક ઊચુ રાખો અને કિબ્લા તરફ મુખ કરવું મુશ્કેલ હોય કે તેનાથી તેને તકલીફ થતી હોય તો જે હાલતમાં છે રહેવા દો.

(દુર્ભ મુખ્તાર વિગેર)

મસ્ફલા-(૫૭૧) : જાંકની (જીવ નીકળવાના સમય) ની હાલતમાં જ્યાં સુધી રૂહ (જીવ) ગળામાં ન આવે તેને તલ્કીન કરો. અર્થાત તેની પાસે બુલંદ

અવાજથી પઢો. “અશહદો અલલા ઈલાહા ઈલ્હલ્લાહો વઅશહદો અન્ મુહમ્મદર્સુલ્લાહ.”
પરંતુ તેને તે પઢવાનો હુકમ ન કરો.

(આમતુલ કુતુબ)

મરસલા-(૫૭૨): જ્યારે તેણે કલમો પઢી લીધો તો “તલકીન” મૌકુફ કરી દો. હાં, જો કલમો પઢ્યા પછી તેણે કોઈ વાત કરી તો ફરી તલકીન કરો કે તેનો અંતિમ શબ્દ “લાઈલાહ ઈલ્હલ્લાહો મુહમ્મદર્સુલ્લાહ” હોય. (આલમગીરી)

મરસલા-(૫૭૩): તલકીન કરનાર કોઈ નેક શખ્સ હોય, એવો ના હોય કે જેને તેના મરવાની ખુશી હોય. અને તેની પાસે તે સમયે નેક અને પરહેઝગાર લોકોનું હોવું બહુજ સારી વાત છે. અને તે સમયે ત્યાં “સૂરાએ યાસ્નિન શરીફ” ની તિલાવત અને ખુશબુ હોવું મુસ્તહબ છે. દા.ત. લોબાન અથવા અગરબતીઓ સળગાવી દો. (હર્રે મુખ્તાર વિગેરે)

મરસલા-(૫૭૪): મૃત્યુ સમયે ડેઝ અને નિફાસ (માસિક તથા સુવાવડ) વાળી સ્ત્રી તેની પાસે હાજર થઈ શકે છે. (આલમગીરી) પરંતુ જેનું ડેઝ તથા નિફાસ રોકાઈ (બંધ થઈ) ગયું હોય અને હજુ ગુસ્લ કર્યું નથી તેને અને જનાબતવાળાઓ આવવું ન જોઈએ. અને પ્રયત્ન કરે કે, મહાનમાં કોઈ તસ્વીર (ફોટો) કે કુતરે ન હોય આ ચીજો હોય તો તત્કાળ કાઢી દેવામાં આવે, કે જ્યાં તે હોય છે ત્યાં રહેતના ફરિશતા આવતા નથી. તેની નજર (જાંકની) ના સમયે પોતાના અને તેના માટે હુઅએ ઐર કરતા રહો. કોઈ ખરાબ શબ્દ જીબથી કાઢો નહીં, કે તે સમયે જે કાંઈકહેવામાં આવે છે ફરિશતા તેના ઉપર આમીન કહે છે. નજર (જીવ નીકળવા) માં સખ્તી દેખો તો સૂરાએ યાસ્નિન તથા સૂરાએ રાએ પઢો.

મરસલા-(૫૭૫): જ્યારે રૂદ્ધ નિકળી જાય તો એક પહોળી પરી જગ્દબાની નીચેથી માથા ઉપર લઈ જઈને બાંધી દો કે મોહું ખુલ્લું ન રહે અને આંખો બંધ કરી દેવામાં આવે અને આંગણીઓ તથા હાથ પગ સીધા કરી દેવામાં આવે. આ કામ તેના ઘરવાળાઓમાં જે વધારે નરમી સાથે કરી શકતો હોય, દા.ત. બાપ અથવા બેટો તે કરે.

(જોહરહ નૈયરહ)

મરસલા-(૫૭૬): આંખો બંધ કરતી વખતે આ હુાં પઢો : બિસ્મિલ્હાહે વ અલા મિલ્હતે રસુલિલ્હાહે અલ્લાહુમ યસ્સિર અલૈહે અમ્રહુ વસહહિલ અલૈહે મા બાદહુ વ અસહીદ્હો બેલેકાએકા વજાલ માખરજ ઈલયહે ઐરમ-મિમા ખરજ અન્ધો. (હર્રે મુખ્તાર)

(તરજુમો): અલ્લાહના નામ સાથે અને રસુલ્લાહની મિલ્હત પર, અથ અલ્લાહ ! તુ તેના કામને તેના ઉપર આસાન કર અને તેના પછીના (કાર્યો)ને તેના ઉપર સહલ-સરળ કર અને પોતાની મુલાકાતથી તું તેને નેકબખ્ત (સદભાગળી) કર અને જેની તરફ નિકળ્યો (આભિરત) તેને તેનાથી બહેતર કર જેનાથી નિકળ્યો (દુનિયાથી)

મરસલા-(૫૭૭): તેના પેટ ઉપર લોખંડ અથવા ભીની (પલાળેલી) માટી અથવા બીજી કોઈ ભારે વસ્તુ મુકીદો કે, જેથી પેટ હુલી જાય નહીં. (આલમગીરી) પરંતુ જરૂરત કરતાં વધારે વજનદાર ન હોય, કે તે તકલીફ રૂપ છે. (હર્રે મુખ્તાર)

મરસલા-(૫૭૮): મૈયતના સધળા બદનને કોઈ કપડાથી ઠાંકી દો અને તેને ખાટલા અથવા પાટીયા વિગેરે કોઈ ઊંચી વસ્તુ પર મુકી દો. કે જમીનનો ભજ પહોંચે નહીં. (આલમગીરી)

મરસલા-(૫૭૯): મૃત્યુ સમયે જો માઝાલ્લાહ (અલ્લાહની પનાહ) તેની જલ્દે કુદ્દી કલ્યાણ (શબ્દ) નીકળ્યો તો કુદ્દનો હુકમ ન આપીશું કે શક્ય છે કે મૌતની સખ્તીમાં અકલ જતી રહી હોય અને બેદોશીમાં આ શબ્દ નિકળી ગયો. (હર્રે મુખ્તાર)

અને બહુજ શક્ય છે કે તેની વાત સંપૂર્ણ સમજમાં ન આવી કે એવી સખ્તીની હાલતમાં માનવી પુરી વાત સપાખ રીતે આદા કરી લે, તે મુશ્કેલ હોય છે.

મરસલા-(૫૮૦): તેના માથે કરજો (દેવું) અથવા જે પ્રકારાનું દેણ બાકી હોય જલ્દીથી જલદી અદા કરી દો, કે હદ્દીસમાં છે કે માયિત પોતાના દેણ (દેવા) માં કેદ છે. એક રિવાયતમાં છે કે તેની રૂદ્ધ (આત્મા) અધવચ્ચે ટીગાઓલી રહે છે. જ્યાં સુધી દેણ (દેવું) અદા ન કરી દેવામાં આવે.

મરસલા-(૫૮૧): માયિતની પાસે તિલાવતે કુર્અન જાઈજ છે. જ્યારે કે તેનું તમામ શરીર

કપડાથી ઢાકેલું હોય અને તસ્બીહ તથા બીજા અજાકાર (જિકો)માં સર્વથા વાંધો નથી.
(દુર્ભુખ્તાર, રદ્દુલ મુહ્તાર, આલમગીરી વિગેરે)
મસાલા-(૫૮૨) : ગુસ્લ તથા કફન દફનમાં ઉતાવળ કરવી જોઈએ. કેમકે હદ્દીસમાં તેની બહુ જ તાકીદ આવી છે. (જવહરણ)

મસાલા-(૫૮૩) : પાડોસીઓ અને તેના મિત્રો તથા સંબંધીઓને ખબર આપી દો કે, જનાગાની નમાજમાં નમાજીઓની અવિકતા થશે, અને તેના માટે દુઆ કરશે, કે તેમના ઉપર હક છે. કે તેની નમાજે જનાગા પઢે અને દુઆ કરે.

(આલમગીરી વિગેરે)

મસાલા-(૫૮૪) : બજારમાં તથા ધોરી માર્ગ (ઉપર તેની મૌતની ખબર આપવા માટે બુલંદ અવાજથી પોકારવું કેટલાકોએ મકરુહ બતાયું છે, પરંતુ સહીછ એ છે કે તેમાં વાંધો નથી પરંતુ જાહેરીયતની આદત અનુસાર મોટા મોટા શબ્દોથી ન હોય.

(જવહર વિગેરે, રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૫૮૫) : આકર્ષિક મૌતથી મર્યાદા તો જ્યાં સુધી પકીન (ખાત્રી) ન હોય, તજહીજ તથા તકફીન (કફન-દફન) મુલતવી રાખે.

(આલમગીરી)

મસાલા-(૫૮૬) : ઔરત મરી ગઈ અને તેના પેટમાં બાળક હરકત (ગતિ) કરી રહ્યું છે, તો ડાબી બાજુએથી પેટ ચીરીને બાળક કાઢવામાં આવે. અને જો સ્ત્રી જીવંત છે અને તેના પેટમાં બાળક મરી ગયું અને સ્ત્રીનો જીવ ઝોપમાં હોય તો બાળક કાપીને કાઢવામાં આવે. અને જો બાળક પણ જીવંત હોય તો કેટલીય તકલીફમાં બાળકને, કાપીને કાઢ વું જાઈજ નથી.

(આલમગીરી દુર્ભુખ્તાર)

મસાલા-(૫૮૭) : જો કોઈએ ઈરાદા પુર્વક કોઈનો માલ ગળી લીધો અને તે મરી ગયો તો જો એટલો માલ પાછળ મુકી ગયો છે કે તાવાન (બદલો) આપી દેવામાં આવે તો તરેકા (મૃતક સંપત્તિ)થી તાવાન અદા કરે. નહીં તો પેટ ચીરીને માલ કાઢ વામાં આવે. અને વગર ઈરાદ છે તો ચીરવામાં ન આવે. (દુર્ભુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસાલા-(૫૮૮) : ગર્ભ વંતી સ્ત્રી મરી ગઈ અને દફન કરી દેવામાં આવી પછી કોઈએ સ્વજનમાં દેખ્યું કે તેણીને બાળક પૈદા થયું તો કેવળ આસ્વજના આધારે કશ્ય ખોદવું જાઈજ નથી.

(આલમગીરી)

મૈયતના ગુસ્લનું બધાન :

મસાલા-(૫૮૯) : મૈયતન નવડાવવાનું ફર્જ કિફાયા છે. કેટલાક લોકોએ ગુસ્લ આપી દીધું તો સૌના માથેથી ઉતરી ગયું. (આલમગીરી)

મસાલા-(૫૯૦) : નવડાવવાનો તરીકો-રીત એ છે કે જે ચારપાઈ (ખાટલા) અથવા પાટીયા (તખ્ત) ઉપર નવડાવવાનો ઈરાદો હોય તેને ગ્રણ અથવા પાંચ અથવા સાત વખત લોબાનની ધુણી આપો અર્થાત જે ગીજમાં તે ખુશ્બુ સળગતી હોય તેને એટલી વખત ખાટલા વિગેરેના આસપાસ ફેરવો અને તેના ઉપર મૈયતને સુવડાવી કુંઠીથી ધુણણો સુધી કોઈ કપડાથી ઢાકી દો પછી નવડાવનાર પોતાના હાથ ઉપર કપું લપેટી, પ્રથમ ઈસ્તિનજો કરાવે, પછી નમાજ જૈવું વુજુ કરાવે, અર્થાત મોઢા પછી કોણી સમેત હાથ ધુવે પછી માથાનો મસોહ કરે, પછી પગો ધુવે. પરંતુ મૈયતના વુજુમાં ગટટાઓ સુધી પહેલા હાથ ધોવું અને કુલ્લી કરવું અને નાકમાં પાણી નાખવું નથી. હા, કોઈ કપડા અથવા દુનું પુમહું પલાળીને દાંતો અને મસોડાઓ અને હોઠો અને નસકોરા પર ફેરવી દો પછી માથા અને દાઢીના વાળ હોય તો ગુલ ઐરુથી ધુવે. આ ન હોય તો પાક સાખુ ઈસ્લામી કારખાનાનો બનેલો અથવા બેસન અથવા કોઈ બીજી ચીજાથી ધુવે. નહીં તો એકલું પાણી પણ કાફી છે. પછી ડાબા પાસે સુવડાવી માથાથી પગો સુધી બોરડીના પાંદળાથી ઉકાળું પાણી વહાવડાવો, કે તખ્તા સુધી પહોંચી જાય પછી જમણા પડખે સુવડાવી એવી જ રીતે કરો અને બોરડીના પાંદળાઓથી ઉકાળું પાણી ન હોય તો ફકત કકુલુ ગરમ પાણી કાફી છે. પછી મૈયતને ટેકો લગાવી બેસાડો અને નરમી સાથે પેટ ઉપરથી નીચે હાથ ફેરવો, જો કાંઈ નાપાકી નીકળે તો ધોઈ નાપો. વુજુ તથા ગુસ્લનું પુનરાવર્તન ન કરો. પછી છેવટે માથાથી પગો સુધી કપુરનું પાણી વહાવો.

પછી તેના શરીરને કોઈ પાક કપડાથી ધીમેથી લુછી નાખો.

મસઅલા-(૫૮૧) : એક વખત સંઘળા શરીર ઉપર પાણી વહાવવું ફરજ છે અને ગ્રાશ વખત સુન્નત છે. મુસ્તાહબ એ છે કે જ્યાં ગુસ્લ આપો પડ્યો કરી લો કે નવડાવવાવાળા અને મદદગારો સિવાય બીજો કોઈ દેખે નહીં. નવડાવતી વખતે ભલે એવી રીતે સુવડાવો જેમ કબ્રિમાં મુકો છો અથવા કિબ્લા તરફ પગ કરીને અથવા જેમ સરળતા હોય તેમ કરો.

(આલમગીરી)

મસઅલા-(૫૮૨) : નવડાવનાર તહારત સાથે હોય, જનાબતવાળા અથવા હેઝવાળી સ્તીએ જો ગુસ્લ આખું તો કરાહત છે, પરંતુ ગુસ્લ થઈ જશે. અને બે દુસ્યે નવડાવ્યો તો કરાહત પણ નથી. સારું એ છે કે નવડાવનાર મૈયિતનો સૌથી વધારે નિકટનો સંબંધી હોય, તે ન હોય અથવા નવડાવવું જાણતો ન હોય તો, કોઈ બીજી વ્યક્તિ જે અનામતતદાર (અયબ ઢાંકનાર) તથા પરહેઝગાર હોય તે નવડાવે.

(આલમગીરી)

મસઅલા-(૫૮૩) : નવડાવનાર વિશ્વાસપાત્ર માણસ હોય કે સંપૂર્ણ રીતે ગુસ્લ આપે. અને જે સારી વાત દેખે. દા.ત. ચહેરો ચમકી ઉઠ્યો અથવા મૈયિતના શરીરમાંથી ખુશું આવી, તો તેને લોકો સામે બયાન કરે. અને કોઈ બુરી ખરાબ વાત જોઈ દા.ત. ચહેરાનો રંગ કાળો થઈ ગયો અથવા દુગ્ધ આવી, અથવા સુરત કે અવયવોમાં પરિવર્તન-વિકાર આવ્યું તો તેને કોઈને કહે નહીં. અને એવી વાત કહેવું જાઈજ પણ નથી. હદ્દીસમાં ઈરશાદ થયો છે કે પોતાના મડદાંઓની ખુબીઓનો ઉલ્લેખ કરો અને તેની બુરાઈઓથી રોકાઈ જાવ.

(જવહરહ નૈયેરહ)

મસઅલા-(૫૮૪) : જો કોઈ બદમજહબ મર્યો અને તેનો રંગ કાળો થઈ ગયો અને કોઈ ખરાબ વાત જાહેર થઈ તો તેનું બયાન કરવું જોઈએ, તે તેનાથી લોકોને ઈભતત તથા નસીહત થશે. (આલમગીરી)

મસઅલા-(૫૮૫) : નવડાવનારની પાસે મુશ્ખુસળ ગાવવું મુસ્તાહબ છે, કે જો મૈયિતના શરીરમાંથી દુગ્ધ આવે તો તેને ખબર ન પડે. નહીંતો ગભરાઈ

જશે. તદઉપરાંત તેણે જરૂરત અનુસાર મૈયિતના અવયવો પર નજર નામદી, જરૂરત વગર કોઈ અવયવ પ્રત્યે દેખે નહીં, કેમકે શક્ય છે કે તેના શરીરમાં કોઈ ઐબ (ખામી) હોય જેને તે છુપાવતો હતો. (જવહરહ)

મસઅલા-(૫૮૬) : જો ત્યાં તેના સિવાય બીજા પણ નવડાવનાર હોય તો નવડાવાનું મહેનતાશું લઈ શકે છે. પરંતુ અફજલ એ છે કે ન લે. અને જો કોઈ બીજો નવડાવનાર ન હોય તો મહેનતાશું દેવું જાઈજ નથી. (દુર્દુષ્ટાર, આલમગીરી)

મસઅલા-(૫૮૭) : જનાબતવાળા (જેના ઉપર ગુસ્લ વાજિબ હોય) અથવા હેઝ તથા નિફાસવાળી સ્ત્રીનું અવસાન થયું તો એક જ ગુસ્લ કાફી છે કે વાજિબ હોવાના કેટલાએ કારણો હોય. સંઘળા એક ગુસ્લથી અદા થઈ જાય છે.

(દુર્દુષ્ટાર)

મસઅલા-(૫૮૮) : પુરુષને પુરુષ નવડાવે અને સ્ત્રીનેસ્ત્રી નવડાવે. મૈયિત નાનો છોકરો છે તો તેને સ્ત્રી પણ નવડાવી શકે છે. નાનાથી ભાવચિંદ્રિય એ છે કે શહવત (કામવાસના)ની હંદે પહોંચાને હોય.

(આલમગીરી)

મસઅલા-(૫૮૯) : જે પુરુષની જનનેસ્ત્રી (લીગ) અથવા અંડકોષ કાપી લેવામાં આવ્યો હોયતે પુરુષ જ છે. અર્થાત પુરુષ જ તેને ગુસ્લ આપી શકે છે. અથવા તેની પત્ની ગુસ્લ આપી શકે છે.

(આલમગીરી)

મસઅલા-(૬૦૦) : સ્ત્રી પોતાના પતિને ગુસ્લ આપી શકે છે જ્યારે કે મૃત્યુથી પહેલા અથવા બાદમાં કોઈ એવું કાર્ય ઘટીત થયું ન હોય જેનાથી તેના નિકાહમાંથી નીકળી જાય દા.ત. પતિના પુત્ર અથવા બાપને શહવત (કામવાસના)થી સ્પર્શ કર્યો અથવા ચુંબન કર્યું અથવા માઝા અલ્લાહ મુરતદ થઈ ગઈ, ભલે ગુસ્લથી પહેલા જ, પછી મુસ્લમાન થઈ ગઈ કે આ કારણોથી નિકાહ તુટી ગયો અને તે અજનબી (પરાઈ) થઈ ગઈ જેથી ગુસ્લ આપી શકતી નથી. (આલમગીરી વિગેર)

મસઅલા-(૬૦૧) : પત્નીને રજઈ તલાક આપી,

હજુ તે ઈદતમાં હતી કે પતિનું અવસાન થઈ ગયું તો ગુસ્લ આપી શકે છે. અને તલાકે બાઈન આપી છે તો જો કે ઈદતમાં છે (ઇતાં તે) ગુસ્લ આપી શકતી નથી. (આલમગીરી, દુર્ભુખ્તાર)

મસાલા-(૬૦૨) : ઉમ્મલ વલદ (તે બાંદી દાસી જેને પોતાના માલિકથી ઔલાદ પૈદા થઈ હોય) અથવા મુદબિરા અથવા મુકાતિબહ અથવા એ જ બાંદી (દાસી) પોતાના મૃતક આકા (માલિક)ને ગુસ્લ આપી શકતી નથી, કારણ આ સંઘળા હવે તેની ભિલ્કતમાંથી ખારિજ થઈ ગયા. એવી જ રીતે જો તે મરી જાય તો માલિક નવડાવી શકતો નથી.

(દુર્ભુખ્તાર વિગેરે)

મસાલા-(૬૦૩) : પતી મરી જાય તો પતિ ન તેને નવડાવી શકે છે ન સર્પશ કરી શકે છે. પરંતુ મોહું જોવાની મનાઈ નથી, (દુર્ભુખ્તાર) લોકોમાં એ વાત જે મશહૂર છે કે પતિ, પત્નીના જનાજાને ન કાંધો આપી શકે છે નકબ્રમાં ઉતારી શકે છે ન મોહું દેખી શકે છે કેવળ ગલતછે. કેવળ નવડાવવામાં અને તેના શરીરને કોઈ (કપડાં વિગેરેની) આડ વગર હાથ લગાડવાની મનાઈ છે.

મસાલા-(૬૦૪) : સ્ત્રીનું મૃત્યુ થયું અને ત્યાં કોઈ બીજી સ્ત્રી નથી કે નવડાવી દે તો તેણીને તયમ્મુમ કરાવવામાં આવે. પછી તયમ્મુમ કરાવનાર મહરમ હોય તો હાથથી તયમ્મુમ કરાવે અને અજનબી હોય ભલે પતિ હોય તો હાથ ઉપર કપું લપેટીને જમીન અથવા જમીનના પ્રકાર (ઉપર હાથ મારે અને તયમ્મુમ કરાવે. અને પતિ સિવાય કોઈ બીજો અજનબી હોય તો કાંડાઓ તરફ નજર કરે નહીં, અને પતિને તેની હાજરત નથી. અને આ મસાલામાં જવાન અને વૃદ્ધ સ્ત્રી બંનેનો એક જ હુકમ છે.

(દુર્ભુખ્તાર, આલમગીરી વિગેરે)

મસાલા-(૬૦૫) : પુરુષનો ઈન્નેકાલ થયો અને ત્યાં ન કોઈ પુરુષ છે ન તેની પત્ની તો જે સ્ત્રી ત્યાં છે તે તેને તયમ્મુમ કરાવે, પછી જો સ્ત્રી મરહમ છે અથવા તેની બાંદી (દાસી) તો તયમ્મુમમાં હાથ ઉપર કપું લપેટવાની જરૂર નથી અને અજનબી (પરાઈ) હોય તો કપું લપેટી તયમ્મુમ કરાવે.

(આલમગીરી)

મસાલા-(૬૦૬) : પુરુષનો પ્રવાસમાં ઈન્નેકાલ થયો અને તેની સાથે સ્ત્રીઓ છે અને કાફિર પુરુષો પણ છે. પરંતુ મુસલમાન પુરુષ કોઈ નથી તો સ્ત્રીઓ તે કાફિર પુરુષને નવડાવવાની રીત બતાવી દે કે તે નવડાવી દે. અને જો પુરુષ કોઈ નથી અને નાની છોકરી સાથે છે કે નવડાવવાની શક્તિ (તાકત) ધરાવે છે. તો આ સ્ત્રીઓ તેને શીખવાડી દે તે નવડાવે. એવી જ રીતે જો સ્ત્રીનો ઈન્નેકાલ થઈ ગયો અને કોઈ મુસલમાન સ્ત્રીઓ ત્યાં ઉપસ્થિત છે, તો પુરુષ તે ગુર મુસ્લિમ સ્ત્રીઓને ગુસલ આપવાની રીત શીખવાડે અને તેમજાથી નવડાવે, અથવા નાનો છોકરો તેના યોગ્ય હોય કે નવડાવી શકે તો તેને શીખવે અને તે નવડાવે. (આલમગીરી)

મસાલા-(૬૦૭) : એવા સ્થળે ઈન્નેકાલ થયો કે ત્યાં પાણી મળતું નથી તો તયમ્મુમ કરાવો અને જનાજાની નમાઝ પઢો. અને નમાઝ પછી જો દફન કરવા પહેલા જો પાણી મળી જાય તો નવડાવી નમાઝનું પુનરાવર્તન કરો.

(દુર્ભુખ્તાર, આલમગીરી)

મસાલા-(૬૦૮) : તે હિજડો જેની અંદર પુરુષ તથા સ્ત્રી બંનેની જનેન્દ્રીઓ હોય તો તેને ન પુરુષ નવડાવી શકે છે ન સ્ત્રી, બલ્કે તયમ્મુમ કરાવવામાં આવે. અને તયમ્મુમ કરાવનાર અજનબી (પરાયા) હોય તો હાથ ઉપર કપું લપેટી લે અને કાંડાઓ તરફ નજર કરે નહીં. એવી જ રીતે ઉપરોક્ત હિજડો કોઈ પુરુષ અથવા સ્ત્રીને ગુસ્લ આપી શકતો નથી. (આલમગીરી) ઉપર મુજબનો હિજડો જો નાનું બાળક હોય તો તેને પુરુષો પણ નવડાવી શકે છે અને સ્ત્રીઓ પણ એવી જ રીતે, તેનું ઉદ્દું.

મસાલા-(૬૦૯) : મુલસમાનનો ઈન્નેકાલ થયો અને તેનો બાપ કાફિર છે, તો તેને મુસલમાન નવડાવે. તેના બાપના કાબુમાં આપે નહીં. કોઈ કાફિર મુસલમાન થયો અને તેની પત્ની કાફિર છે અથવા અહલે કિતાબ છે તો નવડાવી શકે છે, પરંતુ જરૂરત વગર તેણીથી નવડાવવું બહુજ ખરાબ છે. અને જો આતશ પરસ્ત સ્ત્રી અથવા મૂર્તિ પૂજક છે અને તેના મરી ગયા પછી મુસલમાન થઈ તો

નવડાવી શકે છે. એ શરતે કે નિકાહમાં બાકી રહી હોય. નહીંતો નથી નવડાવી શકતી. અને નિકાહમાં બાકી રહેવાની સૂરત એ છે કે જો ઈસ્લામી રાજ્યમાં છે, તો હાડિમે ઈસ્લામ, પતિના મુસલમાન થવા પછી પત્નીને ઈસ્લામ પેશ કરે, જો માની લીધું તો ઠીક, નહીંતો તુરતજ નિકાહથી નિકળી જશે. અને જો ઈસ્લામી રાજ્યમાં નથી તો તેના ઈસ્લામનો પતિના પછી પત્નીને ત્રાણ ડેઝ આવવાનો ઈન્ટેજાર કરવામાં આવશે. આ મુદ્દત દરિમાયાન મુસલમાન થઈ ગઈ તો ઠીક, નહીંતો નિકાહથી નિકળી જશે. અને બંને હાલતોમાં પછી જો કે મુસલમાન થઈ જાય તો ગુસ્લ આપી શકતી નથી. (દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૬૧૦) : મૈયતથી ગુસ્લ ઉત્તરી જવા અને તેના ઉપર નમાજ સહીહ થવામાં મૈયત અને ફેલ શર્ત નથી. ચાંસુધીકે, મડદું જો પાણીમાં પડી ગયું, અથવા તેના. પર વરસાએ વરસ્યો કે સમગ્ર શરીર ઉપર પાણી વહી ગયું, પરંતુ જીવતાઓ ઉપર જે ગુરુદે મૈયિત વાજિબ છે તે તે સમગ્રે જવાબદારીમાંથી મુક્ત થશે કે નવડાવે. જેથી જો મડદું પાણીમાં મથ્યું તો ગુસ્લની નિયતથી તેને ત્રાણવાર પાણીમાં હલાવી લે, કે મસનુન ગુસ્લ અદા થઈ જાય. અને એક વખત હલાયું તો વાજિબ અદા થઈ ગયું પરંતુ સુન્નતની માંગ બાકી રહી, અને નિયત વગર નવડાવવાથી જવાબદારીમાંથી મુક્ત થઈ જશો, પરંતુ સવાબ મળશે નહીં. દા.ત. કોઈને શીખવાની નિયતથી મૈયિતને ગુસ્લ આપ્યું તો વાજિબ નાખ થઈ ગયું પરંતુ મૈયિતના ગુસ્લનો સવાબ મળશે નહીં. ગુસ્લ થઈ જવા માટે એ પણ જરૂરી નથી કે નવડાવનાર મુકલ્લફ મુસલમાન, આડિલ, બાલિગ અથવા નિયતવાળો હોય. માટે ના બાલિગ અથવા કાફિરે નવડાવી દીધું તો ગુસ્લ અદા થઈ ગયું એવી જ રીતે જો પરાઈ સ્ત્રીએ અથવા પુરુષે સ્ત્રીને ગુસ્લ આપ્યું ત્રો ગુસ્લ અદા થઈ ગયું, જો કે તેમણે નવડાવયું જાઈએ હતું નહીં.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૬૧૧) : કોઈ મુસલમાનનું અર્ધ કરતાં વધારે ઘડ મથ્યું તો તેને ગુસ્લ તથા કફન આપીશું. અને જનાયાની નમાજ પણ પઢીશું. અને નમાજ

પછી તે બાકીનો ટુકડો પણ મળ્યો તો જો તેમાં મસ્તક પડા છે તો પડા એજ હુકમ છે. અને જો માયું ન હોય અથવા લંબાઈમાં માથાથી પગ સુધી જમણા અથવા ડાબી બાજુનો ભાગ મળ્યો તો આ બંને હાલતોમાં ન ગુસ્લ છે, ન કફન ન નમાજ, બલ્કે એક કપડામાં લપેટીને દફન કરી દો.

(આલમગીરી, દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૬૧૨) : મરદું મથ્યું જીને એ ખબર નથી કે મુસલમાન છે કે કાફિર? તો જો તેનો દેખાવ (વઝા-કટા) મુસલમાનો જેવો હોય અથવા કોઈ ચિન્હ એવું હોય જેનાથી મુસલમાન હોવું સાબિત થાય છે, અથવા મુસલમાનોના મહોલ્લામાં મળી આવ્યું તો ગુસ્લ આપો અને નમાજ પઢો નહીં તો નહીં.

(આલમગીરી)

મસ્ફલા-(૬૧૩) : મુસલમાન મડદાં કાફિર મડદાઓમાં બેળસેળ થઈ ગયા હોય તો જો ખના વિગેરે કોઈ ચિન્હથી ઓળખ કરી શકીએ તો મુસલમાનોને જુદા કરીને ગુસ્લ તથા કફન આપે અને નમાજ પઢે. અને જો ઓળખાણ પડતી નહોય તો ગુસ્લ આપે અને નમાજમાં ખાસ મુસલમાનો માટે દુઅાની નિયત કરે. અને તેમનામાં જો મુસલમાનોની સંખ્યા અધિક હોય, તો મુસલમાનોના મકબરામાં દફન કરે. નહીં તો જુદા દફન કરે. (દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૬૧૪) : કાફિર મડદા માટે ગુસ્લ તથા કફન દફન નથી, બલ્કે એક ચીથડામાં લપેટી સાંકડા ખાડામાં દાબી દે. આ પણ ત્યારે કરો કે તેનો કોઈ સહધર્મના હોય. અથવા તેને લઈ જાય નહીં. તો મુસલમાન ન હાથ લગાડે ન તેના જનાયા (ઠાઠડી) માંસિકત (સંમિલન) કરે અને જો નિકટના સંબંધના કારણે શરીક થાય તો દુર દુર રહે. જો મુસલમાન જ તેનો સંબંધી સગો છે અને તેનો સહધર્મ કોઈ ન હોય અથવા લઈ જાય નહીં અને સંબંધ (સગાઈ) ના કારણે ગુસ્લ તથા કફન-દફન કરે તો જાઈએ છે. પરંતુ કોઈ કાર્યમાં તેની સાથે સુન્નતનો તરીકો વર્તે નહીં, બલ્કે નાપાકી ધોવાની રીતે તેના ઉપર પાણી વહાવે અને ચીથડામાં લપેટી સાંકડા ખાડામાં દબાવી દે. આ હુકમ કાફિરે અસલીનો છે. અને મુરતદનો

હુકમ એ છે કે સર્વથાન તેને ગુસ્લ આપે ન કરન, બલ્કે કુતરાની જેમ કોઈ તંગ ખાડામાં ધકેલી મારીમાં દબાવી દે.

(હુર્રુ મુખ્તાર)

મસ્ફલા-(૬૧૫) : જિમ્મી સ્ત્રીને મુસલમાન પુરુપનું હમલ (ગર્ભ) હતું અને તે મરી ગઈ, જો કે બાળ કમાં જીવ પડી ગયો હતો તો તેને મુસલમાનોના કષ્ટસ્તાનથી અલગ દફન કરે અને તેની પીઠ ડિબ્લા તરફ કરી દો કે, બાળકનું મુખ ડિબ્લા તરફ થાય. એટલા માટે કે બાળક જ્યારે પેટમાં હોય છે તો તેનું મુખમાંની પીઠની તરફ હોય છે. (હુર્રુ મુખ્તાર)

મસ્ફલા-(૬૧૬) : મૈયિતનું શરીર જો એવું થઈ ગયું કે હાથ લગાડવાથી ખાલ (ચામડી) ઉખડી જશે તો હાથ ન લગાવો કેવળ પાણી વહાવી દો.

(આલમગીરી)

મસ્ફલા-(૬૧૭) : નવડાવવા પછી જો નાક, કાન, મોઢા અને બીજા છિદ્રમાં રૂ (કપાસ) મુકી દો તો વાંધો નથી, પરંતુ બહેતર એ છે કે, ન મુકો.

(આલમગીરી, હુર્રુ મુખ્તાર વિગેરે)

મસ્ફલા-(૬૧૮) : મૈયિતની દાઢી અથવા માથાના વાળમાં કાંસકો કરવા અથવા નખ કાપવા અથવા કોઈ જગ્યાના વાળ મુંડવા અથવા કટરવા અથવા ઉખેડવા નાજાઈજ તથા મકરૂહે તહરીમી છે, બલ્કે હુકમ એ છે કે જે હાલતમાં છે એજ હાલતમાં દફન કરી દો. હા જો નખ તુટી ગયો હોય તો તેને લઈ શકો છો. અને જો નખ અથવા વાળ કાપી લીધા તો કફનમાં મુકી દો.

(હુર્રુ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર, આલમગીરી)

મસ્ફલા-(૬૧૯) : મૈયિતના બંને હાથ, કરવટો (પાસા) માં રાખો. છાતી ઉપર ન રાખો કે આ કુફ્ફારનો તરીકો છે. (હુર્રુ મુખ્તાર) કેટલાક સ્થળો નાફ (ઝુંટી) ના નીચે એવી રીતે રાખે છે જેવું કે નમાજના કિયામતમાં, આવું પણ કરો નહિ.

મસ્ફલા-(૬૨૦) : કેટલાક સ્થળોએ રિવાજ છે કે સામાન્યત મૈયિતના ગુસ્લ માટે કોરા માટલા તથા કોરા બદનાલાવે છે તેની કોઈ જરૂરત નથી. ઘરના વપરાશના માટલા-લોટાથી પણ ગુસ્લ આપી શકો છો. અને કેટલાક એ જહાલત કરે છે કે, ગુસ્લ પછી

તેને ફોડી નાખે છે. આ નાજાઈજ તથા હરામ છે, કે માલ નખ કરવું છે. અને એ ખ્યાલ હોય કે નાપાક થઈ ગયા તો તે પણ ફળુલ વર્થ પણ છે, કે પ્રથમ તો તેના ઉપર છાંટા પડતા નથી અને પડે તો પણ રાજેહ (જે કોંલ પર ફત્વો આપવામાં આવે તે) એ છે કે મૈયિતનું ગુસ્લે હુકમી નાપાકી હુર કરવા માટે છે. તો ઉપયુક્ત પાણીના છાટા પડે અને ઉપયુક્ત પાણી નાપાક નથી, જેવી રીતે જીવતાઓના વુજુ તથા ગુસ્લનું પાણી. અને જો ફરજ કરી લેવામાં આવે કે નાપાક પાણીના છાંટા પડે, તો ધોઈ નાખો ધોવાથી પાક થઈ જશે. અને અકસર સ્થળે તે માટલા-લોટા મરિજદોમાં મુકી દે છે. જો નૈયત એ હોય કે નમાજીઓને તેનાથી આરામ પહોંચશે અને તેનો મહદાને સવાબ પહોંચશે તો આ સારી નિયત છે અને એ મુકવું ઉત્તમ છે. અને જો એ વિચારહોય કે તેને ઘરમાં રાખવું નહુસત (અપ શુકન-અશુભ) છે તો સાવ મુર્ખતા છે અને કેટલાક લોકો માટલાનું પાણી ફેંકી દે છે તે પણ હરામ છે.

કફનનું બચાન :

મસ્ફલા-(૬૨૧) : મૈયિતને કફન આપવું ફર્જ ડિફાયા છે. કફનના ત્રણ દરજા છે. (૧) જરૂરત (૨) કિફાયત અને (૩) સુન્નત, પુરુષ માટે સુન્નત ત્રણ કપડાં છે. (૧) લિફાફો (૨) ઈજાર અને (૩) ખમીસ, અને સ્ત્રી માટે પાંચ છે. ત્રણ ઉપરોક્ત અને (૪) ઓઢણી (૫) સીનાબંધ, ડિફાયત કફન પુરુષ માટે બે કપડાં છે (૧) લિફાફો (૨) ઈજાર અને સ્ત્રી માટે ત્રણ-(૧) લિફાફો (૨) ઈજાર (૩) ઓઢણી અથવા (૧) લિફાફો (૨) ખમીસ (૩) ઓઢણી. કફને જરૂરત બંને માટે જે મળી આવે. અને ઓછામાં ઓછું એટલું તો હોય કે સધારું શરીર ઢાકી જાય. (હુર્રુ મુખ્તાર, આલમગીરી વિગેરે)

મસ્ફલા-(૬૨૨) : લિફાફો અર્થાત ચાદરની માત્રા એ છે કે મૈયિતના કદથી એટલા પ્રમાણમાં વધારે હોય કે બંને તરફ બાંધી શકાય. અને ઈજાર અર્થાત માથાથી પગ સુધી અર્થાત લિફાફો (ચાદર) કરતાં એટલો નાનો હોય જે બાંધવા માટે વધારે હતો અને ખમીસ જેને કફની કહે છે તે ગર્દનથી ધુંટણોના

નીચે સુધી અને આગળ અને પાછળ બંને બાજુઓ બરાબર હોય. જાહિલોમાં જે રિવાજ છે કે પાછળ ઓછો રાખે છે તે ભુલ છે, ચાક અને બાંધો આમાં ન હોય. પુરુષ અને સ્ત્રીની કફનીમાં તફાવત છે. પુરુષની કફની ખભાઓ ઉપર ચીરો અને સ્ત્રી માટે છાતી તરફ ચીરો. ઓફશી ત્રણ હથની હોવી જોઈએ. અર્થાત દોઢ ગજની, સીના બંધ, સ્તનથી કુંટી સુધી અને બહેતર એ છે કે જાંગ સુધી હોય. (આલમગીરી, રદ્દુલ મુહુતાર વિગેરે)

મસાલા-(૬૨૩) : જરૂર વગર કફને કિફાયતથી ઓછું કરવું નાજાઈજ તથા મકરૂહ છે. (હુર્રે મુહ્તાર) કેટલાક મોહતાજ લોકો કફને જરૂરત પર શક્તિમાન હોય છે, પરંતુ મસનુન કફન ઉપલબ્ધ નથી. મસનુન કફન માટે લોકો પાસે સવાલ કરે છે. આ નાજાઈજ છે. કેમકે સવાલ (માંગવું) જરૂરત વગર જાઈજ નથી. અને અહીંથાં જરૂરત નથી. અલબત્ત જો કફને જરૂરત ઉપર પણ શક્તિમાન ન હોય તો જરૂરત જેટલો સવાલ કરે, વધારે નહીં. હા, જો વગર માંગે મુસમમાનો ખુદ મસનુન કફન પુરું કરી દે, તો ઈન્સાઅલ્લાહ પુરો સવાબ પામશે.

(ફત્તાવા રિઝવીયા)

મસાલા-(૬૨૪) : વારસદારોમાં મતતેદ થથો, કોઈ બે કપડાં માટે કહે છે, અને કોઈ ત્રણ કપડા માટે તો ત્રણ કપડા આપવામાં આવે, કે આ સુન્નત છે. અથવા એમ કરવામાં આવે કે જો માલ વધારે છે અને વારસદારો ઓછા તો કફને સુન્નત આપે. અને જો માલ ઓછો છે અને વારસદાર વધારે છે તો કફને કિફાયત આપે. (જવહરહ વિગેરે)

મસાલા-(૬૨૫) : કફન સારું હોવું જોઈએ. અર્થાત પુરુષ ઈદો તથા જુમ્મા માટે જેવા કપડાં પહેરતો હતો અને સ્ત્રી જેવા કપડાં પહેરીને પીયરમાં જતી હતી તે કીમતનું કફન હોવું જોઈએ. હદીસમાં છે કે, પુરુષોને સારું કફન આપો કે પરસ્પર મુલાકાત કરતા અને સારા કફનથી ગર્વ કરેછે અર્થાત પુરુષ થાય છે. સફેદ કફન બેહતર છે. તે નબીએ કરીમ સલ્લાલ્લાહો અલયહે વસ્તુ મેફરમાયું: “પોતાના મડદાઓને સફેદ કપડાઓમાં દફનાવો”

(ગુનીયા, રદ્દુલ મુહુતાર વિગેરે)

મસાલા-(૬૨૬) : લાલ અથવા જફરાનનું રંગેલ અથવા રેશમનું કફન પુરુષ માટે મનાછે, અને સ્ત્રી માટે જાઈજ છે. અર્થાત જે વસ્ત્ર જિંદગીમાં પહેરી શકે છે તેનું કફન આપી શકાય છે અને જે જિંદગીમાં નાજાઈજ છે તેનું કફન પણ નાજાઈજ છે.

(આલમગીરી)

મસાલા-(૬૨૭) : ખુન્શા મુશ્કિલ હિજાને સ્ત્રીની જેમ પાંચ કપડાનું કફન આપવામાં આવે, પરંતુ લાલ રંગ અથવા જફરાનમાં રંગેલ અને રેશમી કફન તેના માટે નાજાઈજ છે. (આલમગીરી)

(નોટ : ખુન્શા મુશ્કિલ તેને કહે છે જેમાં પુરુષ અને સ્ત્રી બન્નેની જનેન્દ્રીઓ હોય)

મસાલા-(૬૨૮) : કોઈએ વસીયત કરી કે કફનમાં તેને બે કપડાં પહેરાવવામાં આવે, તો આ વસીયતનો અમલ ન કરવામાં આવે. અને તેને ત્રણ કપડાં પહેરાવવામાં આવે. અને જો એવી વસીયત કરી કે, હજાર રૂપીયાનું કફન પહેરાવવામાં આવે તો તે પણ લાગુ થશે નહીં મધ્યમ દરજાનું આપવામાં આવે. (રદ્દુલ મુહુતાર, હુર્રે મુહ્તાર, આલમગીરી)

મસાલા-(૬૨૯) : જે નાબાલીગ શહીવતની હદ સુધી પહોંચી ગયો તે બાલિગના હુકમમાં છે. (શહીવતની હદ છોકરાઓમાં એ કે તેનું હિલ સ્ત્રીઓ તરફ રાગબત કરે અને છોકરીઓમાં એ કે તેને દેખીને પુરુષને તેની પ્રત્યે અભિરૂચિ પૈદા થાય, અને તનો અંદરો છોકરાઓમાં બાર વર્ષ અને છોકરીઓમાં નવ વર્ષ છે.) અર્થાત બાલિગને કફનમાં જેટલા કપડાં આપવામાં આવે તેને પણ આપવામાં આવે અને તેનાથી નાના છોકરાને એક કપડાં અને નાની છોકરીને બે કપડાં આપી શકો છો અને છોકરીને પણ બે કપડાં આપવામાં આવે તો સારું છે અને બેહતર એ છે કે બંનેને પુરું કફન આપો ભલે એક દિવસનું બાળક હોય. (રદ્દુલ મુહુતાર)

મસાલા-(૬૩૦) : જુના કપડાંઓનું પણ કફન થઈ શકે છે, પરંતુ કપું ધોએલું હોવું જોઈએ. કેમ કે, કફન ચોખ્યું હોવું પ્રિય છે. (જવહરહ)

મસાલા-(૬૩૧) : મૈયતે જો પોતાની પાછળ કોઈ માલ છોડ્યો હોય તો કફન તેનાજ માલથી હોવું જોઈએ. અને કરજદાર છે તો લેણદાર કફને કિફાયત

માટે મના કરી શકે છે. અને મના કર્યું તો ઈજાજત સમજવામાં ન આવશે. (રદ્દુલ મુહતાર) પરંતુ લેણદાર ને મનાઈનો તે સમયે હક છે. જ્યારે તે સધળો માલ દેણ (દેવા) માં તુબેલો હોય.

મસ્થલા-(દિન ૨) : દેણ (દેવા) તથા વસિયત તથા મીરાસ આ સધળાં ઉપર કફન અંગ્રિમતા ધરાવે છે. અને દેણ, વસિયત પર અંગ્રિમતા ધરાવે છે. અને વસિયત મીરાસ પર અંગ્રિમતા ધરાવે છે.

(જવહરહ)

મસ્થલા-(દિન ૩) : મરનાર કોઈ માલ મુકી ગયો નથી તો કફન તેના માથે જેના માટે તેની જિંદગીમાં ભરણ પોખણ હતુ. અને જો કોઈ એવો માણસ નથી જેના ઉપર ભરણ પોખણ વાજિબ હતું અથવા છે. પરંતુ નાદાર - નિંધન છે તો બયતુલમાલ થી કફન આપવામાં આવે. અને બયતુલમાલ પણ ત્યાં ન હોય જેવું કે અહીંથા હિન્હુસ્તાનમાં સરકારી બયતુલમાલ નથી, તો ત્યાંના મુસલમાનો પર કફન આપવું ફરજ છે. જો ખબર હતી અને કફન ન આપ્યું તો સૌ ગુનેહગાર થશે. જો તે લોકો પાસે પણ નથી. (અર્થાત કફન આપવાની શક્તિ ધરાવતા નથી.) તો એક કપડાં જેટલું (કફન) બીજા લોકો પાસેથી માંગી લે. (જવહરહ, દુર્ભ મુહતાર)

મસ્થલા-(દિન ૪) : સ્ત્રીએ જોકે પોતાની પાછળ માલ છોડ્યો છે તે છતાં તેનું કફન પતિના માથે છે. એ શર્ત કે મૃત્યુ વખતે કોઈ એવી વાત દેખવામાં ન આવી જેનાથી સ્ત્રીનું ભરણ પોખણ પતિ ઉપરથી નખ થઈ જતું. જો પતિ મૃત્યુ પામ્યો અને તેની પત્ની માલદાર છે. તો પણ પત્ની ઉપર કફન વાજિબ નથી. (આલમગીરી, દુર્ભ મુહતાર)

મસ્થલા-(દિન ૫) : આ જે કહેવામાં આવ્યું કે ફલાણા ઉપર કફન વાજિબ છે, તેનાથી ભાવાર્થ શરીર કફન છે. એવી જ રીતે બીજો તજહીઝનો સામાન દા.ત. ખુશબુ અને ગુસ્સાલ (નવડાવનાર) અને લઈ જનારાઓનું મહેનતાણું અને દફનના પર્ચા સૌમાં શરીર માત્રા મુરાદ છે. તે સિવાયની બીજી વાતો જો મૈયિતના માલમાંથી કરવામાં આવી અને વારસદારોએ ઈજાજત પણ આપી દીધી હોય તો જાઈએ છે. નહીં તો પર્ચા કરનારના માથે છે.

(રદ્દુલ મુહતાર)

મસ્થલા-(દિન ૬) : કફન માટે રકમ માંગી લાવ્યા તેમાંથી કાંઈક બચી ગયું તો જો ખબર છે કે ફલાણા માણસે આપ્યું છે તો તેને પાછું આપી દો. નહીં તો બીજા કોઈ મોહતાજના કફનમાં પર્ચા કરી દો. તે પણ ન થાય તો સદકો કરી દો. (દુર્ભ મુહતાર)

મસ્થલા-(દિન ૭) : મૈયિત એવા સ્થળે છે કે, ત્યાં કેવળ એક માણસ છે અને તેની પાસે કેવળ એક જ કપડું છે તો તેના માથે એ જરૂરી નથી કે પોતાના કપડાનું કફન કરી દે. (દુર્ભ મુહતાર)

કફન પહેરાવવાનો તરીકો

મસ્થલા-(દિન ૮) : કફન પહેરાવાની રીત એ છે કે મૈયિતને ગુસ્સા આપ્યા પછી શરીર કોઈ પાક કપડાથી ધીમેથી લૂછીલે કે કફન ખરાબ ન થાય અને કફનને એક અથવા ત્રણ અથવા પાંચ અથવા સાત વાર ધૂણી દઈ લો. તેનાથી વધારે નહીં. પછી કફન એવી રીતે બીજાવવામાં આવે કે પહેલા મોટી ચાદર. પછી તેહબંધ પછી કફની પછી મૈયિતને તેના ઉપર સુવડાવી દો અને કફની પહેરાવો. અને દાઢી અને સધળા શરીર ઉપર ખુશબુ મસળો અને સિજાના સ્થળો અર્થાત માથા, નાક, હાથ, ધૂટણો તથા પગો ઉપર કપુર લગાડો. પછી ઈજાર અર્થાત લુંગી લપેટી લો. પ્રથમ ડાબી બાજુથી પછી જમણી બાજુથી, પછી લિફાફા ચાદરને લપેટો, પહેલા ડાબી તરફથી કે જેથી જમણો છેડો ઉપર રહે. અને માથાંના તથા પગની તરફ બાંધી દો, કે ઉડવાની આંશકા ન રહે. સ્ત્રીને કફની પહેરાવી તેના વાળ ના બે ભાગ કરીને કફનીના ઉપર છાતી ઉપર નાખી દો, અને ઓફાંડી અધી પીઠના નીચેથી બિધાવી માથા ઉપર લાવી મુખ ઉપર નિકાબ-પડદાની જેમ નાંખી દો, કે છાતી ઉપર રહે, કે તેની લંબાઈ અધી પીઠથી છાતી સુધી છે. અને પહોળાઈ એક કાનની બુટીથી બીજા કાનની બુટીસુધી છે. અને લોકો જે એમ કરે છે કે, જિંદગીની જેમ ઓફાંડે છે તે કવળ વ્યર્થ તથા સુન્તત વિરુદ્ધ છે. પછી દસ્તુર પ્રમાણે ઈજાર તથા લિફાફી લપેટો. પછી સોના ઉપર સીના બંધ, સ્તનના ઉપરના ભાગથી જાંગો સુધી લાવીને બાંધો. (આલમગીરી, દુર્ભ મુહતાર વિગેર)

મસ્થલા-(૬૩૮) : પુરુષના શરીર ઉપર એવી સુગંધી લગાવવું જાઈજ નથી જેમાં ઝાફરાન (કસ્તુરી)નું મિશ્રણ હોય. સ્ત્રી માટે જાઈજ છે. જેણે એહરામ બાંધ્યું છે તેના શરીર ઉપર પણ ખુલ્ખુ લગાવો અને તેનું મુખ અને માથું કફનથી ઢાંકવામાં આવે.

(આલમગીરી, વિગેરે)

મસ્થલા-(૬૪૦) : જો મડાનું કફન ચોરાઈ ગયું અને લાશ હજુ તાજી છે તો ફરીથી કફન પહેરાવવામાં આવે. જો મૈયિતનો માલ યથાવત છે તો તેનાથી, અને જો વેચાઈ ગયો છે તો કફન આપવું વારસદારોના માથે છે. વસિયત અથવા કરજમાં માલ આપી દેવામો આબ્યો છે તો તે લોકોના માથે નથી. અને જો સઘળો તરકો (મરનારની સંપત્તિ) દેવામાં હુબેલો છે અને લેણાદારોએ હજુ સુધી કબજો ન કર્યો હોય તો એજ માલથી કફન આપો અને કબજો કરી લીધો તો તેમની પાસેથી પાછો લેશો નહિ. બલ્કે કફન તેના માથે છે કે માલ ના હોવાની પરિસ્થિતિમાં જેના માથે હોય છે, અને જો મજકૂર હાલતમાં લાશ ફાટી ગઈ તો મસનુન કફનની જરૂરત નથી, બલ્કે એક કપું કાફી છે.

(આલમગીરી, હરું મુખ્તાર)

મસ્થલા-(૬૪૧) : જો મડાને જાનવર ખાઈ ગયું અને કફન જો પડેલું મળ્યું તો મૈયિતના માલથી કફન આપવામાં આબ્યું છે તો તરકા (મરનારની સંપત્તિ)માં ગણના થશે અને કોઈ બીજાએ કફન આખ્યું છે, અજનબી યા સગા-સંબંધીએ તો આપનાર માલિક છે, તેની ઈચ્છા હોય તેમ કરે.

(આલમગીરી)

મસ્થલા-(૬૪૨) : હિન્દુસ્તાનમાં સામાન્ય રિવાજ છે કે મસનુન કફન ઉપરાંત ઉપરથી એંક ચાદર ઓઢાવે છે, તે તકીયાદાર અથવા કોઈ મિસ્કીન પર તસદૃક કરે છે અને જાનમાર્ઝ (મુસલ્લો) હોય છે, જેના ઉપર ઈમામ જનાગાની નમાર્ઝ પઢાવે છે તે પણ તસદૃક કરી ટે છે જો આ ચાદર તથા જાનમાર્ઝ મૈયિતના માલથી ન હોય બલ્કે કોઈએ પોતાની તરફથી આપ્યા છે અને આદત અનુસાર આપી જ દે છે. જેણે કફન આખ્યું બલ્કે કફન માટે જે કાપડ લાવવામાં આવે છે તે એ અંદાજે લાવવામાં આવે

છે જેમાં આ બંને પણ થઈ જાય ત્યારે તો સ્પષ્ટ છે કે, તેની ઈજાજત છે. અને તેમાં કાંઈ વાંધો નથી. અને જો મૈયિતના માલથી છે તો તેની બે સૂરતો છે. એક એ કે વારસદાર સૌ બાલિગ હોય અને સૌની ઈજાજતથી હોય તો પણ જાઈજ છે. અને જો ઈજાજત આપી નહીં તો જેણે મૈયિતના માલથી મંગાવ્યું અને તસદૃક કર્યું તેની જવાબદારીમાં આ બંને વસ્તુઓ છે. અથવા તેમાં જે પૈસા ખર્ચ થાય તરકામાં ગણના કરવામાં આવશે અને તે કિંમત ખર્ચ કરનાર પોતાની પાસેથી આપશે. બીજી સુરત (રીત) એ છે કે વારસદારોમાં તમામ અથવા કેટલાક ના બાલિગ છે, તો હવે તે બંને (જનાજા પર ઓઢાડેલી ચાદર તથા મુસલ્લો) વસ્તુઓ તરકાથી હરગિજ આપી શકતી નથી, ભલે તે બાલિગે ઈજાજત પણ આપી દીધી હોય, કે નાબાલિગના માલને વાપરવું હરામ છે.

લોટા-માટલાં હોવા છતાં ખાસ મૈયિતને નવડાવવા માટે નવા ખરીદયા તો તેમાં પણ એ જ તફસીલ છે. ત્રીજા, દસમા, ચાલીસમા, છમાસી, વરસીના ખર્ચાઓમાં પણ એ જ તફસીલ-વિગત છે કે પોતાના માલથી ઈચ્છા હોય તેમ ખર્ચ કરો અને મૈયિતને સવાબ પહોંચાડે અને મૈયિતના માલથી આ ખર્ચ એજ સમયે કરવામાં આવે કે, સૌ વારસદાર બાલિગ હોય અને સૌની અનુમતિ હોય નહીં તો ખર્ચવામાં ન આવે પરેતુ જે બાલિગ હોય પોતાના ભાગમાંથી આવા ખર્ચ કરી શકે છે. એક રીત બીજી એ પણ છે કે મૈયિતે વસિયત કરી હોય દેણ (દેવું) અદા કર્યા પછી જે વધે તેના ૧/૭માં (એક તૃત્યિંશ) માં વસિયત જારી થશે. બહુધા લોકો આનાથી ગાફ્લ છે. અથવા અજાણ છે કે આ પ્રકારના સંઘળા ખર્ચ કરી લીધા પછી હવે જે વધે છે તેનો તરકો સમજે છે. આ ખર્ચાઓમો ન વારસદારથી ઈજાજત લે છે ન નાબાલિગ વારસદાર હોવું નુકશાનકર્તા સમજે છે. અને આ સખત ગલતી છે. આનાથી કોઈ એમ ન સમજે કે તીજા વિગેરે મના કરવામાં આવે છે. તેને કોણ મના કરશે? મના તે કરે જે વધાબી હોય, બલ્કે નાજાઈજ રીતે જે તેનામાં ખર્ચ કરવામાં આવે છે તેનાથી મના કરવામાં આવે છે. કોઈ પોતાના

માલથી (ખર્ચ) કરે અથવા વારસદારો બાળિગજ હોય તેમનાથી ઈજાજત લઈને કરે તો મનાઈ નથી

જનાગો લઈને ચાલવાના બચાનમાં

મસ્ફુલા-(૬૪૩) : જનાગાને કાંધો (પભો) આપવું ઈબાદત છે. દરેક માણસે આ ઈબાદતમાં કસર-કમી ન કરવી જોઈએ. અને હુશુર સૈયેહુલ મુરસલીન સત્ત્વલ્લાહો અલયહે વસત્ત્વમે સઅદ બિન માઝા રદ્દિયલ્લાહો અન્હોનો જનાગો ઉઠાવ્યો.

(જવહરણ)

મસ્ફુલા-(૬૪૪) : સુન્નત એ છે કે, ચાર માણસો જનાગો ઉઠાવે. એક એક પાયો એક એક માણસ પકડે અને જો કેવળ બે માણસોએ જનાગો ઉપાડયો, એક સીરાણે અને એક પંગાતીયે તો વગર જરૂરતે મકરૂહ છે. અને જો જરૂરત હોય દા.ત. જગ્યા તંગ છે તો વાંધો નથી. (આલમગીરી)

મસ્ફુલા-(૬૪૫) : સુન્નત એ છે કે એક પછી એક ચારે પાયાઓને કાંધો આપે અને દરેક વખત દસ-દસ કદમ ચાલે અને પૂરી સુન્નત એ છે કે પહેલા જમણા સિરાણે કાંધો આપે, પછી જમણી પંગાતે, પછી ડાબા સિરાણે પછી ડાબી પંગાતે અને દસ-દસ કદમ ચાલે, તો કુલ (૪૦) ચાલીસ કદમ થાય. કે હદ્દીસમાં છે કે, જે માણસ ચાલીસ કદમ (ડગલા) જનાગો લઈને ચાલે તેના ચાલીસ કબીરા ગુનાહ મિટાવી દેવામાં આવશે. બીજી હદ્દીસમાં છે કે, “જે માણસ જનાગાના ચારે પાયાઓને કાંધો આપે અલ્લાહ તાયાલા તેની આવશ્યક મગફીરત કરી દેશે.”

(જવહરણ, આલમગીરી, દુર્ભ મુખ્તાર,)

મસ્ફુલા-(૬૪૬) : જનાગો લઈને ચાલવામાં ચારપાઈને હાથથી પકીને ખભાઓ ઉપર મુકે સામાનની જેમ ગઈન અથવા પીઠ ઉપર લાદનું મકરૂહ છે. જાનવર (ઉપર જનાગો લાદનું પણ મકરૂહ છે. (આલમગીરી, ગુનીયા, દુર્ભ મુખ્તાર) ડેલા (લારી વિગેરે) ઉપર લાદવાનો પણ જે જ હુકમ છે.

મસ્ફુલા-(૬૪૭) : નાનું દૂધ પીતું બાળક અથવા હમણાં દૂધ છોડયું હોય એ બાળક અથવા તેનાથી થોડું મોટું બાળક તેને જો એક માણસ હાથ ઉપર ઉઠાવી (ઉપાડી) લઈ ચાલે, તો વાંધો નથી. અને

એક પછી એક લોકો હાથો હાથ લેતા રહે. અને જો કોઈ માણસ સવારી પર હોય અને એટલા નાના જનાગાને હાથ ઉપર લીધેલ હોય તો પણ વાંધો નથી. અને તેનાથી મોટું મડદું હોય તો ચારપાઈ પર લઈ જાય (ગુનીયા, આલમગીરી વિગેરે)

મસ્ફુલા-(૬૪૮) : જનાગો મધ્યમ જડપથી લઈ જાય, પરંતુ ન એવી રીતે કે મૈયિતને ઝટકો વાગે. અને સાથે જનારાઓ માટે અફજલ એ છે કે જનાગાની પાછળ ચાલે. જમણી-ડાબી બાજુએ ન ચાલે અને જો કોઈ આગળ ચાલે તો એટલો દૂર રહે કે સાથીઓમાં તેની ગણના કરવામાં ન આવે. અને સધળા જ આગળ હોય તો મકરૂહ છે.

(આલમગીરી વિગેરે)

મસ્ફુલા-(૬૪૯) : જનાગાની સાથે પૈદલ ચાલવું અફજલ છે અને સવારી પર હોય તો આગળ ચાલવું મકરૂહ છે. અને જો આગળ હોય તો જનાગાથી દૂર રહે. (આલમગીરી વિગેરે)

મસ્ફુલા-(૬૫૦) : સ્ત્રીઓએ જનાગાની સાથે જવું નાજાઈજ તથા મના છે. અને નૌહા (વિલાપ) કરનારી સાથે હોય તો સખતાઈથી મના કરવામાં આવે. જો માને નહીં તો તેના કારણે જનાગાની સાથે જવું ત્યજવામાં આવે નહીં કે તેણીઓના નાજાઈજ ફેલથી શા માટે સુન્નત ત્યજે ? બલ્કે દિલથી તેને ખરાંબ સમજે અને જનાગામાં શરીક થાય. (દુર્ભ મુખ્તાર, સગીરી)

મસ્ફુલા-(૬૫૧) : જો ઓરતો જનાગાની પાછળ હોય અને પુરુષોને એ આશંકા હોય કે પાછળ ચાલવામાં સ્ત્રીઓથી ભેળસેળ (ખલત-મલત) થશે અથવા તેઓમાં કોઈ વિલાપ કરનાર હોય તો આ હાલતમાં પુરુષનું આગળ ચાલવું બહેતર છે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૬૫૨) : જનાગો લઈ ચાલવામાં સિરાણું (મસ્તક) આગળ હોવું જોઈએ અને જનાગાની સાથે આગ લઈ જવાની મનાઈ છે.

(આલમગીરી)

મસ્ફુલા-(૬૫૩) : જનાગાની સાથે ચાલનોરોઓને ખામોશીની હાલતમાં રહેવું જોઈએ. મૃત્યુનું અને કબ્રના અહવાલ તથા ભયાનકતાઓને નજર સમક્ષ

રાખો, હુનિયાની વાતો કરો નહીં. હસો નહીં. હજરત અબુલલાહ બિન મસઉદ રદ્દિયલ્લાહો અન્હોએ એક માણસને જનાજાની સાથે હસતો જોયો. આપે ફરમાવ્યું : “તુ જનાજામાં હસે છે તારાથી કોઈ દિવસ વાતચીત કરીશ નહીં.” અને જિક્ક કરવા ચાહો તો દિલમાં કરો, અને હાલના જમાનાનાં લેહાજથી હવે ઉલ્ભાઓએ જિક્કે જહરની પણ ઈજાજત આપી છે.

(સગીરી, હુર્ર મુખ્તાર વિગેરે)

મસ્ફલા-(૬૪૪) : જનાજો જ્યાં સુધી જમીન ઉપર મુકવામાં ન આવે ત્યાં સુધી બેસવું મકરૂહ છે અને મુક્કા પછી જરૂરત વગર ઉભા ન રહો, અને જો લોકો બેઠા હોય, અને નમાજ માટે ત્યાં જનાજો લાવવામાં આવ્યો, તો જ્યાં સુધી નીચે મુકવામાં ન આવે ઉભા થાવ નહીં. એવી જ રીતે જો કોઈ સ્થળે બેઠેલો હોય અને ત્યાંથી જનાજો પસાર થયો તો ઉભા થવું જરૂરી નથી, હા, જે માણસ સાથે જવા ઈચ્છે છે તે ઉંડે અને જાય જ્યારે અવાજો નીચે મુકવામાં આવે તો એવી રીતે ન મુકો કે ડિબ્લા તરફ પગ હોય અથવા માથું બલ્કે આડો રાખો કે જમણી કરવટ ડિબ્લા તરફ હોય.

(આલમગીરી, હુર્ર મુખ્તાર.)

મસ્ફલા-(૬૪૫) : જનાજો ઉપાડવાનું મહેનતાણું લેવું તથા દેવું જાઈજ છે. જ્યારે કે બીજા ઉપાડનારા પણ મોજુદ હોય. (આલમગીરી) પરંતુ જે સવાબ જનાજો લઈ ચાલવા ઉપર હદીસમાં બધાન થયો છે, તે મળશે નહીં. કે તેણે તો બદલો લઈ લીધો છે.

મસ્ફલા-(૬૪૬) : મૈયિત જો કોઈ પાડોસી અથવા સંબંધી અથવા કોઈ નેક માનવી ની હોય તો તેના જનાજાની સાથે જવું નિફલ નમાજ પઢવા કરતાં અફગ્લ છે.

(આલમગીરી)

મસ્ફલા-(૬૪૭) : જે માણસ જનાજાની સાથે થયો, તેણે નમાજ પઢવા વગર પાછા ન ફરવું જોઈએ. અને નમાજ પછી મૈયિતના સંબંધિઓથી ઈજાજત લઈને પાછા ફરી શકે છે. અને દફન પછી તેમની ઈજાજતની જરૂર નથી.

(આલમગીરી)

જનાગાની નમાજનું વર્ણન

મસ્ફલા-(૬૪૮) : જનાજાની નમાજ ફર્જ ડિફાયા

છે. કે જો એક માણસે પણ પઢી લીધી તો સૌ જવાબદારીમાંથી મુક્તાં થઈ ગયા, નહીં તો જેને જેને તેની ખબર પછોંચી હતી અને પઢી નહીં તો ગુનેહગાર થયો. (આમતુલકુતુબ) તેની ફરજ્યાતનો જે માણસ ઈન્કાર કરે છે તે કાફિર છે.

મસ્ફલા-(૬૪૯) : તેના (જનાજાની નમાજ) માટે જમાઅત શર્ત નથી એક માણસ પણ પઢી લે તો ફર્જ અદા થઈ ગઈ (આલમગીરી)

મસ્ફલા-(૬૫૦) : જનાગાની નમાજ વાજિબ થવા માટે એજ શરતો છે જે બીજી નમાજો માટે છે. અથવા (૧) કાદિર (શક્તિમાન) (૨) બાલિગ (પુષ્ટવય) (૩) આકિલ (બુધ્યમાન ગાંડોનહીં.) (૪) મુસલમાન હોવું. એક વાત આમા વધારે છે અથવા તેના મૃત્યુની ખબર હોવી. (રદ્દુલ મુહ્તાર)

જનાગાની નમાજની શરતો

મસ્ફલા-(૬૫૧) : જનાજાની નમાજમાં બે પ્રકારની શરતો છે. એક મુસલ્લી (નમાજ પઢનાર) વિષે બીજી મૈયિત સંબંધે. મુસલ્લીના લેહાજથી તો એજ શરતો છે જે સર્વથા નમાજની છે, અથવા (૧) મુસલ્લીનું હુક્મી તથા હકીકી નાપાકી થી પાક હોવું. તેના કપડાં અને જગ્યાનું પાક હોવું (૨) સત્તરે ઓરત (૩) ડિબ્લા તરફ મુખ હોવું (૪) નિયત તેમાં સમય શર્ત નથી. અને તકબીરે તહીરીમાં રૂકનો છે. શર્ત નથી. જેવું કે પ્રથમ ઉલ્લેખ થયો છે.

(રદ્દુલ મુહ્તાર વિગેરે)

કેટલાક લોકો બુટ પહેરેલ અને બહુધા લોકો બુટ ઉપર ઉભા રહીને નમાજે જનાજા પઢે છે, જો બુટ પહેરેલ પઢી તો બુટ અને તેના નીચેની જમીન બંનેનું પાક હોવું જરૂરી છે. જો મનાઈ જેટલી નાપાકી હશે તો તેની નમાજ થશે નહીં. અને બુટ ઉપર ઉભા રહીને પઢી તો બુટનું પાક હોવું જરૂરી છે.

મસ્ફલા-(૬૫૨) : જનાજો તૈયાર છે અને જાણો છે કે લુઝુ અથવા ગુસ્લ કરશે તો નમાજ થઈ જશે, તો તથમુખ કરીને પઢે. તેની વિગત તથમુખના પ્રકરણમાં વર્ણવી છે.

મસ્ફલા-(૬૫૩) : જો ઈમામ તાહિર (પાક) ન હતો તો નમાજ ફરીથી પઢે. જો કે મુક્તાં તાહિર હોય કે જ્યારેઈ મામની નમાજ થઈ નહીં. તો કોઈની

થઈ નહીં. અને જો ઈમામ તાહિર હતો અને મુક્તદી તહારત વગર, તો પુનરાવર્તન કરવામાં આવે નહીં કેમ કે જો કે મુક્તદીઓની નમાજ થઈ નહીં, પરંતુ ઈમામની તો થઈ ગઈ. એવી જ રીતે જો સ્ત્રીએ નમાજ પઢાવી અને પુરુપોએ તેની ઈકતેદા કરી તો લોટવવા (દોહરાવવા) માં ન આવે કે જોકે પુરુપોની ઈકતેદા સહીહ થઈ નહ, પરંતુ સ્ત્રીની નમાજ તો થઈ ગઈ. એ જ કાફી છે અને જનાગની નમાગની પુનરાવૃત્તિ જાઈજ નથી. (હુર્રે મુખ્તાર)

મસ્ઝલા-(૬૬૪) : જનાગની નમાજ સવારી ઉપર પઢી તો થઈ નહીં. ઈમામનું બાલિગ હોવું શર્ત છે. ભલે ઈમામ પુરુપ હોય કે સ્ત્રી. નાબાલિગે નમાજ પઢાવી તો થઈ નહીં. (હુર્રે મુખ્તાર, આલમગીરી)

જનાગની નમાજમાં મૈયિતથી સંબંધ રાખવાવાળી કેટલીક શર્તો છે. (૧) મૈયિતનું મુસલમાન હોવું.

મસ્ઝલા-(૬૬૫) : મૈયિતથી મુરાદ તે છે જે જીવતો પૈદા થયો પછી મરી ગયો, તો જો મૃતક પૈદા થયો બલ્કે જો અધ્યાધી ઓછો બહાર નીકળ્યો તે સમયે જીવતો હતો બહુધા બહાર નીકળવાથી પહેલા મરી ગયો તો તેની પણ નમાજ પઢવામાં આવે નહીં. અને તફસીલ આગળ આવે છે.

મસ્ઝલા-(૬૬૬) : નાના બાળકના મા-બાપ બંને મુસલમાન હોય અથવા એક તો તે મુસલમાન છે તેની નમાજ પઢવામાં આવે અને બંને કાફિર છે તો ન પઢવામાં આવે. (હુર્રે મુખ્તાર, વિગેરે)

મસ્ઝલા-(૬૬૭) : મુસલમાનને દારૂલ હર્બમાં નાનું બાળક એકલું મર્યાદા અને તેણે ઉઠાવી લીધું પછી મુસલમાનના ત્યાં મર્યાદા તો તેની જનાગની નમાજ પઢવામાં આવે. (આલમગીરી)

મસ્ઝલા-(૬૬૮) : દરેક મુસલમાનની નમાજે જનાગની પઢવામાં આવે. ભલે તે કેવોએ ગુનેહગાર અને કબીરા ગુનાહોને આચરનાર હોય. પરંતુ અમુક પ્રકારના લોકો છે કે તેમની નમાજે જનાગન નથી. (૧) બાળી બળવાખોર (વિદ્રોહી) અર્થાત જે ઈમામે બરહ્દક (ઉપરનાહક) વિદ્રોહ કરે અને એજ બળવાતમાં માર્યો જાય. (૨) ડાંકુ કે જે ડકાયતીમાં માર્યો ગયો કે ન તેમને ગુસ્લ આપવામાં આવે કે નો તેમની

નમાજે જનાગની પઢવામાં આવે, પરંતુ જ્યારે કે ઈસ્લામી બાદશાહે તેમના ઉપર કાબુ મેળવી લીધો અને કલત કર્યો તો નમાજ તથા ગુસ્લ છે. અથવા જો તે ન પકડાયા ન માર્યા ગયા બલ્કે એમજ મરી ગયા તો પણ ગુસ્લ તથા નમાજ છે. (૩) જે લોકો નાહક પક્ષપાતથી લડે બલ્કે જે તેમનો તમાશો દેખી રહ્યા હતા અને પત્થર આવીને વાગ્યો અને મરી ગયા તો તેમની પણ નમાજ જનાગન નથી, હા, તેમના વિભિન્ન થવા પછી મરે તો નમાજ છે. (૪) જેણે કેટલાએ માણસોને ગળું દબાવી મારી નાખ્યા. (૫) શહેરમાં રાત્રે હથિયાર લઈને લૂટમાર કરે તેઓ પણ ડાંકુ છે. એ હાલતમાં માર્યા જાય તો તેમની પણ નમાજ પઢવામાં ન આવે. (૬) પોતાની માં અથવા બાપને મારી નાખ્યો તે મારનારની નમાજ નથી. (૭) જે કોઈનો માલ ઝુંટવી રહ્યો હતો અને તે હાલતમાં માર્યો ગયો તો તેની પણ નમાજ નથી. (આલમગીરી, હુર્રે મુખ્તાર)

મસ્ઝલા-(૬૬૮) : જેણે આપધાત કર્યો જો કે આ બહુજ મોટો ગુનોહ છે પરંતુ તેના જનાગની નમાજ પઢવામાં આવશે. ભલે ઈરાદા પૂર્વક આપધાત કર્યો હોય, જે શાખ્સ રજમ કરવામાં આવ્યો. (પત્થરો મારીને મારી નાખવામાં આવ્યો) અથવા કિસાસ (બદલા) માં માર્યો ગયો તેને ગુસ્લ આપીશું અને તેની નમાજ પઢીશું.

(આલમગીરી, હુર્રે મુખ્તાર, વિગેરે)

મૈયિતના શરીર તથા કફનનું પાક હોવું

મસ્ઝલા-(૬૭૦) : શરીર પાક હોવાથી એ મુરાદ છે, કે તેને ગુસ્લ આપવામાં આવ્યું હોય અથવા ગુસ્લ અશ્કય હોવાની હાલતમાં તથમુમ કરવામાં આવ્યું હોય અને કફન પહેરાવ્યાં અગાઉ તેના શરીરમાંથી નજાસત (નાપાકી) નિકળી ગઈ હોય તો નાપાકી ધોઈનાં ખવામાં આવે. અને જો પાછળ થી ખારિજ થઈ તો હોવાની જરૂરત નથી. અને કફન પાક હોવાનો એ મતલબ છે કે પાક કફન પહેરાવવામાં આવે અને પછીથી જો નજાસત ખારિજ થઈ અને કફન ખરડાયું તો વાંઘો નથી.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહતાર)

મસ્અલા-(૬૭૧) : વગર ગુસલે નમાજ પઢવામાં આવી તો નમાજ થઈ નહીં. તને ગુસલ આપી ફરીથી નમાજ પઢે. અને જો કબ્રમાં મુક્કી દીધો પરંતુ હજુ માટી નાખવામાં આવી નથી તો કબરમાંથી કાઢો અને ગુસલ આપી નમાજ પઢો અને માટી આપી ચુક્યાતો હવે કાઢી શકતા નથી, માટે હવે તેની કબ્ર ઉપર નમાજ પઢો કારણકે પ્રથમ નમાજ થઈ ન હતી કે ગુસલ વગર થઈ હતી. અને હવે કેમકે ગુસલ અશક્ય છે, માટે હવે નમાજ થઈ જશે.

(રદ્દુલ મુહ્તાર, વિગેરે)

(૩) જનાજાનું ત્યાં મોજુદ હોવું અથવા કુલ અથવા અક્સર અથવા માથા સાથે અર્ધા અંગનું મોજુદ હોવું માટે ગાયબની નમાજ થઈ શકતી નથી.

(૪) જનાજો જમીન ઉપર મુક્કેલ હોવું અથવા હાથ ઉપર હોય પરંતુ નિકટ હોય, જો જાનવર વિગેરે ઉપર લાદેલ હોય તો નમાજ જનાજા થશે નહીં.

(૫) જનાજો મુસ્લિમની આગળ કિબ્લા તરફ હોવું જો મુસ્લિમની પાછળ હશે તો નમાજ સહીહ થશે નહીં.

મસ્અલા-(૬૭૨) : જો જનાજો ઉલ્લો મુક્કો અર્થાત ઈમામના જમ્બો મૈયિતના પગ હોય તો નમાજ થઈ જશે પરંતુ ઈરાદપૂર્વક એવું કર્યું; તો ગુનેહગાર થયા.

(હુર્રે મુખ્તાર)

મસ્અલા-(૬૭૩) : જા કિબ્લો જાડવામાં ભુલ થઈ અર્થાત મૈયિતને પોતાના ઘ્યાલથી (ધરણાથી) કિબ્લા તરફ જ મુક્કી હતી પરંતુ વાસ્તવમાં કિબ્લા તરફ નથી તો કિબ્લાની ધારણા (તહરી) ના સ્થળ માં જો ધારણા કરી તો નમાજ થઈ ગઈ. નહીં તો થઈ નહીં.

(હુર્રે મુખ્તાર)

(૬) મૈયિતનું બેભાગનું શરીર જેનું છુપાવવું ફરજ છે, છુપાએલું હોવું

(૭) મૈયિત ઈમામની સન્મુખ હોય, જો એક મૈયિત છે તો તેનો શરીરનો કોઈ ભાગ ઈમામની સન્મુખ હોય અને કેટલીક મૈયિતો હોય તો કોઈ એકના શરીરનો ભાગ ઈમામની સન્મુખ હોવું કાફી છે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્અલા-(૬૭૪) : જનાજાની નમાજમાં બે રૂકન

છે (૧) ચાર વખત “અલ્લાહો અકબર” કહેવું
(૨) કેયામ

ઉઝર (કારણ) વગર બેસીનું અથવા સવારી ઉપર જનાજાની નમાજ પઢી તો નમાજ થઈ નહીં અને જો વલી અથવા ઈમામ બીમાર હતો તેણે બેસીને પઢાવી અને મુક્તદીઓએ ઉભા થઈને પઢી તો નમાજ થઈ ગઈ.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્અલા-(૬૭૫) : જનાજાની નમાજમાં પ્રાણ ચીંગો સુન્નતે મોઅક્કડા છે. (૧) અલ્લાહ અજાય જલ્લાની હમું તથા સના (૨) નબી સલ્લાલ્લાહો અલયહે વસ્ત્લભમ પર દુરુદ (૩) મૈયિત માટે દુઅા.

જનાજાની નમાજનો તરીકો એ છે કે. કાન સુધી હાથ (ઉઠાવી “અલ્લાહો અકબર” કહેતા હાથ નીચે લાવે અને નાફ (હુંટી) ની નીચે દસ્તૂર પ્રમાણે બાંધી લે અને પઢી સના પઢે અર્થાત “સુભાનકલ્લા હુમ્મ વબેહમ્દેકા વતબારકસ્મોકા વતઆલા જદ્દોકા વ લાઈલાહા ગૈરોકા”પછી હાથ (ઉઠાવ્યા સિવાય “અલ્લાહો અકબર” કહે અને પછી દુરુદ શરીર પઢે. બેહતર તે દુરુદ છે જે નમાજમાં પઢવામાં આવે છે. અને કોઈબાજું દુરુદ પઢવામાં આવ્યું તો પણ વાંધો નથી. પછી અલ્લાહો અકબર કહીને પોતાના અને મૈયિત અને મોમીનીન તથા મોમેનાત માટે દુઅા કરે. અને બહેતર એ છે કે તે દુઅા પઢે જે અહાદીસ (હદ્દીસો)માં વારિદ છે. અને માસૂરા દુઅાઓ જો સારી રીતે ન પઢી શકે તો જે દુઅા પઢવી હોય તે પઢે, પરંતુ તે દુઅા એવી હોય કે ઉમુરે આપેરતના સંબંધી હોય. (જવહરદ, નેયેરહ, આલમગીરી, દુર્રે મુખ્તાર વિગેરે) કેટલીક માસૂરા દુઅાઓ આ છે.

(૧) અલ્લાહુમ્મગફિર લે હૃદ્યેના વ મૈયિતના વ શાહેદેના વ ગાઈબેના વ સગીરેના વ કાંગીરેના વ ઝકરેના વ ઉંસાના. અલ્લાહુમ્મ મન અહુ-ચયતહુ મિણા ફથહુયેહિ અલલ ઈસ્લામ, વ મન તવફક્ફયતહુ મિણા ફિતવફક્ફુ અલલ ઈમાન. અલ્લાહુમ્મા લા તહિમના અજરહુ હા વલા તસ્કુતિણા બચાદહુ હા.

તરજુમો: અય અલ્લાહ બખ્શી દે અમારા જિન્દાઓ

અને મુદર્દિઓ અને અમારા હાજર તથા ગાયબને અને અમારા નાના અને અમારા મોટાઓને અને અમારા મર્દ અને ઓરતને અય અલ્લાહ અમારામાંથી તું જેને જીવતા રાખે તેને ઈસ્લામ ઉપર વફાત (મૌત) આપ. અય અલ્લાહ તું અમોને તેના અજરથી મહરૂમ ન રાખ અને તેના પછી અમને ફિલ્તામાં ન નાંખ.

અલ્લાહુમગ ફીર લહુ વહીમહો હા વ આફેહિ હા વઅફો અનહો હા વકરિમ નોગોલહુ હા વસ્સેઅ મદ્ઘલહુ હા

અહિ “બહારે શરીરાત”ના સંપાદકે બીજુ લગભગ ૧૪ જેટલી દુઆઓ રજૂ કરી છે. લંબાણપુર્વક હોવાથી અને અરબી શબ્દોને ગુજરાતી લિપિયાંતર કરવાથી પઢવામાં ભુલ થવાનો ચૌકસ ભય હોવાથી અતે અમે રજૂ કરી નથી. ફકત જાણ માટે તેનો ગુજરાતી તરજુમો રજૂ કરીને સંતોષ માનીએ છીએ. અરબી દુઆઓ જાણવા માટે મૂળ (ઉદ્દુ બહારે શરીરાત ભાગ ૪ જુઓ.) (અનુ)

તરજુમો-અય અલ્લાહ તેને બખ્શા દે અને રહેમ કર અને આદ્ધ્રિયત આપ અને માફ કર અને ઇજજતની મહેમાની કર અને તેની જગ્યાને વિશાળ કર અને તેને પાણી અને બરફ અને ઓલા (કરા)થી ધોઈ નાંખ અને તેને ખતા (ભુલો)થી પાક કર જેવું કે તે સફેદ વસ્ત્રને મેલથી (સાફ) કર્યું અને આને ઘરના બદલામાં બહેતર અહલ (યોગ્ય) ના બદલામાં અહલ આપ. અને બીબી (પત્ની) ના બદલામાં બહેતર બીબી આપ અને આને જન્મતામાં દાખલ કર અને અગાબે કબ્ર તથા ફિલાએ કબ્ર તથા જહનમના અજાબથી સુરક્ષિત રાખ.

તરજુમો-(૩) : અય અલ્લાહ આ તારો બંદો છે અને તારી બાંદી (દાસી) નો બેટો છે, ગવાહી આપે છે કે તારા સિવાય કોઈ માઝુદ નથી અને મોહમ્મદ તારા બંદા અને તારા રસૂલ છે અને તુ અમારાથી વધારે તેને જાણે છે. જો સદાચારી છે તો નેકીમાં વધારો કર અને જો ગુનાહગાર છે તો તેને બખ્શી દે અને તેના અજરથી અમને મહરૂમ ન કર અને તેનાં પછી ફિલ્તામાં ન નાંખ.

છે તો બખ્શી દે, અય અલ્લાહ તેના અજરથી અમને મહરૂમ ન રાખ અને તેના પછી અમોને ગુમરાહ ન કર.

તરજુમો-(૪) : અય અલ્લાહ, આ તારો બંદો છે અને તારી બંદીનો પુત્ર છે તેના વિપે તારો હુકમ પ્રચલિત છે, તેને પૈંડા કર્યા, જો કે તે ઉલ્લેખનીય ન હતો તારી પાસે આવ્યો અને તું તે સૌથી બહેતર છે જેમની પાસે ઉતારવામાં આવે. અય અલ્લાહ હુજજતની તુલકીન કર અને તેના નબી મોહમ્મદ સલ્લાહ્લાહો અલયહે વસ્ત્રલમની સાથે મેળવી દે અને સાબિત કોલ ઉપર સાબિત રાખ. એટલા માટે કે આ તારી તરફ મોહતાજ છે અને તુ તેનાથી ગની છે. આ શહાદત આપતો હતો કે અલ્લાહ સિવાય કોઈ માઝુદ નથી પસ તેને બખ્શી દે અને કરમ કર અને તેના અજરથી અમોને મહરૂમ ન કર અને તેના પછી અમોને ફિલ્તામાં નાંખ, અય અલ્લાહ જો આ પાક છે તો પાક કર અને જો બદકાર છે તો બખ્શી દે.

તરજુમો-(૫) : અય અલ્લાહ આ તારો બંદો છે અને તારી બાંદીનો બેટો છે, તારી રહેમતનો મોહતાજ છે અને તું એના અજાબથી ગની છે, જો નેકી કરનાર (સદાચારી) છે તો તેની ખૂબીમાં વધારો કર અને જો ગુનાહગાર છે તો દરગુજર કર.

તરજુમો-(૬) : અય અલ્લાહ આ તારો બંદો છે અને તારા બંદાનો પુત્ર છે, ગવાહી આપતો હતો કે અલ્લાહ સિવાય કોઈ માઝુદ નથી અને મોહમ્મદ સલ્લાહ્લાહો અલયહે વસ્ત્રલમ તારા બંદા અને તારા રસૂલ છે અને તુ અમારાથી વધારે તેને જાણે છે. જો સદાચારી છે તો નેકીમાં વધારો કર અને જો ગુનાહગાર છે તો તેને બખ્શી દે અને તેના અજરથી અમને મહરૂમ ન કર અને તેનાં પછી ફિલ્તામાં ન નાંખ.

તરજુમો-(૭) : આજે તારો આ બંદો દુનિયાથી નિકળ્યો અને દુનિયાને દુનિયાવાળાઓ માટે રહેવા દીધી તારા તરફ મોહતાજ છે અને તું તેનાથી ગની, ગવાહી આપતો હતો કે અલ્લાહ સિવાય કોઈ માઝુદ (પૂજ્ય) નથી અને મોહમ્મદ સલ્લાહ્લાહો અલયહે વસ્ત્રલમ તારા બંદા અને રસૂલ

છે, અય અલ્લાહ તુ તેને બખ્ષી દે અને તેનાથી દરગુજર કર અને તેને તેના નબી મોહમ્મદ સલ્લાહુલ્લાહો અલયહે વસ્તુ મનીસાથે સંબંધિત કરી દે.

તરજુમો-(૮) : અય અલ્લાહ ! તુ તેનો રબ્બ છે અને તેને પૈદા કર્યો છે અને તેને ઈસ્લામ પ્રત્યે હિદાયત કરી અને તેની રૂહ (આત્મા) ને કબજ કરી, તુ તેના ગુપ્ત અને જાહેરને જાણો છે અમો સિફારસ માટે હાજર થયા તેને બખ્ષી દે.

તરજુમો-(૯) : અય અલ્લાહ અમારા ભાઈઓ અને બહેનોને તું બખ્ષી દે અને અમારી પરસ્પરની હાલતને દુરસ્ત કર અને અમારા દિલોમાં ઉલ્ફત (સ્નેહ) પૈદા કરી દે, અય અલ્લાહ ! આ તારો બંદો ફલાણાનો છોકરો ફલાણો છે, અમે તેના વિષે ઘેર સિવાય કર્યી જાણતા નથી અને તું - તેને અમારા કરતાં વધારે જાણો છે તું અમને અને તેને બખ્ષી દે.

તરજુમો-(૧૦) : અય અલ્લાહ ફલાણાનો છોકરો ફલાણો તારા શરાણો અને તારી રક્ષામાં છે તેને કબ્રના ફિલ્તા અને જહન્નમના અજાબથી બચાવ, તુ વફા અને હમદના યોગ્ય છે, અય અલ્લાહ આને બખ્ષી દે અને રહમ કર, બેશક તું વફા અને હમદના યોગ્ય છે, અય અલ્લાહ આને બખ્ષી દે અને રહમ કર, બેશક તું બખ્ષાનાર મહેરબાન છે.

તરજુમો-(૧૧) : અય અલ્લાહ ! આને શયતાનથી અને કબ્રના અજાબથી બચાવ, અય અલ્લાહ ! જમીનને તેના બંને પાસાઓથી વિસ્તૃત કરી દે અને તેની રૂહને બુલંદ કર અને તારી ખુશનુદી (પ્રસન્નતા) આપ.

તરજુમો-(૧૨) : અય અલ્લાહ ! તેને અમોને પૈદા કર્યો અને અમે તારા બંદા છીએ, અને તું અમારો રબ્બ છે અને તારી જ તરફ અમારે પાછા આવવાનું છે.

તરજુમો-(૧૩) : અય અલ્લાહ બખ્ષી દે અમારા આગળા તથા પાછલાને અને અમારા જીવતા અને મુર્દાઓને અને અમારા પુરુષ અને સ્ત્રીઓને અને અમારા નાના અને મોટાઓને અને અમારા હાજર તથા ગાયબને, અય અલ્લાહ તેના અજાબથી અમોને મહરૂમ (વંચિત) ન કર અને તેના પછી અમોને ફિલ્તામાં ન નાંખ.

તરજુમો-(૧૪) : અય અલ્લાહ, અય અર્રહમરરાહેમીન, અય અર્રહમરરાહેમીન, અય અર્રહમરરાહેમીન, અય જિન્દા, અય કયુમ, અય આસમાનો તથા જમીનને પૈદા કરનાર તથા બુલુગ્ગિવાળા હું તારાથી સવાલ કરું છું, તે કારણે કે હું ગવાહી આપું છું કે તુ અલ્લાહ યકતા (એકાંકી) છે, બેનિયાજ (નિસ્પત્ત) છે, જેણે ન બીજાને જાણ્યો ન બીજાથી જાણ્યો (પૈદાથયો) અને તેના મુકાબિલ (પ્રતિયોગી) કોઈ નથી. અય અલ્લાહ હું સવાલ કરું છું અને તારી તરફ તારા નબી મોહમ્મદ સલ્લાહુલ્લાહો અલયહે વસ્તુ મદ્દ દ્વારા ધ્યાનિત થાઉં છું. અય અલ્લાહ કરીમ જ્યારે સવાલનો હુકમ આપેતો કયારેય પાછો ફેરવતો નથી અને તેને અમોને ઈજાત આપી અમોએ શિફારીસ કરી અને તું સૌ કરીમો (કૃપાળુઓ) થી અધિક કરીમ છે, અમારી શિફારીસ આના વિષે કબુલ કર અને તેની એકલતામાં તું તેના ઉપર રહમ કર અને તેની વહશત (ભય) માં તું રહેમ કર અને તેની ગુરબતમાં તું રહમ કર, તેની બેચેનીમાં તું રહેમ કર અને તેના અગરને મહાન કર અને આની કબ્રને મુનવ્વર (પ્રકાશિત) કર અને તેના ચહેરાને સફેદ કર અને તેની ઘ્વાબ ગાહ (શયન ખંડ-કબ્ર) ને ઠંડી કર અને તેની મંજિલને સુવાસિત કર અને તેની મહેમાની નો સારો સામાન કર, અય ઉત્તમ ઉત્તારનાર અને અય ઉત્તમ બખ્ષાનાર અને અય ઉત્તમ કૃપા કરનાર, આમીન..આમીન..આમીન.. દુર્દોસલામ મોકલ અને બરકત કર શિફાઅત કરનારાઓના સરદાર મોહમ્મદ અને તેમની આલ તથા અસહાબ સૌ ઉપર સઘળી તાઅરીઝો (પ્રશંસા) અલ્લાહ માટે જે રબ્બ છે સમગ્ર સૃષ્ટિનો.

ફાયદો : નવમી-દસમી દુઆઓમાં જો મૈયિતના બાપના નામની ખબર ન હોય તેના સ્થાને આદમ અલયહિસ્સલામ કહે કે તેઓ સૌ આદમીઓના બાપ છે અને જો ખુદ મૈયતનું નામ ખબર ન હોય તો નવમી દુઆમાં હાજા અણ્ણોકા અથવા હાજેહિ અમતોકા પર સંતોષ કરે કુલા બિન કુલા અથવા બિનને છોડી દે અને દસમી દુઆમાં તેના સ્થાને અણ્ણોકા હાજા અથવા ઔરત હોય તો અમતકા

છાંઝેછિ કહે.

ફાયદો : મૈયિતના ફિસ્ક તથા ફજરની ખબર હોય તો નવમી દુઆમાં લાના અલમ ઈલ્લા ઐરના સ્થાને કદ આલિમના મિન્હુ પૈરન કહે કે દરેક ઐરથી બહેતર ભૈર છે.

ફાયદો : આ દુઆઓમાં કેટલાક વિષયો મુકર્રર છે અને દુઆમાં તકરાર (રટણ) મુસ્તહસન છે. જો સઘળી દુઆઓ યાદ હોય અને સમયમાં ગુંજાઈશ હોય તો સૌનું પદવું ઉલા (સારુ) છે. નહીં તો જે ઈચ્છા તે પઢો. અને ઈમામ જેટલો સમય આ દુઆઓ પઢે, જો મુકતદીને યાદ ન હોય તો પ્રથમ દુઆ પછી આમીન આમીન કહેતો રહે.

મસ્ફુલા-(૬૭૬) : મૈયિત મજનુન અથવા નાબાલિગની હોય તો ગ્રીજ તકબીર પછી આ દુઆ પઢે. અલ્લાહુ મજનુન્હો લના ફરતં વ્યજાલહો લના અજરેવ્ય ગુર્ખ્ય્ય જબલહો લના શાફેઅવ્ય-મુશફિકા.

તરજુમો : અય અલ્લાહ તું આને અમારા માટે પેશારવ (પૂર્વજ) કર અને આને અમારા માટે ભંડાર કર અને તેને અમારી શફાઅત કરનાર અને શફાઅત માન્ય કરી દે.

અને છોકરી હોય તો અજઅલહા અને શાફેઅતન તથા મુશાસસાતન કહે. (જોહરહ) મજનુનથી મુરાદ તે મજનુન છે કે બાલિગ થતા પહેલા મજનુન થયો કે તે કયારેય મુકલિલફ જ (શરીઅતના હુકમ લાગુ પઢ્યો) થયો નહીં અને જો પાગલપણું આરજી છે તો તેની મગફેરતની દુઆ કરો જેવું કે બીજાઓ માટે કરવામાં આવે છે કે ઉન્માદથી પહેલાં તો તે મુકલિલફ હતો અને ઉન્માદના અગાઉના ગુનાહ ઉન્માદથી જતા રહ્યા નહીં. (ગુનીયા)

મસ્ફુલા-(૬૭૭) : ચોથી તકબીર પછી કોઈ દુઆ પદ્યા વગર હાથ છોડી દઈને સલામ ફરવી દે, સલામમાં મૈયિત અને ફરિશતાઓ અને નમાજમાં હાજર રહેલાઓની નિયત કરે એવી જ રીતે જેવું કે બીજું નમાજોના સલામમાં નિયત કરવામાં આવે છે, અહીયા એટલી વાત વધારે છે કે મૈયિતની પણ નિયત કરવામાં આવે છે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર તથા ખુલાસહ વિગેરે)

મસ્ફુલા-(૬૭૮) : તકબીર તથા સલામને ઈમામ જહર સાથે (મોટા અવાજથી) કહે, બાકી સઘળી દુઆઓ ધીમે પઢવામાં આવે અને કેવળ પ્રથમ અલ્લાહો અકબર કહેતી વખતે હોથ ઉઠાવે, પછી હોથ ઉઠાવાનું નથી. (જવહરહ, હુર્રે મુખ્તાર)

મસ્ફુલા-(૬૭૯) : જનાગ્રાની નમાજમાં કુર્ચાન, કુર્ચાનની નિયતથી અથવા તશહફુદ પદવું મના છ અને દુઆ તથા સનારાના નિયત અલહમ્દો વિગેરે દુઆઈયા આયાત તથા સના પદવું જાઈજ છે.

(હુર્રે મુખ્તાર)

મસ્ફુલા-(૬૮૦) : બહેતર તો એ છે કે જનાગ્રાની નમાજમાં ત્રણસફો (લાઈનો) કરો કે, જેની નમાજ ત્રણ સફોએ પઢી તેની મગફેરત થઈ જશે અને જો કુલ સાત જ માણસો હોય તો એક ઈમામ થાય અને ત્રણ પહેલી સફમાં અને બે બીજી સફમાં અને એક ગ્રીજ સફમાં રહે. (ગુનીયા)

મસ્ફુલા-(૬૮૧) : જનાગ્રામાં પાછલી સફને સઘળી સફો પર ફરજીલત છે. (હુર્રે મુખ્તાર)

જનાગ્રાની નમાજ કોણ પટાવે

મસ્ફુલા-(૬૮૨) : જનાગ્રાની નમાજમાં ઈમામતનો હક બાદશાહે ઈસ્લામને છે પછી કાજી પછી જુમ્માના ઈમામ પછી મોહલ્લાના ઈમામ પછી વલી (વાલી) ને છે. મહોલ્લાના ઈમામનું વલી ઉપર અગ્રિમતા (તકદુમ) મુસ્તહબ હોવા ની રીતે છે. અને એ પણ એ સમયે કે વલી કરતા અફજલ હોયનહીતો વલી બહેતર છે. (હુર્રે મુખ્તાર, ગુનીયા)

મસ્ફુલા-(૬૮૩) : વલીથી મુરાદ મૈયિતના વારસદાર છે અને નમાજ પઢાવવામાં વલીઓનો એજ કમ છે જે નિકાહમાં છે કેવળ એટલો તફાવત છે કે જનાગ્રાની નમાજમાં મૈયિતના બાપને બેટા ઉપર અગ્રેસરતા છે અને નિકાહમાં પુત્રને બાપ ઉપર, અલબત જો બાપ આલિમ નથી અને જો બેટો આલિમ છે તો જનાગ્રાની નમાજમાં પણ પુત્ર અગ્રેસર છે જો વારસદારો ન હોય તો તે સર્ગો જે બાપની તરફથી સંબંધિત ન હોય તો બીજાઓ ઉપર અગ્રેસર છે. (હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૬૮૪) : મૈયિતનો વલીએ અકરબ (સૌથી અધિક નજીકનો સર્ગો) ગાઈબ છે અને વલીએ

અબઅદ (હુરનો સગો) હાજર છે તો એજ અબઅદ નમાજ પઢાવે. ગાયબ હોવાથી મુરાદ એ છે કે આવવાની પ્રતીક્ષામાં નુકસાન થાય. (હર્રુ મુખ્તાર)

મસ્ફલા-(૬૮૫) : સ્ત્રીનો કોઈ વલી ન હોય તો પતિ નમાજ પઢાવે, તે પણ ન હોય તો પાડોસી પઢાવે, એવી જ રીતે પુરુપનો વલી ન હોય તો પાડોસી બીજાઓ પર અગ્રીમતા ધરાવે છે.

(હર્રુ મુખ્તાર)

મસ્ફલા-(૬૮૬) : ગુલામ મરી ગયો તો તેનો માલિક બાપ અને બેટા, પર અગ્રીમતા ધરાવે ભલે આ બંને આજાદ હોય અને આજાદ થયેલા ગુલામમાં બાપ અને બેટા અને બીજા વારસદારો માલિક પર અગ્રેસર છે.

(હર્રુ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૬૮૭) : મકાતિબનો પુત્ર અથવા ગુલામ મરી ગયો તો નમાજ પઢાવવાનો હક્ક મુકાતિબને છે પરંતુ તેનો મૌલા (માલિક) જો હાજર હોય તો માલિકથી જ પઢાવવી જોઈએ અને જો મકાતિબ મરી ગયો અને એટલો માલ મુકી ગયો કે બદલે ડિતાબત અદા થઈ જાય અને તે માલ ત્યાં હાજર છે તો તેનો પુત્ર નમાજ પઢાવે અને માલ ગાયબ છે તો મૌલા (માલિક) પઢાવે. (જવહરહ)

મસ્ફલા-(૬૮૮) : સ્ત્રીઓ અને બાળકોને જનાગાની નમાજાની વિલાયત (વાલી પણું) નથી.

(આલમગીરી)

મસ્ફલા-(૬૮૯) : વલી અને બાદશાહે ઈસ્લામને અધિકાર છે કે કોઈ બીજાને જનાગાની નમાજ પઢાવવાની પરવાનગી આપી દે. (હર્રુ મુખ્તાર)

મસ્ફલા-(૬૯૦) : મૈયિતના વલીએ અકરમ (નિકટસ્થ સગો) અને વલી અબઅદ (હુરનો સગો) બંને હાજર છે તો વલીએ અકરબને અધિકાર છે કે અબઅદ સિવાય કોઈ બીજા પાસે નમાજ પઢાવી દે. અબઅદને મના કરવાનો અધિકાર નથી અને જો વલી અકરબ ગાયબ છે અને એટલે દુર છે કે તેના આવવાની પ્રતીક્ષા નકરી શકાય અને કોઈ લખાણ દ્વારા અબઅદ સિવાય કોઈ બીજાથી નમાજ પઢાવવા ઈચ્છે છે તો અબઅદને અધિકાર છે કે તેને અટકાવી દે, અને જો વલી યે અકરબ હાજર છે પરંતુ બીમાર છે તો જેની પાસે પઢાવવા ઈચ્છે

પઢાવી દે. અબઅદને મના કરવાનો અધિકાર નથી. (આલમગીરી)

મસ્ફલા-(૬૯૧) : સ્ત્રી મરી ગઈ, તેની પાછળ પતિ અને જવાન પુત્ર છે તો વિલાયત (વાલી પણું) પુત્રને છે. પતિને નથી, અલબત જો આ પુત્ર એજ પતિથી છે તો બાપ ઉપર અગ્રેસરતા મકરહ છે. તેણે બાપ પાસે નમાજ પઢવી જોઈએ. અને જો બીજા પતિથી છે તો સાવકા બાપ ઉપર અગ્રેસરતા કરી શકે છે, કાંઈ વાંધો નથી અને પુત્ર બાલિગ ન હોય તો સ્ત્રીના જે બીજા વલી હોય તેમનો હક્ક છે. પતિનો નહીં. (જવહરહ, આલમગીરી)

મસ્ફલા-(૬૯૨) : બે અથવા કેટલાક માણસો એક દરજાના વલી હોય તો અધિક હક તેનો છે જે વયમાં મોટો છે. પરંતુ કોઈને એ અધિકાર નથી કે, બીજા વલી સિવાય કોઈ બીજા પાસે તેની ઈજાજત વગર નમાજ પઢાવી દે. અને જો આવું કર્યું અર્થાત પોતે ન પઢાવી અને બીજાને ઈજાજત આપી દીધી તો બીજા વલીને મના કરવાનો અધિકાર છે. ભલે આ બીજો વલી વયમાં નાનો હોય અને જો એક વલીએ એક બ્યક્ઝિતને પરવાનગી આપી દીધી. બીજાએ બીજી બ્યક્ઝિતને તો જેને મોટા વલીએ ઈજાજત આપી તે ઉલા છે. (આલમગીરી)

મસ્ફલા-(૬૯૩) : મરનારે વસિયત કરી હતી કે મારા જનાગાની નમાજ ફલાણો માણસ પઢાવે અથવા મને ફલાણો માણસ ગુસ્સ આપે તો આ વસિયત બાતિલ છે અર્થાત આ વસીયતથી વલીનો હક જતો રહેશે નહીં. હા, વલીને અખત્યાર છે કે પોતે ન પઢાવે અને તેની પાસે પઢાવી દે.

(આલમગીરી)

મસ્ફલા-(૬૯૪) : વલી સિવાય કોઈ એવા માણસે નમાજ પઢાવી જે વલી ઉપર અગ્રેસરતા ધરાવતો ન હોય અને વલીએ તેને ઈજાજત પણ આપી ન હતી તો જો વલી નમાજમાં શરીક નથયો તો નમાજનું પુનરાવર્તન કરી શકે છે. અને જો મડું દફન થઈ ગયું છે તો કબ્ર ઉપર નમાજ પઢી શકે છે અને જો તે વલી ઉપર અગ્રેસર છે જેવું કે બાદશાહ તથા કાર્યી તથા મહોત્વાનો ઈમામ કે વલી કરતાં અફજલ (શ્રેષ્ઠ) હોય તો હવે વલી નમાજનું પુનરાવર્તન

કરી શકતો નથી અને જો એક વલીએ ન માજ પઢાવી દીધી તો બીજા વલીઓ પુનરાવર્તન કરી શકતા નથી અને પુનરાવર્તનની દરેક સ્થિતિમાં જે માણસ પ્રથમ ન માજમાં શરીક હતો તે વલી સાથે પઢી શકે છે. અને જે માણસ શરીક હતો તે વલીની સાથે પઢી શકતો નથી, તે જનાગાની બે વખત ન માજ ન આઈજ છે, સિવાય એ હાલતમાં કે ગેર વલીએ વલીની પરવાનગી વગર ન માજ પઢાવી હોય. (આલમગીરી, દુર્ભુત્તાર વિગેરે)

મરસ્યલા-(૬૮૫) : જે વસ્તુઓથી સથળી ન માજો ફાસિદ થાય છે જનાગાની ન માજ પડી તેનાથી ફાસિદ થઈ જાય છે. સિવાય એક વાતના, કે સ્ત્રી, પુરુષની બરાબર (મહારી) થઈ જાય તો જનાગાની ન માજ ફાસિદ થશે નહીં. (આલમગીરી)

મરસ્યલા-(૬૮૬) : મુસ્તહબ એ છે કે મૈયિતની છાતીના સામે ઈમામ ઉભો રહે અને મૈયિતથી દુર ન રહે, મૈયિત ભલે પુરુષ હોય કે સ્ત્રી બાલિગ હોય કે નાબાલિગ, આ તે સમયે છે. કે એકજ મૈયિતની ન માજ પઢાવવી હોય અને જો એક કરતાં વધારે મૈયિતો હોય તો એકની છાતીના સામે અને નિકટ ઉભો રહે. (દુર્ભુત્તાર, રદ્દુલ મુહુતાર)

મરસ્યલા-(૬૮૭) : ઈમામે પાંચ તકબીરો કહી તો પાંચમી તકબીરમાં મુક્તદી ઈમામનું અનુસરણ કરે નહીં બલે ચુપ રહે. જ્યારે ઈમામ સલામ ફેરવે તો તેની સાથે સાલમ ફેરવી દે. (દુર્ભુત્તાર)

મરસ્યલા-(૬૮૮) : કેટલાએ જનાગાની થયા હોય તો એ કસાથે સૌની ન માજ પઢી શકે છે અર્થાત એક જ ન માજમાં સૌની નિયત કરી દે અને અફજલ એ છે કે સૌની જુદી જુદી પઢે. અને આ હાલતમાં એટલે કે જ્યારે જુદી જુદી પઢે તો તેઓ પૈકી જે અફજલ છે તેની પ્રથમ પઢે પછી તેની જે તેના પછી સૌમાં અફજલ છે. (આ ઉપર આગણ સમજી લો)

(દુર્ભુત્તાર, શુનીયા)

મરસ્યલા-(૬૮૯) : મરસ્યુક અર્થાત જેની કેટલીક તકબીરો છુટી ગઈ તે પોતાની બાકી તકબીરો ઈમામના સલામ ફેરવ્યા પછી કહે અને જો એ આંશકા હોય કે દુઅાઓ પઢેસે તો પુરી કરવાથી પહેલા લોકો મૈયિતને ખભા સુધી ઉપાડી લેશે તો કેવળ તકબીર કહી લે, દુઅાઓ છોડી દે.

(દુર્ભુત્તાર)

મરસ્યલા-(૭૦૦) : લાઇક અર્થાત જે આરંભમાં શામેલ થયો પરંતુ કોઈ કારણસર વચ્ચેની કેટલીક તકબીરો રહી ગઈ દા. ત. પહેલી તકબીર ઈમામની સાથે કહી, પરંતુ બીજી અને ત્રીજી છુટી ગઈ તો ઈમામની ચોથી તકબીરથી પહેલા આ તકબીરો કહી લે.

(રદ્દુલ મુહુતાર)

મરસ્યલા-(૭૦૧) : ચોથી તકબીર પછી જે માણસ આવ્યો તો જ્યાં સુધી ઈમામે સલામ ફેરવી ન હોય શામેલ થઈ જાય અને ઈમામના સલામ ફેરવ્યા પછી ગ્રાશ વખત “અલ્લાહો અકબર” કહી લે.

(દુર્ભુત્તાર)

મરસ્યલા-(૭૦૨) : કેટલાએ જનાગાની થયા હોય તો એ કસાથે સૌની ન માજ પઢી શકે છે અર્થાત એક જ ન માજમાં સૌની નિયત કરી દે અને અફજલ એ છે કે સૌની જુદી જુદી પઢે. અને આ હાલતમાં એટલે કે જ્યારે જુદી જુદી પઢે તો તેઓ પૈકી જે અફજલ છે તેની પ્રથમ પઢે પછી તેની જે તેના પછી સૌમાં અફજલ છે. (આ ઉપર આગણ સમજી લો)

(દુર્ભુત્તાર)

મરસ્યલા-(૭૦૩) : કેટલાક જનાગાની ન માજ એક સાથે પઢાવી તો અખત્યાર છે કે સૌને આગણ-પાછળ રાખે અર્થાત બરાબર-બરાબર રાખે અર્થાત એકની પાંચતી અથવા સિરાણે બીજાને અને બીજાની પાંચતી અથવા સિરાણે ત્રીજાને (આ પ્રમાણે કમવાર ગોઠવી લો) જો આગણ-પાછળ રાખે તો ઈમામની નિકટ તેનો જનાગાનો હોય જે સૌથી અફજલ હોય પછી તેના પછી જે અફજલ હોય, કમાનુસાર અને જો ફરીલતમાં સરખા હોય તો જેનું વય અધિક હોય તેને ઈમામની નજીક રાખો, આ તે સમયે છે કે સૌ એક પ્રકારના હોય જો જુદા જુદા પ્રકારના હોય તો ઈમામની નજીક પુરુષ હોય તેની પછી

ઇકરો, પછી ડિજડો પછી સ્ટી પછી મુરાહિલ્ડક (બાલિગ થવાની નિકટ પહોચેલી ઇકરો) અર્થात નમાજમાં જેવી રીતે મુકવામાં મુકતદીઓની સફોમાં તરતીબ (કમ) છે તેનો અકસ અહીંયા છે અને જો આજાએ તથા ગુલામના જનાજા હોય તો આજાએને ઈમામથી નિકટ રાખો જો કે ના બાલિગ હોય તે પછી ગુલામને અને કોઈ જરૂરતથી એક જ કબ્રમાં કેટલાક મહદાં દફન કરે તો તરતીબને અકસ (ઉલ્ટી) કરો અર્થात ડિબ્લા તરફ તેને રાખો જે અફ્જલ છે, જ્યારે કે સર્વ સૌ પુરુપ અથવા સર્વ સૌ સ્ત્રીઓ હોય. નહીં તો ડિબ્લા તરફ પુરુપને રાખો પછી ઇકરાને પછી ડિજડાને પછી મુરાહિલ્ડક, (પુરુતવયની નીકટ પહોચેલી ઇકરો) ને

(આલમગીરી, દુર્ભ મુખ્તાર)

મસ્ઝલા-(૭૦૪) : એક જનાજાની નમાજ શરૂ કરી હતી કે બીજો જનાજો આવી ગયો તો પહેલાની નમાજ પુરી કરી લે અને જો બીજી તકબીરમાં બંનેની નિયત કરી લીધી તો પણ પહેલાની જ નમાજ થશે, અને જો કેવળ બીજાની નિયત કરી તો બીજાની થશે, તેનાથી ફારેગ થઈને પહેલા જનાજાની નમાજ ફરીથી પઢે.

(આલમગીરી)

મસ્ઝલા-(૭૦૫) : જનાજાની નમાજમાં જો ઈમામ બે વળું થઈ ગયો અને કોઈને પોતાનો ખલીફા બનાવ્યો તો જાઈજ છે. (આલમગીરી)

મસ્ઝલા-(૭૦૬) : મૈયિતને જનાજાની નમાજ પઢા વગર દફન કરી દીધી અને માટી પણ વાળી દીધી હોય તો હવે તેની કબ્ર પર નમાજ પઢે, જ્યાં સુધી ફાટવાનું ગુમાન ન હોય અને જો માટી ફેરવી દેવામાં ન આવી હોય તો મૈયિતને બહાર કાઢો અને જનાજાની નમાજ પછી દફન કરો અને કબ્ર ઉપર નમાજ પઢવામાં દિવસોની કોઈ સંપ્રા મુકર્રર નથી કે આ માંસમ અને જમીન અને મૈયતના શરીર તથા બીમારીના મતભેદથી વિવિધ છે, ગરમીમાં જલ્દીફાટીજશે અને શિયાળામાં વિલંબથી ફાટશે તર અથવા ખારી જમીનમાં જલ્દી ફાટશે અને ક્ષારવિહીનમાં વિલંબથી ફાટશે. હુદ્દુપુરુપ શરીર જલ્દી ફાટશે, હુર્બળ શરીર વિલંબથી ફાટશે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુખ્તાર)

મસ્ઝલા-(૭૦૭) : કોઈ માણસ કુવામાં પડીને મૃત્યુ પામ્યો અથવા તેના ઉપર મકાન તુટી પડ્યું અને મહદું કાઢી શકાયું નહીં તો એ જ સ્થળે તેની જનાજાની નમાજ પઢો. અને સમુદ્રમાં હુબી ગયો અને કાઢી શકાયો નહીં તો તેની જનાજાની નમાજ થઈ શકતી નથી કે મૈયિતનું મુસલ્લી (નમાજીઓ) ની સમક્ષ હોવું બહાર નથી. (દુર્ભ મુખ્તાર)

મસ્ઝલા-(૭૦૮) : મસ્ઝિજદમાં જનાજાની નમાજ સર્વથા મકરૂહે તહરીમી છે. ભલે મૈયિત મસ્ઝિજદની અંદર હોય કે બહાર સઘણા નમાજી મસ્ઝિજદમાં હોય કે કેટલાક, કે હદીસમાં જનાજાની નમાજ મસ્ઝિજદમાં પઢવાની મનાઈ આવી છે. (દુર્ભ મુખ્તાર) જનમાર્ગ અને બીજાની જમીન પર જનાજાની નમાજ પઢવું મના છે. (રદ્દુલ મુખ્તાર) અર્થાત જ્યારે કે જમીનનો માલિક મના કરતો હોય.

મસ્ઝલા-(૭૦૯) : જુમ્બાના દિવસે કોઈનો ઈન્ટેકાલ થાય તો જો જુમ્બાથી પહેલા તજહીજ તથા તકફીન (કફન-દફન) થઈ શકે તો પહેલા જ કરી લો, એ વિચારથી રોકી રાખવું કે જુમ્બા પછી લોક સમૂહ વધારે થશે, મકરૂહ છે.

(રદ્દુલ મુખ્તાર વિગેરે)

મસ્ઝલા-(૭૧૦) : મગારિબની નમાજના સમયે જનાજો આવ્યો તો ફર્જ અને સુન્તતો પઢીને જનાજાની નમાજ પઢો. એવી જ રીતે કોઈ બીજી ફર્જ નમાજના સમયે જનાજો આવે અને જમાઅત તૈયાર હોય તો ફર્જ તથા સુન્તતો પઢીને જનાજાની નમાજ પઢો, એ શર્તે કે જનાજાની નમાજના વિલંબમાં શરીર ખરાબ થવાની આ શંકા ન હોય.

(આલમગીરી, રદ્દુલ મુખ્તાર)

મસ્ઝલા-(૭૧૧) : ઈદની નમાજના સમયે જનાજો આવ્યો તો પહેલા ઈદની નમાજ પઢો પછી જનાજાની નમાજ પઢો, પછી પુત્રાં અને ગ્રહણની નમાજના સમયે જનાજો આવેતો પહેલા જનાજાની નમાજ પઢો પછી ગ્રહણની નમાજ પઢો.

(દુર્ભ મુખ્તાર જવહરાહ)

મસ્ઝલા-(૭૧૨) : મુસલમાન પુરુપ અથવા સ્ત્રીનું બાળક જીવતું પેંડા થાય. અર્થાત બહુધા ભાગ (યોનીથી) બહાર થવાના સમયે જીવતું હતું અને પછી મૃત્યુ પામ્યું તો તેને ગુસ્લ તથા કફન આપીશું

અને તેના જનાજાની નમાજ પઢીશું. નહીં તો તેને એમજ નવડાલી એક કપડામાં લપેટી દફન કરી દઈશું, તેના માટે ગુસ્લ તથા કફન મસનુનતરીકાથી નથી અને તેની નમાજ પણ પઢવામાં આવશે નહીં ત્યાં સુધી કે માયું જ્યારેબાહર આયું હતું તે સમયે રહતું હતું પરંતુ અધિકાંશ ભાગ બહાર નીકળવાથી પહેલા જો બાળક મૃત્યુ પામ્યું તો નમાજ પઢવામાં આવે નહીં. અકસર માત્રા એ છે કે માથાની તરફથી હોય તો છાતી સુધી અકસર (અધિકાંશ) છે અને પગો તરફથી હોય તો કે સુધી.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર, વગેરે)

મસ્ફલા - (૭૧૩) : બાળકની માતા અથવા દાયકો જીવતા હોવાની સાક્ષી આપી તો તેની જનાજાની નમાજ પઢવામાં આવે પરંતુ વારસા વિષે તેની સાક્ષી (ગવાહી) અવિશ્વત છે અર્થાત બાળક પોતાના મરહુમ (મૃતક) બાપનો વારસદાર ડેરવામાં આવશે નહીં. ન બાળકની વારસદાર તેની માતા હશે, આ તે સમયે છે કે મુદ બહાર નીકળ્યો અને જો કોઈએ ગર્ભવતીના પેટ ઉપર ફટકો લગાવ્યો કે બાળક મરી ગેલું બહાર નીકળ્યું તો વારિસ થશે અને વારિસ બનાવશે.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા - (૭૧૪) : બાળક જીવતું પૈદા થયું અથવા મરેલું તેની ખલકત (પ્રકૃતિ) સંપૂર્ણ હોય કે અપૂર્ણ વસ્તુત તેનું નામ રાખવામાં આવે અને કેયામતના દિવસે તેના હશર થશે.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા - (૭૧૫) : કાફિરનું બાળક દારુલ હર્બમાં પોતાની માતા અથવા પિતાની સાથે અથવા પાછળ થી કેદ કરવામાં આયું પછી તે મૃત્યુ પામ્યું અને તેના માં-બાપ પૈકી હજુ સુધી કોઈ મુસલમાન થયું નહીં, તો તેને ન ગુસ્લ આપીશું ન કફન, ભલે દારુલ હર્બમાં મૃત્યુ પામ્યું હોય કે દારુલ ઈસ્લામમાં અને જો દારુલ ઈસ્લામમાં તેનો એકલો લાવે અર્થાત તેના માં-બાપમાંથી કોઈને કેદ કરીને ન લાવ્યા હોય, ન તે પોતાની રીતે બાળકના લાવવાથી પહેલા જિમ્મી બનીને આવ્યા તો તેને ગુસ્લ તથા કફન આપીશું અને તેની જનાજાની નમાજ પઢવામાં આવશે. જો તેણે સમજદાર (આકિલ) થઈને કુઝ

ધારણ ન કર્યું. (આલમગીરી, દુર્ભ મુખ્તાર વિગેરે) **મસ્ફલા - (૭૧૬) :** કાફિરના બાળકને કેદ કર્યો અને હજુ તે દારુલ હર્બમાં જ હતો કે તેનો બાપ દારુલ ઈસ્લામમાં આવી મુસલમાન થઈ ગયો તો બાળક મુસલમાન સમજવામાં આવશે અર્થાત જો કે દારુલ હર્બમાં અવસાન પામે તો તેને ગુસ્લ તથા કફન આપીશું, તેની જનાજાની નમાજ પઢીશું.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા - (૭૧૭) : બાળકને માં-બાપની સાથે કેદ કરી લાવ્યા અને તેઓ પૈકી કોઈ મુસલમાન થઈ ગયો અથવા તે બાળક સમજદાર હતો અને પોતે મુસલમાન થઈ ગયો તો આ બંને હાલતોમાં તે મુસલમાન સમજવામાં આવશે.

(તનવીરુલ અભસાર)

મસ્ફલા - (૭૧૮) : કાફિરના બાળકને માં-બાપની સાથે કેદ કર્યું પરંતુ તે બંને ત્યાં જ દારુલ હર્બમાં મૃત્યુ પામ્યા તો હોય મુસલમાન સમજવામાં આવે, બાલિગ પાગલ કેદ કરવા આવ્યો તો હુકમ એજ છે જે બાળકનો.

(રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા - (૭૧૯) : મુસલમાનનું બાળક કાફિર સત્રીથી પૈદા થયું તો તે તેની પરણિત (નિકાહવાળીન હતી અર્થાત તે બાળક જિના (વિભિન્નચાર) નો છે તો તેની જનાજાની નમાજ પઢવામાં આવે.

(રદ્દુલ મુહ્તાર)

કબ તથા દફનનું ભયાન

મસ્ફલા - (૭૨૦) : મૈયિતન દફન કરવું ફર્જ ફિકાયા છે અને એ જાઈજ નથી કે મૈયિતને જમીન પર મુકી દો અને ચારે બાજુથી દીવાલો ચણી લઈને બંધ કરી દો. (રદ્દુલ મુહ્તાર, આલમગીરી)

મસ્ફલા - (૭૨૧) : જે જગ્યાએ ઈન્ટેકાલ થયો એજ જગ્યાએ દફન ન કરો કેમકે આ ઐભિયા અલયહિમુસ્સલામ માટે વિશિષ્ટતા છે, બલ્કે મુસલમાનોના કબ્રસ્તાનમાં દફન કરો. મકસદ એ છે કે તેના માટે કોઈ ખાસ મદફન બનાવવામાં આવે નહીં. મૈયિત બાલિગ હોય કે નાબાલિગ.

(દુર્ભ મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા - (૭૨૨) : કબ્રની લંબાઈ મૈયિતના કદ બરાબર હોય અને પહોળાઈ અર્ધા કદની હોય અને

ઉડાઈ ઓછામાં ઓછી અર્ધા કંદની અને બહેતર (સારુ) એ છે કે ઉડાઈ પણ મૈયિતના કંદની બરાબર હોય અને મધ્યવર્તી દરજો એ છે કે છાતી સુધી હોય. (રદ્દુલ મુહ્તાર) આનાથી મુરાદ એ છે કે લહદ અથવા સંદૂક એટલું હોય. એમ નહીં કે જ્યાંથી ખોદવી શરૂ કરી ત્યાંથી અંત સુધી આ માત્રા હોય.

મસ્સલા - (૭૨૩) : કબ્રબે પ્રકારની હોય છે. (૧) લહદ, કે કબર ખોટીને તેમા કિબ્લા તરફ મૈયિતને મુકવાની જગ્યા ખોટે અને (૨) સંદૂક તે જે છિન્હુસ્તાનમાં સામાન્યત પ્રયુક્તિ છે. લહદ સુન્તત છે, જો જમીન તેના લાયક હોય તો એવું જ કરો અને નરમ જમીન હોય તો સંદૂકમાં વાંધો નથી.

(આલમગીરી)

મસ્સલા - (૭૨૪) : કબ્રની અંદર ચટાઈ વિગેરે બિછાવવું ના જાઈજ છે, કે વગર કારણે માલ નખ કરવું છે.

(હુર્રે મુખ્તાર)

મસ્સલા - (૭૨૫) : તાબૂત, કે મૈયિતને કોઈ લાકડા વિગેરેની સંદૂકમાં મુકીને દફન કરે, આ મકરૂહ છે, પરંતુ જ્યારે જરૂરત હોય. દા.ત. જમીન બહુજ ભેજવાળી છે તો વાંધો નથી આ હાલતમાં તાબૂતનો ખર્ચો તેમાંથી લેવામાં આવે જે મધ્યિતેમાલ છોડ્યો છે.

(આલમગીરી, હુર્રે મુખ્તાર વિગેરે)

મસ્સલા - (૭૨૬) : જો તાબૂત (પેટી) માં મુકીને દફન કરે તો સુન્તત એ છે કે તેમાં મારી બિછાવી દે અને ઉપર લીપણ કરી દે. સારાંશકે ઉપરનો ભાગ લહદ જેવો થઈ જાય અને લોખંડનો તાબૂત મકરૂહ છે. અને કબ્રની જમીન ભીનાશવાળી હોય તો ધૂળ બિછાવી દેવું સુન્તત છે.

(સગીરી, રદ્દુલ મુહ્તાર)

મસ્સલા - (૭૨૭) : કબ્રના ના તે ભાગમાં કે જે મૈયિતના શરીરથી નિકટ છે પાકી ઈટ લગાવવું મકરૂહ છે. ઈટ આગથી પાકે છે. અલ્લાએ તથા મુસલમાનોને આગની અસરથી બચાવે.

(આલમગીરી)

મસ્સલા - (૭૨૮) : કબ્રમાં ઉત્તરવાવાળા બે ત્રણ જે ઉચ્ચિત હોય, આમાં કોઈ સંખ્યા ખાસ નથી અને બેહતર એ છે કે શક્તિશાળી, તથા અમાનતદાર હોય કે કોઈ અયોગ્ય વાત દેખે તો લોકોને જાહેર

(હુર્રે મુખ્તાર વિગેરે)

મસ્સલા - (૭૨૯) : જનાજો કબ્રથી કિબ્લા તરફ રાખવું મુસ્તબ છે કે મહદુ કિબ્લા તરફથી કબ્રમાં ઉત્તરવામાં આવે. એવું નહીં કે કબ્રની પાંયતીએ મુકે અને માથા તરફથી કબ્રમાં લાવે.

(હુર્રે મુખ્તાર વિગેરે)

મસ્સલા - (૭૩૦) : સ્ત્રીનો જનાજો કબ્રમાં ઉત્તરનાર મહરમ (જેની સાચે કામ્યાને માટે નિકાલ હરામ હોય) હોય. તે ન હોય તો બીજા સગાઓ, તે પણ ન હોય તો પરહેઝગાર અજનબી (મહરમના હોય તે) ઉત્તરવામાં વાંધો નથી. (આલમગીરી)

મસ્સલા - (૭૩૧) : મૈયિતને કબ્રમાં રાપતી વખતે આ દુઅા પડો. બિસ્મિલ્હાહે વબિલ્હાહે વ અલામિલ્હાહે રસુલિલ્હાહે અને એક રિવાયતમાં બિસ્મિલ્હાહ પછી વ ફી સબી લિલ્હાહે પણ આવ્યું છે.

(આલમગીરી રદ્દુલ મુહ્તાર)

મસ્સલા - (૭૩૨) : મૈયિતને જમણા પાસે સુવડાવી અને તેનું મુખ કિબ્લા તરફ કરો જો કિબ્લા તરફ મુખ કરવું ભૂલી ગયા, પાટીયા લગાવ્યા પછી યાદ આવ્યું તો પાટીયું હઠાવી કિબ્લા તરફ કરી દો અને માટી નાંખી દીઘા પછી એમજ રહેવા દો. એવી જ રીતે જો ડાબી પાસે મૈયિતને મુકી અથવા જે બાજુએ સિરાણું હોવું જોઈએ તે બાજુએ પગ કર્યો તો ઢીક કરી દે. નહીં. તો નહીં.

(આલમગીરી, હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્સલા - (૭૩૩) : મૈયિતને કબ્રમાં મુક્યા પછી કફનની ગાંઠો ખોલી નાંખો. કે હવે તેની જરૂરત નથી. અને ન ખોલો તો વાંધો નથી. (જવહરહ)

મસ્સલા - (૭૩૪) : મૈયિતને કબ્રમાં મુક્યા પછી લહદને કાચી ઈટોથી બંધ કરો અને જમીન નરમ હોય તો પાટીયા લગાડવું પણ જાઈજ છે. પાટીયાઓની વચ્ચે જો જગ્યા રહી ગઈ તો તને ઢેલા વિગેરેથી બંધ કરી દો. સંદૂકનો પણ એ જ હુકમ છે.

(હુર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્સલા - (૭૩૫) : સ્ત્રીનો જનાજો હોય તો કબ્રમાં ઉત્તરવાથી લઈને પાટીયા લગાવવા સુધી કબ્રને કપડા વિગેરેથી ઢાકી રાખો, પુરુપની કબ્રને દફન કરતી વખતે ઢાકો નહીં. અલબત જો કાંઈ ઉગર

હોય તો મુખ વિગેરે છુપાવવું જાઈજ છે. સ્ત્રીનો જનાઝો પણ ઢાંકેલો રહે. (જવહર દુર્મુહ્તાર)

મસાલા - (૭૩૬) : પાટીયા મુક્કા પછી માટી આપવામાં આવે. મુસહબ એ છે કે, માથાતરફ બંને હાથોથી ગ્રણ વખત માટી નાંખો. પ્રથમ વાર કહો. “મિન્ડા ખલકનાકુમ” (અર્થ-આનાથી જ (માટીથી) અમોએ તમને પૈદા કર્યા) બીજીવાર વફીહે નુઈદોકુમ (પર્થ-અને તેમાં જ (માટીમાં જ) તમને પાછા ફેરવીશું ત્રીજીવાર “વ મિન્ડા નુખરેજોકુમ તારતન ઉપરા.” (અર્થ-અને તેનાથી જ (માટીથી) તમને ફરીવાર કાઢીશું) અથવા પ્રથવાર- ‘અલ્લાહુમમા જાફિલ અર્દ, અન બિ જમ્બોહિ.’ (અર્થ અય અલ્લાહ જમીનને તેના બંને પાસાઓથી વિસ્તૃત કરે) બીજીવાર અલ્લાહુ મ્મફિતહ અભ્વાભસમાએ લે રહેહિ (અર્થ-અય અલ્લાહ તેની રૂહ માટે આસમાનન (દરવાજા ખોલી દે.) ત્રીજીવાર અલ્લાહ હુમ્મા જાબ્વિજહો મિન હુરિલ અધયને. (અર્થ-અય અલ્લાહ! તારી રહમતથી તુ આને જન્નતમાં દાખલ કરી દે.)

બાકીની માટી હાથથી અથવા પાવડા વિગેરેથી કબ્રમાં નાખો અને જેટલી માટી કબ્રમાંથી નીકળી હોય તેના કરતાં વધારે નાખવું મકરૂહ છે.

(જવહર રહ, આલમગીરી)

મસાલા - (૭૩૭) : હાથમાં જે માટી લાગી હોય તેને ખંખેરી નાંખો અથવા ધોઈ નાંખો તમને અખત્યાર છે.

મસાલા - (૭૩૮) : કબ્ર ચોંડી ન બનાવો, બલ્કે તેમાં ઢાળ રાખો, જેવું ઉટનું પલાણ હોય છે. અને તેના ઉપર પાણીછાંટવામાં વાંધો નથી, બલ્કે બહેતર છે. અને કબ્ર એક વે'ત ઉચ્ચી હોય અથવા થોડીક વધારે. (આલમગીરી રદ્દુલ મુહ્તાર)

મસાલા - (૭૩૯) : જહાજ પર ઈન્ટેકાલ થયો અને ડિનારો નિકટ ન હોય તો ગુસ્લ તથા કફન આપી જનાઝાની નમાજ પઢીને સમુદ્રમાં ડુબાઈ દો.

(ગુનીથા, રદ્દુલ મુહ્તાર)

મસાલા - (૭૪૦) : ઉલ્મા તથા મશાયખ તથા સાદાતની કબ્રો પર કુબુબો વિગેરે બનાવવામાં વાંધો નથી. અને કબ્રને પાકી ન બનાવવામાં આવે. (દુર્મુહ્તાર, રદ્દુલ મુહ્તાર). અર્થાત અંદરથી પાકી

ન કરવામાં આવે અને જો અંદર કાચી હોય અને ઉપરથી પાકી તો વાંધો નથી.

મસાલા - (૭૪૧) : જો જરૂરત હોય તો કબ્ર પર નિશાન (ચિન્હ) માટે કાંઈ લખી શકે છે, પરંતુ એવા સ્થળે ન લખે કે બેચદિબી થાય. એવા મકબરાઓમાં દફન કરવું ઉત્તમ છે. જ્યાં સાલેહ (નેક) લોકોની કષ્ટોહોય. (જવહર રહ, દુર્મુહ્તાર)

મસાલા - (૭૪૨) : મુસહબ એ છે કે દફન પછી કબ્ર પર સુરએ બકરહનો અભ્વલ તથા આખરી ભાગ પઢે. સિરાઝો અલિફ-લામ-મીમથી મુફ્લેહુન સુધી અને પાંગેતીએ આમનર્સુલોથી સૂરતના અંત સુધી પઢે. (જવહર રહ)

મસાલા - (૭૪૩) : દફન પછી કબ્રની પાસે એટલીવાર રોકાંબું મુસતહબ છે જેટલીવાર ઉટઝુઝુ કરીને માંસ વહેંચી દેવામાં આવે કે તેમના રહેવાથી મૈયિતને સ્નેહ થશે અને મુનકર નકીરના જવાબ આપવામાંડરન થશે. અને એટલીવાર કુરાઅનની તિલાવત અને મૈયિત માટે દુસ્તાત્થા ઈસ્ટિગફાર કરે અને આ દુઓ કરે કે મુનકર-નકીરના જવાબમાં અડગ રહે. (જવહર રહ વિગેરે)

મસાલા - (૭૪૪) : એક કબ્રમાં એક કરતાં વધારે મડદાં જરૂરત વગર દફન કરવા જાઈજ નથી. અને જો જરૂરત હોય તો કરી શકે છે, પરંતુ બે મૈયિતોની વચ્ચે માટી વિગેરે આડ કરી દે અને કોણ આગળ હોય કોણ પાછળ તે ઉપર આવી ગયું છે.

(આલમગીરી)

મસાલા - (૭૪૫) : જે શહેર અથવા ગામ વિગેરે માં ઈન્ટેકાલ થયો ત્યાંના જ કબ્રસ્તાનમાં દફન કરવું મુસતહબ છે જો કે ત્યાં રેહતો ન હોય, બલ્કે જે ઘરમાં ઈન્ટેકાલ (અવસાન) થયો તે ઘરવાળાઓના કબ્રસ્તાનમાં દફન કરે. અને બે એક માઈલ બદાર લઈ જવામાં વાંધો નથી કે, શહેરના કબ્રસ્તાન અકસર (બહુધા) એટલા અંતરે હોય છે. અને જો બીજા શહેરમાં તેની લાશ ઉઠાવી લઈ જાય તો અકસર ઉલ્માએ મના કર્યું છે. અને એજ સહીહ છે. આ તે હાલતમાં છે કે દફનની અગાઉ લઈ જવા ચાહે, અને દફન પછી તો સર્વથા સ્થળાંતર કરવું મના (નિપેદ) છે. સિવાય કેટલીક હાલતોમાં કે જે હવે આગળ મજકુર થશે (આલમગીરી) અને આ

કે જે કેટલાક લોકોની રીત પ્રથા છે કે જમીનને સુપ્રત કરે છે. પછી ત્યાંથી લાશને કાઢીને બીજે સ્થળે દફન કરે છે, આ નાજાઈજ છે અને રાફઝીઓને તરીકો (પ્રથા) છે.

મસ્ફલા-(૭૪૬) : બીજાની જમીનમાં માલિકની પરવાનગી વગર લાશને દફન કરી દીધી તો માલિકને અધિકાર છે કે બલે મૈયિતના સંબંધીઓને કહે કે તમારું મદહું કાઢી લો અથવા જમીન સરખી કરીને તેમાં ખેતી કરે. એવી જ રીતે જો તે જમીન પાડોસી હક્કમાં લઈ લેવામાં આવી અથવા ગસબ કરેલ (પડાવી પાડેલ) વસ્ત્રનું કફન આખ્યું, તો માલિક મદદાને કઠાવી શકે છે.

(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૭૪૭) : વક્ફ કરેલા કબ્રસ્તાનમાં કોઈ એ કબ્ર તૈયાર કરાવી, તેમાં બીજા લોકો પોતાનું મદહુ દફન કરવા ઈચ્છે છે અને કબ્રસ્તાનમાં જગ્યા છે તો આમ કરવું મકરૂહ છે. અને જો દફન કરી દીધું તો કબ્ર ખોદાવનાર મદદાને બહાર કઠાવી શકતો નથી. જે ખર્ચ થયું છે તે લઈ લે.

(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૭૪૮) : સ્ત્રીને કોઈ વારસદારો ઘરેણાં સમેત દફન કરી દીધી અને કેટલાક વારસદારો હાજર ન હતા, તે વારસદારોને કબ્ર ખોદાવાની પરવાનગી છે, કોઈનો કાંઈ માલ કબ્રમાં પડી ગયો, અને માટી નાખી દીધા પછી યાદ આખ્યું તો કબ્ર ખોદાને કાઢી શકે છે. જો કે તે એક જ દિરહમ હોય.

(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

(નોટ : દિરહમ એટલે ચાંદીની “ચારાણી” અનુ.)

મસ્ફલા-(૭૪૯) : પોતાના માટે કફન તૈયાર રાખ્યું તો વાંધો નથી અને કબ્ર ખોદાવી રાખવું અર્થ વગરનું છે, શું ખબર કર્યાં તેનું મરણ થશે. (દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૭૫૦) : કબ્ર પર બેસવું, સુઈ રહેવું, ચાલવું, જાજરુ-પેશાબ કરવું હરામ છે. કબ્રસ્તાનમાં જે નવો રસ્તો કાઢવામાં આવ્યો તેના ઉપરથી પસાર થવું નાજાઈજ છે, ભલે નવો હોવું તેને ખબર હોય કે તેની ધારણા હોય. (આલમગીરી, દુર્ભ મુખ્તાર)

મસ્ફલા-(૭૫૧) : પોતાના કોઈ સગા-સંબંધીની કબ્ર સુધી જવા ઈચ્છે છે. પરંતુ કબ્રો ઉપરથી પસાર

થવું પડશે તો ત્યાં સુધી જવું મના છે, દૂરથી જ ફાનેહા પઢી છે. કબ્રસ્તાનમાં બુટ પહેરીને જાય નહીં, એક માણસને હુલ્લરે અકદસ સલ્લલલાહો અલયહે વસલ્લમે બુટ પહેરેલી હાલતમાં જોયો તો આપે ફરામબ્યું : “બુટ ઉતારી નાંખ, ન કબ્રવાળાને તુ તકલીફ આપ ન તે તને તકલીફ આપે.”

મસ્ફલા-(૭૫૨) : કબ્ર પર કુઅર્ન પઢવા માટે ડાફ્ફિઝ મુકર્રર કરવું જાઈજ છે. (દુર્ભ મુખ્તાર) અર્થાત જ્યારે કે પઢનાર મહેનતાશાથી ન પઢતા હોય કે મહેનતાશાં પર કુઅર્ન પઢવું અને પઢાવવું ના જાઈજ છે. જો મહેનતાશાં પર પઢાવવા ઈચ્છે તો પોતાના કામકાજ માટે તેમને નોકર રાખે, પછી તેમનાથી આ કામ લે.

મસ્ફલા-(૭૫૩) : શિજરો અથવા અહદનામું કબ્રમાં મુકવું જાઈજ છે, અને બહેતર એ છે કે, મૈયિતના મુખની સામે ડિલ્લા તંરફ તાખું ખોદીને તેમાં મુકે, બલ્કે “દુર્ભ મુખ્તાર”માં કફન પર અહદનામું લખવાને જાઈજ કહ્યું છે અને ફરમાબ્યું કે તેનાથી મગફેરતની આશા છે. અને મૈયિતની છાતી અને કપાંણ ઉપર “બિસ્મિલ્લાહ રિહેહમા નિર્હીમ” લખવું જાઈજ છે. એક માણસે તેની વસિયત કરી હતી. ઈન્નેકાલ પછી તેમની છાતી અને લલાટ પર બિસ્મિલ્લાહ શરીફ લખી રહેવામાં આવી, પછી કોઈએ તેમને સ્વખમાં જોયા, હાલત પૂછી, તો કહ્યું : જ્યારે મને કબ્રમાં મુકવામાં આવ્યો અંજાબના ફરિશ્તા આવ્યા, ફરિશ્તાઓએ જ્યારે પેશાની (લલાટ) પર “બિસ્મિલ્લાહ શરીફ” જોઈ તો કહ્યું : તું અંજાબથી બચી ગયો. (દુર્ભ મુખ્તાર, ગુનીયા અને તાતારખાનીયા) એમ પણ થઈ શકે છે કે પેશાની પર બિસ્મિલ્લાહ શરીફ લખે અને છાતી ઉપર કલમએ તૈયેબા “લાઈલાહ ઈલલલલાહો મુહમ્મદરુસુલુલ્લાહ” લખે, પરંતુ નવડાવ્યા પછી, કફન પહેવરાવ્યા પહેલા કલેમાની આંગળીથી લખે.

(રદ્દુલ મુહ્તાર)

જિયારતે કુલૂર

મસ્ફલા-(૭૫૪) : કબ્રોની જિયારત કરવું મુસ્તહબ છે. અઠવાણીમાં એક દિવસ જિયારત કરે, જુઘા અથવા જુમેરાત અથવા શનિવાર અથવા સોમવારના દિવસો સુયોગ છે. સૌમાં ઉત્તમ દિવસ

જુમ્મામાં સવારનો ટાઈમ છે, ઔદ્ઘિયાએ કિરામના મજારો પર સફર (પ્રવાસ) કરીને જબું જાઈજ છે. તેઓ પોતાના જાઈરીન (દર્શનાર્થીઓ) ને લાભ પહોંચાડે છે અને જો ત્યાં કોઈ શરાબ વિરુદ્ધનું કામ હોય દા.ત. સ્ત્રીઓથી ભેણેસેળ, તો તેના કારણે નિયારત ત્યાગ કરવામાં આવે નહીં, કેએવી વાતોથી નેક કામનો ત્યાગ કરવામાં આવતો નથી. બલ્કે તેને ખરાબ સમજે અને શક્ય હોય તો ખરાબ વાત નખ કરે.

(રદ્દુલ મુહ્તાર).

મસ્યલા-(૭૫૫) : સ્ત્રીઓ માટે પણ કેટલાક ઉલ્લમાઓ એ કબ્રોની નિયારતને જાઈજ બતાવ્યું છે. હુર્ઝ મુહ્તારમાં એજ કોલ પસંદ કરવામાં આવ્યો, પરંતુ સ્નૈહીઓની કબ્રો પર જશે તો રૂદન આકંદ કરશે માટે મનાઈ (નિષેધ) છે. અને સાલેહીન (નેક લોકોની) કબ્ર પર બરકત માટે જાય તો વૃધ્યાઓ માટે વાંધો નથી, અને જવાનો માટે મનાઈ છે. (રદ્દુલ મુહ્તાર) અને અસ્લીમએ છે કે સ્ત્રીઓને સર્વથા મના કરવામાં આવે કે પોતાનાઓની કબ્રોની ની કબ્રો પર યાતો તાંજીમ (આદર)માં હદ્થી વધી જશે અથવા બે અદબી કરશે, કે સ્ત્રીઓમાં આ બંને વાતો અવિકતાથી જોવામાં આવે છે. (ફતાવા રિઝવીયા)

મસ્યલા-(૭૫૬) : કબ્રની નિયારતનો તરીકો એ છે કે પાંગેતી તરફથી જઈને મૈયિતના મુખની સામે ઉભા થાય, સિરાજા તરફથી ન આવે કે મૈયિતે માટે તકલીફના કારણ રૂપ છે. અર્થાત મૈયિતે ગઈન ફેરવીને દેખવું પડશે કે, કોણ આવે છે. અને આવી રીતે કહે. “અસ્લામો અલૈકુમ અહલ દાર કૌમિમ-મુમેનીના અન્તુમ લના સલહુન વ ઈન્ના ઈન્શા અલ્લાહો બે કુમ લાહેકુન. ન સંસુલ્લાહ લના વલું મુલ્લાફ વલ્લાફેયતા યહું મુલ્લાહુમ સંકદેમીના મિના વલ્લસ્તાખેરીના. અલ્લાહુમ! રબુલ્લાહિલ્લાનેયતે વલ્લાજસાહિલબાલેયતે વલ્લાઝામિન્નખેરતે અદખિલ હાજેહિલ્લભુર મિન્કારૌહંવ્યરખાનવ્યમિના તહિયતંવ્ય સલામા”

(તરજુમો : સલામ થાય તમારા ઉપર અય મોમેનીન કોમના ઘરવાળાઓ, તમો અમારી આગળવાળા છો અને અમો ઈન્શા અલ્લાત તમારાથી

મળવાળા છીએ. અલ્લાહુ અમો પોતાના અને તમારા માટે અફવ તથા આફિયત (ક્રમાતથા કુશળ તા)નો સવાલ કરીએ છીએ. અલ્લાહ અમારા આગલાઓ અને પાછલાઓ પર રહેમકરે. અય અલ્લાહ ફાની (નાશંચત) આત્માઓના અને સડી જનાર શરીર અને જર્જરીત હાડકાઓના રબ્બ, તું પોતાની તરફથી આ કબ્રોમાં તાજગી અને સુગંધી દાખલ કર અને અમારા તરફથી તહિયત (આદાબ) તથા સલામ પહોંચાડી દે,) પછી ફાતેહા પછે અને બેસવા ઈચ્છે તો એટલા અંતરે બેસ કે તેમની પાસે જિંદગીમાં બેસતો હતો અથવા દુર અંતરે બેસી શકતો હતો.

(રદ્દુલ મુહ્તાર)

મસ્યલા-(૭૫૭) : કબ્રસ્તાનમાં જાય તો અલહુમદો શરીર અને અલિફ-લામ-મીમ થી મુફ્લેહુન સુધી અને આયતુલ કુર્સિઅને આમનર્સુલ અંતીમ સૂરહ સુધી અને સૂરાએ યાસીન અને તબારકલુલુની જને અલહાકુ મુત્તકાસુર એક એક વખત અને કુલહોવલ્લાહ બાર અથવા અગીયાર અથવા સાત અથવા ત્રણ વખત પઢે. અને આ સૌનો સવાબ મડદાંઓને પહોંચાડે. હઠીસમાં છે. જે માણસ અગીયાર (૧૧) વખત કુલહોવલ્લાહ શરીર પઢીને તેનો સવાબ મડદાંઓને પહોંચાડે તો મડદાંઓની ગણત્રી બરાબર તેને સવાબ મળશે.

(રદ્દુલ મુહ્તાર, હુર્ઝ મુહ્તાર)

મસ્યલા-(૭૫૮) : નમાજ, રોજા હજજ ઝકાત અને દરેક પ્રકારની ઈબાદત અને દરેક નેક, ફર્જ તથા નિફલ અમલનો સવાબ મડદાંઓને પહોંચાડી શકે છે. તે સૌને પહોંચશે અને તેના સવાબમાં કાંઈ કમી-ઉણપ ન થશે, બલ્કે તેની રહેમતથી આશા છે કે સૌને સંપૂર્ણ સવાબ મળે. એવું નથી કે એજ સવાંબની વહેચણી થઈને ટુકળો ટુકળો મળે. (રદ્દુલ મુહ્તાર) બલ્કે આશા છે કે આ સવાબ પહોંચાડનાર માટે તે સૌના મજમુઆ (સરવાળા)ની બરાબર મળે, દા.ત. કોઈ નેક કામ કર્યુ. જેનો સવાબ ઓછામાં ઓછો દસ મળશે. તેણે દસ મડદાંઓને સવાબ પહોંચાડયો તો દરેકને દસ દસ મળશે અને તેને એકસો દસ અને હજારને પહોંચાડયો તો તેને

દસ હજાર દસ આ ઉપર અંદાજો કરો. (એ જ ગણત્રી પ્રમાણે સવાબ મળશે.)

(ફિતાવા રિઝવિયા)

મસ્થલા-(૭૫૮) : નાબાલિગો કાંઈ પર્ટીને અથવા કોઈ નેક અમલ (સદકાર્ય) કરીને તેનો સવાબ મદદાને પહોંચાડયો તો ઈન્શા અલ્લાહ તાઓલા પહોંચશે.

(ફિતાવા રિઝવિયા)

મસ્થલા-(૭૬૦) : કબ્રને બોસો (ચુબંન) દેવું કેટલાક ઉલ્માઓએ જાઈજ કહ્યું છે. પરંતુ સહીહ એ છે કે મનાછે. (અશઅતુલ લમાાત) અને કબ્રનો “તવાફ તઅજીમી” મના છે. અને જો બરકત લેવા માટે મજારની આસપાસ ફર્યો તો વાંધો નથી, પરંતુ અવામ (સામાન્ય લોકો) ને મના કરવામાં આવે, બલ્કે અવામની સામે કરવામાં પણ ન આવે, કે તેઓ કાંઈનું કાંઈ સમજશે.

દફન પછી તલકીન :

મસ્થલા-(૭૬૧) : દફન પછી મદદાને તલકીન કરવું અહલે સુન્નતની નજરોમાં મશરૂહ (શરીરાતી વાત) છે. (જવહરરહ) એ જે અકસર કિતાબોમાં છે કે તલકીન કરવામાં આવે નહીં, તે “મોઅતજલા” નો મજાહબ છે, કે તેમજો અમારી કિતાબોમાં આ ઉમેરો કરી દીધો. (રદ્દુલ મુહુતાર) હદીસમાં છે કે હુઝુરે અકદસ સત્તલલાહો અલ્યાહે વસત્તલમ ફરમાવે છે. “જ્યારે તમારો કોઈ મુસલમાન ભાઈ મૃત્યુ પામે અને તેને મારી આપી ચુકો તો તમારા પૈકી એક માણસ કબ્રના સીરાઓ ઉભો રહીને કહે : ફલાણા બિન ફલાણા, તે સાંભળશે અને જવાબ આપશે નહીં, પછી કહે : ફલાણા બિન ફલાણા, તે સીધો થઈને બેસી જરો, પછી કહે : ફલાણા બિન ફલાણા, તે કહેશે અમને ઈરશાદ કર, અલ્લાહ તારા ઉપરરહેમ (દયા) કરે, પરંતુ તમને તેના કહેવાની ખબર થતી નથી,” પછી કહે—“ઉઝ્ફુર મા ખરજત અદૈહે મ્યિનદુન્યા શહાદતન અલ-લાઈલાહા ઈલ્લલાહો વ અન્ન મુહુમ્મદન અબ્દોહુ વ રસુલોહુ સત્તલલાહો તાઓલા અદૈહે વસત્તલમ, વ અન્ન કર્દીત બિલ્લાહે રબબં વ્યબિલ્દીસ્લામે દીનવ્યબેમુહુમ્મદિન સત્તલલાહો તાઓલા અદૈહે વસત્તલમ નભીયં વ્યબિલ્કુઅને ઈમામા.”

(તરજુમો :- તુ તેને યાદ કર જેના ઉપર તુ દુનિયામાંથી નીકળ્યો અર્થાત તે ગવાહી કે અલ્લાહ સિવાય કોઈ મઅબુદ નથી અને મોહમ્મદ સત્તલલાહો અલ્યાહે વસત્તલમ તેના બંદા અને રસુલ છે. અને એ કે તુ અલ્લાહના રજ્બ અને ઈસ્લામના દીન, અને મોહમ્મદ સત્તલલાહો અલ્યાહે વસત્તલમ ના નભી અને કુર્અનના ઈમામ હોવા પર રાજી હતો.)

મુનકર-નકીર એકબીજાનો હાથ પકડીને કહેશે ચાલો અમો તેની પાસે શું બેસીએ જેને લોકો તેની હુજાર શિખવાડી ચુક્યા, આ વાત પર કોઈએ હુજુરને અર્જ કરી જો તેની મા (માતા) નું નામ યાદ ન હોય તો, આપે ફરમાવ્યું, બીજી હવ્યા તરફ નિષ્ઠત (સંબંધ) કરે. આ હદીસને તિથાનીએ કબીરમાં અને જિયાએ અહિકામમાં અને બીજા મુહિદ્દિસોએ રિવાયત કરી, કેટલાક મોટા ઈમામો તાબેઈન ફરમાવે છે : જ્યારે કબ્ર પર મારી બરાબર કરી ચુકે, અને લોકો પાછા જાય તો મુસ્તહબ સમજવામાં આવતું કે મૈયિતથી તેની કબ્રની પાસે ઉભા રહીને આમ કહેવામાં આવે - યાં હુલાં બિન કુલાં ! કુલ લાઈલાહા ઈલ્લલાહો. (અય ફલાણા બિન ફલાણા ! તું કહે કે, અલ્લાહ સિવાય કોઈ મઅબુદ નથી) ત્રણ વખત ફરી કહેવામાં આવે - કુલ : રબ્બીયલ્લાહો વ દીનયત ઈસ્લામો વ નભીયેચી મોહમ્મદ સત્તલલાહો તાઓલા અલ્યાહે વસત્તલમ.

(તુ કહે કે મારો રજ્બ અલ્લાહ છે અને દીન ઈસ્લામ છે અને મારા નભી મોહમ્મદ સત્તલલાહો અલ્યાહે વસત્તલમ છે.)

આલા હજરતે આના ઉપર એટલો બીજો વધારો કર્યો.

વઅલમ અન્ન હાજેનિલ્લાહીના અત્યાકા અય યાતેયાનેકા ઈન્નમાં હુમા અદ્દાનેલિલ્લાહે લા યદુરાને વલા યન્કાઅને ઈલ્લા બેઈજનિલ્લાહે ફલા તખ્ફ વલા તહજીન વ અશહદો અન્ન રબ્બુકુલ્લાહો વ દીનકલ્દીસ્લામો વ નભીયેક મુહુમ્મદુન સત્તલલાહો અદૈહે વસત્તલમ સુખાનલ્લાહો વ ઈચ્યાક બિલકૌલીસ્સાબિતે

ફીલ્ડતાતિદદુન્યા વફીલ્યાખેરતે વ ઈન્નાં
હુવલ્યાફુર્રહીમ."

(અને જાહી લેકે આ બે શખ્સો જે તારી પાસે
આવ્યા અથવા આવશે તે અલ્લાહના બંદા છે.
ખુદાના હુકમ વગર ન નુકસાન પહોંચાડે ન નશો,
માટે ન ખૌફ કર ન ગમ કર અને તુ ગવાહી આપકે
તારો રજ્ય અલ્લાહ છે અને તારો દીનઈસ્લામ છે
અને તારા નબી મોહમ્મદ સલ્લાહ્લાહો અલયહે
વસ્ત્રમછે. અલ્લાહ અમને અને તને સાબિતકોલ
(કથન) પર સાબિત (દ્રઢ) રાખે, હુનિયાની
જિંદગીમાં અને આપેતરમાં, બેશક તે બખ્શવા
વાળો મહેરબાન છે.)

મસ્ખલા-(૭૬૨) : કષ્ટ પર કુલ નાંખવું બહેતર છે
કે જ્યાં સુધી તર (વીલા) રહેશે. તસ્બીહ કરશે અને
મૈયિતનું દિલ બહેલશે (રાજ થશે). (રદ્દુલ
મુહ્તાર) એવી રીતે જનાજા ઉપર કુલોની ચાદર
નાખાવમાં પણ વાંધો નથી.

મસ્ખલા-(૭૬૩) : કષ્ટ પરથી લીલું ધાસ ઉપેડવું
જોઈએ નહીં કે તેની તસ્બીહથી રહેમત ઉત્તરે છે
અને ઉપેડવામાં મૈયતનો હક નખ્ક કરવું છે. (રદ્દુલ
મુહ્તાર)

તાજીયત (શોક પ્રદર્શન) નું બચાન :

મસ્ખલા-(૭૬૪) : તઅઝીયત મસનુનાંછે. હદીસમાં
છે કે જે માઝસ પોતાના ભાઈની મુસિબતમાં
તા'જીયત કરે કિયામતના દિવસે અલ્લાહ તાલા
તેને કરામતનો જોડો (પોષાક) પહેરાવશે. આને
ઈબ્ને માજાએ રિવાયત કરી, બીજી હદીસ તિરમિઝી
તથા ઈબ્ને માજામાં છે "જે માઝસ કોઈ દુઃખીયારાની
તઅઝીયત કરે તેને તેના જેવો જ સવાબ મળશે.

મસ્ખલા-(૭૬૫) : તા'જીયતનો સમય મૂલ્ય થી
ત્રણ દિવસ સુધી છે. તેના પછી મકરૂહ છે કે, ગમ
(રંજ) તાજો થશે, પરંતુ જ્યારે તા'જીયત કરનાર
અથવા જેની તા'જીયત કરવામાં આવે તાં હાજર
ન હોય અથવા હાજર છે પરંતુ તેને ખબર નથી તો
પાછળથી તા'જીયત કરવામાં વાંધો નથી.

(જવહરાહ, રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૭૬૬) : દફનથી અગાઉ પણ તા'જીયત
જાઈજ છે, પરંતુ અફઝલ એ છે કે, દફન પછી
હોય. આ તે સમયે છે કે મૈયિતના સંબંધીઓ રડારડ

ન કરતા હોય. નહીં તો તેમની તસ્લી (સાંતવન)
માટે દફનથી અગાઉ જ કરે. (જવહરાહ)

મસ્ખલા-(૭૬૭) : મુસ્તહબ એ છે કે મૈયિતના
સથળા સગાઓને તા'જીયત કરે, નાના મોટા,
પુરુપ-સ્ત્રી સૌને, પરંતુ સ્ત્રીને તેના મહરમોજ
તા'જીયત કરે. તા'જીયતમાં એમ કહે, "અલ્લાહ
તાલાલ મૈયિતની મગફેરત કરે અને તેને પોતાની
રહેમતમાં ઢાંકી લે અને તમને સબ્ર આપે અને આ
મુસીબત પર સવાબ અતા કરે." નબી સલ્લાહ્લાહો
અલયહે વસ્ત્રમાં આ શબ્દોથીતા'જીયત ફરમાવી
: "લિલ્ખાહે મા અખજ વ અખતા વ કુલ શૈંન
ઈન્દહુ બે અજલિમ મુસમ્મા."

(ખુદાનું જ છે જે તેણે લીધું-દીધું અને તેની
નજીદીક દરેક ચીજા એક મુકર્રર (ઠેરવેલ) મુદ્દત સુધી
છે.) (આલમગીરી વિગેરે)

મસ્ખલા-(૭૬૮) : મુસીબત પર સબ્ર કરે તો તેને
સવાબ મળે છે. એક મુસીબતોનો અને બીજો
સબ્રનો. અને હાય-વાય કરવાથી બંને જતા રહે છે.
(રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૭૬૯) : મૈયિતના સ્નેહીઓનું ધરમાં
બેસવું કે લોકો તેમની તા'જીયત માટે આવે, તેમાં
વાંધો નથી. અને મકાનના દરવાજા પર અથવા
આમ રસ્તા પર પાથરણા પાથરીને બેસવું ખરાબ
વાત છે. (આલમગીરી, દુર્ભુત્તાર)

મસ્ખલા-(૭૭૦) : મૈયિતના પાડોશી અથવા દુરના
સગા વહાલાં જો મૈયિતના ધરવાળાઓ માટે તે
દિવસ અને રાત માટે ખાંધું લાવે તો બહેતર છે.
અને તેમને આગ્રહ કરી ખવડાવે. (રદ્દુલ મુહ્તાર)

મસ્ખલા-(૭૭૧) : મૈયિતના ધરવાળાઓ તીજા
વિગેરેના દિવસે દઅવત કરે તો ના જાઈજ તથા
ખરાબ બિદાયત છે કે દઅવત તો ખુશીના સમયે
ઉચ્ચિત છે, ન કે ગમ (રંજ) ના સમયે. અને જો
ફીરો (ગરીબો) ને ખવડાવે તો બહેતર છે.

(ફિલ્હલ કદીર)

મસ્ખલા-(૭૭૨) : જે લોકો પાસે કુર્અન મજૂદ
અથવા કલમએ તૈયેબહ પઢાવું તેમના માટે પણ
ખાંધું (ભોજન) તૈયાર કરવું નાજાઈજ છે. (રદ્દુલ
મુહ્તાર) અર્થાત જ્યારે કે ઠેરવી (નક્કી કરી) લીધું
હોય અથવા મઅરુફ (પ્રસિદ્ધ) હોય અથવા તેઓ

માલદાર લોકો હોય.

મસ્ફુલા-(૭૭૩) : તીજા વિગેરેનું ખાણું અક્સર મૈયિતના તરકા (વારસા) થી કરવામાં આવે છે, તેમાં એ લેલાજ જરૂરી છે કે વારસદારોમાં કોઈ નાભાલિગ ન હોય. નહીં તો સપ્ત હરામ છે. એવી જ રીતે જો કેટલાક વારસદારો હાજર ન હોય તો પણ ના જાઈજ છે, જ્યારે કે ગેર હાજરોથી પરવાનગી ન લીધી હોય. અને સૌ બાલિગ હોય અને સૌની અનુમતિથી હોય અથવા કેટલાક નાભાલિગ અથવા ગેરહાજર હોય પરંતુ હાજર બાલિગ પોતાના ભાગમાંથી કરે તો વાંધો નથી.

(ખાનીયા વિગેરે)

મસ્ફુલા-(૭૭૪) : તા' જીયત માટે બહુધા રિશ્ટેડાર સ્ત્રીઓ એકત્ર થાય છે અને રડતી-પીટતી, વિલાપ કરે છે, તેમને ખાણું આપવામાં આવે નહીં, કે તેવું કરવું ગુનાહ પર મદદ આપવી છે. (કશ્કુલ-ગેતા)

મસ્ફુલા-(૭૭૫) : મૈયિતના ઘરવાળાઓને જે ભોજન મોકલવામાં આવે છે તે ખાણું કેવળ ઘરવાળાઓ ખાય અને તેમના જ યોગ્ય મોકલવામાં આવે. અધિક નહીં. બીજાઓએ તે ખાણું ખાવું મના છે. (કશ્કુલ ગેતા) અને કેવળ પહેલા દિવસે ખાણું મોકલવું સુન્નત છે, તેના પછી મકરૂહ છે..

(આલમગીરી)

મસ્ફુલા-(૭૭૬) : કબ્રસ્તાનમાં તા' જીયત કરવું બિદાત છે (રદ્દુલ મુહ્તાર) અને દંફન પછી મૈયિતના મકાન પર આવવું અને તાંત્રીયત કરીને પોતપોતાના ઘેર જવું, જો આકસ્મિક હોય તો વાંધો નથી. અને તેનો રિવાજ પાડવો જોઈએ નહીં. અને મૈયિતના મકાન પર તાંત્રીયત માટે લોકોનો સમૃદ્ધ (મજમો) કરવું દફનથી પહેલા હોય અથવા પછી. એ જ સમયે હોય કે બીજા કોઈ સમયે, ખિલાફ ઉલા છે. અને કરે તો ગુનોહ પણ નથી.

મસ્ફુલા-(૭૭૭) : જે માણસ એક વખત તા' જીયત કરી આવ્યો તેને બીજીવાર તા' જીયત માટે જવું મકરૂહ છે. (દુર્મુખ્તાર)

મસ્ફુલા-(૭૭૮) : સોગ માટે કાળા વસત્રો પહેલવા પુરુષો માટે ના જાઈજ છે. (આલમગીરી) એવી જ રીતે કાળા બિલ્લાં લગાવવા કે તેમાં નસારા (પ્રિસ્તીઓની) મુશાબેહત-અનુરૂપતા પણ છે.

મસ્ફુલા-(૭૭૯) : મૈયિતના ઘરવાળાઓએ ગ્રાદિવસ એટલા માટે બેસવું કે લોકો આવે અને તા' જીયત કરી જાય. જાઈજ છે, પરંતુ ત્યાગ બહેતર છે અને આ તે સમયે છે કે પાથરણાં અને બીજી સજાવટ ન કરવી હોય. નહીં તો ના જાઈજ છે.

(આલમગીરી, રદ્દુલ મુહ્તાર)

મસ્ફુલા-(૭૮૦) : વિલાપ અર્થાત મૈયિતના શુણો અતિશ્યોક્તિ સાથે બચાન કરીને અવાજથી રડવું જેને બીજા કહે છે, બીલ ઈજમાાં (સર્વ સમંતિએ) હરામ છે. એવી જ રીતે વાવેલા (હાહાકાર) તથા હાય મુસીબત કહીને ચિલ્વાવું હરામ છે.

(જવહરણ વિગેરે)

મસ્ફુલા-(૭૮૧) : ગિરેબાન (કપડાં) ફાડવું, મોહું નોચવું, વાળ વિભેરવા, માથા ઉપર ધુળ નાખવી, છાતી કુટવી, સાથળો પર હાથ મારવા, આ સધણું જાહીલીયતના કામ છે અને હરામ છે.

(આલમગીરી)

મસ્ફુલા-(૭૮૨) : ગ્રાદિવસ કરતાં વધારે સોગ જાઈજ નથી, પરંતુ સ્ત્રી પતિના મરણ ઉપર ચાર મહીના અને દસ દિવસ સોગ કરે. (હદીસ)

મસ્ફુલા-(૭૮૩) : અવાજથી રડવું મના છે. અને જો અવાજ બુલંદ ન હોય તો તેની મનાઈ નથી, બલ્કે હુલુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે હજરત ઈશ્રાહીમ રદીયલ્લાહો તાંત્રા અન્હોના અવસાન પર બકા ફરમાવી. (અશ્વ વહી જાય એ રીતે રડયા) (જવહરી) આ સ્થળે કેટલીક હદીસો જે (વિલાપ) વિગેરે વિષે આવેલી છે, ઉલ્લેખ કરવામાં આવે છે કે મુસ્લિમાન ધ્યાન પૂર્વક જુએ અને પોતાના ત્યાંની સ્ત્રીઓને સંભળાવે કે આ બલા હિન્દુસ્તાનની અકસર સ્ત્રીઓમાં હિન્દુઓના અનુકરણથી જોવામાં આવે છે.

હદીસ-(૧) : બુખારી તથા મુસ્લિમ અભુલ્લાહ બિન મસઉદ રદીયલ્લાહો અન્હોથી રાવી કે હુલુરે અકદસ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે જે (પુરુપ-સ્ત્રી) મોઢા ઉપર તમાચા મારે અને ગિરેબાં ફાડે અને જાહીલીયતનું પોકારવું પોકારે (નૌહા કરે) તે અમારા પૈકી નથી.

હદીસ-(૨) : સહીહ્યનમાં અબુ હુયરણ રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે, (મુસ્લિમ

શરીરના શબ્દોમાં) હુણુર સલ્લલાહો અલયહે ફરમાવે છે કે જે માઝસ માથું મુંડાવે અને નૌહા (વિલાપ) કરે અને કપડાં ફાડે, હું તેનાથી મુક્ત છું. હદીસ-(૩) : સહીહ મુસ્લિમ શરીરમાં અખુ માલિક અશાઅરી રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુણુર સલ્લલાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે મારી ઉમ્મતમાં ચાર કામ જાહિલીયત (ઈસ્લામ પુર્વ) ના છે, લોકો તેને છોડેશો નહીં (૧) હસબ પર ફ્રે (અભિમાન) કરવું (૨) નસબ (વંશ) માં ટોણા મારવું (૩) તારલાઓથી વરસાદ ઈચ્છાવું (ફલાણાં નક્ષત્રના કારણે પાણી વરસશે) (૪) અને નૌહા કરવું. અને ફરમાવ્યું : નૌહા કરવાવાળીએ જો મૃત્યુથી પહેલા તૌભા ન કરી તો કિયામતના દિવસે એવી રીતે ઉભી કરવામાં આવશે કે તેના ઉપર એક ખમીસ કરતરાણનું હશે અને એક ખારશત (ખૂજલી કરવાવાણું) નું હશે.

હદીસ-(૪) : સહીહયનમાં અખુલ્લાહ બિન ઉમર રદીયલ્લાહો અન્હોથી રિવાયત છે કે હુણુર સલ્લલાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે આંખના અશ્વ અને દિલનાગમના કારણે અલ્લાહ તાયાલા અજાબ કરતો નથી અને જ્ઞાન પ્રત્યે ઈશારો કરીને ફરમાવ્યું : પરંતુ આના કારણે અજાબ અથવા રહેમ કરે છે. અને ઘરવાળાઓના રડવાના કારણે મૈયિત પર અજાબ થાય છે. અથિત જ્યારે કે તેણે વસિયત કરી હોય અથવા ત્યાં રડવાનો રિવાજ હોય અને મના ન કર્યુ હોય, વલ્લાહો તાયાલા આઅલમો અથવા એ મુરાદ છે કે તેમના રડવાથી તેને તકલીફ થાય છે કે બીજી હદીસમાં આચુંછે કે અય અલ્લાહના બંદાઓ પોતાના મડદાંઓને તકલીફ આપો નહીં, જ્યારે તમો રડવા લાગો છો તો તે પણ રહે છે.

હદીસ-(૫) : ભુખારી તથા મુસ્લિમ, મુગીરહ, બિન શોઅબા રદીયલ્લાહો અન્હોથી રાવી કે રસુલુલ્લાહ સલ્લલાહો અલયહે વસલ્લમ ફરમાવ્યું છે. જેના ઉપર નૌહા (વિલાપ) કરવામાં આવ્યો કિયામતના દિવસે તે વિલાપના કારણે તેના ઉપર અજાબ થશે. અથિત એજ સ્વરૂપોમાં.

હદીસ-(૬) : સહીહ મુસ્લિમમાં છે કે ઉમ્મે સલમા રદીયલ્લાહો અન્દ કહે છે, જ્યારે અખુ સલમાં રહિયલ્લાહો અન્હોનાં ઈન્નેકાલ થયો તો મે કહું,

મુસાફરી અને પરદેશમાં તેમનો ઈન્નેકાલ થયો. તેમના ઉપર એવી રીતે રીશ કે જેની ચર્ચા થાય. મે રડવાનો નિશ્ચય કર્યો હતો અને (એક) સ્ત્રી પણ એ ઈરાદાથી આવી કે મારી મદદ કરે. રસુલુલ્લાહ સલ્લલાહો અલયહે વસલ્લમ તે સ્ત્રીને કહું : જે ધરથી અલ્લાહ તાયાલાએ શયતાનને બેવખત કાઢ યો તુ તેમાં શયતાનને દાખલ કરવા ચાહે છે. તે ફરમાવે છે કે હું રડવાથી રોકાઈ ગઈ અને રડી નહીં.

હદીસ-(૭) : તિરમિગી અખુ મુસા રદીયલ્લાહો અન્હોથી રાવી કે રસુલુલ્લાહ સલ્લલાહો અલયહે વસલ્લમ ફરમાવે છે - જે મરી જાય તે અને રડનાર તેની ખુલ્લીઓ બયાન કરીને રેણે, અલ્લાહ તાયાલા તે મૈયિત પર બે ફરિશ્તા મુકર્રર કરી દે છે જે તેને કોચે છે, અને કહે છે, શું તું એવો હતો.

હદીસ-(૮) : ઈન્ને માજા અખુ ઓમામા રદીયલ્લાહો અન્હોથી રાવી કે રસુલુલ્લાહ સલ્લલાહો અલયહે વસલ્લમ ફરમાવેછે : અલ્લાહ અજાં વ જલ્લ ફરમાવે છે કે અય ઈન્ને આદમ ! જો તુ પ્રથમ સદમા (આધાત) સમયે સબ્રાંકરે અને તાલિબ થાય તો તારા માટે જન્નત સિવાય કોઈ સવાબ પર હું રાજી નથી.

હદીસ-(૯) : અહુમદ તથા બયહકી ઈમામ હુસેન બિન અલી રદીયલ્લાહો અન્હોથી રાવી કે હુણુર સલ્લલાહો અલયહે વસલ્લમ ફરમાવે છે કે જે મુસલમાન પુરુષ અથવા સ્ત્રી પર કોઈ મુસીબત પહોંચી તેને યાદ કરીને “ઈન્ના લિલ્લાહે વ ઈન્ના ઈલયહે રાજેઉન” કહે. જો કે મુસીબતનો સમય લાંબો થઈ ગયો હોય તો અલ્લાહ તાયાલા તેના ઉપર નવો સવાબ અતા કરે છે અને એવો જ સવાબ આપે છે જેવો તે દિવસે કે મુસીબત પહોંચી હતી.

શાહીદનું બચાન

અલ્લાહ અજાં વ જલ્લ ફરમાવે છે - ‘વલા તહુુ લે મંય યુક્તલો કી સબીલિલ્લાહે અભ્વાત. બલ અહ્યાઉંવ વલા કિલ્લ લાતશાઓરન. (જે લોકો અલ્લાહની રાહમાં કલ કરવામાં આવ્યા તેમને મુર્દા ન કહો બલે તે જિન્દા છે પરંતુ તમને ખબર નથી) અને ફરમાવે છે. “વલા તહસબન્નલ્લાગીના કોતેલુ ફી સબીલિલ્લાહે અભ્વાતન બલ અહ્યાઉં

ઈન્દ્રબેહિમ યુર્જકુન. ફરેહીના બેમા આતા હોમુલ્લાહો મિન ફદ્વેહિ વ યસ્તબ્શે રુના બિલ્લજીના લમ યલ્હકુ બેહિમ મિન ખલ્કેહિમ અલ્લા ખૌકુન અવૈહિમ વલાહુમ યહઝનુન યસ્તબ્શે રુના બે ને ને અમતિલ્લાહે વ ફદ્વિલ્ય અન્નલ્લાહ લા યોહીઓ અજર મુ'મેનીન."

(જે લોકો રાહે ખુદામાં કલ કરવામાં આવ્યા તેમને મુર્દા ગુમાન કરો નહીં બલ્કે તેઓ પોતાના રખને ત્યાં જિન્દા છે તેમને રોજી મળે છે, અલ્લાહે પોતાના ફજલથી જે તેમને આપ્યો તેના ઉપર ખુશ છે. અને જે લોકો પાછળવાળા તેમનાથી હજુ ન મળ્યા તેમના માટે ખુશખબરીના તાલિબ કે તેમના ઉપર ન કાંઈ ખૌફ (ડૃ) છે અને તેઓ ગમગીન (ઉદાસ) થશે. અલ્લાહની ને અમત અને ફજલની ખુશખબરી ચાહે છે અને એ કે ઈમાન વાળાઓનો અજર અલ્લાહ નખ કરતો નથી.)

હદીસોમાં શહીદોના ફંાઈલ અધિકતાથી આવેલા છે. શહાદત કેવળ તેનું જ નામ નથી કે જેહાદમાં કલ કરવામાં આવે, બલ્કે એક હદીસમાં ફરમાવ્યું કે, તેના સિવાય બીજી સાત શહાદતો છે.

(૧) જે તાઉન (ખેગ) થી મર્યો તે શહીદ છે. (૨) જે દૂલીને મર્યો તે શહીદ છે. (૩) જાતુલજમ્બ (પાંસળીનું-દંડ-ખુરિસી) માં મર્યો તે શહીદ છે. (૪) જે પેટની બીમારીમાં મર્યો તે શહીદ વે. (૫) જે બ્લૂને મર્યો તે શહીદ છે. (૬) જેના ઉપર દીવાલ વિગરે પડી જાય અને મરી જાય તે શહીદ છે. (૭) જે સ્નીપ્રુસ્ટિ અથવા કુંવારાપણમાં મરી જાય તે શહીદ છે.

ઉપરોક્ત હદીસને ઈમામ માલિક, અબુ દાઉદ તથા નિસાઈએ જાબિર બિન અતીક રદીયલ્લાહો તાલાલા અન્હોથી રિવાયત કરી અને ઈમામ અહમદની રિવાયત જાબિર રદીયલ્લાહો અન્હોથી છે કે, રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વસ્તુલ્લમે ફરમાવ્યું : તાઉન (ખેગ) થી ભાગનાર તેના જેવો છે. જે જેહાદથી ભાગ્યો અને જે તેના પર સબ્ર કરે તેના માટે શહીદનો અજર છે. અહમદ તથા નિસાઈ ઈબાઝ બિન સારિયા રદીયલ્લાહો અન્હોથી રિવાયત કરે છે કે હજુર સલ્લલ્લાહો અલયહે વસ્તુલ્લમ ફરમાવે છે જે માણસ તાઉનમાં

મૃત્યુ પામે તેમના વિષે અલ્લાહ અજર વ જલ્લના દરબારમાં મુક્દમો રજુ થશે, શહીદો કહેશે આ અમારા ભાઈ છે. આ લોકો એવી રીતે જ કલ કરવામાં આવ્યા છે જેવા અમો. અને પથારીઓ ઉપર અવસાન પામનાર કહેશે આ અમારા ભાઈ છે, તેઓ પોતાની પથારીઓ પર મર્યાજેવા અમો. અલ્લાહ અજર વ જલ્લ ફરમાવશે તેમના જખમ (ધા) જુઓ, જો તેમના જખમ કલ થનારાઓના અનુરૂપ હોય તો તેઓ તેમના પૈકી જ છે, અને તેમના જસાથે જોવામાં આવશે તો તેમના જખમ શોહદાના. જખમોના અનુરૂપ હશે, જેથી તેમને શોહદામાં શામેલ કરી દેવામાં આવશે.

ઈબ્ને માજાની રિવાયત ઈબ્ને અબ્બાસ રદીયલ્લાહો અન્હોમાથી છે કે, હજુરે ઈરશાદ ફરમાવ્યો (૮) મુસાફિરનું મૃત્યુ શહાદત છે. તે સિવાય બીજી કેટલીએ હાલતો છે. જેમાં શહાદતનો સવાબ મળે છે. ઈમામ જલાહુદીન સુયુતી વિગેરે ઈમામોએ તેમનો ઉલ્લેખ કર્યો છે તે પૈકી કેટલીક આ છે. (૯) સિલ (ટી.બી.) ની બીમારીમાં મર્યો (૧૦) સવારી ઉપર પરીને અથવા મિર્ગ (વાઈથી મર્યો (૧૧) તાવમાં મર્યો (૧૨) માલ અથવા (૧૩) પ્રાણ અથવા (૧૪) કોઈ સાચા માણસને બચાવવામાં કલ કરવામાં આવ્યો (૧૬) ઈશ્કમાં મર્યો એ શરતે કે પાક દામન હોય અને તે છુપાવ્યું હોય (૧૭) કોઈ હિસ્ક પશુએ ફાડી ખાધો (૧૮) બાદશાહે અત્યાચાર દુપે કેદ કર્યો અથવા (૧૯) માર્યો અને મરી ગયો (૨૦) કોઈ મુજી જાનવરના કરડાથી મર્યો (૨૧) ઈલ્મે દીનની તલબમાં મર્યો (૨૨) મોઅજિન કે જે સવાબની તલબ માટે અજાન પઢતો હોય (૨૩) સત્યવાદી વેપારી (૨૪) સમુદ્રના પ્રવાસમાં ઉલ્ટી અને ઉલ્કા આવે (અને તેનાથી મૃત્યુ પામ્યો) (૨૫) જે પોતાના બાળકો - પરિવાર માટે શ્રમ કરતો હોય તે ઓમાં અલ્લાહના અહકામો કાયમ કરે અને તેમને હલાલ ખવડાવે (૨૬) જે માણસ નિત્ય પચ્ચીસ વખત આ પઢે. 'અલ્લાહુમાા બાર્કિ લી ફીલ મૌતે વ ફીમા બઅદલ મૌતે.' (૨૭) જે માણસ ચાશતની નમાજ પઢે અને દરેક મહિનામાં ત્રણરોજા રાખે અને વિત્રને સફર તથા

હજરમાં કયાંય ત્યજે નહીં. (૨૮) ફસાડે ઉમ્મતના સમયે સુન્નત પર અમલ કરનાર, તેના માટે સો (૧૦૦) શહીદો નો સવાબ છે. (૨૯) જે માણસ બિમારીમાં, લા ઈલાહા ઈલ્હા અન્તા સુખલાનકા ઈની કુનતો મિનજ જાલેમીન. ચાલીસ વખત પઢે અને એજ બીમારીમાં મૃત્યું પામે અને સારો થઈ ગયો તો તેની મગફેરત થઈ જશે. (૩૦) કુફ્ફારથી મુકાબલા માટે સરહદ પર ધોડો બાંધનાર (૩૧) જે માણસ તહારત સાથે સુઈ રહ્યો અને મૃત્યું પામે (૩૨) જે માણસ નબીએ કરીમ સત્તલલાહો અલયહે વસ્તુલમ પર સો (૧૦૦) વખત હુરુદ શરીફ પઢે (૩૪) જે માણસ સાચા દિલથી એ સાવલ કરે કે અલ્લાહની રાહમાં કતલ કરવામાં આવે (૩૫) જે વડિત જીમાના દિવસે મૃત્યુ પામે (૩૬) જે વડિત સવારે અઉજો બિલ્લાહે સમીઈલ અલીમે મિનશ્યતાનિર્જળે ત્રણ વખત પઢીને સૂરએ હશરની પાછલી ત્રણ આયતો પઢે. અલ્લાહ તથાલા (૭૦) સિતેર હજાર ફરિશ્તા મુકર્રર કરશે કે તેના માટે સાંજ સુધી ઈસ્તિગફાર કરે અને જો તે દિવસે મર્યાદ તો શહીદ મર્યાદ અને જો સાંજે કહે તો સવાર સુધી માટે એ જ વાત છે.

ફિક્ટિવી મસાઈલ (શહીદોના)

ફિક્ટિવી પરિભાષામાં શહીદ તે મુસલમાન આડિલ, બાલિગ તાહિરને કહે છે જે રૂલ્ભની રીતે કોઈ તીક્ષ્ણ હથિયાર ધ્વારા કતલ કરવામાં આવ્યો અને નફસે કતલથી માલ ન વાજિબ થયો હોય અને દુનિયાથી નફો-લાભ ન ઉઠાવ્યો હોય. શહીદનો એ હુકમ છે કે ગુસ્લ આપવામાં ન આવે. એમ જ લોહી સહિત દફ્ન કરી દેવામાં આવે તો જ્યાં આ હુકમ પામવામાં આવશે ત્યાં હુક્હા તેને શહીદ કહશે. નહીંતો નહીં. પરંતુ શહીદ ફિક્ટિવીન હોવાથી એ લાજિમ નથી કે શહીદનો સવાબ પણ પામે નહીં. કેવળ તેનો મતંલબ એટલો થશે કે ગુસ્લ આપવામાં આવે, અને બસ.

મસ્સલા-(૭૮૪): ના બાલિગ અને ગાંડાને ગુસ્લ આપવામાં આવે, જો કે તે કોઈપણ રીતે કતલ કરવામાં આવ્યા. જનાભતવાળાં અને હયઝ તથા નિફાસવાળી સત્ત્રી ભલે હજુ હયઝ તથા નિફાસમાં

હોય કે ખતમ થઈ ગયું પરંતુ હજુ ગુસ્લ કર્યું નહીં, તો તે સધળાને ગુસ્લ આપવામાં આવે.

(રદ્દુલ મુહતાર)

મસ્સલા-(૭૮૫): હયઝ શરૂ થયે હજુ પુરા ત્રણ દિવસ થયા ન હતા કે કતલ કરવામાં આવી તો તેને ગુસ્લ આપીશું નહીં. કે હજુ એ કહી શકતા નથી કે હયઝવાળી છે. (હુર્રે મુખ્તાર)

મસ્સલા-(૭૮૬): જનાભતવાળો હોવું એવી રીતે ખબર પડશે કે કતલથી પહેલા તેણે પોતે બયાન કર્યું હોય અથવા તેની પત્નીએ બતાવ્યું. (જવહરાદ)

મસ્સલા-(૭૮૭): તિક્ષ્ણ હથિયાર તે છે જેનાથી કતલ કરવાથી પર કાતિલ પર કિસાસ (ખુનનો બદલો) વાજિબ થાય છે. અર્થાત જે હથિયાર અવયવોને કાપીને અલગ પાડી દે જેવું કે તલવાર. બંદુકને પણ તિક્ષ્ણ હથિયાર કહીશું.

(રદ્દુલ મુહતાર)

મસ્સલા-(૭૮૮): જ્યારે નફસે કતલથી કાતિલ પર કિસાસ વાજિબ ન હોય બલ્લે માલ વાજિબ હોય તો ગુસ્લ આપવામાં આવશે. દા.ત. લાઠીથી માર્યો અથવા કતલ ચુકી જવાના સ્થાન પર મારી રહ્યો હતો અથવા કોઈ શખ્સ નરન તલવાર લઈને સુઈ ગયો અને નિદ્રાવસ્થામાં અથવા કોઈ આદમી પર તે તલવાર પડી અને તે મરી ગયો અથવા કોઈ શહેર અથવા ગામમાં અથવા તેમની નીકટ કતલ થનાર પેલો માર્યો અને તેના કાતિલની ખબર નથી, આ સધળી હાલતોમાં ગુસ્લ આપીશું. અને જો કતલ થનાર શહેર વિગેરેમાં મળ્યો અને ખબર છે કે ચોરોએ કતલ કર્યો છે, ભલે હથિયારથી કતલ કર્યો હોય કોઈ બીજી વસ્તુથી, તો ગુસ્લ આપવામાં આવે નહીં. જો કે ખબર નથી કે કોણો કતલ કર્યો છે, તો ગુસ્લ આપીશું નહીં. એવી જ રીતે જો જંગલમાં મળ્યો અને ખબર નથી કે કોણો કતલ કર્યો છે, તો ગુસ્લ આપીશું નહીં. એવી જ રીતે જો ડાકુઓએ કતલ કર્યો તો ગુસ્લ આપીશું નહીં. હથિયારથી કતલ કર્યો હોય કે બીજી વસ્તુથી.

(રદ્દુલ મુહતાર વિગેરે)

મસ્સલા-(૭૮૯): જો નફસે કતલથી માલ વાજિબ ન થયો બલ્લે માલનું વાજિબ થવું કોઈ બાબુ કાર્યથી છે. દા.ત. કાતિલ થનારના સંબંધીઓની

વચ્ચે સુલેહ થઈ ગઈ અથવા બાપે પુત્રને મારી નાખ્યો કે તેનો વારસદાર પુત્ર છે. દા.ત. પોતાની પત્નીને મારી નાખ્યો અને પત્નીનો વારસદાર પુત્ર છે જે એ જ પતિથી છે તો ડિસાસનો માલિક એ જ છોકરો થશે, પરંતુ કેમકે તેનો બાપ કાતિલ છે એટલે ડિસાસ સાકિત (નાખ્ય) થઈ ગયો. તો આ હાલતોમાં ગુસ્લ આપવામાં આવે નહીં.

(રદ્દુલ મુહ્તાર વિગેરે)

મસ્ફ્રલા-(૭૮૦): જો કતલ રૂલ્ભની રીતે ન હોય બલ્કે ડિસાસ અથવા હદ અથવા દંડમાં કતલ કરવામાં આવ્યો અથવા ડિસક પશુએ મારી નાખ્યો તો ગુસ્લ આપીશું. (હર્રે મુખ્તાર)

મસ્ફ્રલા-(૭૮૧): કોઈ માશસ ઘાયલ થયો પરંતુ તેના પછી દુનિયાથી લાભવિત થયો. દા.ત. ખાદું અથવા પીધું અથવા સુઈ રહ્યો અથવા ઈલાજ કર્યો, જો કે આ વસ્તુઓ બહુ જ અલ્ય હોય અથવા ત્યાંજ જ્યાં જાખ્યી થયો અથવા નમાજનો એક સમય સંપૂર્ણ હોશમાં પસાર થયો, એ શર્તે કે નમાજ અદા કરવા માટે શક્તિમાન હોય અથવા ત્યાંથી ઉઠીને બીજી જગ્યાએ ગયો અથવા લોકો તેને યુદ્ધ ભૂમિમાંથી ઉપાડીને બીજા સ્થળે લઈ ગયા ભવે તે જીવતો પછોંચ્યો હોય કે માર્ગમાં જ ઈન્જેકલ થઈ ગયો અથવા કોઈ દુન્યવી (સંસારિક) વાતની વસીયત કરી અથવા વેપારની વાત કરી અથવા કાંઈ ખરીદયું અથવા કેટલીક વાતો કરી તો આ સધળી હાલતોમાં ગુસ્લ આપીશું એ શર્તે કે આ કાર્યો જેહાદ પુરાં થયા પછી ઘટીત થયા. અને જો યુદ્ધદરમિયાન થાયતો આ વસ્તુઓ શહાદતને બાધક નથી અર્થાત ગુસ્લ ન આપીશું. અને વસીયત જો આપેરત વિષે હોય અથવા બે-એક વાતો બોલ્યો જો કે લડાઈ પછી, તો શહીદ છે. તેને ગુસ્લ ન આપીશું. અને જો લડાઈમાં કતલ કરવામાં નથી આવ્યો બલ્કે અત્યાચાર રૂપે તો તે વસ્તુઓમાંથી જો કોઈ જોવામાં આવી તો ગુસ્લ આપીશું. નહીં તો ન આપીશું. (હર્રે મુખ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફ્રલા-(૭૮૨): જેને હળ્બી અથવા બાળી (બળ વાખોરે) અથવા ડાકુએ કોઈ હથિયારથી કતલ કર્યો હોય અથવા તેમના જાનવરોએ તેને કચડી નાખ્યો, જો કે ખૂદ એ જ તેમના જાનવરો પર સવાર હતો

અથવા ખેંચી લઈ જઈ રહ્યો હતો અથવા તે જાનવરે પોતાના હાથ-પગ તેના ઉપર માર્યા અથવા દાંતથી કરડયો અથવા તેની સવારીને તે લોકોએ ભડકાવી દીધી તેનાથી તે પડીને મરી ગયો અથવા તેમણે તેના ઉપર આગ ફેંકી અથવા તેમના ત્યાંથી હવા આગ ઉડાવી લાવી અથવા તેમણે કોઈ લાકડીમાં આગ લગાવી દીધી જેનો એક છેડો આ બાજુએ હતો અને આ હાલતોમાં બળીને મરી ગયો અથવા યુદ્ધ ભૂમિમાં મૃત્યુ પામેલો મળ્યો અને તેના ઉપર ઝખમનું નિશાન છે. દા.ત. આંખ કાનથી લોહી નીકળ્યું છે અથવા ગળામાંથી સાફ લોહી નીકળ્યું અથવા તે લોકોએ શહેરપનાહ (કોટ) ઉપરથી તેને ફેંકી દીધો અથવા તેના ઉપર દીવાર તોડી પાડી અથવા પાણીમાં તુબાડી દીધો અથવા પાણી બંધહતું અને તેમણે ખોલીને તે બાજુએ વહાવી દીધું કે તુલી ગયો અથવા ગળું દબાવી દીધું, સારાંશ તે લોકો જે રીતે પણ મુસલમાનને કતલ કરે અથવા કતલના કારણરૂપ બને, તે શહીદ છે.

(આલમગીરી, હર્રે મુખ્તાર વિગેરે)

મસ્ફ્રલા-(૭૮૩): યુદ્ધ ક્રેત્રમાં મરેલો મળ્યો અને તેના ઉપર કતલનું કોઈ ચિન્હ નથી અથવા તેનું નાક અથવા પાખાના (ગુદા) પેશાબના સ્થાનેથી લોહી નીકળ્યું છે અથવા ગળામાંથી જામી ગયેલું લોહી નીકળ્યું અથવા શત્રુના ભયથી મૃત્યુ પામ્યો તો ગુસ્લ આપકામાં આવે. (હર્રે મુખ્તાર)

મસ્ફ્રલા-(૭૮૪): પોતાનો પ્રાણ અથવા માલ અથવા કોઈ મુસલમાનને બચાવવામાં લડ્યો અને માર્યો ગયો તે શહીદ છે. લોખંડ અથવા પત્થર અથવા લાકડી પૈકી કોઈ ચીજથી કતલ કરવામાં આવ્યો તે પણ શહીદ છે. (આલમગીરી)

મસ્ફ્રલા-(૭૮૫): બે નૌકાઓમાં મુસલમાન હતા કે દુશ્મને એક નૌકા પર આગ ફેંકી તે લોકો બળી ગયા, તે આગ આગળ વધીને બીજી નૌકામાં લાગી તેઓ પણ બળ્યા તો આ બીજી નૌકાવાળા પણ શહીદ છે. (આલમગીરી)

મસ્ફ્રલા-(૭૮૬): મુશરીકનો ધોડો છુટીને ભાગ્યો અને તેના ઉપર કોઈ સવાર નથી, તેણે કોઈ મુસલમાનને કચડી નાખ્યો અથવા મુસલમાનને કાફિર પર તીર ચલાયું અને તે મુસલમાનને વાગ્યું અથવા

કાફિરના ધોડાથી મુસલમાનનો ધોડો ભડક્યો તેણે મુસલમાન સવારને પાડી દીધો અથવા માઝલ્લાહ મુસલમાનો ભાગી છુટ્યા અને કાફિરોએ તેમને આગ અથવા પાઈની તરફ વિવશ કર્યા અથવા મુસલમાનોએ પોતાની આસપાસ ગોખરુ બિધાવ્યા હતા પછી તેના ઉપર ચાલ્યા અને મરી ગયા, આ સધળી હાલતોમાં ગુસ્લ આપવામાં આવે.

(આલમગીરી)

મસ્ખલા-(૭૭૭) : લડાઈમાં કોઈ મુસલમાનનો ધોડો ભડક્યો અથવા કાફિરોનો જોઈને ચેમક્યો પરંતુ કાફિરોએ તેને નથી ભડકાવ્યો અને તેણે સવારને પાડી દીધો અને તે મરી ગયો અથવા કાફિર ડિલ્લાબંધ થયા અને તેના ઉપરથી લપસીને કોઈ પડ્યો અને મરી ગયો અથવા માઝલ્લાહ મુસલમાનોને પરાજ્ય થયો અને એક મુસલમાનની સવારીએ બીજા મુસલમાનોને કચડી નાખ્યા, ભલે તે મુસલમાન તેના ઉપર સવાર હોય કે લગામ પકડીને લઈ જતો હોય અથવા પાઇળથી હાંકતો હોય અથવા હુસ્મન પર હુસ્મો કર્યો અને ધોડા ઉપરથી પડીને મરી ગયો, આ સધળી હાલતોમાં ગુસ્લ આપવામાં આવે. (આલમગીરી)

મસ્ખલા-(૭૭૮) : ઉભયપક્ષ સામને થયા પરંતુ લડાઈનો પ્રસંગ આવ્યો નહીં અને એક શાખ્સ મરી ગયલો મળ્યો તો જ્યાં સુધી એ ખબર ન હોય કે તિકણ હથિયારથી અત્યાચાર રૂપે કઠલ કરવામાં આવ્યો છે, તો ગુસ્લ આપવામાં આવે.

(આલમગીરી)

મસ્ખલા-(૭૭૯) : શહીદના શરીર ઉપર જે વસ્તુઓ કફનના પ્રકારની ન હોય તો તે ઉતારી લેવામાં આવે. દા.ત. પોસ્ટીન, બખ્તર, ટોપી, લોખંડનો ટોપ, હથિયાર, કપાસનું કપહું, અને જો મસનુનું કફનમાં કાંઈ કમી પડે તો વધારો કરવામાં આવે. અને પાયજામો ઉતારવામાં ન આવે. અને જો કમી છે પરંતુ તેને પુરું કરવા માટે કાંઈ નથી તો પોસ્ટીન અને કપાસનું કપહું ઉતારો નહીં. શહીદના સધળા વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરાવવા મકરૂહ છે. (આલમગીરી, રદ્દુલ મુહતાર વિગેરે)

મસ્ખલા-(૮૦૦) : જેવી રીતે બીજા મડદાઓને

સુગંધી લગાવીએ છીએ, શહીદને પણ લગાડે. શહીદનું લોહી ધોવામાં આવે નહીં, લોહી સમેત દફન કરે. અને જો કપડામાં નાપાકી લાગી હોય તો ધોઈ નાખો. (આલમગીરી વિગેરે) શહીદની જનાજાની નમાજ પદ્ધવામાં આવે.

(અમ્માતુલ કુતુબ)

મસ્ખલા-(૮૦૧) : દુશ્મન પર વાર કર્યો તેના ઉપર ફટકો પડ્યો નહીં બલ્કે ખુદ પોતાના ઉપર પડ્યો અને મરી ગયો તો ઈન્દ્રલ્લાહ શહીદ છે, પરંતુ ગુસ્લ આપે અને નમાજ પઢે. (જવહરહ)

કાબામાં નમાજ પટવાનું બચાન :

સહીદ બુખારી તથા સહીદ મુસ્લિમમાં છે કે અખુલ્લાહ બિન ઉમર રદીયલ્લાહો અન્ધો કહે છે કે રસુલુલ્લાહ સત્ત્વલ્લાહો અલયહે વસ્ક્રમ અને ઓસામા બિન જયદ તથા ઉસ્માન બિન તલ્હા હજ્બી તથા બિલાલ બિન રબાહ રદીયલ્લાહો તથા અનુમ કા'બા મોઅઝમામાં દાખલ થયા અને દરવાજો બંધ કરી લેવામાં આવ્યો. થોડીક વાર સુધી ત્યાં થોભ્યા જ્યારે બહાર પદ્ધાર્યા તો મેં બિલાલ રદીયલ્લાહો અન્ધોને પૂછ્યું, હજુરે શું કર્યું? આપે કર્યું : એક સ્થંભ જમણી તરફ અને બીજો ડાબી તરફ કર્યો અને ત્રણ સ્થંભ પાઇળ રાખ્યા પછી નમાજ પઢી. અને તે જમાનામાં બયતુલ્લાહ શીરીફના છ સંભ હતા.

મસ્ખલા-(૮૦૨) : કા'બા શરીફની અંદર દરેક નમાજ જાઈજ છે, ફર્જ હોય કે નિફલ, એકલો પઢે કે બાજમાસત જોકે ઈમામનું રૂખ બીજી બાજુએ હોય અને મુક્તદીનું બીજી તરફ, પરંતુ જ્યારે કે મુક્તદીની પીઠ ઈમામની સામે હોય તો મુક્તદીની નમાજ થશે નહીં. અને જો મુક્તદીનું મુખ ઈમામના મુખની સામે હોય તો નમાજ થઈ જશે, પરંતુ જો કોઈ વસ્તુ દરિમયાનમાં આડ રૂપ ન હોય તો મકરૂહ છે. અને જો મુક્તદીનું મુખ ઈમામના પાસાની તરફ હોય તો કરાહત વગર જાઈજ છે.

(જવહરહ, દુર્દુલ મુહતાર વિગેરે)

મસ્ખલા-(૮૦૩) : કા'બા શરીફની છિત પર નમાજ પઢી તો પણ એજ હાલતો છે પરેતુ તેની છિત ઉપર નમાજ પઢવું બલ્કે ચ્યાદવું પણ મકરૂહ છે,

(તનવીરુલ અબસાર)

મસ્ફલા-(૮૦૪) : મહિદુલહરામ શરીરફમાં કા'બા મોઅઝમાની આસપાસ જમાઅત કરી અને મુક્તદી કા'બા મોઅઝમાના ચારે તરફ હોય તો પણ જોઈ છે. જો કે મુક્તદી ઈમામ કરતાં કા'બા શરીરથી નિકટતમ હોય એ શર્ત કે આ મુક્તદી જે ઈમામ કરતાં નિકટતમ છે, તે બાજુએ ન હોય જે તરફ ઈમામ હોય બલ્કે બીજી તરફ હોય. અને જો એ બાજુએ જ છે જે તરફ ઈમામ છે, અને ઈમામ કરતાં નિકટતમ (ઇમામથી આગળ) છે તો તેની નમાજ થઈ નહીં.

(આમતુલ કુતુખ)

મસ્ફલા-(૮૦૫) : ઈમામ અંદર છે અને મુક્તદી બહાર તો ઈકતેદા સહી છે, બલે ઈમામ એકલો અંદર હોય અથવા તેની સાથે કેટલાક મુક્તદી પણ હોય, પરંતુ દરવાજો ખૂલ્લો હોવો જોઈએ કે ઈમામ ના રૂકુઅ તથા સુજુદનો હાલ માલુમ થતો રહે અને જો દરવાજો બંધ છે. પરંતુ ઈમામનો અવાજ આવે છે, તો પણ વોંધો નથી, પરંતુ જે હાલતમાં ઈમામ એકલો અંદર હોય કરાહત છે કે ઈમામ એકલો બુલંદી પર હશે અને આ મકરહ છે.

(દુર્ભ મુહ્તાર, રદ્દુલ મુહ્તાર)

મસ્ફલા-(૮૦૬) : ઈમામ કા'બાની બહાર હોય અને મુક્તદી અંદર તો પણ નમાજ સહીહ છે, એ શર્ત કે મુક્તદીની પીઠ ઈમામના મવાજૃષ (સનમુપ) માં ન હોય.

(રદ્દુલ મુહ્તાર)

ભાગ-૪ સમાપ્ત થયો.

★ ★ ★ ★ ★

કદ તમું હાગજુગાં બેહમ્દીલ્લાહે તથાલા વલહુલ હંમ્દો અવ્યલન વ આખેરન વ બાતેનન વ ઓહેરન વસ્સાલાતો વસ્સાલામો અલા મન અર્સલહુ શાહેદંધ શ્રેરંવનીરંધ્ય દાખેવન ઈલ્લાહે બે ઈગનેહિ વ સિરાજમ-મુનીરા. વ આલેહિ વ અશહાબેહિ વ ઈઙ્નેહિ વ હિજબેહિ અજમઈન ઈલા યૌમિદીન. વલહુંમ્દો લિલ્લાહે રદ્દુલ્લાત્યાલમીન વ અનલ્કકીરિલુફુફતકેરો ઈલલ-ગાની, અબુલ ઉલા, "અમજદઅલી અવ-આ'ગમી ગાફેરલ્લાહો લહુ વલે વાલેદાહે

આમીન"

(બહારે શરીરાત, ભાગ-૪ની આલાહજરત અજીમુલ બરકત ઈમામ અહમદ રજા ફાજિલે બરેલ્વી રદીપત્રલાહો અન્હોએ તસ્દીક ફરમાવી છે. અને હજરત સદરુશશરીરાખને ઘણી દુઆઓ આપી છે. તે એ રજુ કરીએ છીએ.-અનુવાદકો.)

આલાહજરત અજીમુલ બરકત મૌલ્લી હાજ કારી મુફતી અહમદ રજાખાન સાહેબ કાદરી બરકતાતીનો પવિત્ર અભિપ્રાય.

નિષ્મિલ્લાહિરહમાનિરહીમ :

અહુંમ્દો લિલ્લાહે વક્ફા વ સલામુન અલા ઈબાદેહિલ્લાગીનસ્તફા લા સૈયેમા અલશારેઈલ-મુસ્તફા વ મુક્તફશ્યાહે ફીભશારેએ ઓલસ્સીદ્ક વસ્સફા.

ફકીર, ગાફેરલહુલ મૌલલકદીરે આ રિસાલો બહારે શરીરાત, ભાગ-ચોથો કે જેને અબુલ (ઉલા મૌલવી હકીમ મોહમ્મદ અમજદઅલી કાદરી, બરકતી, આજમીએ તસનીફ કર્યો છે તેનું અવલોકન કર્યું. અહુંમ્દો લિલ્લાહ મસાઈલેસહીહ, રણહિયા, મુહકકા મુનક્કાહ પર આધ્યારિત જોયો. આજકાલ આવી ડિતાબની જરૂરત હતી કે અવામ ભાઈ સાદી ઉર્દુમાં સહીહ મસ્ફલા પામે અને ગુમરાહી તથા ભુલોના બનાવટી તથા ગિલેટના ઘરેણાઓની તરફ આંખ ન મંડાય, મૌલા અર્જુન વ જલ્લ મુસન્નિફના આયુષ્ય તથા ઈલ્મ તથા ફ્યાઝમાં બરકત આપે અને દરેક પ્રકરણમાં આ ડિતાબના બીજા ભાગો કાફી તથા શાફી રચવાની તૌફીક આપે અને તેમને અહલે સુન્તતમાં પ્રકાશિત તથા નિયમ અને દુનિયા તથા આખેરતમાં નાફે અને મકબુલ ફરમાવે આમીન.

વલહુંમ્દો લિલ્લાહે રદ્દિલ આલમીન વ સલ્લાલાહો તથાલા અલા સૈયેદના વ મૌલાના મોહમ્મદિંઘ વ આલેહિ વ સહબેહિ વ ઈઙ્નેહિ વ હિજબેહિ અજમઈન આમીન. નિલાહિજજ્હ હિ.

સન ૧૩૩૭

سُلَيْمَانٌ
بِنْ مُوسَى
وَمُحَمَّدٌ
بْنُ عَلِيٍّ